

ॐ

શ્રી વિનયવિજયજી કૃત

# શાંતસુધારસ

એક અપૂર્વ અધ્યાત્મ અને વૈરાગ્યમુખ ગ્રંથ

અનુવાદ અને વિવેચક  
મનઃસુખભાઈ કિરતચંદ મહેતા



— SHREE —  
**Raj Saubhag**

શ્રી રાજ - સૌભાગ સત્સંગ મંડળ

સૌભાગ પરા, સાયલા - ૩૬૩ ૪૩૦

પ્રકાશક:

મુમુક્ષુગણ

શ્રી રાજ-સૌભાગ સત્યંગ મંડળ

સાયલા - ૩૬૩ ૪૩૦

આવૃત્તિ: ઈ.સ.૨૦૧૪

પ્રાપ્તિ સ્થાન:

શ્રી રાજ-સૌભાગ આશ્રમ

નેશનલ હાઇવે ૮-એ ની બાજુમાં,

સોભાગ પરા, સાયલા - ૩૬૩ ૪૩૦

જી. સુરેન્દ્રનગર. ગુજરાત. India.

ટે. ૦૨૭૫૫-૨૮૦૪૩૩ / ૨૮૦૭૮૧

ઈ-મેલ : [rajsaubhag@yahoo.com](mailto:rajsaubhag@yahoo.com)

[www.rajsaubhag.org](http://www.rajsaubhag.org)

## નિવેદન

પૂ. શ્રી વિનયવિજયજી મહારાજ સાહેબે સંસ્કૃતમાં રચેલ 'શાંતસુધારસ' ગ્રંથ એક સુમધુર કાવ્યકૃતિ છે. એ ભાવનાઓનો મહિમા વર્ણવાનું મહાગીત છે. આ કાવ્યગ્રંથમાં અનિત્ય વગેરે બાર ભાવનાઓનું તથા મૈત્રી વગેરે ચાર ભાવનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે ધારું મનોહર, હૃદયર્સ્પર્શી તથા આત્મભાવને જગૃત કરનાર છે. કોઈ ગાયક મધુરકંઠ એનું ગાન કરે તો મુમુક્ષુના ચિત્તને ડોલાવી અને મોહને હણનાર છે.

વૈરાગ્ય પ્રેરક આ ગ્રંથની પ્રથમની બાર ભાવનાઓ ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવનારી, આત્મભાવ સંનુભ રાખનાર તથા આત્મા સાથે અનુસંધાન કરાવનારી છે. ત્યાર પછીની મૈત્રી આદિ ચાર ભાવના સાધ્યલક્ષી પ્રાણીને ઊડા વિચારમાં નાખી દે તેવી છે.

પ. કૃ. દેવ શ્રીમદ્ રાજયંકરજીએ શાંતસુધારસ ગ્રંથ અંગે મુમુક્ષુઓને પત્ર દ્વારા જણાયું છે કે,  
વૈરાગ્યભાવના એ ભૂષિત એવા 'શાંતસુધારસાદિ' ગ્રંથો નિરંતર ચિત્તન કરવા યોગ્ય છે.

[વ. પત્ર નં.૩૧૮]

'શાંતસુધારસ'માં કહેલી ભાવના 'અધ્યાત્મસાર' માં કહેલો 'આત્મનિશ્ચય અધિકાર' એ ફરી  
ફરી મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું.

[વ. પત્ર નં.૩૩૦]

શ્રી 'શાંતસુધારસ'નું પણ ફરી વિવેચન રૂપ ભાષાંતર કરવા યોગ્ય છે તે કરશો. [વ.૩.નોંધ.  
૨૫]

પ.કૃ.દેવની કરુણાસભર આ ભાવના શ્રી મનસુખભાઈ કિરતયંદ મહેતાએ ઉપાડી લીધી અને આ  
ગ્રંથનો ગુજરાતી અનુવાદ તથા વિવેચન તેમણે કર્યું અને તેમના સુપુત્ર ડો. ભગવાનદાસ

મહેતાએ વિ.સ.૧૯૮૨ માં તેને ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરેલ છે. મનસુભલાઈના પિતાશ્રી કિરતચંદભાઈ વવાજીયાની પોસ્ટઓફિસમાં પોસ્ટ માસ્ટર હતાં તે પહેલાથી ૪ તેમજા પરિવારનો સંબંધ પ.કૃ.દેવના પરિવાર સાથે હતો અને વિ.સ.૧૯૮૫પના ચૈત્ર માસમાં તેમણે પ.કૃ. દેવને સદ્ગુરુ તરીકે સ્વીકરેલ હતાં.

પ્રથમ આવૃત્તિ પછી આ ગ્રંથની બીજી બે આવૃત્તિઓ પણ પ્રસિદ્ધ થયેલ છે.

હાલ આ ગ્રંથ અપ્રાય હોવાથી અને શ્રી રાજ-સૌભાગ આશ્રમમાં આ ગ્રંથનો સ્વાધ્યાય શિખરમાં કરાવવાનો નિર્ણય થયો હોવાથી, આશ્રમનાં મુમુક્ષુઓ એ તેને ફરી છપાવવાનો નિર્ણય કર્યો.

પૂ. લાઈશ્રી વૈરાગ્યનાં આવા અનેક પુસ્તકોમાંથી દેશ - પરદેશના મુમુક્ષુઓને શિબિર વખતે સ્વાધ્યાય કરાવતા હોય છે.

વૈરાગ્યનો આ ઉત્તમ ગ્રંથ ચોક્કસ મુમુક્ષુઓ ને ઉપકારી થશે.

તા.૨૫-૧૨-૨૦૧૪

સાયલા.

મુમુક્ષુગણ  
શ્રી રાજ-સૌભાગ આશ્રમ

## અનુક્રમણિકા

<u>ક્રમાંક</u>	<u>વિષય</u>	<u>પાના નં.</u>
●	ઉપોદ્ગધાત	૧ થી ૧૪
૧.	અનિત્ય ભાવના	૧૫ થી ૨૬
૨.	અશરણ ભાવના	૨૭ થી ૪૮
૩.	સંસાર ભાવના	૫૦ થી ૭૧
૪.	એકત્વ ભાવના	૭૨ થી ૮૬
૫.	અન્યત્વ ભાવના	૮૭ થી ૧૦૪
૬.	અશુચિ ભાવના	૧૦૬ થી ૧૧૮
૭.	આશ્રવ ભાવના	૧૧૮ થી ૧૩૦
૮.	સંવર ભાવના	૧૩૧ થી ૧૪૦
૯.	નિર્જરા ભાવના	૧૪૧ થી ૧૫૦
૧૦.	ધર્મ ભાવના	૧૫૧ થી ૧૬૦
૧૧.	લોકસ્વરૂપ ભાવના	૧૬૧ થી ૧૬૮
૧૨.	બોધિદુર્લભ ભાવના	૧૬૮ થી ૧૭૭
૧૩.	મૈત્રી ભાવના	૧૭૮ થી ૧૮૩
૧૪.	પ્રમૌદ ભાવના	૧૮૪ થી ૧૯૧
૧૫.	કારુણ્ય ભાવના	૧૯૨ થી ૧૯૯
૧૬.	માધ્યરથ ભાવના	૨૦૦ થી ૨૦૭
●	ગંથ પ્રશાસ્તિ	૨૦૮ થી ૨૦૯
●	ઉપસંહાર	૨૧૦

\* \* \* \*

## મંગલ સૂત્ર

“વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આત્મજ્ઞાન,  
તેમજ આત્મજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન ॥”  
“ત્યાગ-વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન,  
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન ॥”  
—શ્રીમદ્ રાજચંદ્ર

“હું બલિહારી રે એ વૈરાગ્યની, ઉપજ્યો જેને અંગજી.”  
- નિષ્ઠુલાનંદ સ્વામી

“ત્યાગ ન ટકે રે, વૈરાગ્ય વિના.”  
- શ્રી નિષ્ઠુળાનંદજી

“ જ્યાં લગી આત્મ તત્ત્વ ચિન્તયું નહિં  
ત્યાં લગી સાધના સર્વ જૂઠી.”  
- નરસિંહ મહેતા

“અધ્યુવે અસાસયંમિ સંસારંમિ દુક્ખપउરાએ,  
કિં નામ દુધ્યંત કર્મયં જેણાહં દુઃગંડં ન ગચ્છેદ્યા ॥”  
- શ્રી ઉત્તરાધ્યયન ૮-૧

“શરદંબુધરચ્છાયા ગત્વયો યૌવનશ્રિયઃ ।  
આપાતરમ્યા વિષયાઃ પર્યતપરિતાપિનઃ ॥”  
“અંતકઃ પર્યવસ્થાતા જન્મિનઃ સંતાપદઃ ।  
ઇતિ ત્વાજ્યે ભવે ભવ્યો મુક્તાવુત્તિષ્ઠતે જનઃ ॥”  
-કિરાત

“જાણ્યું તો તેનું ખરું, જે મોહે નવ લોપાય,  
સુખ-દુઃખ આવ્યે જીવને, હર્ષ-શોક નવ થાય.”  
- પ્રકીર્ણ

ॐ

। श्री परमगुहम्यो नमः ।

## उपोद्घात

મંગલ. તીર્થકરની વાણીનું માહાત્મ્ય :

॥ શાર્વૂલવિક્રીડિતં વૃત્તં ॥

નીરંદ્રે ભવકાનને પરિગલતર્યાશ્રવામ્ભોધરે ।

નાનાકર્મલતાવિતાનગહને મોહાંધકારોદ્ધરે ॥

આન્તાનામિહ દેહિનાં સ્થિરકૃતે કારુળ્યપુણ્યાત્મભિ: ।

તીર્થશો: પ્રથિતાસુધારસકિરો સ્મયા ગિરઃ પાંતુ વ: ॥૧॥

અર્થ :

આ ભવારણ્યમાં ચોપાસ પંચ આશ્રવરૂપ વરસાદ વરસી રહ્યો છે, તેમાં વળી એવું કોઈ અંધ-છિદ્ર નથી કે આશ્રવ વરસાદ બહાર નીકળી હલવાઈ જય, અથવી આ ભવાટવી આશ્રવજળથી ભરાતી જઈ શકી જ ઉત્તરતી જય છે- ઊડા પાયા નાંખતી જય છે. તેમાં વળી એ આશ્રવજળને લઈ જતાતના કર્મરૂપી વેલાઓ ચોતરફ ઊડાં મૂળ નાંખી ફેલાતા જય છે, અને આ સંસારવનને ગહન, જેમાં નાંખી નજર ન પહોંચે, એવું કરી મૂકે છે. આમ એ વન ગહન તો છે, તેમાં વળી મોહરૂપી અંધકારથી તે તદ્દન ગહન થયું છે. એવા આ અંધકારવ્યામ ગહન સંસાર-અરણ્યમાં ભટકતા જીવોને સ્થિર કરવા, પરિઅમણમાંથી અટકાવવા, ચતુર્ણતિમાંથી છોડાવવા, જેને તેઓનાં આ ભવભટકરૂપ દુઃખ જોઈ દ્વારા ઊપજ છે એવા પુણ્યાત્મા તીર્થકર ભગવાને જે

આનંદકારી સુધારસભરી વાળી પ્રકાશી છે, જે આનંદકારી વચનામૃતોની રચના કરી છે તે પવિત્ર વચનામૃતો હે ભવ્યો ! તમારું રક્ષણ કરો.

### જીવનો વિભાગ - વિભાગ એ દુઃખ :

જીવો મિથ્યાત્વ, અગ્રત, પ્રમાદ, કથાય અને યોગ આ પાંચ આશ્રવવડે કર્મ બાંધી રહ્યા છે. મોહને લઈ તેઓને વસ્તુનું સ્વરૂપ સમજાતું નથી અને તેથી પોતાનું નહીં તેને પોતાનું ગણી તે માટે દુઃખી થાય છે, પોતાની સત્ય વસ્તુથી વિમુખ રહે છે. આવા અવિવેકથી જે પોતાની નથી, જે પોતાની બહાર છે, પોતાથી અલગ છે, પર છે, તેને પોતાની ગણી તેને લેવા ચોતરફ તે ભટક્યા કરે છે, ચર્ચાતિમાં રજાયા કરે છે, જન્મમરણ કર્યા કરે છે; પણ જેને તે પોતાની વસ્તુ ગણે છે એવી એ પર વસ્તુ કેમે કરી પ્રામ થતી નથી અને એ પ્રામ થાય પણ કંચાંથી ? પારકી વસ્તુ માટે ગમે તેટલા પ્રયત્ન તે લેવા, તે પોતાની કરવા કરીએ, પણ તે પ્રયત્ન નિષ્ફળ જ જાય છે. પારકી એ પારકી જ, એ પોતાની કેમ થાય ? પોતાનું તો પોતામાં જ છે; એ કંઈ બહાર નથી. એટલે બહાર રજાયે, ભટક્યે એ કરી પ્રામ થતું નથી. આ બહાર રજાળવું કેવળ અજ્ઞાન-મોહ-અવિવેકને લઈને થાય છે. એના પરિણામે ઈચ્છિત વસ્તુ તો મળતી નથી, પણ તે વેગળી જતી જાય છે, ઉલ્લંઘ દુઃખ થાય છે અને અજ્ઞાન-મોહ-અવિવેકની વૃદ્ધિ થતી જાય છે, જે એને વધારે રજાળતો કરે છે; જેથી એ વધારે પરિભ્રમણ કરે છે. નરક, તિર્યાય, મનુષ્ય, દેવરૂપે સારી-માઠી ગતિ કર્યા કરે છે અને દુઃખ ભોગવે છે. એ પરિભ્રમણ દુઃખમાંથી એ કયારે બચે ? કે જ્યારે એ સ્થિર થાય, તેનામાં વિવેક જાગે અને તે વિચારે કે અહો, આ હું કેવળ મૂર્ખઈ કરું છું, મારી વસ્તુ તો મારી પાસે જ છે, તે બહાર રજાળવાથી નહિ મળે. આ મારે રજાળવું પડ્યું છે, રજાળવું પડે છે, આ હું ચર્ચાતિમાં બ્રમજ કરી રહ્યો છું અને અનેક પ્રકારે જન્મમરણનાં દુઃખ-ચિંતા ભોગવી રહ્યો છું, તે કેવળ મારા અજ્ઞાનથી, બહાર રહેલી વસ્તુને મારી ગણી તે લેવાની ઈચ્છાથી જ. પણ તે મને કંચાંથી મળે ? ન જ મળે. મારું તો મારી પાસે છે; એમાં જ મારે સ્થિર થવું ઘટે છે, - આમ વિવેક વિચાર તેનામાં જાગે તો જ તેને શાંતિ થાય, તો જ તે સ્થિર થાય.

## જીવ માત્ર સુખના કામી, પણ સત્તુભથી અજ્ઞાત :

જુગતમાં જીવ માત્ર સુખના કામી છે, જીવ માત્ર સુખ પ્રાપ્ત કરવા ભથ્થી રહ્યા છે; પણ તેઓને સુખ પ્રાપ્ત થતું નથી, હુંભી દેખાય છે, એ આશ્વર્ય છે ! સુખનું સ્વરૂપ જ તેઓ જાણતા નથી. સુખનું ખરું સ્વરૂપ બહુ વિરલા જાણે છે, અને જેઓ જાણે છે તેઓ જ તે પામે છે. જીવને વિપરીત બુદ્ધિને લીધે, ગ્રમાદ-કષાયને લીધે ખરા સુખનું સ્વરૂપ સમજાતું નથી.

## સુખ અંદર છે, બહાર નથી :

એ સુખ બહાર નથી, પણ આત્મામાં છે. જે સુખ આત્મામાં જ છે તે આત્માથી અલગ એવા દેહ, પરિગ્રહ, ભમતા આદિમાં કયાંથી મળે ? કદી ન મળે. તો જે વાટેથી જીવને સુખ ન જ મળે, તે વાટે સુખ માટે કરેલા પ્રયત્ન કેમ નિષ્ફળ ન જાય ? જાય જ; અને કષારૂપે જીવ વધારે હેરાન થાય. સુખ વાસ્તવિક પોતામાં છે, પરમાં નથી.

"Happiness can not be found from without,

It is within ourselves."

"Happiness to ourselves consigned."

- Goldsmith's Traveller.

## સમકિત કે સાચી સમજ :

આમ જ્યારે ખરું-સમજય તારે જ જીવ સ્થિર થાય, તારે જ તેના પ્રયત્નો ખરી વાટે થાય; અને એ ખરી વાટના પ્રયત્નો સફળ થઈ તેને સુખ આપે જ, તેના પરિભ્રમણ દૂર થાય. જ્ઞાનીઓ આવી ખરી સમજને સમકિત કરે છે. વસુને વસુરૂપે જાણવી તેને સમકિત કરે છે. અવસુને અવસુરૂપે જાણવી તેને સમકિત કરે છે. સત્યને સત્યરૂપે જાણ્યું હોય તો જ તે ભણી પ્રવૃત્તિ થાય છે. અસત્યને અસત્યરૂપે જાણ્યું હોય તો જ તેની નિવૃત્તિ થાય છે. અસત્યને સત્યરૂપે જાડી તે ભણી કરેલી પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે. સત્ય પ્રાપ્ત નથી થતું, દુઃખ થાય છે, બુદ્ધિ મલિન થાય છે, જાય છે. જ્ઞાન ઉપર આવરણ આવે છે, સુખ દૂર જાય છે.

સત્યને અસત્યરૂપે જાણવાથી તેથી નિવર્તવાનો પ્રસંગ આવે છે, સત્ય પામવામાં અંતરાય આવે છે.

તેમજ જે વાટે સુખ મળે છે તે વાટનું ભાન થાય, તો તે વાટે સુખ માટે પ્રયત્ન થઈ શકે છે, જે પ્રયત્ન સફળ થઈ સુખ આપે છે.

જે વાટે સુખ નથી મળતું, તે વાટનું ભાન થાય તો સુખ માટે તે વાટે જતાં અટકવું થાય છે. નિષ્ફળ ગ્રયાસ, બેદ, દુઃખનો અવકાશ રહેતો નથી.

જે વાટે સુખ નથી મળતું, તે વાટે સુખ મળશે, એવી ખોટી મતિ જીવને થાય તો તે વાટે તેને સુખ નથી મળતું, છતાં મને આ વાટે સુખ મળશે એ અમણાથી તે પ્રયત્ન કર્યે જાય છે, પણ તે બધાં નિષ્ફળ થાય છે. જીવ બેદ અને દુઃખ જ બ્લોરે છે.

જે વાટે સુખ મળે છે તે વાટે સુખ નહિ મળે એવી ખોટી મતિ જીવને થાય તો તે સાચી વાટે પ્રયત્ન કરતો અટકે છે. મને આ વાટે સુખ નહિ મળે, સુખ તો બીજી વાટે મળશે, આથી તે ખરી વાટે પ્રયત્ન કરતો અટકે છે અને સત્ય સુખનો અંતરાય પામે છે.

### મિથ્યાત્વ કે ખોટી સમજ :

આ ખોટી મતિને જ્ઞાનીઓ મિથ્યાત્વ કહે છે, સાચી મતિને સમકિત કહે છે. એ વિપરીત મતિ દૂર થાય, અને સમકિત (સમ્યગ્દાચિ), સાચી સમજ જીવને આવે તો જ તે સ્થિર થાય છે, શાંત થાય છે, સુખી થાય છે, બટકતો અટકે છે.

### સાચી સમજનું ફળ :

જ્ઞાનીઓ કહે છે કે જીવને સમ્યગ્દાચિ પ્રાપ્ત થાય, તેઓને સાચી સમજ આવે અર્થાત્ સત્ય વસ્તુનું સત્યરૂપે, અને અસત્યનું અસત્યરૂપે ભાન થાય, તો તેઓ તે જ ભવે મોક્ષ પામે, તેમ ન થાય તો ત્રાજે ભવે, અને તેમ ન થાય તો વધારેમાં વધારે પંદર ભવે તો એ જીવ મુક્તાય જ, કર્મથી સર્વધા છૂટી મોક્ષ પામે જ, શાશ્વત સુખ પામે જ.

## જાળે તે પામે :

આ વાત વિવેક વિચારે સાવ સત્ય લાગે છે, કેમ કે સત્ય વસ્તુનું જીવને ભાન થાય, એટલે અસત્ય વસ્તુ ભણીની પ્રવૃત્તિ સહેજે અટકે. અસત્ય વસ્તુની પ્રવૃત્તિને લઈને તો તેને ભમવું પડ્યું છે, એ અસત્ય વસ્તુની પ્રવૃત્તિ અટકે એટલે તેનું ભ્રમણ પણ અટકે, અને ભ્રમણ અટકે, જન્મ-જરા-મરણ અટકે તો પછી બીજું જોઈએ છે શું ?

## કર્મ ભોગવવાં કરજ પતાવવું :

જન્મ-જરા-મરણ રહિત સ્થિતિ, અજરામર અવસ્થા, કદી જ્યાંથી પડવાપણું ન થાય એવું સ્થાન તે જ મોક્ષ. આમ સત્ય વસ્તુનું જીવને ભાન થાય તો તેનો તરત જ, તે જ ભવે મોક્ષ થાય. પણ પૂર્વકર્મનું દેવું તે ભોગવી પતાવવાનું બાકી રહ્યું હોય તો તે ભોગવી પતાવી દેવા માટે એકાદ બે ભવ કે ઉત્કૃષ્ટ પંદર ભવ થાય તે ભલે, પણ એ સાચી સમજ ઊપજ્યા પછી તો જીવ સર્વથા ધૂટે જ, પછી સ્થિર દેણે પામ્યા પછી જીવ ભવ ભલે કરે, પણ તે ભવ તેને મુક્તિ પ્રતિ જતાં ન જ રોકે; તે ભવ બીજી ભાવિ ભવની પરિપાઠી ન જ ઊપજવે. સાચી સમજ ન થઈ હોય, સમ્યજ્ઞાન ન થઈ હોય, ત્યાં સુધી થતી પ્રત્યેક ભવ બીજી નવા ભવ કરવાનાં કારણ થાય જ. અનંત અનુબંધ થયા જ કરે. પણ સાચી સમજ આવ્યે એ અનંત અનુબંધ નાશ પામે; અને પૂર્વ ઊપાર્જલાં કર્મ સમ્યજ્ઞ પ્રકારે સાધ્ય દેણ્યાએ, ભોગવી લેવાં, જેરવી નાંખવા. આગણું કર્મ પુદ્ગલનું લીધેલું પાછું સર્વથા ચુકાવી આપવા, તેના દેણાથી મોકણા થવા, એકાદ બે કે વધારેમાં વધારે પંદર ભવ કરવા પડે તે ભલે, પણ તેથી મુક્તિની અટકાયત તો ન જ થાય. મુક્તિના રસે તો તે પડી ચૂક્યો છે.

## વટેમાર્ગુનો રાતવાસો :

“દેણે સ્થિરાદિ ચારમાં, મુગતિ પ્રયાશ ન ભાંજે રે;

રયણી શયન જેમ શ્રમ હરે, સુસનર સુખ તેમ છાંજે રે.”

- પણોવિજ્યજ્ઞ (યોગદાનિ સજ્જાય)

અર્થાતું સમ્યગુદૃષ્ટિ થયા પછી પૂર્વકર્મ ભોગવવા તેને દેવાદિના ભવ કરવા પડે, તે જેમ અમૃત સ્થાને જવા નીકળણે વટેમાર્ગું રસ્તામાં ચાત્રિવાસો કરે તેના જેવું સમજજવું.

### સમ્યગુદૃષ્ટિ અને ભવની નિયમાં :

સ્થાન દૂર હોય તો એક, બે કે વધારે ઠેકણો રાત રહેવું પડે, પણ રસ્તાનો માહિતાનાર છે, જે સ્થળે જવું છે તે તરફ જવા નીકળ્યો છે, એટલે ત્યાં તો વહેલો મોડો પહોંચે જ છે. તેમ સમ્યગુદૃષ્ટિ પામી જાચા રસ્તાથી માહિત થયો છે, અને મોક્ષ ભજી એણે પ્રયાણ કર્યું છે, તો તે વહેલો મોડો ત્યાં પહોંચવાનો જ છે. કોઈ છેટી વાટેથી નીકળ્યો હોય, અર્થાતું તેને વધારે કર્મ ભોગવવાં બાકી હોય તો તેને દેવ-મનુષ્યાદિ ગતિ પામવારૂપ વધારે રાતવાસા કરવા પડે છે. કોઈ પણ એથી જ નીકળ્યો હોય, અર્થાતું જેને બદ્ધ થોડાં કર્મ ભોગવવાં બાકી હોય તેને રાતવાસો રહેવું પડતું નથી, બીજે ભવ કરવો પડતો નથી, તે જ ભવે મોક્ષસ્થાને પહોંચે છે; અથવા એકદ બે દેવ-મનુષ્યાદિના ભવ કરવારૂપ રાતવાસા કરી હંચિત સ્થાને પહોંચે છે.

### યથાર્થ જાણપણું :

આમ જેટલા જેટલા મહાપુરુષો મોક્ષ પામી સિદ્ધ થયા છે તે બધા સત્ય વસ્તુજ્ઞાન પામવાથી જ; સમ્યગુદૃષ્ટિ થવાથી જ; વસ્તુને વસ્તુપણે જાણવાથી જ; અવસ્તુને અવસ્તુરૂપે જાણવાથી જ; સત્યને સત્યરૂપે જાણવાથી જ; અસત્યને અસત્યરૂપે જાણવાથી જ; આત્માને આત્મરૂપે જાણવાથી જ; પોતાને પોતારૂપે જાણવાથી; પોતે તે પોતે, પર નહિ એમ જાણવાથી; પર તે પર, પોતે નહિ એમ જાણવાથી; પોતાની વસ્તુ તે પોતાની એમ જાણવાથી; પારકી વસ્તુ તે પારકી એમ જાણવાથી; પોતાની વસ્તુ તે પારકી નહિ, એમ જાણવાથી; પારકી વસ્તુ તે પોતાની નહિ એમ જાણવાથી; પોતે તો જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ઉપયોગી અવિનાશી આત્મા છે, એમ જાણવાથી; આત્મા તે આત્મા, અને પુદ્ગલ તે પુદ્ગલ એમ જાણવાથી; આત્મા તે પુદ્ગલ નહિ અને પુદ્ગલ તે આત્મા નહિ, એમ જાણવાથી; એ આદિ વિવેકપ્રકાશથી જ તેઓ આ ગઢન અંધકારમય સંસારવનમાંથી માર્ગ પામી, હંચિત સ્થાને પ્રહોંચ્યા.

## દુ:ખિયાનાં દુ:ખ દુ:ખિયા જાણો : છૂટેલાઓની બંધાયેલા પ્રતિ કરુણા :

આ ચતુર્ગતિરૂપ સંસારમાં અજ્ઞાનથોળે રહ્યાતા જીવોને પણ જે આ સાચી સમજ આવે, તો તેઓ બિચારા સ્થિર થાય; અને દુ:ખી થતા અટકે; એવી કરુણા આવવાથી શ્રી તીર્થકર પરમાત્માએ તેઓને સત્ય માર્ગ ઉપદેશ્યો છે. તેઓ પોતે વસ્તુસ્વરૂપ આણી, જે રસેથી મોક્ષ પામ્યા, તે રસો બતાવે છે. તીર્થકર પોતે પણ સાચી સમજ પામ્યા પૂર્વ આ પ્રકારે રહ્યાતા હતા; પરિભ્રમણ દુ:ખ ભોગવતા હતા. સાચી સમજ પામ્યે તેઓએ પરિભ્રમણના પરિણામરૂપ ખોટો માર્ગ છાંડી દીધો, સન્માર્ગ લીધો; અને ધારેલ ડેકાણે પહોંચ્યા; સુખનું યથાર્થ સ્વરૂપ સમજ સુખ પામ્યા. તેઓશ્રીને, સુખનું ખરું સ્વરૂપ સમજ્યા વિના સુખ માટે ફાંડા મારી દુ:ખી થતા આ સંસારી જીવોની કરુણા આવવાથી, તેઓશ્રીએ આં સત્ય સુખસ્વરૂપનો અને તે પામવાનો આ પવિત્ર બોધ કર્યો છે. તે હે, ભવ્ય જીવો ! તમારું રક્ષણ કરો ! અર્થાત્ તે બોધનો આશ્રય લ્યો, તે પ્રમાણે વર્તો, તમારું કલ્યાણ થશો. આ શાંતસુધારસ એ પવિત્ર કરુણાવાન મુદ્યાત્મા તીર્થનાથનો ઉપદેશ જ છે.

### તીર્થનાથ કેમ કહેવાયા ?

તેઓશ્રીને તીર્થનાથ એ પવિત્ર ઉપનામ છાજે જ છે, તેઓ પોતે તીર્થ, તીર્થના તીર્થરૂપ છે; તરવાના સાધનરૂપ છે; તેઓશ્રીના આશ્રયે જીવ સંસારસમુદ્ર તરી જાય છે; એવી તીર્થનાથ નામ તેઓશ્રીને છાજે છે, અથવા જે વડે જીવ સંસારસમુદ્ર તરી જાય, તેવાં સાધનો, દાન-શીલ-તપ-ભાવરૂપ ધર્મ, અથવા જ્ઞાનાદિ આરાધનારૂપ ધર્મ, એ તરવાના સાધનોનો ઉપદેશ કર્યો હોવાથી તીર્થનાથ એવું પવિત્ર નામ તેઓને છાજે છે. આ પરમ કૃપાળુ, કરુણાળુ, પવિત્રાત્મા શ્રી તીર્થકર દેવે જ ઉપદેશેલો આ શાંતરૂપ અમૃતરસ છે. તે પીવાથી જીવો અમર થાય છે, જન્મ-મરણથી બચે છે. ૧.

## ॥ દુર્વિલંકિતવૃત્તં ॥

સ્ફુરતિ ચેતસિ ભાવનયા વિના ।  
 ન વિદુષમણિ શાંતસુધારસ: ॥  
 ન ચ સુખં કૃશમપ્યમુના વિના ।  
 જગતિ મોહવિષાદવિષાકુલે ॥ ૨॥

**અર્થ :** વિદ્વાનોને પણ શાંતિરૂપી અમૃતરસ ફરી ફરી વિચાર કર્યા વિના, અનુપ્રેક્ષા વિના, તેની તે વાત ફરીફરી જુદે જુદે રૂપે વિચાર્યા વિના, ભાવના વિના ચિત્તમાં સ્હુરતો નથી; સ્હુરે છે, તો યથાર્થ સ્હુરતો નથી.

### અનાદિ વૈભાવિક અત્યાસ કેમ ટણે ?

મૂળે જીવ અનાદિકાળથી વૈભાવિક દશામાં પડ્યો છે; તેમાં એ અનાદિ કાળથી વસ્તુને અવસ્તુરૂપે ગણ્ણો બેઠો, અવસ્તુને વસ્તુરૂપે ગણ્ણો બેઠો છે. આ અવિવેક, આ વૈભાવિક મોહ, એમ જુદે જુદે પ્રકારે ફરી ફરી વિચાર્યા વિના, અથવા સત્ય વસ્તુ તે સત્ય, અસત્ય તે અસત્ય, પર તે પર, સ્વ તે સ્વ, પર તે સ્વ નહિ, સ્વ તે પર નહિ, - એમ ફરી ફરી નવાં નવાં રૂપે દાખલા દલીલથી, ઉપમા અનુમાનથી, પ્રત્યક્ષ પરોક્ષ રીતે, સદ્ગુરુ દ્વારા, સત્તસંગ સમાગમથી, આત્મકષયોપશમ અનુસાર, આગમપ્રમાણ વડે, ઈતિહાસપ્રમાણ વડે, દેખાંત સિદ્ધાંતથી વિચારે નહિ, નિધરિ નહિ, નક્કી કરે નહિ, ત્યાં સુધી દૂર ન થાય, દૂર થાય તો તે સર્વથા દૂર ન થાય. અનાદિ કાળનો મિથ્યા ભાવ, મિથ્યા વાસના, ખોટી ખુદ્દિ એકદમ નાશ પામવી, સુલટાવવી દુષ્કર છે.

### ભેંસનું દેખાંત :

સદ્વસ્તુની ભાવનાથી જ એ મતિ દૂર થાય, સન્મતિ આવે. લાંબા કાળ સુધી આપણા વેર રાખેલી, આપણા ઘરને ખીલે બાંધેલી ભેંસ બીજાને વેચીએ, તો પણ આગલા પરિચયથી, અત્યાસથી પ્રથમ દિવસે અથવા તો થોડા હિવસ એ આપણા ઘરના પરિચિત ખીલે આવી ઊભી રહે, એને વળી જ્યારે ભારી ધકેલી મૂકીએ અને તેનો નવો ધણી તેને પોતાને વેર લઈ જાય, અને આમ વખતોવખત થાય ત્યારે જ તે ભેંસને

નવા ઘરનો પરિચય પડે અને પછી તાં સિથર થાય. તેમ અનાદિકળનો વૈભાવિક મોહ છોડવો બહુ મુશ્કેલ છે. પૂર્વનો અભ્યાસ પરિચય જીવ એકદમ ન છાડે.

### વિભાવનું પ્રાબલ્ય અને અનુપ્રેક્ષણની જરૂર :

માટે ભાવનાની, અનુપ્રેક્ષણની ફરી ફરી જરૂર છે. ભાવનાથી તેને વસ્તુના સ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય છે. વસ્તુનો યથાર્થ નિર્ણય થતાં અજ્ઞાન, મોહ, અવિવેક નાશે છે, અને જીવને સત્ય સુખનો લાભ થાય છે. માટે સત્ત વસ્તુનો સતત ફરીફરી વિચાર આત્માર્થીએ કર્તવ્ય છે. તે વિના શાંતસુધારસ સમાન ગ્રલુનો બોધ પણ યથેચું પરિણામ આપતો નથી. માટે ભાવનાનો જ્ઞાનીઓ ઉપદેશ કરે છે.

### ભાવના એટલે શું ?

ભાવના એટલે પુટ. સુવર્ણને સાવ ચોળ્યું કરવું હોય તો સંપુટમાં, કુલીમાં મૂકી, ફરી ફરી તપાવવા રૂપ ભાવના-પુટ દેતાં તે શુદ્ધ થાય છે, અથવા સૂંઠ આદિને શુદ્ધ કરવા, કમાવવા, નિમક અને લીલુના રેસના ફરી ફરી પુટ આપી ફરી ફરી સૂકવવા રૂપ ભાવના દેતાં શુદ્ધ થાય છે, અથવા જતજાતની ધાતુઓ, જેમ કે પારો, ત્રાંબ, કલઈ, જસત આદિ અથવા સોમલ, વધનાગ આદિને શોધવા, શુદ્ધ કરવા કાર-ખટાશ આદિના ફરી ફરી પુટ આપતાં, તે જેમ શુદ્ધ થાય છે, તેમ આ જીવને પણ જુદી જુદી રીતે વસ્તુ વિચારતાં જ્ઞાનનિર્મળતા થાય છે; - વસ્તુસ્થિતિ યથાર્થ સમજાય છે.

### વિચારનાં પ્રમાણ :

જ્ઞાનીઓ વસ્તુસ્વરૂપને જુદે જુદે રૂપે ભાવે છે; વિચારે છે.

- (૧) ઈતિહાસપ્રમાણ વડે,
- (૨) આગમપ્રમાણ વડે,
- (૩) સંદ્રગુડ દારા,
- (૪) બીજા સત્તસમાગમે,

- (૫) પ્રત્યક્ષ સ્વાનુભવ વડે - પોતાની શક્તિ અનુસાર પોતાનો ક્ષયોપશમ પહોંચે ત્યાં સુધી,
- (૬) પરોક્ષ, શ્રી કિનેશરનાં વચ્ચનો વડે,
- (૭) ઉપમા વડે,
- (૮) અનુમાન વડે,
- (૯) દાખલા, દલીલ, દસ્તાંત સિદ્ધાંતથી,

આમ અનેક પ્રકારે તત્ત્વને કરી કરી વિચારવું એને જ્ઞાનીઓ ભાવના કહે છે. એવી ભાવના વિના આગળ જગ્ઘાવું તેમ પૂર્વના લાંબા વૈભાવિક પરિચયને લઈ વિદ્વાન પુરુષોના ચિત્તમાં પણ તત્ત્વજ્ઞાન સહૃરતું નથી, હરટું નથી, તો સામાન્ય જીવનું તો શું કહેવું ? માટે બધાએ સદ્ગ્ભાવના વડે પોતાનાં ચિત્ત વાસિત કરવાં, એ તાત્પર્ય છે, એ બોધ છે. એથી જ પૂર્વનો લાંબા વખતનો પરિચિત વૈભાવિક મોહ ટળશે.

### વિષનો ઉતાર :

બાડી બાજો ઉપાય નથી. તેમાં પણ આ જગત જેમાં મોહ અને બેદૃપી જેર ડેર ડેર વ્યાપી રહ્યું છે, અને જીવો વ્યાકુળ થઈ હ્યકાં ખાય છે, ત્યાં તો તે મોહ અને તજજ્ઞન્ય દુઃખરૂપ જેર ટાળવા આ સદ્ગ્ભાવના ભાવ્યા વિના છૂટકો જ નથી. તે વિના લેશમાત્ર સુખ નહિ મળે. વસ્તુતત્ત્વ વિચારી તેનો નિર્ણય કર્યે છૂટકો છે. ૨

### તરતના થાકેલાઓને વિસામો :

યદિ ભવભ્રમહેદપરાહૃદ્ય !  
 યદિ ચ ચિત્તમનંતસુખોન્મુખ !  
 શ્રણુત તત્ત્વધિય : શુભભાવના-  
 ભૂતરસં મમ શાંતસુધારસં ॥૩॥

**અર્થ :** હે, બુદ્ધિમંતો ! અગાઉ કહ્યું છે તેમ હવે જો તમારું ચિત્ત ભવભ્રમજ્ઞના દુઃખથી પરાજ્ઞુખ થયું હોય, ભવદુઃખમાંથી છૂટવા ઈચ્છાતું હોય, સુખ, સત્ય સુખ, ગ્રામ કરવાની ઈચ્છાવાળું હોય, તો અમે રહેલો

આ શાંતસુધારસ શ્રવણ કરો. તેમાં જે ભાવના માટે અમે પૂર્વ આટલું આટલું કહ્યું, તે ભાવનાઓનો રસ નાખેલો છે. જે ફરી ફરી વિચારતાં સત્ય સુખ આપવાનું કરશે થશે. એથી વસ્તુ તત્ત્વ સમજશે; મોહ છૂટશે; અને તમારી અંગત ઋષિ જે દબાઈ રહી છે, હંકાઈ રહી છે, તે વ્યક્ત થઈ પ્રકટ થઈ તમને અપૂર્વ આનંદ આપશે.

અલબત્ત જેઓને સારી બુદ્ધિ ઉપણ હશે, અને જેઓ સંસારપરિભ્રમણથી થાક્યા હશે, અને જેઓને આ સુખ નહિ, આ તો દુઃખ, સુખ તો બીજું કાંઈ હોવું જોઈએ, એવો વિચાર સ્ફુરે તે સત્ય સુખ માટે જેઓ દેણી ફેંકતા હશે, તેને જ આ શાંતસુધારસ દુચિકર થશે.

**ભાવિકાળે થાકનારાઓને ભાવિ વિસામો આજ :**

બીજ પામર જીવો, જેઓ હજ થાક્યા નહિ હોય, અને પૂરવેગમાં અસત્ત વસ્તુ ભણી દોડી રહ્યા હશે, અને સુખ-દુઃખનું જેને ભાનં નહિ હોય, તેવા જીવો આ પ્રતિ અભાવની નજરે જોશે. તેવા દ્યા ખાવા જેવા જીવો પણ જ્યારે થાક્યો, ત્યારે આ શાંતિરૂપી અમૃત વરસાવતા સદ્ગુણના વિભૂષિત ગ્રંથનો આશ્રય લેશે. તાત્પર્ય કે જીવો વહેલામોડા આવી ભાવનાનો આશ્રય લઈ વસ્તુસ્વરૂપ વિચારી નિર્ધારિશે, સારી સમજ પામશે, સભ્યગઢાય થશે, ત્યારે તેઓનો ઘૂંઠકો છે; ત્યારે તેઓ દુઃખનો અત્યંતાભાવ પામશે. વધારે શું કહીયે ? તરતના થાકેલા તરત ભાવનાઓનું ચિંતિવન કરશે. ભાવિ કાળે થાકનારાઓ ભાવિકાળમાં એને વિચારશે. પણ એ બધાને આ ભાવનાનો આશ્રય છે. સદ્ગુદ્ધિ આવ્યા વિના તત્ત્વજ્ઞિશાસ્ન નહિ થાય; આ ભાવના ભણી લક્ષ નહિ આય; પણ જીવને ભવદુઃખનું ભાન થયે તેની બુદ્ધિ અવશ્ય ઠેકાડો આવશે અને બુદ્ધિ ઠેકાડો આવતાં જિજ્ઞાસુ થઈ આવાં પવિત્ર શાંતિ આપનારાં શ્રી વીતરાગ પરમાત્માના વચ્ચનામૃતોનો આશ્રય લેશે. તે વચ્ચનો તેના ઉપર પહેલીવાર અસર નહિ કરે, તો બીજી વારના આશ્રયથી કરશે; બીજી વાર નહિ કરે, તો ત્રીજી વાર કરશે. આમ પુનઃ પુનઃ એ વચ્ચનોના આશ્રયથી જીવ ઉપર અવશ્ય સાત્ત્વિક અસર થશે.

“દોરીયે છેદાય છે, પાકા કાળા પહાણ.”

અને સ્વરૂપ નિર્જય કરી એ આત્મસુખ-સત્સુખ પામશે. આ ભાવનાઓનો આ ઉદેશ છે. તેનો હે, સદ્ગુણવાળા જીવો ! તમે આશ્રય લો. ૩

**ભાવનાનું ચિંતન અને સમતાનું ઊગવું :**

સુમનસો મનસિ શૃતપાવના,  
નિદયતાં દ્વયધિકાદશ ભાવના : ।  
યદિહ રોહતિ મોહતિરોહિતાદ  
ભુતગતિ વિંડિતા સમતા લતા ॥૪॥

અર્થ : હે, પંડિત પુરુષો ! તમે કાનને પવિત્ર કરનારી આ બાર ભાવના શ્રવણ કરી હૃદયમાં ધારણ કરો; અનું નિરંતર ચિંતન કરો, એથી પ્રભ્યાત અને અતિ અદ્ભુત સમતારૂપી વેલ, જેનું સત્પુરુષોએ આટલું બધું માણાત્મ્ય કહેલું છે, તે ઊંચી નીકળી મોહંઘકરને ટાળી દેશે. તાત્પર્ય કે પ્રથમ જીવ જો સમતા ખરે, શાંત થાય, તો તેને વસ્તુવિચાર સૂઝે, વસ્તુવિચાર સૂઝે તો વસ્તુનિર્ણય થાય, વસ્તુનિર્ણય થાય તો ખરે માર્ગ જવાય, અને ધારેલ વાત પમાય. માટે હે, પંડિત પુરુષો ! તમે જ્યા સમતા આદરો. સમતા આશવા માટે આ ભાવનાઓ પ્રબળ સાધન છે. ૪

**વિવેક કેમ આવે ?**

॥ રથોદ્વત્તા વૃત્તં ॥

આર્તી રૈદ્ર પરિણામ પાવક-  
-પ્લુષ ભાવુક વિવેક સૌદ્ધલ્યે ॥  
માનસે વિષયલોલુણાત્મનાં ।  
ક્વ પ્રોહતિતમાં શમાદૂર : ॥૫॥

અર્થ : હે, પંડિત પુરુષો ! તમે સમતા આદરો; અર્થત્તુ આર્તી-રૈદ્ર ધ્યાનરૂપ માઠાં પરિણામ છાંડી ધો; વિષયલોલુપતા ત્યજી દો, એટલે વિવેક અને સુવિચાર જગશે; સમતા આવશે. કેમ કે આર્તી-રૈદ્ર પરિણામરૂપ અભિનધી મનના વિવેક અને સદ્ગુણાર ભસ્મીભૂત થાય છે;

અને જ્યાં વિવેક અને સદ્ગિયાર નાશ પામ્યા હોય અને વિષયલોલુપ્તા વર્તતી હોય, ત્યાં સમતાના અંકુરો ક્યાંથી ઊગે ?

“બીજે દરદે કુતો વૃક્ષઃ ।”

બીજ બળી ગયું હોય, તો વૃક્ષ ક્યાંથી થાય ? ન થાય. તેમ વિવેક સદ્ગિયારરૂપ બીજ બળી ગયું હોય તો સમતા રૂપી વૃક્ષ ક્યાંથી ઊગે ? ન જ ઊગે. માટે તમે આર્તરૌદ્ર ધ્યાન છોડી દો, વિષયમાં આસક્ત ન થાઓ, એટલે તમને સમતા આવશે. ક્વચિત્ ઈષ વસ્તુનો વિયોગ થાય, ક્વચિત્ અનિષ્ટનો સંયોગ થાય, તો તેથી તમે ખેદ ધરો નહિ, રોગ આવ્યે આકુળવાકુળ થાઓ નહિ, હવે શું થશે એમ ચિત્તવો નહિ, મારું ભવિષ્યમાં શું થશે ? ગુજરો કેમ ચાલશે ? એ આદિ ભવિષ્યનો ખેદ કરો નહિ. એ આર્તધ્યાનના સંક્ષેપે પ્રકાર છે. તમે જેવું પૂર્વ ઉપાજ્ઞું છે, તેવું સારું-મારું તમારે ભોગવવું પડશે. તો તમે વર્થ ખેદ કરો નહિ. એથી બુદ્ધિ મહિન થાય છે. આમ આર્તધ્યાન છાંડો; તથા હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહવૃદ્ધિ - એ વગેરેનો બીજાને ઉપદેશ ન આપો; બીજાને એ પાપો આચરતા દેખી રજી ન થાઓ. મહારભના ઉપદેશ-અનુમોદનથી વિરમો. આમ આ રૌદ્રધ્યાનથી અટકો અને વિષય પરથી આસક્તિ દૂર કરો - ઓછી કરો. એટલે વિવેક-સદ્ગિયાર જગશે અને સમતા આવશે એટલે કલ્યાણ દૂર નથી. ૫

**ભાવના - ennobles the mind :**

॥ વસંતતિલકા વૃત્તં ॥

યસ્યાશયં શ્રુતકૃતાતિશયં વિવેક-  
પીયૂષવર્ષરમणીયરમં શ્રયંતે ॥

સદ્ભાવનાઃ સુરલતા ન હિ તસ્ય દૂરે ।  
લોકોત્તરાશમસૌખ્યફલપ્રસૂતિઃ ॥૬॥

**અર્થ :** સત્ત્વાસ્ત્ર શ્રવણથી ઉદાર થયેલા અને વિવેકમૃત જરવાથી આનંદ આપત્તા જેના મન આ સદ્ભાવનાઓનો આશ્રય કરે છે, તેને કલ્યવૃક્ષ વેગળો નથી, તેને પ્રકૃષ્ટ શાંતિ રસરૂપ લોકોત્તર સુખનું ફળ મળે

છે, અર્થात् પવિત્ર શાસ્ત્ર સાંભળી સાંકું મન મૂડી દઈ, મનને ઉદાર કરી વિવેકપૂર્વક જેઓ આ ભાવના ભાવે છે, તેઓ નિશ્ચય શાંતિનું અપૂર્વ સુખ પામે છે. ૬

બાર ભાવનાઓનાં નામ :

॥અનુષ્ટુપ્ વૃત્તં ॥

અનિત્યતા શરીરને, ભવ મેકત્વ મન્યતાં ॥

અશૌચમાશ્રવં ચાત્મનુ, સંવર્ણ પરિભાવય ॥૭॥

કર્મણો નિર્જરાં ધર્મ, સુકૃતાં લોકપદ્ગતિ ।

બોધિદુર્લભતામેતા, ભાવયનુ મુચ્યસે ભવાતુ ॥૮॥

અર્થ : હે; આત્મન ! આ બાર ભાવનાનાં નામ સાંભળ. એ ભાવના ફરી ફરી વિચારતાં તું નિશ્ચયે ભવથી છૂટીશ; જન્મ-જરા-મરણ રહિત એવો તારો સ્વસ્વભાવી ભોક થશે. માટે એ ભાવના ભાવણે.

(૧) અનિત્ય (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (૫) અન્યત્વ,  
 (૬) અશુદ્ધિ (૭) આશ્રવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) ધર્મ (૧૧)  
 લોકસ્વરૂપ (૧૨) બોધિદુર્લભ.



## અનિત્ય ભાવના

શરીર અનિત્ય :

॥ પુષ્પિતાગ્રા વૃત્તં ॥  
 વપુરિવ પુરિદં વિદભ્રલીલા-  
 પરિચિત મષ્યતિભદ્રુરં નરાણામ् ।  
 તદતિભદ્રુર્યૌવનાવિનીતં  
 ભવતિ કથં વિદુષાં મહોદયાય ॥૧॥

**અર્થ :** રે, વિદ્ધ, વિદ્વાન પુરુષ, ચેતન ! આ તારું અનંગ જેવું, કામદેવ જેવું, સુંદર શરીર અભ્રલીલા જેવું ક્ષણભંગુર છે. જુવાનીનો બહાર ભલે એમાં ખીલ્યો છે, પણ સાંજે આકાશમાં સંદ્યા ખીલે છે, અને તરત લય પામી જાય છે, તેમ આ તારા શરીરનો જુવાનીનો બ્ધાર પણ ક્ષણિક સમજ. એમાં તારે રાચવા જેવું નથી. વળી જુવાનીની ઉન્મત્તતાને લઈ આ શરીર બેકી જઈ દુર્વિનીત થાય છે; જુવાનીના છાકથી હથમાં નથી રહેતું, તો એ શરીરથી વિદ્વાન પુરુષોનો ભહોછય થાય નહિ; તેઓનું દારિદ્ર્ય એ શું દળો ? કંઈ જ નહિ. માટે એ ક્ષણવિનાશી શરીર પર મોહ રાખી રાચવા જેવું નથી. ૧

આયુષ્ય, ધન, ઈદ્રિય-વિષય અનિત્ય :

॥ શાર્ડૂલવિક્રીડિતં વૃત્તં ॥

આયુર્વિદુતરત્તરંગતરલં લગ્નાપદઃ સંપદઃ ।  
 સર્વેપીન્દ્રિયગોચરસ્થ ચટુલાઃ સન્ધ્યાભ્રરાગાદિવત् ॥  
 મિત્રસ્ત્રીસ્વજનાદિસંગમસુખં સ્વનેદ્રજાલોપમં ।  
 તલિક વસ્તુ ભવે ભવેદિહ મુદામાલમ્બનં યત્તસ્તામ્ ॥૨॥

**અર્થ :** અહો ! આ સંસારમાં એવી કઈ નિત્ય, અવિનાશી વस્તુ છે કે જેનો સત્પુરુષો આનંદપૂર્વક આશ્રય કરે ? કોઈ જ નહિ.

- (૧) આયુષ્ય - આ તો વાયુથી હાલેલાં પાણીનાં ભોજાં જેવું ચંચલ છે.
- (૨) સંપત્તિ - આ યે વિપત્તિયુક્ત છે. “સંપત્તિ ત્યાં વિપત્તિ.”
- (૩) ઈદ્રિયોના વિષયો - આ પણ ભલે મીઠા લાગે પણ તે સાંજે આકાશમાં ખીલેલી સંધ્યાના જેવા નાશવંત છે.

(૪) ભિત્ર, સ્ત્રી, સ્વજનાદિ સંગ - આથી ઉપજતું સુખ પણ સ્વપ્ન સમાન છે; ઈદ્રિયોન સમાન છે. સ્વપ્નમાં ઈઠેલ વાત જેમ સત્ય હોતી નથી, ઈદ્રિયોનો તમાશો જેમ સાચો હોતો નથી, તેમ ભિત્ર, સ્ત્રી, સ્વજનાદિના સંગપરિચયથી ઉપજેલું સુખ વાસ્તવિક નથી; કલ્યાણ માત્ર છે, વળી તે ક્ષણિક છે.

આમ આ જગતમાં કઈ વસ્તુ એવી નિત્ય છે, - આયુ કે સંપત્તિ, કે ઈદ્રિયોના વિષયો, કે ભિત્ર, સ્ત્રી, સ્વજનાદિના સંગ-પ્રસંગ, કે જેમાં સત્પુરુષો રાચે ? અર્થાત് આ સંસારના ભાવ જ અનિત્ય છે, ક્ષણભંગુર છે, તેમાં સત્પુરુષને રાચવાનું હોય નહિ. ૨

“વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ;  
પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણનો પ્રસંગ ?”

- શ્રીમદ્ રાજચ્ચ પ્રાણીત મોક્ષમાળા શિ.પા. ૪૨

**જડભાવ અનિત્ય, સંસારી ચેતનભાવ અનિત્ય :**

પ્રાત ભ્રતરિહાવદાતરુચયો યે ચેતનાચેતના ।

દૃષ્ટા વિશ્વમન:પ્રમોદવિદુરા ભાવા: સ્વત: સુંદરા: ॥

તાંસ્તત્રૈવ દિને વિપાકવિરસાન્ હા નશ્યત: પશ્યત-

શ્રીત: પ્રેતહતં જહાતિ ન ભવપ્રેમાનુબન્ધં મમ ॥૩॥

**અર્થ :** હે, બંધુ ! જગતમાં પ્રાતઃકાલે સ્વર્ણ કાંતિવાળા, આખા જગતને અત્યેત પ્રેમ ઉપજાવતા, સ્વત: સુંદર એવા જડચેતનના ભાવ તે

નથી જોયા ? જોયા છે. તે જ ભાવ ફરી તે જ દિવસે કાળપરિપાકને લઈ વિરસ થઈ નાશ પામે છે. અહો ! આમ એ જડ-ચેતનનું પ્રત્યક્ષ નાશસરૂપ જેતાં છતાં આ મારું ભૂતના વધગાડવાણું, મિથ્યાત્મ મોહથી મુંજાયલું મન આ ક્ષાશભંગુર સંસાર પ્રતિનો મોહ-પ્રેમ છાડતું નથી; અરે ! ત્યાં જ મમત્વ-આસક્તિ ધરાવે છે ! એ બરેખર બેદકારક છે.

### સંસારમાં વસ્તુઓ બે :

આ સંસારમાં બે વસ્તુઓ દેખીએ છીએ : (૧) જડભાવ, (૨) જડમિશ્રિત ચેતનભાવ. એકાંત ચેતનભાવ તો સિદ્ધ અવસ્થામાં છે. તે તો સંસારથી પર છે. જડભાવ, તે બધા જડ પૌદ્યગલિક પદાર્થો. જડમિશ્રિત ચેતન ભાવ, તે આ બધા સંસારી, સંસારમાં પરિબ્રમજ કરતા, ચાર ગતિમાં રૂણતા દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકી જીવો.

આ બસે ભાવો, જડભાવ તેમજ જડમિશ્રિત ચેતન ભાવ વિનાશી છે, અનિત્ય છે, ક્ષાશભંગુર છે.

### પુદ્ધગલનાં વિવર્તા :

જડભાવ કાળપરિપાક પામી રૂપાંતર્ય પામે છે; પહેલે સમયે નહોતા, તેવા બીજા સમયે થાય છે; એક જ રૂપે રહેતા નથી; એના સ્વભાવ પ્રમાણે સરે છે, નાશ પામે છે. ફરી બીજાં રૂપ બ્રહે છે.

જડમિશ્રિત ચેતન ભાવ, અર્થાત્ સંસારી જીવો પણ જન્મ-મરણરૂપ નવાં નવાં રૂપ બતાવી રહ્યા છે. કર્મવશ જીવ ફરી ફરી જન્મ-મરણરૂપ ભવ કરી અવનવા વેપ ભજવે છે.

### કાળનો સ્વાભાવ :

સૂર્ય સવારે ઉદ્ય પામે છે; પ્રકાશે છે; સ્વત: સુંદર છે; આખા જગતને આનંદ આપે છે; તે પણ પુનઃ કાળપરિપાક પામી સાંજે અસ્ત પામે છે.

સમુદ્રમાં ભરતી આવે છે; જેનારની આંખોને ઉછળતાં મોજાં આનંદ આપે છે; તે જ ભરતી કાળપરિપાક પામી ઓટરૂપે શુભી જાય છે.

સૂર્યવિકાસી કમળ સવારે ઉગ્રી આખો દિવસ જગતના ચક્ષુને ઢારે છે; કાળ પરિપાક પામી તે સાંજે ચીમળાઈ જય છે.

સાંજે સંધ્યા ખીલે છે; જગતજીવનાં લોચનોને આળાદ આપે છે; થોડા વખતમાં પરિપક્વ થઈ નાશ પામે છે.

પુષ્પો ખીલે છે; સુગંધ આપે છે; તેઓનાં રંગ-રૂપ-વર્ણ આંખોને શીતળ કરે છે. પણ થોડો વખત ખીલી તેઓ પરિપક્વ થઈ, વૃદ્ધ થઈ ચીમળાઈ જય છે.

### જડ-ચેતનના ચમત્કાર :

કુદ્ર જંતુઓ ઉપજે છે, વિષસે છે. આવા જીવો કોઈ સવારે ઉપજે છે; અને સાંજે તો પરિપક્વ થઈ વિષસી જય છે. કોઈ તો દિવસમાં અનેકવાર ઉપજે છે; અને થોડો વખત રહી નાશ પામે છે.

તેમ વળી કોઈ કોઈ આપણા જ સગાસંબંધીઓ, ઓળખીતા જેને આપણે પ્રાતઃકાળે જેયા હોય, તે કાળધર્મ પામી સાંજે હતા ન હતા થઈ જય છે.

### જડ-ચેતન ભાવ ક્ષણિક :

આમ અનેક પ્રકારે આ જગતના જડ-ચેતન ભાવની ક્ષણાભંગુર ઘટમાણ જેતાં છતાં, ચેતન; તને વૈરાગ્ય-કેમ સ્હુરતો નથી? અરે! તું આ પ્રતિક્ષણે નાશ પામતી વસ્તુઓ ઉપર કેમ મિથ્યા મોહ રાખી રહ્યો છે? ચેતન! બુઝ બુઝ! મોહ છોડી દે! ત

દવે આ પહેલી ભાવનાનું અષ્ટાળિયું કહે છે :

### વૈભવ, જીવિત વિનાશરૂપ :

॥ રામગિરિ રાગ ॥

મૂઢ મુદ્દસિ મુધા, મૂઢ મુદ્દસિ મુધા ॥ ધ્રુવપદ ॥  
વિભવમનુચિત્ય હદિ સપરિવારં ।

કુશશિરસિ નીરમિવ ગલદનિલકંપિતં ।  
વિનય જાનીહિ જીવિતમસારં ॥ મૂ૦ ॥૧॥

અર્થ : હે, મૂઢ જીવ ! તું આ તારા વૈભવ અને તેનો પરિવાર જે ધર, કુટુંબ, પરિગ્રહ આદિ તેનું ચિંતવન છદ્યને વિષે કરી કેમ નકામો મોહ પામે છે ? એ વૈભવ આદિનું ચિંતવન કરવા જેવું નથી; એ મોહ છે. એ તારી પણે શાશ્વત રહેવાના નથી, કેમ કે આ તારું જે જીવન છે તે ડાખના અગ્રભાગ પર રહેલા પાણીના બિદુ જેવું અસાર છે. જેમ ડાખની આણી ઉપર રહેલું પાણીનું ટીવું વાયુના જરા ડાખવાથી ગરી પડે છે, તેમ હે, મૂઢ જીવ ! આ તારું જીવિત પણ ક્ષણવિનાશી છે. એ પણ મૃત્યુરૂપી વાયરાના ઝપાટામાં આવતાં પડશે. અને આ વૈભવાદિ જેની તું ચિંતા કર્યા કરે છે, તે ધર્યા રહેશે. માટે એ મોહ છાંડી દે, પ્રમાદ ત્યજ દે. અને આ વખત છે, એટલામાં મુરુષાર્થ કરી આત્મહિત કરી દે. ૧

### વિષયરસ વીજળીનો જબકારો :

પશ્ય ભજુરમિદં વિષયસુખસૌહદરં ।

પશ્યતામેવ નશ્યતિ સહાસં ॥

એતદનુહરસી સંસારસ્પં રહ્યા-

-ચલદજલબાલિકારુચિ વિલાસં ॥ મૂર્ઠ ॥ ૨ ॥

અર્થ : હે, સંભિત્ર આત્મા ! તું આ વિષય સુખ સાથે મિત્રતા કરે છે, પણ તે ક્ષણભંગુર છે; એ સુખ જેયું ન જેયું ત્યાં એકદમ નાશ પામે છે, માટે તારે એની પ્રાતિ કર્તવ્ય નથી. આ સંસારનું સ્વરૂપ વીજળીના જબકારો જેવું છે. જેમ વીજળીનો જબકારો થયો અને તત્કાળ વેગે કરી પાછો સમેટાઈ જાય છે, તેમ આ સંસારના ભાવ ઉપજ્યા, જરા રહ્યા ન રહ્યા ત્યાં પાછા સમેટાઈ જાય છે, એવા એ ક્ષણવિનાશી છે, માટે તે પર મંમતા રાખવી યોગ્ય નથી. એ મિથ્યા મોહ છે. ૨

### ઘૌવનની વક્તા :

હંત હતયૌવનં પુછમિવ શૌવનમ् ।

કુટિલમતિ તદપિ લઘુ દષ્ટનષ્ટમ् ॥

તેન બત ફરવશાપરવશા હતથિયઃ ।

કટુકમિહ કિ ન કલયોતિ કષં ॥ મૂર્ઠ ॥ ૩ ॥

**અર્થ :** અરે, આ દુષ્ટ યુવાવસ્થા ફૂતરાની પૂછડી જેવી છે, ફૂતરાની પૂછડી જેમ વાંકી છે, તેમ યુવાવસ્થામાં કુટિલ મતિ હોય છે; આડી-વક સમજ હોય છે; યુવાવસ્થામાં આવેલો જીવ બીજાનું માનતો નથી; વળી જેમ ફૂતરાની પૂછડી સીધી કરીએ અને તરત વાંકી થઈ જાય, તેમ ઘોવનાવસ્થામાં આવેલા જીવની મતિ ઠેકાણે આણીએ ન આણીએ ત્યાં ઉન્મત થઈ જાય છે; અને યુવાવય ખીલ્યું ન ખીલ્યું ત્યાં કરમાઈ જાય છે. આમ યુવાવસ્થાની સ્થિરતાનો લેશમાત્ર વિશ્વાસ કર્તવ્ય નથી.

આમ છતાં જેદ થાય છે કે એ યુવાવસ્થાને પરવશ સ્ત્રી કે પુરુષને, પુરુષ કે સ્ત્રીવશ થઈ બુદ્ધિ ઉપર ધૂળ નાખે છે; અને એના પરિણામે કષ્ટુપ કરવાં ફળનો વિચાર કરતા નથી. તાત્પર્ય કે યુવાવસ્થાથી ઉપાજેલી ભાઈ મતિને લઈ સ્ત્રીપુરુષો કામવિવશ થઈ વિષયભોગ ભોગવે છે; અને પોતાની બુદ્ધિને મહિન કરે છે; પણ એનાં બહુ માટાં ફળ તેઓને ભોગવવાં પડે છે, તેનો આ યુવાવસ્થાને આડે તેઓને વિચાર આવતો નથી, એ કાણભંગુર યુવાવયનો પણ વિશ્વાસ કરવા જેવું નથી.

યુવાવય એ જીવનો આત્મમંથન કાળ છે. અર્થાત્ એ આત્માને ભથી નાખે છે. એમાંથી બચ્યો તેનું કલ્યાણ સમજવું.

“યુવાવયનો સર્વસંગપરિત્યાગ પરમ પદને આપે છે.”

— શ્રીમદ્ રાજચંદ્ પ્રણીત મોક્ષમાણા શિ.પા. ૧૦૧

હે, ચેતન ! તારે આમ વિચારી એ ક્ષણવિનાશી વસ્તુ પર મોહ કર્તવ્ય નથી. એ મોહ કેવળ દુઃખદાયી છે; છાંડવા યોગ્ય છે. તે દેહ જરે પણ આશા ન જરે :

યदપि પિણ્યાકતામજ્ઞમિદમુપગતમ् ।

ભુવનદુર્જયજરાપીતસારમ् ॥

તદપિ ગતલજ્જમુજ્જતિ મનો નાઙ્ઘિનાં ।

વિતથમતિ કુથિતમન્મથવિકારમ् ॥ મૂ૦ ॥ ૪ ॥

**અર્થ :** એ ઘોવનાવસ્થામાં શરીરના સબળપણાને લઈ કામવિકાર

होय ते तो ठीक; पङ्ग जगतमां जेनो ज्य न करी शकाय, जेने टाणी न शकाय अवै जरावस्था आवी शरीरनुं बधुं सत्त्व हरी लई तेने अत्यंत हुर्बय करी नांभे छे छतां आ देहधारीओनां मन केवां निर्लज्ज छे, के केवण धिक्कारवा योग्य अने असारभूत कामविकारने छांडता नथी !

### ॥ आशातृष्णा जीर्यतोऽपि न जीर्यति ॥

देह जर्जरित थाय, घडपङ्ग आवे, पङ्ग आशा-ईच्छा तो नवयौवन रहे.

अहो ! यौवन पङ्ग जतुं रहे छे, वृद्धावस्था पङ्ग पोतानो भाव भजवी जती रही मृत्युमां परिखाम पामे छे. आवी क्षणाभंगुर अवस्थाओ छतां तेमां थअेला हुए विकारो मन छांडतुं नथी, ममता मूकतुं नथी, आशा छांडतुं नथी, ए भरेभर जेहनी वात छे. येतन ! तारे आ अनित्य वस्तुओ पर भोइ करवो योग्य नथी. जेना पर वृथा भोइ करे छे, ते वस्तुओ तारे पराणे छोडवी पडशे; अथवा तेओ तने छोडी चाली जशे; तुं रडतो रहीश. माटे तुं ऐनो भोइ छांडी हे. ४

अनुत्तर विभाननां सुख पङ्ग परिमित :

सुखमनुत्तरसुरावधि यदतिमेदुरं ।

कालतस्तदपि कलयति विरामं ॥

कतरदितरत्तदा वस्तु सांसारिकं ।

स्थिरतरं भवति चितय निकामं ॥ मू० ॥ ५ ॥

अर्थ : जो ! आ जगतमां भोटामां भोटां अने लांबो काण नभे ऐवा सुख तो अनुत्तर विभाननां छे. ते सुखनी पङ्ग काणे करी मर्यादा छे; अर्थात् अमुक वभते ए सुख पङ्ग विसाम पामे छे; ए सुख अनंत काण स्थावी नथी; तो ए अनुत्तर (जेनाथी भीज्ञ कांઈ उत्तर, यडियाती नथी) करतां संसारमां भीज्ञ कांઈ वस्तु यडियाती वधारे स्थिर छे, तेनो तुं योक्कस विचार कर. तात्पर्य के आ जगतमां कोई पङ्ग वस्तु स्थिर नथी. भले पछी ते कोझे-अबजो-परार्ध वरसो सुधी चाले, पङ्ग ते परार्ध वरसो पङ्ग मर्यादावाणां छे; अनंतकाणनी अपेक्षाए ए वरसो क्षण समान छे.

આવો અનિત્ય પ્રકાર આ જગતના જગતેતન ભાવનો વિચારીને વિનય !  
તું એ પરની મૂર્ખજી છાંડ. ૫.

સાથે રમનારા ચાલ્યા ગયા, છતાં આપણો નિ શંક !

યૈ: સમં ક્રીડિતા યે ચ ભૃશમીડિતા: ।

યૈ: સહાકૃષ્ણહિ પ્રીતિવાદં ॥

તાનુ જનાનુ વીક્ષ્ય બત ભસ્મભૂય ગતા-  
-ન્રિવિશંકા: સ્મ ઇતિ ધિકુ પ્રમાદં ॥ મૂ૦ ॥ ૬ ॥

અર્થ : અહો ! જેની સાથે આપણે બેલતા, રમતા, હસતા,  
બોલતા, આનંદવાર્તા કરતા, જેની સુતિ કરતા, મશકરી કરતા, એવા  
કેટલાક આપણા સ્નેહીઓને મૃત્યુ પામી ભસ્મીભૂત થયેલા જેયા, છતાં  
આપણે નિઃશંક છીએ, એ પ્રમાદને ધિક્કાર છે. આપણી સાથે જ  
રમનારા જેમ ચાલ્યા ગયા એમ આપણે પણ જવું છે, એ આપણાને કેમ  
વિચાર નથી આવતો ? હે, ચેતન ! આ પ્રમાદ કર્તવ્ય નથી. નિઃશંક  
રહેવા જેવું નથી. ચોક્કસ માન કે તેઓની પેઠે આપણે પણ જવું જ છે.

“રાજુ ગાળુને બોલતા,  
કરતા હુકમ દેરાન રે,

પોઢ્યા અભિનમાં એકલા,

કાયા રાખ સમાન રે;

બ્રહ્મદાત નરક પ્રયાણ રે,

એ ઋષિ અથિર નિદાન રે,

જવું પીપળ પાન રે,

મ ધરો જૂઠ ગુમાન રે,

સહજાનંદી રે આતમા,

તારું વિચારી જેય રે.”

— શ્રી વિરવિજયજ્ઞ

येतन ! तु ताहु विचार, अने आ अनित्य जगतनी मूर्छा छाँडी हे. ५

असकृदुमिष्य निमिषंति सिन्धूर्मिवत्-

चेतनाचेतनाः सर्वभावाः ॥

इन्द्रजालोपमाः स्वजनधनसंगमा-

-स्तेषु रूप्यंति मूढस्वभावाः ॥ मू० ॥ ७ ॥

**अर्थ :** आ जगतना बधा भाव, ज३ अने येतन भाव, स्थावर अने ज़ंगम भाव, समुद्रमां उठता कल्पोल जेवा छे. जेम समुद्रनां भोजन पारंवार उठीने लय पामे छे, तेम आ जगतना बीज बधा भाव उपजे छे अने विश्वसे छे. आम ए विनाशी छे. तेनो विश्वास कर्तव्य नथी. धन-स्वजनादिना संगम ईद्रज्ञ जेवा छे; छतां ते उपर जे छवो राये छे, ते खरेखर मूढ छे. येतन ! तारे ऐवी मूढता दाखववी घटती नथी. येतन ! ए भोउ वृथा छे; हुःखदायी छे; भाटे ए भोउ छाँडी हे; प्रभाद छाँडी हे. ७

काण भक्षक :

क्यलयनविरतं जङ्गमाजङ्गमं ।

जगदहो नैव त्रृप्यति कृतान्तः ॥

मुखगतान् खादतस्तस्य करतलगते-

-र्न कथमुपलस्यते इस्माभिरंतः ॥ मू० ॥ ८ ॥

**अर्थ :** अहो ! आ कृतान्त-काण जगतना सर्व स्थावर-ज़ंगम भावोनो निरंतर भक्ष करी रखो छे छतां तुमि पामतो नथी, पोताना मुखमां आवेदाने ए छोडतो नथी; तो पछी अमे जे अना छाथमां ज सपडायेला छीअे, तेने ए मुखमां मूँझी तेनो भक्ष क्यूँ विना केम रहेशे ? अर्थात् अमे पशु मृत्युने वश छीअे. काणे करी आ जगतना बधा भावो क्षणे क्षणे उपजे छे, विश्वसे छे, तेम आपछो पशु काणने वश होई उपज्वा-विश्वसवा ३५ जन्म-मरण करी रखा छीअे. शाश्वत तो एक आपझो आत्मा छे. बाझी केवण अनित्य छे. ते पर डिचित् पशु भोउ कर्तव्य नथी. ८

નિત્યમેક ચિદાનંદમયમાત્મનો ।  
 સુપરભિસ્થ સુખમનુભવેય ॥  
 પ્રશમરસ નવસુધાપાન વિનયોત્ત્સવો ।  
 ભવતુ સતતં સત્તામિહ ભવેદ્ય ॥ મૂ૦ ॥ ૯ ॥

**અર્થ :** ચેતન ! આગળ જણાવ્યા મુજબ જગતના બધા ભાવો કષણભંગુર છે. કેવળ નિત્ય, ચિદાનંદમય, જ્ઞાનાનંદમય, જ્ઞાન-દર્શન-ચારિત્રમય તો તું જ છે. તો તે જ તારું સ્વરૂપ જોઈ વિચારી તું સુખ અનુભવ. બીજી મૂર્ખી છાંડી દે.

અને સત્પુરુષો પ્રશમરસવાળા આ નૂતન અમૃતનું પાન કરી નિરંતર આ વિનયને (વિનયવિજ્ય ઉપાધ્યાય કર્તા પુરુષને, અથવા સુવિનીત આત્માને) આનંદ ઉત્સવ કરો. શ્રી વિનયવિજ્યજી કહે છે કે આ શાંત સુધારસ નામનો નવો ગ્રંથ, મેં લોકસેવામાં નિવેદન કર્યો છે; સજજનો તે વાંચી વિચારી તેનો લાભ લેશે, તો મને મોટો આનંદ ઉત્સવનું કારણ થશે. મારો પ્રયાસ સફળ થશે. સંસાર તાપથી બળતા જીવોને એ શાંતિનું કારણ થશે, એ મને મોટો લાભ છે.

આ અનિત્ય ભાવના ઉપર નીચેની વાત બહુ વિચારવા જેવી છે.

### ભિખારીનો ખેદ\*

“એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો, ત્યાં તેને ભૂખ લાગી. એટલે તે ભિયારો લડથડિયાં ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી ત્યારે તેના કાલાવાલાથી કરુણા પામીને તે ગૃહસ્થની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન ભોજન આણી આપ્યું. ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો; આવીને એક ઝડ તળે બેઠો; ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ જૂનો થયેલો પોતોનો જળનો ઘડો મુક્ક્યો, એક બાજુ એ પોતાની ફાટીતૂટી મલિન

\* શ્રીમદ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા. - શિક્ષાપાઠ ૪૧-૪૨

ગોદડી મૂકી અને એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રણજાળ થતાં એણો તે ભોજન ખાઈને પૂરું કર્યું. પછી ઓશીકે એક પથર મૂકીને તે સૂતો.

### ભિભારીનું સ્વખન :

ભોજનના મદધી જરા વારમાં તેની આંખો મીચાઈ ગઈ. નિત્રાવશ થયો, એટલે તેને એક સ્વખનું આવ્યું. પોતે જાણે મહા રાજરિદ્ધિ પાખ્યો છે; સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા છે; દેશ આખામાં પોતાના વિજયનો ઉકે વાગી ગયો છે.

સમીપમાં તેની આશા અવલંબન કરવા અનુયરો ડિભા થઈ રહ્યા છે; આજુભાજુ છઠીદારો ખમા ખમા પોકારે છે; એક રમણીય મહેલમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રીઓ તેના પગ ચાંપે છે; પંખાથી એક બાજુએથી પંખાનો મંદ મંદ પ્રવન ઢોળાય છે; એવા સ્વખનમાં તેનો આત્મા ચઢી ગયો. તે સ્વખનાના ભોગ લેતાં તેના રોમ ઉલ્લસી ગયાં. એવામાં મેઘ મહારાજા ચઢી આવ્યા, વીજળીના જબકારા થવા લાગ્યા, સૂર્યદ્વિ વાદળાંથી ઢંકાઈ ગયો; સર્વત્ર અંધકાર પથરાઈ ગયો; મુશલધાર વરસાદ થશે એવું જણાયું અને એટલામાં ગાજીવીજથી એક પ્રબળ કડાકો થયો, કડાકના અવાજથી ભય પામીને તે પામર ભિભારી બિચારો જાગી ગયો.

### સ્વખનું મિથ્યાપણું :

જુએ છે તો જે સ્થળે પાણીનો ખોખરો ઘડો પડ્યો હતો તે સ્થળે તે ઘડો પડ્યો છે; જ્યાં ફાટીતૂટી ગોદડી પડી હતી ત્યાં જ તે પડી છે. પોતે જેવાં મહિન અને ફાટેલાં કપડાં પહેર્યા હતાં તેવાં ને તેવાં ગોખજળીવાણાં વસ્ત્રો શરીર ઉપર ધારણ કર્યા છે. નથી તલભાર વધ્યું, કે નથી જવભાર ઘટ્યું. નથી તે દેશ કે નથી તે નગરી; નથી તે મહેલ કે નથી તે પલંગ; નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છઠીદારો; નથી તે સ્ત્રીઓ કે નથી તે વસ્ત્રાલંકારો; નથી તે પંખા કે નથી તે પવન; નથી તે અનુયરો કે નથી તે આશા; નથી તે સુખવિલાસ કે નથી તે મહોન્નતતા; ભાઈ તો જેવા પોતે હતા તેવા ને તેવા દેખાયા. એથી તે દેખાવ જોઈને

તે જેદ પાય્યો. સ્વપ્રમાં મેં ભિથ્યા આઉંબર દીકો, તેથી આનંદ માન્યો; એમાંનું તો અહીં કશુયે નથી. સ્વખના ભોગ ભોગવ્યા નહીં અને તેનું પરિશામ જે જેદ તે હું ભોગવું છું. એમ એ પામર જીવ પશ્ચાત્તાપમાં પડી ગયો.

### સંસાર એક સ્વખન :

અહો, ભવ્યો ! ભિખારીના સ્વમ જેવાં સંસારનાં સુખ અનિત્ય છે. સ્વખનમાં જેમ તે ભિખારીએ સુખસમુદ્ધાય દીકા અને આનંદ માન્યો તેમ પામર પ્રાણીઓ સંસારસ્વખનનાં સુખ-સમુદ્ધાયમાં આનંદ માને છે. જેમ તે સુખસમુદ્ધાય જગૃતિમાં ભિથ્યા જાણાયા તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં સંસારનાં સુખ તેવાં જાણાય છે. સ્વખના ભોગ ન ભોગવ્યા છતાં જેમ ભિખારીને જેદની પ્રાપ્તિ થઈ, તેમ મોહંદ્ય પ્રાણીઓ સંસારમાં સુખ માની બેસે છે; અને ભોગવ્યા સમ જણે છે; પરંતુ પરિશામે જેદ, દુર્જતિ અને પશ્ચાત્તાપ લે છે. તે ચપળ અને વિનાશી છતાં સ્વપ્રના જેદ જેવું તેનું પરિશામ રહ્યું છે.”

॥ ઇતિ શ્રીશાંતસુધારસગોયકાચ્યે અનિત્યભાવનાવિભાવનો

નામ પ્રથમः પ્રકાશः ॥

ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં

અનિત્ય ભાવના નામનો પ્રથમ પ્રકાશ સમાપ્ત.



ॐ

## અશરણ ભાવના

મરણ આવ્યે ચક્વતી અને ઈંડ પણ અનાથ :

॥ શાર્દૂલવિક્રીડિતં વૃત્તં ॥

ય ષટ્ઠંડમહી મહીનતરસા નિર્જિત્ય બગ્રાજિરે

યે ચ સ્વર્ગભુજો ભુજોર્જિત્પદા મેદુર્મુદા મેદુરા : ॥

તેજિ ક્રૂરકૃતાન્તવક્ત્રરદનેર્નિર્દલ્યમાના હઠા -

દત્તાણા : શરણાય હા દશ દિશઃ પ્રૈક્ષંત દીનાનનાઃ ॥૧॥

અર્થ : અહો ! જે મોટા પરાક્રમ વડે છ ખંડ પૃથ્વી જીતી તેના ઘણી થઈ બેઠા છે એવા ચક્વતી રાજાઓ, અને હર્ષ કરી પુષ્ટ થયેલા, અત્યંત બળવાન, સ્વર્ગસુખના ભોગવનારા એવા દેવતાઓ પણ કૂર કાળની તીણી દાઢાઓ વડે બળાત્કારે દળાઈ જતાં છતાં, તેને કોઈ બચાવી શકતું નથી. અહો ! એવા ચક્વતી અને દેવતાઓ પણ દીન વફને કરી દશે દિશાએ શરણ માટે દાણિ ફેંકે છે, પણ તેઓને કોઈ બચાવી શકતું નથી. કાળ આવ્યે જીવને કોઈ તેના મુખમાંથી બચાવવા સમર્થ નથી. છ ખંડ પૃથ્વીના ધણી મહાન ચક્વતીઓ પણ કાળની આગળ લાચાર છે. જે મહાન પરાક્રમ વડે તેઓ છ ખંડ પૃથ્વી જીતે છે તે મહાન પરાક્રમ પણ કાળ આગળ કાંઈ કરી શકતું નથી, કાળ આવે ત્યારે તેઓ દીન-લાચાર થઈ જાય છે. વળી દેવતાઓ પણ જેઓ અહોનિશ મોજ કરી રહ્યા છે, જેઓ અત્યંત બળવાન છે, પોતાની દેવતાઈ શક્તિથી ઈચ્છિત ભોગો પ્રાપ્ત કરી શકે એવા છે અને જેઓ સ્વર્ગના સુખમાં નિમણ છે, તે દેવતાઓ પણ આસુષ્ય કીણા થયે કાળના જપાટામાં આવી જાય છે; કાળ તેઓને પણ છોડતો નથી. કાળ આવે ત્યારે તેઓનું નૂર હરાઈ જાય છે, વીર્ય દાાઈ

જાય છે, ચિત્ત-પ્રકુલ્પિતતા નાશ પામે છે. તેઓ દીન મુખ કરી “અરે ! કોઈ બચાવો” એમ ચોતરફ દૃષ્ટિ ફેરે છે, જાવાં નાંખે છે, પણ અરે ! એવા ચકવતી અને દેવેંદ્ર પ્રમુખને પણ કોઈ ભોતના પંજમાંથી બચાવી શકવા સમર્થ નથી. હે, ચેતન ! આમ ચકવતી અને દેવતાથી માંડી આ જગતમાં સર્વ જીવ અશરણ છે. કાળ આગળ બધા લાચાર છે. તેઓને ગમે તેટલું બળ, પરાકર, અભિમાન, ઋષિહોય, પણ એ કોઈનું જેર જરા પણ કાળ આગળ ચાલતું નથી.

“જ ખંડના અધિરાજ જે ચેડે કરીને નીપજ્યા,  
બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા;  
એ ચતુર ચક્રી ચાલિયા હોતા ન હોતા હોઈને,  
જન જાણીયે મન માનીયે નવ કાળ મૂકે કોઈને.  
મહિમય મુગટ માયે ધરીને કર્ણ કુંડળ નાખતા,  
કાંચન કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા;  
પળમાં પડવા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખોઈને,  
જન જાણીયે મન માનીયે નવ કાળ મૂકે કોઈને.”

— શ્રીમદ્ રાજચંદ્ર

### શલાકા પુરુષોનો બોધ :

હે જીવ આમ ! કોઈને પણ કાળ છોડતો નથી. કાળના મુખમાં પડેલા બધા જીવો અશરણ છે. હે ચેતન ! પૂર્વકાળમાં થઈ ગયેલા તેસઠ શલાકા પુરુષો આપણને શું બોધ આપે છે ? તેઓ એમ કહે છે કે તમે જગતમાં જેને શલાકા પુરુષ ગણી ઉત્કૃષ્ટતા આપો છો, એવા અમે પણ આયુ પૂર્ણ થયે ચાલી નીકળ્યા, કાળ આગળ અમારું પણ કાંઈ ન ચાલ્યું; અમારી સિદ્ધિ થઈ તે તો જેડે કાળનો વિશ્વાસ ન કર્યો અને આત્મહિત સાધ્યું, બોધ્યું, એવા પૂર્વ થયેલા પરમ કૃપાળું અરિહંતદેવની કૃપાથી. બાકી અમે પણ અશરણ હતા. આવો અશરણતાનો બોધ એ પૂર્વ થયેલા મહાપુરુષોનાં ચરિત્રથી આપણને મળે છે.

“જન જાણીયે મન માનીયે નવ કાળ મૂકે કોઈને.”

— શ્રીમદ્ રાજચંદ્ર

## કાળનો વિશ્વાસ કર્તવ્ય નથી :

॥ સ્વાગતા વૃત્તં ॥

તાવદેવ મદવિભ્રમમાલી ।

તાવદેવ ગુણગૌરવશાલી ॥

યાવદક્ષમકૃતાન્તકટાક્ષૈ-

નૈકિતો વિશરણો નરકીઠ: ॥૨॥

અર્થ : અહો ! આ મૃત્યુને કોઈ વારી શકે એમ નથી. મૃત્યુ આગળ આ નર કીડા સમાન છે. આ નર-કીટનાં મદ, અહંકાર, વિલાસ અને ગુણનું ગૌરવપણું ત્યાં સુધી જ ટકવાના, કે જ્યાં સુધી એ કાળનાં કટાકખાણથી વિધાયો નથી, અથવા કાળ આવશે ત્યારે એ શરણરહિત થશે; એનું ડાપણ, એનું વાચાળપણું, એનો ધન, રૂપ, કુળ, જ્ઞાતિ, વિદ્યા, ઐશ્વર્ય આદિનો મદ-અહંકાર ઉંઘી જશે, એના મોટા મોટા ગુણો પણ ધર્યા રહેશે. એ બિચારો, કૂર કરાણ કાળના જપાટામાં આવી જશે. માટે રે, ચેતન ! તારે કાળનો વિશ્વાસ કરવા જેવું નથી. કાળના મુખમાં પણ્યો છું, તે તને કોઈ બચાવે એમ નથી. ૨.

“જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા,  
અવળા કર્યે જેના બધા સવળા સદા પાસા પડ્યા;  
એ ભાગ્યશ્શાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને,  
જન જાણીયે મન માનીએ નવ કાળ મૂકે કોઈને.  
તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા,  
હથી હણે હાથે કરી એ કેસરી સમ દેખિયા;  
એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને,  
જન જાણીયે મન માનીયે નવ કાળ મૂકે કોઈને.”

— શ્રીમદ્ રાજચંદ્ર

યમનો વજદંડ અને જીવની વિવશતા :

॥ શિખરિણી બૃત્તં ॥

પ્રતાપૈર્યાપત્રં ગલિતમથ તેજોભિસુદિતૈ ।

ગતં ધૈર્યોદ્યોગો: શ્લથિતમથ પુષેન વપુષા ॥

પ્રબૃત્તં તદ્વાગ્રહણવિષયે બાંધવજનૈ-

જને કીનાશેન પ્રસભમુષનીતે નિજવશં ॥૩॥

અર્થ : અહો ! જ્યારે યમરાજ આ જીવને એકદમ પોતાને સ્વાધીન કરે છે, અર્થાત્ જ્યારે કાળ આવે છે, ત્યારે આ જીવના પ્રતાપ, બળ, પરાક્રમ હરાઈ જાય છે; ગમે તેવી ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચેલું તેનું તેજ ગળી જાય છે; તેનાં ધૈર્ય, ઉદ્ઘોગો, પ્રવૃત્તિઓ, ખટપટ, આણપંખાળ, પ્રપંચ બધું જતું રહે છે; તેનું હષ્ટપુષ્ટ શરીર શિથિલ થઈ જાય છે; ટાહું શીતલ થઈ જાય છે, તેનાં હાજાં ગગડી જાય છે, કાયા નિસ્સેજ થઈ, ભૂમિ પર પડી જાય છે; અને તેના બાંધવજનો તેનું દ્રવ્ય લઈ લેવા પ્રવૃત્ત થાય છે. હે ચેતન ! કાળનું આવું નિષ્ઠુર સ્વરૂપ વિચારી તેનો તારે લેશ પણ વિશ્વાસ કરવો યોગ્ય નથી. કાળ કાંઈ આગણથી સંદેશો-સમાચાર કહાવતો નથી કે હું તમને લેવા આવું છું; તેથાર થઈ રહેજો. એ તો એકદમ અચાનક આવી પડે છે. ગમે તે સ્થળો, ગમે તે કાળો, ગમે તે સ્થિતિમાં કાળને કશો પ્રતિઅંધ નથી; એ અપ્રતિબદ્ધવિદ્ધારી છે. ચેતન ! કાળ આવતાં પોતાનું તો નૂર-તેજ હરાઈ જાય છે, ધીરજ જતી હે રહે છે, ઉદ્ઘમો લાંબા થઈ સુઝે છે.

સ્વાર્થપરાયણ બંધુઓ અને તેઓનું અજ્ઞાન :

એ તો ઠીક, પણ આ વિચિત્રતા, આ સ્વાર્થપરાયણતા તું જો તો ખરો, કે જે બાંધવવર્ગ ગણાય છે, તે તો જનાર્યાનાં દ્રવ્યની વહેચણીમાં, લેવાઢેવામાં ગુંથાય છે. તેઓ તો એમ જ જાણે છે, કે જનારો તો ગયો; આપણે તો કદી જવાના જ નથી.

## ફીલનાં બાચકાં અને જીવનાં જાવાં :

અહો ચેતન ! આ મોહ બહુ દુઃખદામી છે. કણનો લેશ માત્ર વિશ્વાસ કરવા જેવું નથી. કોઈ વીસ-પચીસ વરસનો નવયુવાન માણસ ગુજરી જય છે, ત્યારે લાલાકાર વર્તે છે; પોણોસો એંશી વરસનો ડોસો પણ બેદ કરે છે અને બિચારો ભરી ગયો એમ કહી શોક દેખાડે છે; પણ અરે ! હું પણ જવાનો છું, હું કાઈ અમરપટો નથી લખાવી લાયો, એ તો અને ભાન જ નથી આવતું. તેમ હે ચેતન ! જીવના ભરી ગયા પછી તેના બાંધવજનો દ્રવ્ય વહેંચવા-સાટવામાં રોકાય છે, કે જાણો તેઓ શાશ્વત રહેવાના છે ! અહો ! તેઓનો વિભાગ ! વળી હે ચેતન ! એક બાબત વિચારતાં બહુ બેદ થાય છે. જીવ ભરવાની આણી ઉપર હોય છે ત્યારે મૃત્યુથી ડરતો થાણે ચોતરફ બચવા જાવાં નાખે છે. પાણીના પૂરમાં તણાતાં માણસ જેમ ઊછળતાં મોજનાં ફીલને બાચકાં ભરે તેમ તેનાં જાવાં નકામાં છે. જે કુટુંબ આદિ સાથે તેને સ્નેહ છે, જે ધન-ધર આદિ પ્રતિ તેને મમતા લાગી છે. અને જે ચિંતવેલા મનોરથો અધૂરા રહી જાય છે તે બધાંને છોડતાં તેનું ફદ્ય કપાઈ જાય છે; તેથી છુંન ન થવું પડે તો સાંદું એમ એ જાવાં નાખે છે. પણ કૂર પમરાજની આગળ તેનું કશું ચાલતું નથી. જેના પર સ્નેહ રાખ્યો છે, જેના પર મમત્વ દાખલ્યું છે, એવી વસ્તુઓ પરાણે બળાત્કારે તેને છોડવી પડે છે. તે વખત તેની આંતરડી કપાઈ જાય છે, પણ કોઈને તેની દ્યા આવતી નથી, કોઈ તેને બચાવતું નથી. તેના સ્વજનો, કુટુંબીઓ તેને શાંતિ-દિલાસો આપવાને બદલે તેનાં દુઃખમાં ઉમેરો કરે છે.

## મૃત્યુ સુધારક બોધ

### મૃત્યુ સુધારવા બોધ, આરાધના, નિઝામણાં :

રે ભાઈ ! તું કશામાં મેમત્વ રાખીશ નહિ, આ મૃત્યુ કોઈને છોડે એમ નથી, આયુષ્ય પ્રબળ હશે તો હજી પણ તું બચીશ, આયુષ્ય નહિ હશે તો ઉપાય નથી, માટે બેદ કરીશ નહિ. બેદ કરવાથી કાંઈ મૃત્યુને દ્યા જાવે એમ નથી, એ પાછું જાય એમ નથી. એમે પણ વહેલા-મોડા આયુષ્ય પૂર્ણ થયે ચાલી નીકળશું, મોટા મોટા રાજી-રાજા પણ ચાલી

નીકળ્યા છે, તેઓનાં નામનિશાન પણ રહ્યાં નથી, માટે ભાઈ, આ વખતે તું બીજા કશામાં ચિત્ત રાખ નહિ. એક પરમ શરણના દાતાર અરિહંતદેવ પર ચિત્ત રાખ, નિરાગી સર્વજ્ઞ પરમાત્માનું સ્મરણ કર, એ તને સહાય થશે, બાકી અમારી કે આ બીજા કુદુંબિઓની કે આ ઘર-બારની કે ધનની ફીકર કર નહિ. તું ઈચ્છે કે ન ઈચ્છે પણ તારે છોડવી પડશે, માટે એમાં મોહ ન રાખ, એથી મૂર્ખરી પામ નહિ. એ મોહ-મૂર્ખરી દુઃખદાયી છે, તારો રોગ એથી શાંત થવાને બદલે વધે છે, તું કાળની વધારે નજીક જતો જય છે, તારો આત્મા મલિન થાય છે, તારી બુદ્ધિ મંદ થાય છે, તારું જ્ઞાન અવરાય છે.

માટે પ્રિયબંધુ ! આ વખતે તો તું સદ્ગુરુ, સદ્ગર્મનું શરણ દે, બીજી ચિત્ત છોડી હે. તે અને અમે બધાઓ અનેક વખત જન્મ-મરણ કર્યાં છે, અનેક વખત આ પ્રમાણે મૃત્યુ પામતાં દુઃખ આપણે પામ્યા છીએ; એ મમત્વને લઈને. પણ બંધુ ! એ મમત્વ છાડશું, શાંત ચિત્ત રાખી આત્મા ઉપર ધ્યાન રાખી આ મરણકાળ આરાધી લેશું, તો બંધુ ! ફરી ફરી આવાં મરણનાં દુઃખ ભોગવવાં નહિ પડે, માટે બંધુ ! તને અમારી અતિ નખ અને હિતકરી વિનંતિ છે, કે તું તારો જીવ અમારામંથી કે આ ઘરબાર, ધનાદિ પરવસ્તુમંથી ખસેડી તારા પોતાના ધ્યાનમાં લગાડ અથવા પરમાત્મામાં જોડ.

**પોતાના પ્રારબ્ધ પોતા પાસે :**

**બધાનો ભગવાન બેલી :**

આ તારાં નિરાધાર સ્ત્રી-પુત્રોની અથવા આ તારાં નિરાધાર ભાઈ-ભાંડું, માતા-પિતાની લેશ માત્ર ચિત્તા કરીશ નહિ. તારા વિના એનું શું થશે, એને કોણ પાળશે-પોખરો, એ ચિત્તા પણ રાખીશ નહિ, કેમ કે સર્વનો બેલી પરમેશ્વર છે. જેને કોઈ આધાર નથી તેનો આધાર પરમેશ્વર છે. તેઓ બધાં પોતપોતાનાં કર્મ કરી આવ્યાં છે, પોતપોતાનાં કર્મ કરી સુખ દુઃખ ભોગવશે, સારું-માહું ભોગવશે, તેઓના પૂર્વ સંચિત-પ્રારબ્ધ તેઓની પાસે છે, તે તેઓના બેલી થશે. માટે તું લેશમાત્ર તેમની ચિત્તા કરીશ નહિ. વળી તેઓને અર્થે તારી કરેલી ચિત્તા કોઈ પણ

દીતે કામ આવે એમ નથી, કારણ કે તું ગમે તેટલા દુઃખ-બેદ ધરે પણ એથી આ કાળશિકારીને જરા પણ દયા આવવાની નથી, તે તને છોડવાનો નથી, અથવા બે-ચાર દિવસ વધારે રહેવા દે એવી મહેતલ આપે એવો નથી.

### કાળનો કઠિન કાયદો :

એનો કાયદો અતિ કઠિન છે; તે કોઈને છોડે એમ નથી. એટલે તારી ચિત્તા નકામી છે, ઊલંઘું તાંકું જ્ઞાન મહિન કરે છે, માટે તેઓને તો તું પરમેશ્વરને સોંપી દઈ તું તારો વિચાર કર અને આ તારી મરણની છેલ્લી ઘડી છે, તેમાં પ્રભુને સમરી લે, પરમ પવિત્ર પંચપરમેષ્ઠિના ધ્યાનમાં લીન થા, બીજું બધું ભાન ભૂલી જા, આથી તારી પરમ સદ્ગતિ થશે.

બંધુ ! અમે તારા ગમે તેવા પ્રિય ભિત્ર, કુટુંબીઓ, બાંધવ જન છીએ છતાં અમે તને બચાવી શકીએ એમ નથી. બંધુ ! જે તું આ મૃત્યુથી બચી શકે એમ હોય તો અમારાથી બનતું અમે લે કરીએ, ધન ખરચીએ, ડાહાપણ ડાહોળીએ, પણ એ ધન કે ડાહાપણ, કોઈની લાગવગ, સિફારસ, શિરજોરી આ કાળના વજ જેવા રાજ્યદંડ આગળ ચાલતી નથી, એનો કાયદો અપ્રતિહત છે, એટલે બંધુ ! અમે લાચાર છીએ. બંધુ ! અમે પણ તારા જવાથી બહુ દુઃખી થશું, તારા વિરહથી અમને પણ લાગી આવે છે; પણ શું કરીએ ? ઉપાય નથી. બેદ કરવો તે કેવળ મોછ છે, તે અમારે પણ કર્તવ્ય નથી.

### પંખીમેળો :

આપણે સાંજે\* જાડ પર આવી બેઠેલાં પંખીના ટોળા સમાન છીએ. આયુષ્ય ક્ષય થવારૂપ મ્રાતઃકાળ થયે આપણે બધા પોતપોતાના માર્ગ ચાલી નીકળવાના એ સત્ય છે, માટે અરસપરસ વિરહયોગે આપણે લેશમાત્ર બેદ કર્તવ્ય નથી; આપણે જરાએ બેદ કર્તવ્ય નથી. હે બંધુ ! તું તારા સ્વરૂપમાં લીન થા, પ્રભુને ભજ. હવે એ જ તારો આધાર છે.

\* “પંખી આપ ફીર ચિહ્ન દિશકે, તરુંવર રેન બસેરા,  
સહુ અપને અપને મારગતે હોત ભોરકી વેરા.

અવધૂ કયા તેરા કયા મેરા ?”

## અસાધ્ય રોગમાં ભગવત્શરણ પરમૌષધ :

તારો રોગ ટાળવા અમે અમારું બનતું કર્યું છે, અમે તારો રોગ ટાળવા યોગ્ય ઉપયારો કરી અમારો બંધુધર્મ જાળવ્યો છે. આ બંધુધર્મ તો આ ભવનો જ છે; પણ તારો રોગ ઉપશમ્યો નહિ, પણ કર્મ કઠણાઈએ વધતો ગયો; અને હવે તું પ્રત્યક્ષ મૃત્યુની અંજી ઉપર આવી પડ્યો છે; માટે હવે તો પરમ ઔષધરૂપ પરમાત્માનું રટણ કર.

“શરીરે જર્જરીભૂતે, વ્યાધિગ્રસ્તે કલેવરે ।

ઔષધં જાહીવીતોયં, વૈદ્યો નારાયણો હરિ ॥”

## વાસ્તવિક બંધુભાવ :

એથી તારું પરમ કલ્યાણ થશે. આ ભવના બંધુરૂપે તારી સેવા-ચાકરી, તારું વૈયાવૃત્ય, ઔષધોપચાર કરી અમે બંધુભાવની ફરજ યથાશક્તિ અદા કરી છે; એ છતાં તને રોગ શાંતિરૂપ કરવા અસમર્થ થયા છીએ, પણ બંધુ ! એ બંધુભાવ વાસ્તવિક નથી; ખરો બંધુભાવ તો હવે દેખાડીએ છીએ. પ્રથમ બંધુભાવ તો મોહને લઈ અમે દાખવ્યો. હવે તને તારા પોતાના સ્વરૂપમાં લીન થવા, તારા આત્માનું તારા જ્ઞાનાદિનું ચિંતવન કરવા, પરમાત્માનું ધ્યાન કરવા રૂપ બોધ આપી અમે ખરો બંધુભાવ બજાવીએ છીએ. બંધુ ! આ છિત્વચનો કહી અમે અમારી ફરજ અદા કરીએ છીએ.

## સંસારની અસારતા અને ચાર શરણા :

તું કશામાં ચિત્ત રાખીશ નહિ, લેપાઈશ નહિ, તું અનંત શક્તિનો ધણી એવો આત્મા છે, કર્મવશે આવા દુઃખ ભોગવવાં પડ્યાં, અજ્ઞાને કરી કર્મવગ થયો; માટે ફરી એ દુઃખ ન ભોગવવાં પડે, સંયોગ-વિયોગ ન પામવા પડે એ માટે જ્ઞાનમાં લીન થા. આ શરીરરોગ તો ન ટાયો; હવે આ ભવરોગ ટાળવા જ્ઞાનનો આશ્રય લે; પ્રભુભક્તિરૂપ ઔપદ્ય લે.

“જન્મ જરા મરણે કરી એ,  
આ સંસાર અસાર તો,  
કર્યા કર્મ સહુ અનુભવે એ,  
કોઈ ન રાખણાર તો,  
શરણ એક અરિહતનું એ,  
શરણ સિદ્ધ ભગવંત તો,  
શરણ ધર્મ શ્રી જિનનો એ,  
સાધુ શરણ ગુણવંત તો.”

— શ્રી વિનયવિજયજી (પુષ્પપ્રકાશ સ્તવન)

### પુષ્પનો પ્રકાશ અને આરાધનાનાં દ્વાર :

બંધુ ! આ વિચાર આજ શરણરૂપ છે, માટે તું આગલાં પાપોની ત્રિકરણ શુદ્ધિએ ક્ષમા ચાહ, આશે-અજણે કરેલાં-થાએલાં વૈર વિરોધ માટે પ્રાણીમાત્રની ક્ષમા માંગી લે, દુષ્કૃતની નિદા કર, ઉત્તમ કૃત્યની અનુમોદના કરી લે, આ ભવમાં તેં જે જે સારાં કૃત્યો કર્યા હોય તે સારભૂત ગણી તેની અનુમોદના કર, પ્રત પચ્ચખાડા આદર, દેહ પરથી ભમય છાડી હે, આનશન કર, આ રોગમાંથી સહેજે ઉંહું તો ભલે, નહિ તો મારે હવે આ દેહથી કાંઈ પણ વસ્તુ ખાન-પાન, ઔષધાદિ કલ્પે નહિ એમ પ્રતાદિ આદર અને પ્રભુમાં લીન થા. બંધુ ! ઉત્તમ ગતિ પામવાનો આ ઉત્તમ રસ્તો છે; પૂર્વના મહાપુરુષો ઉત્તમ ગતિ એ વાટે પોત્યા છે. માટે તું પણ એ વાટે નિશ્ચય ઉત્તમ ગતિ પાભીશ, અમે તારા ખરા પ્રિયજનો છીએ; તારી પરમ સદ્ગ્રાતિ થાઓ એવું અંતઃકરણથી ઈચ્છાએ છીએ. માટે બંધુ ! હવે તારા મૃત્યુકાળની આ પળ જય છે, એ છેલ્લી પળો છે એમ સમજી તારા પોતામાં લીન થા, બીજું લક્ષ છોડી હે, શ્રી પરમ સદગુરુ પરમાત્માને સંભાર.

### આ તે સ્નેહ કે વૈરીભાવ ?

આવા પ્રકારનો મૃત્યુ સુધારનારો શાંત-પવિત્ર-ઉપકારી બોધ

આપવાને બદલે, હે, ચેતન ! જેને તું સ્વજન, કુટુંબીઓ ગણો છે તે તો ઉલટા તું જતો રહેવાનો છે એમ જાણી તારા દુઃખ-રોગ-ચિંતાની દરકાર રાખ્યા વિના તને પૂછે છે : કહો કાંઈ કહેવું છે ? હવે તમારા વિના આ બાધીનું શું થશે ? આ છોકરાંઓનું ભરણ-પોષણ કોણ કરશે ? આ માબાપને કોણ પાળશે ? એ આદિરૂપે વિટંબના કરી ઉલટા જનારોનાં દુઃખમાં શાંતિ-દિલાસો આપવાને બદલે તેના દુઃખમાં ઉમેરો કરે છે. જે ચિંતાથી તે પીડાય છે તે જ ચિંતામાં વધારો કરે છે. હે, ચેતન ! જેને તું તારાં ગણો છે, તેઓ તને જો ! આમ દુઃખ વખતે કેવું સુખ આપે છે ! વળી તેઓ કદાચ સ્વાર્થ છાંડી તારા રોગ નિવારણના ઉપાય જરૂરી રાખે તો તું કદાચ બચી જય, પણ તે તો પોતાના સ્વાર્થને વશ થઈને, તારું અહિત જ વાંચે છે. તને સહજ લગાર વધારે રોજ થયો જાણી, અરે ! અમારું હવે શું થશે ? એમ સ્વાર્થવશ થઈ રહી પડી તને વધારે દુઃખી કરે છે. તેઓ તારા દુઃખને રેડે છે. તું આ રોગથી મરી જવાનો છે, એવો તને તો ઘ્યાલ પણ ન હોય અને તું હિંમતમાં હોય, પણ તે તારો ઘ્યાલ અને હિંમત એ તારા ગણાતાં સ્વજનો રહેવા દેતાં નથી તો ! તેઓના કલ્યાંઠથી તું નિરાશ થઈ જય છે. તારા પગ ભાંગી જય છે અને એ નિરાશાથી પણ ધક્કીવાર રોગ વધી તારું સોપવાતી (સોપકમી) આપું તૂટી જઈ તું મૃત્યુને વશ થાય છે. તેઓ પોતાના સ્વાર્થને નહિ રહતાં તને હિંમત આપે તો ઉલટો તારો રોગ ઉપશમી તું કદાચ વધારે વખત જીવવા પામે, પણ હે, ચેતન ! તારાં એ સ્વજનો એમ કલ્યાંઠી થવા દે ? આવો આ મૃત્યુ અવસરનો સ્વજનાદિનો વિચિત્ર મોહ છે, વિચિત્ર સ્વાર્થ છે.

**મૃત્યુ પાછળ વાણોખાં, પડ્યા પર પાટુ,  
જશ બદલે જુતિયાં, સ્નેહીઓનો સ્વાર્થ :**

અને ચેતન ! તારા જવા પછી એ શું કરે છે ? તું જે તેઓને માટે આપો ભવ ધૂળ ઘાલી રહ્યો, ખખ્યો તેનું તો ગમે તે થાઓ, સારી ગતિ થાઓ કે માઠી થાઓ; તેનો તો તેઓને વિચાર પણ નથી, પણ ઉલટા તારા જવા પછી તારાં દ્રવ્યની ભાંગફોડ કરે છે; તે વહેંચાણીમાં તોકાન કરે છે, કોઈને ઓછું મળે છે, કોઈને વધારે મળે છે, આથી વિરોધ થાય છે; કોઈ તને જશ આપે છે, કોઈ તારાથી યેડા કાઢે

છે. આમ પછવાડે તારા પ્રતિ વીતક થાય છે, વીતે છે. પોતાનું સુખ ગયું જાહી લીઓ લાંબા કાળ સુધી રડાપીટ કરે છે, તારા નામનો છેડો તાણે છે. પુરુષો પણ તારા સંબંધ રૂપ નામને યાદ કરી, કોઈ ભાઈ કહી, કોઈ બેટા કહી તને લાંબા સાદે યાદ કરે છે, પણ કોઈ એમ નથી વિચારતું કે તારી શી ગતિ થઈ ? તું કઈ ગતિમાં પડ્યો ? તારું શું થયું ? તું સુખી છે કે હુઃખી ? એનો હે ચેતન ! કોઈ વિચાર કરતું નથી. તું ગયો એમ અમારે પણ જવું છે એવો વિચાર પણ તેઓને નથી. તેઓ તો જાણે શાશ્વત રહેવાના હોય, એમ ગણી તારાં ધન-પરિશ્રાહની વહેચણી કરતાં ઓછું-વધારે મળવાથી ઉલટા કલાહ કરે છે, અને જે ધન તેં પાપ કરી, હુઃખ વેઠી ભેગું કર્યું, અને જે બધું ઉપભોગમાં લીધા વિના આમ ને આમ મૂર્તી તારે આમ કાળને વશ થઈ ચાલી નીકળવું પડ્યું, તે જે તારાં ધનને લઈ તેઓ તને કલંક આપે છે, તારી અપકીર્તિ ગાય છે, તને ચોરે ચડાવે છે કે ફલાણો ગયો, પણ મારું કાંઈ કરતો ન ગયો, અથવા અમુકને વધારે આપતો ગયો, મને ઓછું આપતો ગયો.

### દ્રવ્યનો હુરુપયોગ :

ચેતન બંધુ ! આ પ્રમાણે તારા જવા પછી તારા દ્રવ્યનો તેઓ સ્વાર્થવશે ગેરઉપયોગ કરે છે. તારા નામને ફરતી પાદડી બંધાવે છે. પણ કોઈને એમ વિચાર નથી સૂજતો; કે એ બિચારે હુઃખી થઈ, પાપ કરી આ પૂંજ ભેગી કરી એ પોતે ભોગવ્યા વિના ચાલતો થયો, તો એ બધી પૂંજ નહિ તો તેનો અમુક ભાગ ભલા સુકેને વાવીએ; ધર્મ અર્થે આપીએ, સુપાને તેનું દાન કરીએ; આ વણા ગરીબ કંગાળ અપંગ છે; તેઓને તે વડે ખાવા-પીવાનું કરી આપીએ, ભલા એની આંતરી છરશે; ધર્મ થશે; અથવા જ્ઞાન ઉદ્ઘાર કરીએ. આ બધાં ધર્મકાર્યથી મરનારનાં આત્માનું કલ્યાણ થશે; અને આપણે પણ એ ધર્મકાર્યમાં કારણિક હોવાથી આપણને પણ ધર્મલાભ થશે. ચેતન બંધુ ! આ વિચાર તેઓને નથી આવતો. તેઓ પામર બિચારા વિચારતા નથી કે જે ધન જનારાને ભોગ ન પડ્યું તે તેઓને ભોગ કેમ પડશે ? પણ મૌહ-અવિવેક-સ્વાર્થ આડે તેઓ આ વિચાર નથી કરી શકતા.

બંધુ ! જે મૃત્યુ પછી પછવાડે આવી સ્થિતિ થાય છે, તે

મૃત્યુ-શિકારી બાળ ખેંચીને આ સંતોષમાં અપ્રમાણિકા તિલો છે. તેમાં  
જીવે દેશ ભાત્ર પ્રમાણ કર્તવ્ય નથી. ત

હવે આ ભાવનાનું અષ્ટાગ્નિયું કહે છે :

**સ્વજન સમીપ છતાં સંત પણ મરણ આગળ અશરણ :**

॥ મારુતી રાગ ॥

સ્વજનજનો બહુધા હિતકાર્મ ।

પ્રીતિરસૈરભિરાર્મ ॥

મરણદશાવશ મુપગતવંત ।

રક્ષતિ કોડપિ ન સન્ત ॥

વિનય વિધીયતાં રે શ્રી જિનધર્મ: શરણ ।

અનુસંધીયતાં રે શુચિતરચરણસમરણ ॥ ૧૧ ॥

અર્થ : ચેતન ! ઉપર જે સ્વજનોનો સ્વાર્થ પ્રકાર બતાવ્યો. તે કાઈ  
બધા સ્વજનો એવા નથી હોતા, એ સાચી વાત છે; પણ ઘણાખરા, સ્વાર્થ  
આડે, જનારાનો વિચાર નથી કરતા; છતાં ઘણો ભાગે સ્વજનો આપણા  
હિતના કામી હોય છે, આપણા હિતમાં રાજુ હોય છે અને આપણા ઉપર  
પ્રીતિ કરી રાજુ થાય છે; પણ જ્યારે મરણ અવસ્થા જીવને આવે છે  
ત્યારે જ્યે કોઈ સંતપુરુષ હોય, પણ તેનું કોઈ રક્ષણ કરતું નથી; તેને  
મૃત્યુમાંથી કોઈ બચાવી શકતું નથી. આમ સંતપુરુષો પણ મરણમાંથી  
બચવા અસમર્થ છે, તેને તેના પર પ્રેમ ધરનારા તેના હિતેણી સ્વજનો  
પણ બચાવી શકતા નથી. આમ આ અશરણતા વિચારી, વિનય ! તું  
પવિત્ર શ્રી જૈન ધર્મનું શરણ લે; અને વિરોધ પવિત્ર એવા ચારિત્રનું તથા  
જેણો ચારિત્ર અંગીકાર કર્યું છે એવા પવિત્ર સત્યપુરુષોનું સરણ કર.

“સર્વજનો ધર્મ સુશર્ણ જાહી,

આરાધ્ય આરાધ્ય પ્રમાવ આણી;

અનાથ એકાંત સનાથ થાશે,

એના વિના કોઈ ન બાંધુ સ્હાશે.”

— શ્રીમદ્ રાજચંદ્ર કૃત ભાવનાબોધ - અશરણ ભાવના

ચેતન ! તને એક સર્વજ્ઞ પરમાત્માનો ધર્મ જ શરણભૂત થશે, તેનું  
શરણ ધર. ૧

મીન અને ધીવર તેમ છુવ અને યમ :

તુરગરથેભનરાવૃત્તિકલિતં  
દધતં બલ મસ્હાલિતં ॥  
હરતિ યમો નરપતિમણિ દીનં ।  
મैનિક ઇવ લઘુમીનં ॥ વિં ॥૨॥

અર્થ : અહો ! જેમ મથીમાર માછલીઓ પકડી તેને દીન કરી મૂકે  
છે તેમ જેની આસપાસ અશ્વ, રથ, લાથી, પાયદળ એ રૂપ ચતુરંગી  
સેના વીંયાઈ રહી છે અને અસ્થાલિત બળને ધરવાવાળા છે એવા રાજ  
પણ યમના મુખમાં પડતા દીન થઈ જય છે; તેવા સેના અને ભુજાબળ  
ઉપર મુસ્તાક રહેનારા નૃપતિઓ પણ કાળ આગળ અશરણ છે.  
મથીમાર આગળ પામર માછલીઓ જેમ દીન-લાચાર છે તેમ કાળ  
આગળ આવા બળવાન ઋષિદ્વિમાન રાજાઓ પણ લાચાર છે.

“અતુલ બલી હરિ યકી રામા,  
ભુજોર્જિત મદમત્ત રે;  
કૂરે જમ બલ નિકટ આવે,  
ગલિત જયે સત... માયા જલ રે.”

— શ્રી રૂપવિજયજી

બધાને નચાવનારો નિર્દ્ય કાળ !

પ્રવિશતિ વજ્ઞમયે યદિ સદને,  
વૃણમથ ઘટયતિ વદને ॥  
તદપિ ન મુદ્ધતિ હત સમવર્તી,  
નિર્દ્યપૌરુષનર્તી ॥ વિં ॥ ૩ ॥

અર્થ : અહો ! આ કાલ-કૃતાંત ડેવળ દયુરાહિત છે. તે પોતાના

બળે નાચી રહ્યો છે, અને જગતના બળવાન જીવોને પણ નચાવી રહ્યો છે. તે બધા પર એકસરખો પ્રહાર કરવાવાળો છે. નથી જેતો એ રંક, નથી જેતો એ રાજ, નહિ નાનો, નહિ મોટો-ગમે તે હોય-બધા પર એક સરખી રીતે પોતાના વજનભય કાયદાનો અમલ કરે છે. કોઈ જીવ ભલે વજનભય, ચોતરફ મજબૂત બંધ એવા ધરમાં પુરાય, પણ ત્યાં પણ તેને કાળ છોડતો નથી. અથવા ભલે તે જીવ મોઢામાં તણખતું લઈ કાળને બચાવવા આજુજુ કરે, પણ કાળ તો તે આજુજુ ઉપર ધ્યાન જ આપતો નથી. આમ કાળ આગળ આપું જગત અશરણ છે. મોટા મોટા રાજવીઓ કાળને વશ થઈ જમદેશ ચાલી ગયા છે.

“જે તખત બેસી હુકમ કરતા,  
પહેરી નવલા વેષ રે;  
પાઘ સેહરા ધરત ટેઢા,  
મરી ગયા જમદેશ - માયાજલ રે.  
પૃથ્વીને જે છત્ર પરે કરે,  
કરે મેરુનો દડ રે;  
તે પણ ગયા હાથ ધસંતા,  
મૂકી સર્વ અખંડ - માયાજલ રે.”

— શ્રી રૂપવિજયજી

આમ હે વિનય ! આજો સંસાર અશરણાનુપ છે, માટે તું તો પવિત્ર શ્રી કૈન ધર્મનું શરણ આદર અને પવિત્ર ચારિત્રની અનુસંધિ કર. ત વિદ્યા, મંત્ર, તંત્ર, ઔષધ, બધાં કાળ આગળ અફળ :

વિદ્યામંત્રમહૌષધિસેવાં,  
સૂજતુ વશીકૃતદેવાં ॥  
રસતુ રસાયનમુપચયકરણ,  
તદ્વિષ ન મુખતિ મરણ ॥ વિ૦ ॥ ૪ ॥

અર્થ : ચેતન ! ભલે ચાહે તે કોઈ વિદ્યાસિદ્ધિથી કે મંત્રસિદ્ધિથી કે કોઈ મહાઔષધિ વડે દેવતાને સાધી; અથવા શરીરને મજબૂત કરવા, પુષ્ટ

કરવા, વજ જેવું કરવા રસાયન સેવે, પણ તેને એમ છતાં પણ મૃત્યુ છોડતું નથી. આયુષ્ય ક્ષીણ થયે મંત્રસિદ્ધિ, વિદ્યાસિદ્ધિ, કે દેવતાની સહાય કાંઈ કામ આવતું નથી; એમાંથી કાંઈ પણ મૃત્યુ રોકવા સમર્થ નથી. તેમજ રસાયણ વડે ભલે શરીરને તંહુરસ્ત કે પુષ્ટ કર્યું હોય, પણ તેવું શરીર પણ આયુ ક્ષીણ થયે કામ આવતું નથી. એવા શરીરમાંથી પણ આત્માને કાળ ધકેલી મૂકે છે, માટે વિદ્યા, કે મંત્ર, કે દેવસાધના, કે રસાયન કોઈ માન કરવા યોગ્ય નથી. મોટા મોટા ધન્યવંતરી જેવા વૈઘો, ડૉક્ટરો પણ કાળ આગળ વિવશ થઈ જઈ દેખ છોડી ચાલી નીકળ્યા છે. તેઓની વૈઘક-કુશળતા કાંઈ કામ નથી આવી, તેમ જ મોટા વિદ્યાસિદ્ધિવાળા વિદ્યાર્થરો, કે તંત્રમાં કુશળ તાંત્રિકો પણ આયુ પૂર્ણ થયે હોતા નહોતા થઈ ગયા છે. આમ હે વિનય ! સર્વ જીવ કાળ આગળ અશરણ છે. એક પરમ આશ્રયરૂપ શ્રી જિનવર દેવ અને પવિત્ર ચારિત્ર છે તેને તું આદર. ૪

### મરણને કશી અટકાયત નથી :

વધુષિ વિરં નિરુણદ્વિ સમીરં ।  
પતતિ જલધિપરસીરં ॥  
  
શિરસિ ગિરેરધિરોહતિ તરસા ।  
તદપિ સ જીર્યતિ જરસા ॥ વિ૦ ॥ ૫ ॥

**અર્થ :** કોઈ માણસ ભલે પવન જ્ય કરે, અર્થાત્ ગ્રાણાયામ વડે લાંબા કાળ સુધી શરીરમાં પવનનો રોધ કરે, ભલે કોઈ માણસ સમુદ્રને પેલે પાર જઈ પડે, અથવા મહાપરાક્રમે કરી ઊંચા પર્વતના શિખર પર ચડી જઈ બેસે, પણ ત્યાંથે તેને ઘડપણ છોડે એમ નથી, ત્યાં પણ તેનો દેહ જર્જરિત થઈ પડી જવાનો જ, ત્યાં પણ મૃત્યુ આવવાનું જ.

“જન્મ જરા મરણો કરી એ,  
આ સંસાર અસાર તો.”

આ સંસારમાં જન્મ-જરા-મરણની અશરણતા ઠેરઠેર છિવાઈ રહી છે. એવું કોઈ સ્થળ નથી કે કોઈ જીવ તેનો આશ્રય લઈ એન્ટિપુટિથી બયે.

ઉંચા પર્વતની ટોચ ઉપર, ઊરી ખાઈના તળિયે, સમુક્રને પેલે પાર ગમ્યાં જાઓ પણ મરણ તો ચોક્કસ છે. પવન રોધી કોઈ સમાધિ લગાવે, પણ આથું પૂર્ણ થયે તેને દેહ છોડવો જ પડશે. આમ, હે વિનય ! આ આથું જગત અશરણભૂત છે. શરણરૂપ તો અરિહ્ંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, નિરાગી મુનિવરો અને તેઓશ્રીનો પ્રરૂપેલ ધર્મ છે. તેનો હે વિનય ! તું આશ્રય કરી તારા આત્માની ચારિન સાથે અનુસંધિ કર. તારા આત્માને ચારિત્રમાં, સંયમમાં જોડ. ૫

### જરા પણ દુર્વાર :

સૃજતી મસિતશિરોરૂહલિતિં,  
મનુજશિરો\* વલિપલિતિં ॥  
  
કો વિવધાનાં ભૂઘનમરસં,  
પ્રભવતિ રોધ્યું જરસં ॥ વિ૦ ॥ ૬ ॥

અર્થ : અહો ! આ જરા અવસ્થાને અટકાવવા કોણ સમર્થ છે ? કોઈ નથી. માણસના કાળા વાળ, જેથી માણું શોભી રહ્યું છે, તેને શેત પલીયલ કરી મૂકે છે. યુવાવસ્થારૂપ વર્ષાંજીતુના આ સુંદર કાળા વાળરૂપી પાણીથી ભરેલાં શ્યામ વાદળને અહો ! આ જરાવસ્થા શેત વાળરૂપ બીજી ઝાતુના પાણી વિનાના વિરસ વાદળાં કરી મૂકે છે. અથવા ધડપણ વાળને શેત કરી મૂકે છે, શરીરનો રસ હરી લે છે. એવા ધડપણને કોણ છઠાવી શકે એમ છે ? ધડપણ આગળ પણ કોઈની કારી ફાવતી નથી, ટીકી લાગતી નથી, એવો અશરણભૂત આ સંસાર છે, એમ જોઈ ચેતન વિનય ! તું શ્રી જિનેંદ્ર ભગવાનનું શરણ લે. ૬

### શરીર રોગશ્રસ્ત :

ઉદ્યત્ત ઉગ્રરૂજા જનકાયઃ,  
કઃ સ્યાતત્ત્ર સહાયઃ ॥  
  
એકોડનુભવતિ વિધુરુપરાગં,  
વિભજતિ કોડપિ ન ભાગં ॥ વિ૦ ॥ ૭ ॥

\* પાઠાંતર - 'મનુજશિર: વિતપદિત.'

અર્થ : હે બંધુ ચેતન ! જ્યારે આ દેહ રોગવ્યાપ થશે, ત્યારે તને કોઈ સહાયભૂત થશે ? ના, કોઈ નહિ. કોઈ એમાં ભાગ નહિ લે. તેમ કે જો ! આ ચંદ્રનું રાહુ વડે ગ્રહણ થાય છે ત્યારે એ ગ્રહણપીડિઓમાં ચંદ્રની આસપાસના બીજા નક્ષત્ર-તારા ભાગ લે છે ? ના, નહિ જ. એ ગ્રહણ ચંદ્ર પોતે જ ભોગવે છે, તેમ આ શરીરમાં પ્રત્યક્ષ રોગાદિ ઉપજે, તે આત્માએ જ ભોગવવાં પડે છે; આસપાસના હંસ જન, મિત્ર, કુટુંબીઓ કે સ્વજન કોઈ તેમાં ભાગ લેતું નથી. કોઈ એ હુખ ઓછું કરી શકતું નથી, કે ટાળી શકતું નથી.)

“શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય;  
તે કોઈ અન્યે લઈ ના શકાય.”

- શ્રીમદ્ રાજચંદ્ર હૃત ભાવનાબોધ - એકત્વભાવના

આમ હે ચેતન ! આ જગતને જન્મ, જરા, રોગ, મૃત્યુને વશ પડ્યું અશરણરૂપ દેખી તું શ્રી છિનેશ્વર ભગવાનનો આશ્રય લે, તેઓનો ધર્મ આદર. ઉ

શરણ એક ધર્મ :

શરણમેકમનુસર ચતુરઙ્ગ,  
પરિહર મમતાસરં ॥  
  
વિનય રવય શિવસૌરવ્યનિધાનं,  
શાંતસુધારસપાનં ॥ વિ૦ ॥ ૮ ॥

અર્થ : હે વિનય ! આમ સર્વ પ્રકારે આ જગત અનાથ, અશરણ છે, એમ જાણી તું જેના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ જ્ઞાન ચતુરથીરૂપ ચાર અંગ છે, એવા તારા શાશ્વત આત્માનો જ આશ્રય કર; અથવા જેને એ ચતુરથી વ્યક્ત થઈ છે એવા વીતરાગ પરમાત્માનું શરણ લે; અથવા દાન-શીલ-તપ-ભાવ-રૂપ જેનાં ચાર અંગ છે, એવા પવિત્ર ધર્મનો આશ્રય લે, પરવસ્તુ પરની મમતા અને આસક્તિ ત્યજે દે, અને હે વિનય ! આ શાંત સુધારસનું પાન કરી શિવસુખ પ્રાપ્ત કર. આ શાંત સુધારસના પાનથી તને મોક્ષશ્રી મળશે. માટે વિનય ! આ

જગત અસાર અશરાવાડુપ આણી -

“ભજ સદા ભગવંત ચેતના,  
સેવ શુદ્ધ પદપદ્મ રે;  
રૂપ કહે કર ધર્મકરણી,  
પામે શાશ્વત સબ... માયાજલ રે.”

- શ્રી રૂપવિજયજી

અનાથી મુનિ\*

અનેક પ્રકારની ઋષિવાળો મગધ દેશનો<sup>+</sup> શ્રેષ્ઠ નામે રાજ અશકીડાને માટે મંડિકુંબ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારનાં વૃક્ષો ત્યાં આવી રહ્યા હતાં; નાના પ્રકારની કોમળ વેલ્લીઓ વટાટોપ થઈ રહી હતી. નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પશ્ચિમોનાં મધુરાં ગાયન ત્યાં સંભવાતાં હતાં; નાના પ્રકારનાં જળનાં જરાણ ત્યાં વહેતાં હતાં; ટૂંકમાં એ વન નંદનવન જેવું લાગતું હતું. તે વનમાં એક ઝડ તળે મહાસમાધિવંત પણ સુકુમાર અને સુખોચિત મુનિને તે શ્રેષ્ઠિકે બેઠેલા દીઠા. એનું રૂપ જેઈને તે રાજ અત્યંત આનંદ પાય્યો. ઉપમા રહિત રૂપથી વિસ્મિત થઈને મનમાં તેની પ્રશાંસા કરવા લાગ્યો: આ મુનિનો કેવો અદ્ભુત વર્ણ છે! એનું કેવું મનોહર રૂપ છે! એની કેવી અદ્ભુત સૌભ્યતા છે! આ કેવી વિસમયકારક ક્ષમાનો ધરનાર છે! આના અંગથી વૈરાગ્યનો કેવો ઉત્તમ પ્રકાર છે! આની કેવી નિર્લોભતા જ્ઞાય છે! આ સંયતિ કેવું નિર્ભય નામ્રપણું ધરાવે છે! એ ભોગથી કેવો વિરક્ત છે! એમ ચિંતવતો ચિંતવતો, મુદ્દિત થતો થતો, સુતિ કરતો કરતો, ધીમેથી ચાલતો ચાલતો, પ્રદક્ષિણા દઈને, તે મુનિને વંદન કરીને અતિ સમીપ નહીં, તેમ અતિ દૂર નહીં એમ તે શ્રેષ્ઠિક બેઠો.

\* શ્રીમદ્ રાજચંદ્ર ફૂલ મોકામાણ.

+ શ્રેષ્ઠ રાજ પચીસસ્થો વરસ ઉપર છાલના મૂર્વ બંગાળના એક મહાન જૈનધમા રાજ હતા. શ્રી તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના પરમ અનન્ય ભક્ત હતા.

### શ્રેષ્ઠિક અને અનાથી મુનિનો સંવાદ :

પછી બે હાથની અંજલિ કરીને વિનયધી તેણે તે મુનિને પૂછ્યું : “હે આર્થ ! તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરણ છો; ભોગવિલાસના માટે તમારી વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; પ્રત્યુત્તુના કામભોગ, જળ સંબંધીના વિલાસ, તેમ જ મનોધારિશી સ્ત્રીઓનાં સુખવચનનું મધુર શ્રવણ છીતાં, એ સઘળાનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉધમ કરો છો એનું શું કારણ ? તે મને અનુગ્રહથી કહો.”

રાજનાં આવાં વચન સાંભળીને મુનિએ કહ્યું “હે રાજ ! હું અનાથ હતો. મને અપૂર્વ વસ્તુનો ગ્રામ કરાવનાર તથા યોગક્ષેમનો આપનાર, મારા પર અનુકૂળા આણનાર, કલણાથી કરીને પરમ સુખનો દેનાર એવો મારો કોઈ મિત્ર થયો નહીં, એ કારણ મારા અનાથીપણાનું હતું.”

શ્રેષ્ઠિક મુનિના ભાષણથી સ્પિત હસીને બોલ્યો :- “તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હોય ? જો કોઈ નાથ નથી તો હું થઈ હું. હે ભયત્રાણ ! તમે બોગ ભોગવો. હે, સંયતિ ! મિત્ર, જ્ઞાતિએ કરી દુર્લભ એવો છે તમારો મનુષ્યભવ સુલભ કરો.”

### વંધ્યા પુત્ર કચ્છાંથી આપે ?

અનાથીએ કહ્યું : “અરે ! શ્રેષ્ઠિક રાજ ! પણ તું પોતે અનાથ છે તો મારો નાથ શું થઈશ ? નિર્ધન તે ધનાઢ્ય કચ્છાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન કચ્છાંથી આપે ? અજ તે વિદૃતા કચ્છાંથી હે ? વંધ્યા તે સંતાન કચ્છાંથી આપે ? જ્યારે તું પોતે અનાથ છે તો મારો નાથ કચ્છાંથી થઈશ ?”

### શ્રેષ્ઠિક મહારાજાની આકુળતા :

મુનિનાં વચનથી રાજ અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. કોઈ કણે જે વચનનું શ્રવણ થયું નથી, તે વચનનું યત્તિ-મુખથી શ્રવણ થયું અથી તે શંકિત થયો અને બોલ્યો :- “હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, અનેક પ્રકારના મદોન્મત હાથીઓનો. ધર્ષી છું, અનેક પ્રકારની સેના

મને આધીન છે; નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુર્ખાદની કંઈ મારે ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સંવધા પ્રકારના ભોગ હું પામ્યો છું; અનુયરો મારી આજાને હૃતી રીતે આરાધી છે; એમ રાજને છાજતી સર્વ પ્રકારની સંપત્તિ મારે ધેર છે, અનેક મનોવાંચિત વસ્તુઓ મારી સમીપ રહે છે. આવો હું મહાન છતાં અનાથ કેમ હોઉં ? રખે હે ! ભગવાન ! તમે મૃષા બોલતા હો.”

મુનિએ કહું : “રાજ ! મારું કહેવું તું ન્યાયપૂર્વક સમજનો નથી. હવે હું જેમ અનાથ થયો, અને જેમ મેં સંસાર ત્યાજ્યો તેમ તને કહું છું; તે એકાત્મ અને સાવધાન ચિત્તથી સાંભળ. સાંભળીને પછી તારી શંકાનો સત્યાસત્ય નિર્ણય કરજો :

### અનાથીની અનાથતા :

“કૌશાંબી” નામે અતિ ઊર્જ અને વિવિધ પ્રકારની ભવ્યતાથી ભરેલી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્વિથી પરિપૂર્ણ ધનસંચય નામનો મારો પિતા રહેતો હતો. હે મહારાજ ! યૌવનવયના પ્રથમ ભાગમાં મારી આંખો અતિ વેદનાથી વેરાઈ; આપે શરીરે અજ્ઞિ બળવા માંડ્યો; શાસ્ત્રથી પણ આતિશય તીક્ષ્ણ તે રોગ વૈરીની પેઠે મારા ઉપર કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુઃખવા લાગ્યું. વજના મદાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપભૂવનારી એવી તે દારુણ વેદનાથી હું અત્યંત શોકમાં હતો. સંખ્યાબંધ વૈદ્ય શાસ્ત્રનિપુણ વૈદ્યરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા; અને તેમણે અનેક ઔપધ ઉપચાર કર્યા, પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ ગજાતા વૈદ્યરાજે મને તે દર્દથી મુક્ત કરી શક્યા નહીં, હે રાજ ! એ જ મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું; પણ તેથી કરીને મારી તે વેદના ટળી નહીં. હે રાજ ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખાર્ત થઈ;

\* અલ્લાહાબાદથી ચાણીસ માઈલ દૂર “કૌશાંબ” ગ્રામ છે, ગ્રામહું છે, જૂના ખરિયેરો છે, ફેનોનું તીર્થ છે, વિચ્છેદ પ્રાય છે, General Cunninghamના Reports on the archæological researches of Indiaમાં એ બાબત ધર્યું જાગ્રત્વ જેવું મળે છે.

પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ હે રાજ ! મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા, પણ મારી તે વેદના ટળી નહીં, હે રાજ ! એ જ મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું તે દુઃખ ટળ્યું નહીં. હે મહારાજ ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા ઉપર અનુરત અને પ્રેમવંતી હતી, તે આંસુ ભરી મારું હૈયું પલાણતી હતી, તેણે અત્ર-પાણી અને નાના પ્રકારનાં અંધોલણ, ચૂવાછિક સુગંધી પદાર્થ, તેમજ અનેક પ્રકારનાં ફૂલચંદનાદિકનાં અજીવીતાં અજીવીતાં વિલેપન કર્યા છતાં, હું તે વિલેપનથી મારો રોગ શમાવી ન શક્યો; ક્ષણ પણ અગળી રહેતી નહોતી એવી તે સ્ત્રી પણ મારા રોગને ટળી ન શકી, એ જ હે મહારાજ ! મારું અનાથપણું હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહિ. એ વેળા પુનઃ પુનઃ મેં અસ્વચ્છ વેદના ભોગવી. પછી હું પ્રયંકી સંસારથી બેદ પામ્યો. એક વાર જે આ મહાવિંબનામય વેદનાથી મુક્ત થાઉં તો ખંતી, દંતી અને નિરારંભી પ્રવજ્યાને ધારણ કરું, એમ ચિંતવીને શયન કરી ગયો. જ્યારે રાત્રી અતિકમી ગઈ ત્યારે હે મહારાજ ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ; અને હું નીરોગી થયો. માત-તાત-સ્વજન-બંધવાહિકને પૂછીને પ્રભાતે મેં મહા ક્ષમાવંત, ઈદ્રિયને નિગ્રહ કરવાવાળું અને આરંભોપાદિથી રહિત એવું અણાગારત્વ ધારણ કર્યું.

### અનાથીની સનાથતા :

“હે શ્રેણિક રાજ ! ત્યાર પછી હું આત્મા-પરમાત્માનો નાથ થયો. હવે હું સર્વ પ્રકારના જીવનો નાથ છું. તું જે શંકા પામ્યો હતો તે હવે ટળી ગઈ હશે. એમ આપું જગત ચક્કવતી પર્યેત અશરણ અને અનાથ છે. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે; માટે હું કહું છું તે કથન તું મનન કરી જજે. નિશ્ચય માનજે કે આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે; આપણો આત્મા જ કુર્ઝ શાલ્ભાલિ વૃક્ષના દુઃખનો ઉપજવનાર છે.

## આત્મા કર્તા અને આત્મા હત્તા :

આપણો આત્મા જ વાંछિત વસ્તુરૂપી દૂધની દેવાવણી કામગેનું ગાયના સુખનાં ઉપજવનાર છે; આપણો આત્મા જ કર્મનો કરનાર છે, આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે; આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપણો આત્મા જ દુઃખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વેરી છે; આપણો આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણો આત્મા જ નિર્ભળ આચારે સ્થિત રહે છે.”

## “શ્રેષ્ઠિક મહારાજા સમકિત પાખ્યા રે”

એમ આત્મપ્રકાશક બોધ શ્રેષ્ઠિકને તે અનાથી મુનિએ આપ્યો. શ્રેષ્ઠિક રાજ બહુ સંતોષ પાખ્યા. બે હાથની અંજલિ જોડી તે એમ બોલ્યો : “હે ભગવન્ ! તમે મને ભલી રીતે ઉપદેશ્યો; તમે જેમ હતું તમ અનાથપણું કહી બતાવ્યું. મહર્ષિ ! તમે સનાથ, તમે સબાંધવ અને તમે સધર્મ છો. તમે સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ ! હું તમને ક્ષમાવું છું, તમારી જ્ઞાન શિક્ષાથી લાભ પાખ્યો છું. ધર્મધ્યાનમાં વિદ્ધ કરવાવાળું ભોગ ભોગવવા સંબંધીનું મેં તમને હે મહાભાગ્યવંત ! જે આમંત્રજ્ઞ દીવું, તે સંબંધીનો મારો અપરાધ મસ્તક નમાવીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સુતિ ઉચ્ચારિને રાજ્યપુરુષકેસરી શ્રેષ્ઠિક વિનયથી પ્રદક્ષિણા કરી સ્વસ્થાનકે ગયો.

## તાત્ત્વય્ય :

મહાતપોધન, મહામુનિ, મહાપ્રભાવંત, મહાયશવંત, મહાનિર્ગ્રથ અને મહાશ્રુત અનાથી મુનિએ મગધદેશના શ્રેષ્ઠિક રાજને પોતાનાં વીતક ચરિત્રથી જે બોધ આપ્યો છે, તે ખરે ! અશરાણભાવના સિદ્ધ કરે છે. મહામુનિ અનાથીએ ભોગવેલી વેદના જેવી, કે એથી અતિ વિશેષ વેદના અનંત આત્માઓને ભોગવતા જોઈએ છીએ એ કેવું વિચારવા લાયક છે ! સંસારમાં અશરાણતા અને અનંત અનાથતા છિવાઈ રહી છે. તેનો ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ થાય છે. એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા છતાં અનાથી અનાથ હતા; તેમ પ્રત્યેક

આત્મા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સર્વે અનાથ જ છે. સનાથ થવા  
સર્વે, સત્કર્મ અને સત્ગુરુને જાળવા અવશ્યના છે.”

॥ ઇતિ શ્રી શાંતસુધારસગેયકાવ્યે અશરણભાવનાવિભાવનો

નામ દ્વિતીયઃ પ્રકાશઃ ॥

ઇતિ શ્રી શાંત સુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં

અશરણભાવના નામનો બીજો પ્રકાશ સમાપ્ત.



ॐ

## સંસારભાવના।

લોભ દાવાનણ :

॥ શિખરિણી વૃત્તં ॥

ઇતો લોભ: ક્ષોભં જનયતિ દુર્તો દવ ઇવો ।  
 લસલાભાભોભિ: કથમપિ ન શક્યઃ શમયિતું ॥  
 ઇતસ્તુણાડકાણાં તુદતિ મૃગતૃણેવ વિફળા ।  
 કર્થ સ્વસ્થૈ: સ્થેર્ય વિવિદ્યભયભીમે ભવવને ॥૧॥

અર્થ : અહો ! આ ભવરૂપી વનમાં અનેક પ્રકારના ભય રહેલા છે; એ ભવ-વન અત્યંત ભયંકર છે; તેમાં જીવો સ્વસ્થતા કેમ પામી શકે ? આ ભવરૂપી વનમાં લોભરૂપી દાવાનણ પ્રગટ્યો છે. તે જીવોને ક્ષોભ પમાડી રહ્યો છે. તે લોભ દાવાનણ દુર્ત છે; તેનો જલદી સહેલાઈથી અંત આણી શકાય એમ નથી; અહો ! એ લોભરૂપ દાવાનણ કેવા પ્રકારે શમાવી શકાય ? એ શમાવવો દુષ્કર છે; કેમ કે જેમ જેમ લાભ મળો છે, તેમ તેમ લોભ વધો છે. લાભરૂપી જળથી એ લોભ શમાવી શકાય એમ નથી.

અંજવાનાં પાણી અને વિષયરસ :

“જહા લાહો તહા લોહો ।”

જેમ જેમ લાભ મળો તેમ તેમ લોભ વધો, લોભ-તૃણા બહુ અનિષ્ટ વસ્તુ છે; એ આકાશના જેવી અનંત છે; તે સદાકાળ નવયૌવન રહે છે; કંઈક ઈચ્છા જેટલું મામ થયું કે એ ઈચ્છાને વધારી ટે છે અથવા

લોભ-તૃષ્ણા આદિ વિષયોનો એ સ્વભાવ જ છે, કે જેને અર્થે એ લોભ, વિષયવિકાર આદિ ઉપજેલ હોય, તે મળે તે લોભ-વિષય વિકાર આદિ ઉપશમવાને બદલે વધે છે. અજિનમાં ધી હોમવાથી, અજિની શાંતિ થવાને બદલે જેમ વૃદ્ધિ થાય છે, તેમ વિષયને પુષ્ટ કરે આવી વસ્તુ આપવાથી વિષય વધે છે. તેમ જ લાભથી લોભ વધે છે. આવો લોભ દાવાના આ સંસાર અરણ્યમાં પ્રજણી રહ્યો છે; વળી આ સંસાર અરણ્યમાં ઈદ્રિયોરૂપ પશુઓ વિષયરસરૂપ જાંઝવાનાં પાણીની તૃષ્ણા રાખી નકામા હુંઘી થાય છે. વિષયરસ જાંઝવાનાં પાણી જેવાં છે. જાંઝવાનાં પાણીથી જેમ તરસ છીપતી નથી, ઊલટી વધે છે; તેમ વિષયરસથી ઈદ્રિયો તુમ થતી નથી, ઊલટી વધારે તરસી થાય છે, બહેકી જાય છે અને આત્માને હુંઘી કરે છે. અહો ! આવી મૃગતૃષ્ણા જેવી તૃષ્ણા જે સંસારવનમાં જીવોને હેરાન કરી રહી છે, તેમાં તે જીવો ક્યાંથી સુખ-સ્વસ્થતા પામે ? અથર્તુ ન જ પામે. આવી ભયંકર આ સંસારઅટવી છે. તૃષ્ણારૂપી દાવાના ચોતરક પ્રજ્યાલિત છે અને તે બિચારાં પ્રાણીઓનો એકી હાથે સંદાર કરી રહ્યો છે. એવું આ સંસારનું ભયંકર સ્વરૂપ વિચારી હે ભવ્યો ! તેમાંથી છૂટવાનો ગ્રયાસ-પુરુષાર્થ કરો. ૧

ચિંતાનો અસ્થલિત પ્રવાહ – આધિ, વ્યાધિ અને ઉપાધિ :

૧૦૩ -

ગલત્યેકા ચિંતા ભવતિ પુનરન્યા તદધિકા ।

મનોવાકાયે હા વિકૃતિરતિરોધાત્તરજસ : ॥

વિપદ્ગતાર્વત્તે જ્ઞાટિતિ પતયાલો : પ્રતિપદ : ।

ન જંતો : સંસારે ભવતિ કથમયાર્ત્તિવિરતિ ॥૨॥

અર્થ : અહો ! આ સંસારમાં પ્રાણીઓને કોઈ પણ પ્રકારે હુંઘનો અંત આવતો નથી. અથર્તુ આ સંસાર હુંઘમય છે. જ્યાં એક ચિંતા મટી ન હોય, ત્યાં બીજી એથી મોટી ચિંતા આવીને ઊભી રહે છે. જીવોના મન, વચ્ચન, કાયામાં વિકાર હોય છે. જીવો આધિ, વ્યાધિ, ઉપાધિગ્રસ્ત છે. કોઈ જીવોને માનસિક પીડા નહે છે, કોઈ ચિંતાથી, વહેમથી હુંઘિત.

હોય છે, તો કોઈ જીવોને શરીર સંબંધી, રોગ આદિનું દુઃખ હોય છે, તો કોઈ જીવોને મહાઉપાધિનું, વ્યવહાર-ખટપટનું દુઃખ હોય છે. કોઈને એ એક, કોઈને બે, તો કોઈને ત્રણેથી દુઃખ હોય છે. આમ આ સંસારમાં મન, વચન, કાયાના વિકારથી જીવો દુઃખી છે. આમ આ સંસાર વિપત્તિની ખાઈ જેવો છે. તેમાં પ્રતિક્ષણે જીવો પડી રહ્યા છે. આવી વિપત્તિની ખાઈરૂપ સંસારમાં પ્રાણીઓના દુઃખનો ભેટેય આરો નથી. તે સંસાર પ્રતિ જીવે લેશમાત્ર મોહ કરવા જેવું નથી. “જ્ઞાનીઓએ આ અનંતખેદમય, સંસારને અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઈને તેઓએ આ સંસારને પુંઠ દીધી છે, તે સત્ય જ છે. એ ભણી પાછું વળી જેવા જેવું નથી. ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે.” ૨

— શ્રીમદ્ રાજચંદ્ર કૃત મોક્ષમાળા

દુઃખ કયું ?

સહિત્વા સંતાપાનશુચિજનનીકુક્ષિકુહરે ।  
તતો જન્મ પ્રાય્ પ્રચુરતરકષ્કમહતઃ ॥  
સુખાભાસૈર્યવત્સૃશતિ કથમધ્યતિરિવાતિ ।  
જરા તાવત્કાયં કવલયતિ મૃત્યો: સહચરી ॥૩॥

અર્થ : જીવ પ્રથમ તો માતાની અપવિત્ર કૂખમાં-ગર્ભમાં જ અનેક સંતાપ સહન કરે છે. પછી જન્મ પામી અનેક પ્રકારના મહાકષ્ટો પામી મોટો થઈ, લાશ, હવે દુઃખનો અંત આવ્યો, હવે નિરાંત થઈ એમ જ્યાં દેખીતાં સુખ, કાલ્યનિક સુખનો સ્વર્ણ કરે છે, ત્યાં જ મૃત્યુની બેનપણી જરા અવસ્થા કાયાનો ક્રોણિયો કરી જાય છે, અર્થાત્ ઘડપણ આવે છે, દેહ જર્જીરિત થવા માટે છે અને કાળ આવી ઓણિંતો પ્રાણ હરી લે છે. આવો દુઃખરૂપ આ સંસાર છે. ગર્ભનાં દુઃખથી માંડી મરણ પર્યત જીવ દુઃખી જ છે.

“જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ;”

— શ્રીમદ્ રાજચંદ્ર

અહો ! આ જગતમાં મોટા મોટા દુઃખના હેતુ હોય તો તે જન્મ-જરા-મરણરૂપ સંસાર જ છે.

“કારણ તેનાં બે કથાં, રાગ-દ્રેષ આજાહેતુ.”

— શ્રીમદ્ રાજચંદ્

### દુઃખનાં કારણ :

એ સંસારદુઃખનાં કારણ જેનું કશું પણ પ્રયોજન નથી, એવા રાગ-દ્રેષ કરવા એ જ છે. અર્થાત્ જીવને રાગ-દ્રેષ કરવાનું કાંઈ પણ પ્રયોજન જ નથી. એને શું મળી જાય છે, અથવા એનું શું હરાઈ જાય છે કે એ રાગ-દ્રેષ કરે છે ? એનું તો એની પાસે છે. નથી તલભાર વધતું કે નથી જવભાર ઘટતું. તો તે શા માટે રાગ-દ્રેષ કરે છે ? એ રાગ-દ્રેષ કરવાથી તો ઊલદું એને જન્મ-મરણરૂપ સંસારમાં ભટકવું પડે છે. એ સંસાર કેવળ દુઃખમય જાણી એણે રાગ-દ્રેષ છાંડવા યોગ્ય છે.

### ગર્ભદુઃખ :

ઓક તરણા સુકુમારને રોમે રોમે લાલચોળ સોયા ધોચીએ તેથી જે અસંઘ વેદના ઊપજે છે તે કરતાં આઠગણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે, ત્યારે પામે છે.

### જન્મદુઃખ :

લગભગ નવ ભાસ મળ, મૂત્ર, લોહી, પડુ આદિમાં અહોરાત્ મૂર્ખાગિત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે.

### બાધ્યદુઃખ :

ગર્ભસ્થાનની વેદનાથી અનંતગણી વેદના જન્મ સમયે ઊપજે છે. ત્યાર પછી બાળાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ અને અજ્ઞાનાવસ્થામાં અણસમજથી રજણી રડીને તે બાળાવસ્થા પૂર્ણ થાય છે અને યુવાવસ્થા આવે છે.

### યૌવનદુઃખ :

ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પત્ત થયો ત્યાં એટલે વિષયવિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ,

આળસ, અભિમાન, નિધ દેખિ, સંયોગ, વિયોગ એમ ઘટમાણમાં પુવાવય ચાલ્યું જાય છે; ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે.

### વાર્ધક્યહુઃખ :

શરીર કેપે છે, મુખે લાળ જરે છે, ત્વયા પર કરચલી પડી જાય છે. સુંધરું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે. કેશ ધવળ થઈ ખરવા માಡે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ લડથડિયાં ખાતાં ચાલવું પડે છે. કાં તો જીવન પર્યત ખાટલે પડ્યા રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઈત્યાહિ રોગ આવીને વળજે છે, અને થોડા કાળમાં કાળ આવીને ક્રોણિયો કરી જાય છે.

### મરણહુઃખ :

“આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે પણ કેટલી બધી વેદના છે ?”

- શ્રીમદ્ રાજચંદ્ કૃત મોક્ષમાણ

આમ જીવનથી માંડી મરણ પર્યત જીવને દુઃખ, દુઃખ ને દુઃખ જ આ સંસારમાં છે, સુખ નથી. આ સંસાર કેવળ દુઃખદાયી છે. ૩

### જીવ પંખી, દેહ પિંજર, કાળ બિલાડો :

॥ ઉપજાતિવૃત્ત ॥

વિભ્રાન્તચિત્તો બત બંગ્રમીતિ ।

પદ્મીવ રૂદ્રસ્તનુપઝરેડ્જી ॥

નુદ્રો નિયત્યાડતનુકર્મતં-

-સંવાનિત: સાગ્રહિતાંતકૌતુ: ॥ ૪ ॥

અર્થ : અહો ! આ દેહરૂપી પાંજરામાં પુરાઓલો જીવરૂપ પદ્મી ભાંતિવાણા ચિત્તે કરી, વિભ્રમે કરી, મિથ્યાત્યે કરી વસુના અનિષ્ટયે કરી, ચોતરઙ્ગ, ચતુર્ગતિમાં ભટકી રહ્યો છે, પરિભ્રમણ કરી રહ્યો છે. આહટ દોહટ ચિત્તવી રહ્યો છે, કર્મ બાંધી રહ્યો છે. પ્રારંભે પ્રેર્યો ધ્યકો

મોટાં કર્મરૂપ તાંત્રણાથી વીટાયો છે. કાળરૂપ બિલાડે તેની પાસે બેઠો છે. તે આ જીવપંખીને ઉપાડ્યે કે ઉપાડ્યો એમ થઈ રહ્યું છે. પ્રથમ તો ભાંતિવાળા ચિત્તને લઈ આ જીવને કાંઈ પણ સુખનો લેશ નથી; એ નિર્ણતર કાળના સુખમાં પડ્યો છે. આવો આ સંસારનો પરિભ્રમણનો દુઃખદ પ્રકાર છે. ૪

॥ અનુષ્ટુપ્સ્વર્તં ॥

અનંતાન્ પુદ્ગલાવર્તાનનંતાનંતસ્પભૃત ।

અનંતશો ભ્રમત્યેવ, જીવોઽનાદિભવાણવિ ॥ ૫ ॥

અર્થ : આ સંસાર અનાદિ છે. એ સંસાર-સમુક્રમાં જીવ અનંતીવાર અનંતા પુદ્ગલપરાવર્તન કરી રહ્યો છે, અનંતાનંત રૂપ ધારણ કરતો તે કરી રહ્યો છે. અહો ! આ પરિભ્રમણનું દુઃખ ઓછું નથી. હે જીવ ! એ પરિભ્રમણરૂપ દુઃખથી નિવૃત્ત થા, નિવૃત્ત થા. તેમાં થવા પુરુષાર્થ કર, પુરુષાર્થ કર. તેંબું ભવ કર્યા. ૫

“હો, સાહેબ, બાહુ જિનેશ્વર વિનિઃ,  
વિનતારી અવધાર હો,

હો, સાહેબ, ભવમંડપમાં નાટક નાચિયો,  
હવે મુજ પાર ઉતાર હો. હો સાહેબ.”

— પ્રાકૃત સ્તવન.

જાણો તે માણો :

હવે આ ગીજુ ભાવનાનું અષ્ટાગિયું કહે છે,  
કુદારા રાગ-શાંત સુધારસ કુંડમાં-એ દેશી ॥

કલય સંસારમતિદારુણ,  
જન્મમરણાદિભયભીત રે ॥

મોહરિપુણેહ સગલગ્રહં,  
પ્રતિપદ વિપદમુપનીત રે ॥ ક૦ ૧ ॥

અર્થ : હે ! વિનય ! જો તને જન્મ, મરણાદિના ભય લાગ્યા હોય,  
અર્થાત જો તું જન્મ-મરણથી ઉરતો હોય તો આ સંસારને અત્યંત દારૂણ  
જાણ. અરે ! તને મોહરપી શત્રુ ગણેથી પકડી પ્રતિક્ષાણો વિપત્તિ પમારી  
રહેલ છે. જેને જન્મવાળો, મરવાનો, જરાવસ્થાનો, અનિષ્ટ સંયોગનો,  
ઈએ વિયોગનો, રોગ આદિનો ભય ન હોય, તે બલે સુખેથી સંસારમાં  
સુખ માને ! પણ તને હું કહું છું કે વિનય ! જો તું એ જન્મ-મરણના  
હુખ્યથી ઉરતો હોય તો મોહ છોડી દઈ આ સંસારને કેવળ દારૂણ,  
હુખ્યમય જાણ. જન્મ-મરણથી ન થાક્યા હોય, ભય ન પાયા હોય,  
એવા બીજા છુંબો બલે સુખે સુવે, મોહ કરી સંસારને બલે સુખરૂપ  
માને-પણ તું તો હે વિનય ! જો તારે એ હુખ્યમાંથી, ભયમાંથી છૂટનું  
હોય, તો આ સંસારને હુખ્યરૂપ દારૂણ જાણ, કેમ કે હુખ્યનું કારણ  
જાણવામાં આવે તો તે ટાળવા પ્રયત્ન થાય; માટે પ્રથમ તો તું આ  
સંસારને હુખ્યરૂપ જાણ. હુખ્યરૂપ એને જાણીશ તો તું એમાંથી ઓસરીશ;  
તો તું એનો મોહ મૂકીશ; એનાથી પરાજૂખ થઈશ; અને એનો મોહ જતાં  
તારી સત્ય વસ્તુ ઉપર તને ભાવ આવશે, તેનું ભાન થશે, તેનું શાન  
થશે, તેનો પ્રત્યક્ષ અનુભવ થશે, માટે વિનય, તું આ સંસારને દારૂણ  
જાણ. ૧

### સંસાર અનુભવ :

સ્વજનતનયાદિપરિચયગુણૈ-  
રિહ મુધા બધ્યસે મૂઢ રે ।  
પ્રતિપદં ન વનવૈરનુભવૈ:  
પરિભવૈરસકૃતુપગૂઢ રે ॥ ક૦ ૨ ॥

અર્થ : ચેતન ! આ પુત્ર સ્વજનાદિના પરિચયમાં કણે કણે વારંવાર  
જીતજીતના, નવા નવા, અનુકૂળ-પ્રતિકૂળ અનુભવ નથી થતા ? થાય  
છે. કોઈના પરિચયથી હર્ષ થાય છે, કોઈના પરિચયથી શોક થાય છે,  
કોઈના પ્રસંગથી માન, કોઈના પ્રસંગથી અપમાન, કોઈના પ્રસંગથી તેનું  
મન દુભાવું, કોઈના પ્રસંગથી આપણું દિલ દુભાવું, કોઈનાથી વૈરવિરોધ,  
કોઈનાથી સ્નેહ, કોઈનાથી અભાવ,-આમ અરસપરસ પરિચયથી,

જાતજાતના અનુભવ થાય છે. તો હે, ચેતન ! એ સ્વજન પુત્રાદિના પરિચયરૂપી દોરડાથી તું શા માટે ફોકટ બંધાય છે ? એ બંધન તને હિતકારી નથી; અહિતકર છે. સ્વજનાદિના સંગપ્રસંગથી નકામા બંધાવું એ આ દારુણ સંસારનો જ ચમત્કાર છે; તે તું હે વિનય ! વિચાર, વિચાર. ૨

### અસ્તોદય અને સમવૃત્તિ :

વળી -

ઘટયસિ ક્યવચન મદમુન્ત્રતે : ।

ક્વચિદહો હીનતાદીન રે ॥

પ્રતિભવં રૂપમપરાપરં ।

વહસિ બત કર્મણાધીન રે ॥ ક૦ ૩ ॥

અર્થ : ચેતન ! કોઈ વખત તું ઉત્ત્રતિ પામે છે, અધિકાર પામે છે, માન પામે છે, યશ મેળવે છે, ધન કમાય છે, એ વગેરે રૂપ સારા દિવસો પામી સારી અવસ્થામાં આવે છે ત્યારે અભિમાન નથી કરતો ? કરે છે. તેમ માઠી અવસ્થા આવ્યે દીન-રાંક નથી થતો ? થાય છે. વળી કર્મને વશ પડ્યો તું ભવભવમાં નવાંનવાં રૂપ નથી કરતો ? કરે છે. કોઈ જન્મમાં નારકી, કોઈ જન્મમાં તિર્થિય, કોઈ જન્મમાં દેવ, કોઈ જન્મમાં મનુષ્ય, વળી મનુષ્યભવમાં પણ કોઈ ભવમાં રાજ, કોઈ ભવમાં રાંક, કોઈ ભવમાં સ્ત્રી, કોઈ ભવમાં નાંસુસક ઈત્યાદિ જુદાં જુદાં રૂપે તું નથી જન્મતો ? જન્મે છે. વળી ઘણી વાર તો એક જ ભવમાં જુદી જુદી સારી-માઠી સ્થિતિ-અવસ્થા તું પામે છે. એક જ ભવમાં રાજપણું, રંકપણું, ધનલાભ, ધનહાનિ, કીર્તિ, અપકીર્તિ આદિ વિરોધી અવસ્થાઓ તું પામે છે. આ બધું મહાભેદ ઉપજાવે એવું છે, પણ હે ચેતન ! આમાં હર્ષ-ભેદ પામવા જેવું કર્દી નથી. આ સંસારનો જ એવો વિચિત્ર જેદરૂપ, દુઃખરૂપ સ્વભાવ છે. આ સંસાર જ એવો દારુણ છે, તે તું જે; વિચાર. ૩

## એકમાં અનેક :

જાતુ શૈશવદશાપરવશો ।  
 જાતુ તારુણ્યમદમત્ત રે ॥  
 જાતુ દુર્જયજરાજર્જરો ।  
 જાતુ પિતૃપતિકરાયત્ત રે ॥ ક૦ ૪ ॥

**અર્થ :** જુદા જુદા ભવની વાત તો કોરે મૂક, પણ આ એક જ ભવમાં તું કેવી જુદી જુદી અવસ્થાઓ પામે છે, અને તે દરેકમાં કેવાં દુઃખ છે, તે તું જરા વિચારી જો.

- (૧) બાળક અવસ્થામાં તું પરવશ રહે છે. ખાવા-પીવા માટે, પહેરવા-ઓઢવા આદિ માટે તારે પારકાને અધીન રહેવું પડે છે.
- (૨) યુવાવસ્થામાં તું મદમાં છડી જય છે, એ પણ તને જ દુઃખ છે.
- (૩) જરાવસ્થામાં પ્રતિક્ષણો તરી કાયા લડથડવા માડે છે.
- (૪) ભરણ - અને છેવટે યમરાજના હાથ તારા તરફ લંબાય છે. તે તને લઈ જય છે અર્થાત્ તું ભરણ પામે છે.

આમ એક જ ભવમાં જુદી જુદી માઠી અવસ્થાઓ ભોગવવી પડે છે. તે હે, વિનય ! આ દારુણ સંસાર છે. તે દારુણપણું વિચારી તેમાંથી છૂટવાનો પ્રયત્ન આદર. ૪

## પિતા તે પુત્ર, સંસારની વિકૃતિ !!!

બ્રજતિ તનયોऽપિ નનુ જનકતાં ।  
 તનયતાં બ્રજતિ પુનરેષ રે ॥  
 ભાવયનું વકૃતિમિતિ ભવગતે-  
 સ્ત્યજતમાં નૃભવશુભશેષ રે ॥ ક૦૫ ॥

**અર્થ :** આ સંસારમાં કોઈ જીવ એક ભવમાં પુત્ર હોય, તે બીજા ભવમાં પિતા થાય છે, વળી તે જ ફરી ભવાંતરે પુત્ર થાય છે. આવી આ સંસારની વિકૃતિ, વિચિત્રતા છે, તે તું વિચાર; અને આ નરભવનાં

તારાં કાંઈ પુષ્ય બાકી રહ્યાં હોય તો આ દારુણ સંસારને સર્વથા એકદમ ત્યજુ હે. તાત્પર્ય કે તારાં શુભ કર્મ રહ્યાં હશે તો જ તું આ સાત્ત્વિક વિચાર કરી શકીશ; તો જ તને સંસારની અસારતા સૂઝશે; અને તો જ તું એથી છૂટી શકીશ; બાકી તારાં પુષ્યનાં શેષ પણ ખવાઈ ગયાં હશે, તો તો તને સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા પડા સમજાવી નહિ શકે.

### નરદેહ અને પુષ્ય શોષ :

પણ ચેતન ! તને આ નરદેહ પ્રામ થયો છે, એ જ હું તો તાંતું પુષ્ય, શુભશેષ સમજું છું, કેમ કે તારાં પુષ્ય ખવાઈ ગયા હોત તો તને આ નરદેહ ન મળત. પણ જ્યારે તને એ નરદેહ સાંપજ્યો છે, તો તારાં એ બાકી રહેલાં પુષ્યનો લાભ લઈ લે; તારી મતિ આ સંસારનો પ્રકાર ચિંતવવામાં જોડ. નિશ્ચયે તને આ સંસાર દારુણ લાગશે. ૫

### મોહ, માદિરા અને ઉન્માદ (DELIRIUM :)

વર્ણી -

યત્ દુ:ખાર્તિગદવલવૈ-

સુદિનં દહસે જીવ રે ॥

હંત તત્ત્વૈ રઘ્યસિ ચિરં ।

મોહમદિરામદક્ષીબ રે ॥ ક૦ ॥ ૬ ॥

**અર્થ :** હે જીવ ! તું આ સંસાર-અરજ્યમાં પ્રતિદિવસ દુઃખ, ચિંતા, રોગરૂપી દાવાનાન વડે બળીજળી રહ્યો છે, છતાં હજુ તું ત્યાં જ રાચી રહ્યો છે ! અરે, મોહરૂપી માદિરાપાનથી તારી બુદ્ધિ જ વિપરીત થઈ ગઈ છે. મોહ માદિરાનો તને છાક ચડ્યો છે. ઉન્માદ (Delirium) થયો છે. નહિ તો જેમાં તને અનેક પ્રકારનાં દુઃખ, માનસિક ચિંતા કે શારીરિક રોગ, પ્રતિક્ષણ હેરાન કરી રહ્યાં છે, તેમાં તારું ફરી ફરી રાચવાપણું કેમ હોય ? ન જ હોય. ચેતન ! તને આ મોહથી જ દુઃખ થયું છે, એ મોહ આડે તું સંસારની અસારતા વિચારી શકતો નથી; માટે તું એ મોહ છોડી દઈ આ સંસારનું દારુણ સ્વરૂપ વિચાર. ૬.

## ઠગરૂપ કાળ !!!

દર્શયન કિમપિ સુખવૈભર્વ ।  
 સંહરસ્તદથ સહસૈવ રે ॥  
 વિપ્રલભયતિ શિશુમિવ જનં ।  
 કાલવટુકોડ્યમતૈવ રે ॥ ક૦ ૭ ॥

**અર્થ :** આ કાળનો વિપ્રલંબ તો જુઓ. આ ઠગ એવા કાળની ઠગાઈ તો જુઓ ! જેમ કોઈ માણસ બાળકને ફોસલાવવા કાંઈ ચીજ ઘડીભર આપી પાછી તેની પાસેથી ખૂંચવી લે, તેમ આ કાળ પણ આ સંસારમાં જ કાંઈક સુખવૈભવનાં દર્શન કરાવ્યાં, ન કરાવ્યાં ત્યાં જ તેને અક્રમાત્મ અદીસાથે હરી લે છે. અર્થાત् આ સંસારમાં કાળરૂપી ચોર લપાઈને બેઠો છે. તે ઓચિતા પ્રાણ હરી લે છે. મનનું ધાર્યુ મનમાં રહે છે. એવો દારંધ્ર આ સંસારનો પ્રકાર છે. તેમાં લેશ માત્ર તારે પ્રમાદ કર્તવ્ય નથી. ૭

## સંસારદર્શન અને મોક્ષનો ઉપાય :

સકલસંસારભયભેદકં ।  
 જિનવચો મનસિ નિબધાન રે ॥  
 વિનય પરિણમય નિઃશ્રેયસં ।  
 વિહિતશરમરસસુધાપાન રે ॥ ક૦ ૮ ॥

**અર્થ :** વિનય ! સંસાર તો આ પ્રમાણે ભયંકર છે. તે ભયમાંથી તારે ધૂટવું હોય તો એ ભયને નાશ કરનારી શ્રી જિનેશ્વરટેવની પવિત્ર વાણી તારા હૃદયમાં ધારણ કર અને આ શાંતસુધારસનું પાન કરી પરિણામરૂપે મોક્ષસુખ પ્રાપ્ત કર. શ્રી સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનાં પવિત્ર વચ્ચનામૃતોનો વિચાર કરીશ, તો તને આ સંસારની અસારત્તા માલમ પડશે; સમતા આવશે અને મોક્ષ-સુખ મળશે. ૮

## સંસાર કોના જેવો છે ?

### સંસારસમુક્ત :

ઉપમા : આ સંસારને જેટલી અધો ઉપમા આપીએ એટલી થોડી છે.

“(૧) સંસારસમુક્ત - સંસારને તત્ત્વજ્ઞાનીઓ એક મહાસમુક્તની પણ ઉપમા આપે છે. સંસારદૃપી સમુક્ત અનંત અને અપાર છે, અહો ! લોકો ! એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો, ઉપયોગ કરો, આવાં એમનાં સ્થળો સ્થળો વચ્ચનો છે. સંસારને સમુક્તની ઉપમા છાજતી પણ છે. સમુક્તમાં જેમ મોજાંની છોળો ઊછળ્યા કરે છે, તેમ સંસારમાં વિષયદૃપી અનેક મોજાંઓ ઊછળે છે. જળનો ઉપરથી જેમ સપાટ દેખાવ છે, તેમ સંસાર પણ સરળ દેખાવ દે છે. સમુક્ત કચાંક જેમ બહુ ઊડો છે અને ભમરીઓ ખવરાવે છે, તેમ સંસાર કામવિષય પ્રપંચાદિકમાં બહુ ઊડો છે, તે મોહરદૃપી ભમરીઓ ખવડાવે છે. થોડું જળ બલે હોય, છતાં જેમ સમુક્તમાં ઊભા રહેવાથી કાદવમાં ગુંચ્યો જઈએ છીએ, તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તુષ્ણાદૃપી કાદવમાં ગુંચવી દે છે. સમુક્ત જેમ નાના પ્રકારના ખરાબા અને તોઝાનથી નાવ કે વહીણને જોખમ પહોંચાડે છે, તેમ સ્ત્રીઓદૃપી ખરાબા અને કામદૃપી તોઝાનથી સંસાર આત્માને જોખમ પહોંચાડે છે. સમુક્ત જેમ અગાધ જળથી શીતળ દેખાતો છતાં વડવાનળ નામના અજીનિનો તેમાં વાસ છે, તેમ સંસારમાં માયાદૃપી અજીન બણ્યા જ કરે છે. સમુક્ત જેમ ચોમાસામાં વધારે જળ પામીને ઊડો ઊતરે છે, તેમ પાપદૃપી જળ પામીને સંસાર ઊડો ઊતરે છે, અર્થાતું મજબૂત પાયો કરતો જાય છે.

### સંસાર અજીન :

(૨) સંસારાનલ - સંસારને બીજુ ઉપમા અનલની-અજીનની છાજે છે. અજીનએ કરી જેમ મહાતાપની ઉત્પત્તિ છે, અજીનથી બળેલો જીવ જેમ મહા વિલવિલાટ કરે છે, તેમ સંસારથી બળેલો જીવ અનંત દુઃખરૂપ નરકથી અસંદ્ય વિલવિલાટ કરે છે. અજીન જેમ સર્બ વસ્તુનો ભક્ત કરી જાય છે, તેમ સંસારના મુખમાં પડેલાનો તે ભક્ત કરી જાય છે. અજીનમાં

જેમ જેમ ધી અને ઈધન હોમાય છે, તેમ તેમ તે વૃદ્ધિ પામે છે; તેવી જ રીતે સંસારરૂપ અગ્નિમાં તીવ્ર મોહરૂપ ધી અને વિષયરૂપ ઈધન હોમાતાં તે વૃદ્ધિ પામે છે.

### સંસાર અંધકાર :

(૩) સંસારાંધકાર - સંસારને બીજી ઉપમા અંધકારની છાજે છે. અંધકારમાં જેમ સિંદરી સર્પનું ખોડું ભાન કરાવે છે, તેમ સંસાર સત્યને અસત્યરૂપે બતાવે છે. અંધકારમાં જેમ પ્રાણીઓ આમતેમ ભટકી વિપત્તિ ભોગવે છે, તેમ સંસારમાં બેભાન થઈને અનંત આત્માઓ ચતુર્ગતિમાં આમતેમ ભટકે છે. અંધકારમાં જેમ કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી, તેમ સંસારરૂપી અંધકારમાં વિવેક-અવિવેકનું જ્ઞાન થતું નથી. જેમ અંધકારમાં પ્રાણીઓ છતી આંખે અંધ બની જાય છે, તેમ છતી શક્તિએ તેઓ સંસારમાં મોહંધ બની જાય છે. અંધકારમાં જેમ ધુવડ હત્યાદિનો ઉપદ્રવ વધે છે, તેમ સંસારમાં લોભ, માયાદિકનો ઉપદ્રવ વધે છે, એમ અનેક ભેટ ભેતાં સંસાર તે અંધકારરૂપ જ જણાય છે.

### સંસારચક્ક :

(૪) સંસાર શક્તયક - સંસારને ચોથી ઉપમા શક્ત એટલે ગાડાંનાં પૈડાંની છાજે છે. શક્તયક જેમ ફરતું રહે છે, તેમ સંસારમાં પ્રવેશ કરતાં તે ફરવારૂપે રહે છે. શક્તયક જેમ ધરી વિના ચાલી શક્તનું નથી, તેમ સંસાર મિથ્યાત્વરૂપ ધરી વિના ચાલી શકતો નથી. શક્તયક જેમ આરા વડે કરીને રહ્યું છે, તેમ સંસાર શક્ત પ્રમાદાદિ આરા વડે ટકચો છે. એમ અનેક મકારે શક્તયકની ઉપમા પણ સંસારને લાગી શકે છે. સંસારને બીજી ઘણી ઉપમા આપી શકાય એમ છે. સંસાર વન, સંસાર દાવાનળ, સંસારગર્ત, હત્યાદિ, પણ આ ચાર મુખ્ય ઉપમા છે. આમાં તત્ત્વ લેવું યોગ્ય છે.

### (૧) સંસારસમુદ્ર કેમ તરી શકાય ?

સાગર જેમ મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સદ્ગુરૂરૂપી નાવ, અને સદ્ગુરૂરૂપી નાવિકથી સંસારસાગર પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાઢા પુરુષોએ નિર્વિન્ધ રસ્તો શોધી

કાઢ્યો હોય છે, તેમ જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનરૂપ નિર્વિઘ્ન ઉત્તમ રાહ બતાવ્યો છે.

### (૨) સંસારાભિન કેમ હારી શકાય ?

અભિન જેમ સર્વને ભક્ત કરી જાય છે, પરંતુ પાણીથી બ્રૂહાઈ જાય છે. તેમ વૈરાગ્યજળથી સંસારાભિન બૂજવી શકાય છે.

### (૩) સંસારાંધકાર કેમ ઓલવી શકાય ?

અંધકારમાં જેમ દીવો લઈ જતાં પ્રકાશ થતાં જોઈ શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનરૂપી નિર્ભૂત દીવો સંસારરૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે.

### (૪) સંસારચક કેમ અટકે ?

શક્તચક જેમ બળદ વિના ચાલી શકતું નથી, તેમ સંસારચક રાગદ્રોષ વિના ચાલી શકતું નથી.

એમ એ સંસાર રોગનું નિવારણ ઉપમા વડે અનુધાનાદિ પ્રતીકાર સાથે કહું. આત્માર્થિએ પોતે એ નિરંતર મનન કરવા અને બીજાને બોધવા યોગ્ય છે.”

— શ્રીમદ્ રાજચંદ્ કૃત મોક્ષમાળા

આ સંસારભાવનાનું સ્વરૂપ ભાવતાં ધ્યાન મહાનુભાવો પરમસિદ્ધિને પાસ્યા છે. તેમાં મૃગાપુત્ર પણ એક મહાપુરુષ થઈ ગયા છે. તેનું ચારિત્ર બહુ બોધક હોવાથી અતે આપ્યું છે, તે વિચારવા જેવું છે.

### મૃગાપુત્ર :

“અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા,  
અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા;  
ઉધાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું,  
નિવૃત્તિ શીધમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.”

— શ્રીમદ્ રાજચંદ્

નાના પ્રકારનાં મનોહર વૃક્ષથી ભરેલાં ઉધાનો વડે સુશ્રીવ નામનું એક સુશોભિત નગર છે. તે નગરના રાજ્યસ્થન પણ બળભદ્ર નામનો

એક ચાળ થયો. તેની પ્રીયંવદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિ-પત્નીથી બલશ્રી નામે એક કુમારે જન્મ લીધો હતો. મૃગાપુત્ર એવું એનું પ્રભ્યાત નામ હતું. જનક-જનેતાને તે અતિ વલલભ હતો. એ મુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યો હતો એથી કરીને દમીશર એટલે યતિમાં અગ્રેસર ગણવા યોગ્ય હતો.

### મુનિનું દર્શન જાતિસ્મરણ શાન અને વૈરાગ્યનું પ્રકટવું :

તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદમાં પોતાની સ્ત્રી સાથે દોગંડુક દેવતાની પેઢે વિલાસ કરતો હતો. નિરંતર પ્રમોદ સહિત ભનથી વર્તતો હતો. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રલથી પ્રાસાદનો પટશાળ જરૂર હતો. એક દિવસ તે કુમાર પોતાના ગોખમાં બેસી ચોતરફ આખા નગરને નિરખી રહ્યો છે. તેવામાં એક મોટા ચોક ઉપર તેની દૃષ્ટિ પડી. ત્યાં તેણે એક પરમ શાંત મુનિને જોયા. તેને મૃગાપુત્ર નિહાળીને જોવા લાગ્યા. નિરખી નિરખીને જોતાં યાદ આવ્યું હોય એમ બોલ્યા : હું આણું છું કે આવું રૂપ મેં ક્રયાંક દીકું છે. આમ બોલતાં બોલતાં રાજકુમાર શોભનિક પરિણામ પામ્યા, તેનો મોહપટ ટલ્યો અને ઉપશમ પામ્યા, જાતિસ્મરણશાન થયું. પૂર્વભવનું સ્મરણ થતાં, તે મહાત્રાળિના ભોક્તા મૃગાપુત્રને પૂર્વના ચારિત્રની સ્મૃતિ થઈ, એકદમ વિષય ઉપરથી એનો રાગ નાશ પામ્યો. માતાપિતા સમીપે આવી બોલ્યા કે “પૂર્વભવમાં મેં પાંચ મહાક્રત સાંભળ્યાં હતાં. તિર્યચના અનંત દુઃખ પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુઃખી નિવૃત્તાવાનો હું હવે અભિલાષી થયો છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે ગુરુજનો, મને તે પાંચ મહાક્રત ધારણ કરવાની અનુષ્ઠા આપો.”

### વિષયભોગ કિં પાક ફળ :

કુમારના નિવૃત્તિથી ભરેલાં વચ્ચનો સાંભળીને માતાપિતાએ ભોગ ભોગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ વચ્ચનથી મેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે :-

“અહો માત અને અહો તત ! જે ભોગોનું તમે મને આમંત્રણ કરો છો, તે ભોગ મેં ભોગવ્યા. તે ભોગ વિષફળ, કિપાક વૃદ્ધનાં ફળ

જેવા છે, ભોગવ્યા પછી કડવા વિપાકને આપે છે, એ ભોગ સદૈવ દુઃખોત્પત્તિનાં કારણ છે. આ શરીર અનિત્ય અને કેવળ અશુચિમય છે. અશુચિથી ઉત્પત્ત થયું છે. જીવનો એ અશાશ્વત વાસ છે, અનંત દુઃખનો હેતુ છે, રોગ, જરા અને કલેશાદિનું એ શરીર ભાજન છે. એ શરીરને વિષે હું કેમ રતિ કરું ? બાળપણે એ છાંડવું છે, કે વૃદ્ધપણે એવો આ શરીરનો નિયમ નથી. જે શરીર પાણીના પરપોતા જેવું છે, તે શરીર વિષે સ્નેહ કેમ યોગ્ય હોય ? મનુષ્યપણામાં પણ એ શરીર પામીને કોઢ, જવર વગેરે વ્યાધિને તેમજ જરા-મરણને વિષે ગ્રાહાવું રહ્યું છે, તેમાં હું કેમ પ્રેમ બાંધું ? જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગનું દુઃખ, કેવળ દુઃખના હેતુ સંસારમાં છે. ભૂમિ-ક્ષેત્ર, કંચન, કુદુંબ, આવાસ, પુત્ર, પ્રમદા, બાંધવ એ બધાને છાંડીને માત્ર કલેશ પામીને આ શરીરમાંથી ચોક્કસ જવું છે.”

### પુષ્ય સંબલ :

“કિપાકવૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, તેમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહાપ્રવાસને વિષે જતાં સાથે અમજણ ન લે અને કુદ્ધા-તૃષ્ણાથી દુઃખી થાય, તેમ ધર્મના અનાચરણથી પુરુષ પરભવ પ્રતિ પરવરતાં સુખ ન પામે, જન્મ-જરાદિનાં દુઃખ પામે. મહાપ્રવાસમાં પ્રયાણ કરતાં કોઈ પુરુષ અમજણ સાથે લે અને કુદ્ધા-તૃષ્ણાથી પીડિત ન થાય, તેમ ધર્મનો આચરનાર પુરુષ પરભવને વિષે પરવરતાં સુખ પામે, અલ્ય કર્મવાળો હોય, અશાતાવેદનીય રહિત હોય. હે પવિત્ર માતાપિતા ! જેમ કોઈ ગૃહસ્થના ઘરમાં આગ લાગે છે ત્યારે તે ઘરઘણી અમૂલ્ય વસ્ત્રાદિ લઈ જર્ઝી વસ્તુ રહેવા હે છે, તેમ આ લોક બળતો દેખી જર્ઝી વસ્ત્રાદિ જરા-મરણને છાંડીને અમૂલ્ય આત્માને તમે આજા આપો એટલે હું તારીશ.”

### ચારિત્રનું સ્વરૂપ અને તેની દુષ્કરતા :

“મૃગાપુત્રનાં વચન સાંભળીને શોકાર્ત થયેલાં એનાં માતા-પિતા બોલ્યાં :- “હે પુત્ર ! આ તું શું કહે છે ? ચારિત્ર પાળવું બહુ દુષ્કર છે. ક્ષમાદિ ગુણાને પતિઅ ધરવા પડે છે, રાખવા પડે છે, યતનાથી સાચવવા પડે છે. સંયતિઅ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવો પડે છે. સંયતિને

પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધ રાખવી પડે છે. અથવા સર્વ જંગત ઉપર સરાખો ભાવ રાખવો પડે છે." એવું એ પ્રાણાત્મિકાત્મવિરતિ પ્રથમ પ્રત યાવજ્ઞચ્ચ પાળવું દુષ્કર તે પાળવું પડે છે. સંયતિને સદાકાળ અપ્રમાદપણે મૃષાવચનનું વજ્ઞવું, હિતવચન વદવું, એવું પાળતાં દુષ્કર બીજું મૃષાવાદવિરતિ પ્રત ધારવું પડે છે. સંયતિને દંતશોધન અર્થે એક સળીનું પણ અછા વર્જનું, નિર્વધ અને ધોષરહિત જ્ઞિતાનું આચરવું, એવું પાળવું દુષ્કર ત્રીજું અદ્યતાદાન વિરમણપ્રત ધારણ કરવું પડે છે. કામભોગના સ્વાદ અને મૈથુનસેવન ત્યાગીને બ્રહ્મચર્યરૂપ ચોયું મૈથુનવિરતિક્રત ધારણ કરવું પડે છે, તેમજ ધન, ધાન્ય, દાસ, પરિશ્રદ્ધ, ભમત્વ સંબળા પ્રકારનો આરંભ, - એ બધાંના ત્યાગરૂપ નિર્મમત્વપણે પાંચમું પરિશ્રદ્ધ વિરમણપ્રત ધારણ કરવું પડે છે."

### બાવીશ પરિષહ અને ખાંડાની ધાર :

"આ બધાં ગ્રતો પાળવાં અતિ અતિ વિકટ અને દુષ્કર છે. વળી ચાન્તિભોજનનો ત્યાગ, ધૃતાદિ પદાર્થ વાસી રાખવાનો ત્યાગ, આ અતિ દુષ્કર છે, માટે, તું હે પુત્ર, ચારિત્ર ચારિત્ર શું કરે છે? ચારિત્ર ખાંડાની ધાર છે. ભૂખના પરિષહ, તરસના પરિષહ, વઠ-નાયના પરિષહ, ડાંસ-મંદ્યરના પરિષહ, આકીશ, ઉપાશ્રય, તૃલસ્યર્થ, મલ એ વગેરેના પરિષહ સહન કરવા. આવું વિકટ ચારિત્ર કેમ પાણી શકાય? વધના પરિષહ, બંધના પરિષહ કેવા વિકટ? જ્ઞાનારી કેવી દુષ્કર? ભળ્યું ન ભળ્યું - યાચના કરવી કેવી દુઃખદ? યાચના કરતાં છતાં ન ભળો, એ અલાસ પરિષહ કેવો દુઃખદ? કાયર પુરુષના હદ્યને ભેદી નાખનારું કેશ-લુચન કેવું વિકટ છે? પુત્ર, તું વિચાર કર. કર્મવૈરીને રૌદ્ર એવું બ્રહ્મચર્ય કેવું વિકટ છે? ખરે, અધીર આત્માને એ બધાં અતિ અતિ વિકટ છે. પ્રિય પુત્ર! તું સુખ ભોગવવા યોગ્ય છે. અતિ રમણીય દીતે નિર્મણ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર યોગ્ય છે. પ્રિય પુત્ર! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. યાવજ્ઞચ્ચ એમાં વિસામો નથી. સંયતિના મહાગુણાનો સમુદ્ધાય લોઢાની પેઠે બહુ ભારે છે. સંયમભાર વહન કરવો અતિ અતિ વિકટ છે. આકાશગંગાની સામે પાર જવું જેમ દોહારું છે, તેમ ઘોવન વધને વિષે સંયમ મહાદુષ્કર છે. સામે પ્રવાહે જવું જેમ

હુઝર છે તેમ યૌવનને વિષે સંયમ મહાદુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરબો દુર્લભ છે તેમ સંયમ-ગુણ-સમુદ્ર તરબો યૌવનમાં મહાદુર્લભ છે. વેળુંનો કવલ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે.”

### લોકાના જવ ચાવવા અને સંયમ આચરવો :

“અદ્યગધારા પર ચાલવું જેમ વિકટ છે તેમ તપ આચરવું મહાવિકટ છે. જેમ સર્પ ઓકાંત દિશિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઈર્યાસમિતિ માટે એકાંતિક ચાલવું મહાદુર્લભ છે. હે પુત્ર ! જેમ લોકાના જવ ચાવવા દુર્લભ છે તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અનિન્ના શિખા પીવી દુર્લભ છે તેમ જુવાનીમાં યતિ થવું મહાદુર્લભ છે. જેમ ગ્રાજવે કરી મેરુ તોળવો દુર્લભ છે તેમ નિશ્ચયપપાદાથી, નિઃશંકતાથી દશવિધ યતિર્ધમિ પાળવો દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર તરબો જેમ દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરબો દોષબલો છે. હે પુત્ર ! શબ્દ, ગંધ, રૂપ, રસ, સ્પર્શ એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભોગ ભોગવી ભુક્તભોગી થઈને વૃદ્ધપણામાં તું ધર્મને આચરજે.”

### Where there is will, there is a way.

#### વિરક્તને સંયમ સુકર :

“માતાપિતાનો ભોગ સંબંધી ઉપદેશ સાંભળો તે મૃગાપુત્ર માતા-પિતા પ્રતિ એમ બોલી ઉઠ્યા કે “વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવો કંઈએ દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંતવાર સહી છે; ભોગવી છે. મહાદુઃખથી ભરેલી, ભયને ઉપાયવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. જન્મ-જ્યા-મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિરૂપ સંસારાટ્યોમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખો મેં ભોગવ્યા છે.”

#### નરકની યાતના :

“હે ગુરુજનો ! મનુષ્યલોકમાં જે અનિ અતિશય ઉષ્ણ મનાયો છે, તે અનિથી અનંતગણી ઉષ્ણ તાપવેદના નરકને વિષે એં આત્માએ

ભોગવી છે. મનુષ્યલોકમાં જે ટાક અતિ શીતળ મનાઈ છે, એ ટાકથી અનંતગણી ટાક નરકને વિષે અશાતાએ આ આત્માએ ભોગવી છે. લોહમય ભાજન-તેને વિષે ઉંચા પગ બાંધી, નીચું મસ્તક કરીને દેવતાએ વૈકિય કરેલા આકરા બળતા અજિનમાં આકંદ કરતાં આ આત્માએ અત્યુગ્ર દુઃખ ભોગવ્યાં છે.”

### કંદબ નદીની વેળુ :

“મહાદવના અજિન જેવા મરુદેશમાં જે વેળુ છે તે વેળુ જેવી વજન્ય છે, તેવી વજન્ય વેળુ કંદબ નામે નદીની છે. તે સરીઓ ઉખા વેળુમાં પૂર્વે મારા આ આત્માને અનંતીવાર બાધ્યો છે. નરકમાં મહારૌદ્ર પરમાધારીએ મારા કડવા વિપાકને લઈ અનંતીવાર ઉંચા વૃક્ષની શાખાએ મને બાધ્યો હતો. બંધવ રહિત એમાં મને લાંબી કરવત લઈ છેધો હતો.”

### ખીજડાના જાડના કાંટા :

“અતિ તીક્ષ્ણ કંટકે કરી વ્યાપે ઉંચા શાલ્મલી વૃક્ષને વિષે બાંધાને મહાબેદ પમાડ્યો હતો. પાશે કરીને બાંધી આધો-પાછો ખેંચવે કરી મને અતિ દુઃખી કર્યો હતો. મહા અસ્ત્ર કોલહુને વિષે શેલડીની પેઠે આકંદ કરતો હું અતિ રૌદ્રતાથી પીડાયો હતો. એ ભોગવવું પડ્યું, તે માત્ર મારા અશુભ કર્યના અનંતીવાર ઉદ્યથી જ હતું. શાનતુરે સામનામા પરમાધારીએ કીધો. શબ્દલનામા પરમાધારીએ તે શાનતુરે મને ભૌય પર પાડ્યો, - જીર્ણ વસ્ત્રની પેઠે ફાડ્યો; વૃક્ષની પેરે છેધો, એ વેળા હું અતિ અતિ તરફકતો હતો.”

“વિકાળ ખડુગે કરી, ભાલાએ કરી, તથા બીજાં શરસ્ત વડે કરી મને તે પ્રયંકીઓએ વિખંડ કીધો હતો. નરકમાં પાપકર્મ જન્મ લઈને વિષમ જતના ખંડનું દુઃખ ભોગવ્યામાં મજા રહી નથી.”

### અસિપત્ર વન :

“પરતંત્ર કરી અનંત પ્રજ્ઞવલિત રથમાં રોજની પેઠે પરાણે મને જોતર્થો હતો. મહિષની પેઠે દેવતાના વૈકિય કરેલા અજિનમાં હું બાધ્યો હતો. ભડ્યું થઈ અશાતાથી અત્યુગ્ર વેદના ભોગવતો હતો. ઢંક-ગીધ

નામના વિકરાળ પકીઓની સાથસા જેવી ચાંચથી ચુંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતો હતો. તૃપાને લીધે જગપાનનું ચિંતવન કરી વેગમાં દોડતાં, વૈતરણીનું છરપલાની ધાર જેવું અનંત દુઃખ પાણી પામ્યો હતો. જેના પાંડડાં તીવ્ર ખૂબજાની ધાર જેવાં છે, મહાતાપથી જે તપી રહ્યું છે, તે અસિપત્ર વન હું પામ્યો હતો. ત્યાં આગળ પૂર્વકાળે મને અનંતવાર છેદ્યો હતો. મુદ્રગરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂળથી કરી, મુશણથી કરી તેમ જ ગદાથી કરી મારા ગાત્ર ભાંગ્યા નાંખ્યાં હતાં. શરાષ્ટ્રરૂપ સુખ વિના હું અશરાષ્ટ્રરૂપ અનંત દુઃખ પામ્યો હતો, વસ્ત્ર પેઢે મને છરપલાની તીક્ષ્ણ ધારે કરી, પાળીએ કરી, અને કાતરણથી કરી કાય્યો હતો. મારા ખંડોખંડ કટકા કર્યા હતા. મને તિરણો છેદ્યો હતો. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી, એમ હું અનંત દુઃખ પામ્યો હતો. પરવશતાથી મૃગની પેઢે અનંતવાર પાશમાં હું સપડાયો હતો. પરમાધારીએ મને મગરમશ્શરૂપે જળ નાખી અનંતવેળા દુઃખ આખ્યું હતું. સિયાશારૂપે પંખીની પેઢે જળમાં બાંધી અનંતવાર મને હથ્યો હતો. ફરશી હત્યાદિક શસ્ત્રથી કરીને મને અનંતીવાર વૃક્ષની પેઢ ઝૂટીને મારા સૂક્ષ્મ છેદ કર્યા હતા.”

### પરમાધારી લુહાર :

“મુદ્રગરાદિકના પ્રધારવતી લોહકાર જેમ લોહ ટીપે, તેમ મને પૂર્વકાળે પરમાધારીઓએ અનંતીવાર ટીખ્યો હતો. ત્રાંબું, લોહું અને સીસું અભિનથી ગાળી તેનો ડળકળતો રસ મને અનંત વાર પાયો હતો. અતિ રૌક્તાથી તે પરમાધારીઓ મને એમ કહેતા હતા કે પૂર્વબ્લવમાં તને માંસ પ્રિય હતું, તે લે આ માંસ. એમ મારા શરીરના ખંડોખંડ કટકા મેં અનંતીવાર ગણ્યા હતા. મધ્યની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડ્યું નહોતું. એમ મેં મહાભયથી, મહાત્રાસથી, મહાદુઃખથી કંપાયમાન કાયાએ અનંત વેદના ભોગવી હતી. જે સહન કરતાં અતિ તીવ્ર-રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળસ્થિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંતવાર તે નરકમાં મેં ભોગવી હતી. જેવી વેદના મનુષ્યલોકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણી અવિક અશાતાવેદની નરકને વિષે રહી હતી. સર્વ ભવને વિષે મેં અશાતાવેદની ભોગવી છે. મેથાનુમેષ

માત્ર પણ ત્યાં શાતા નથી. એ પ્રમાણે મૃગપુત્રે વૈરાગ્યભાવથી સંસાર પરિબ્રમણ હુખ કર્યાં.”

એના ઉત્તરમાં માતા-પિતા બોલ્યાં “કે હે ! જો તારી ઈશ્વા દીક્ષા લેવાની છે, તો દીક્ષા અછણ કર, પણ ચાર્ચિત્રમાં રોગોત્પત્તિ વેળા વૈદક કોણ કરશે ? દુઃખનિવૃત્તિ કોણ કરશે ? એ વિના બહુ દોષાંદું છે.”

### મૃગચર્ચા અને સંયમ :

મૃગપુત્રે કહ્યું : “એ ખરું, પણ તમે વિચારો, કે અટવીમાં મૃગ તેમ જ પંખી એકલું હોય છે. તેને રોગ ઉત્પન્ન થાય છે, ત્યારે તેનું વૈદું કોણ કરે છે ? જેમ વનમાં મૃગ વિહાર કરે છે તેમ હું ચાર્ચિત્રવનમાં વિહાર કરીશ ; અને સત્તર ભેટ શુદ્ધ સંયમનો રાગી થઈશ. બાર ભેટ તપ આદરીશ ; અને મૃગચર્ચાથી વિચરીશ. મૃગને વનમાં રોગનો ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કોણ કરે છે ?” એમ પુનઃ કહી તે બોલ્યો કે, “કોણ તે મૃગને ઔષધ દે છે ? કોણ તે મૃગને આનંદ, શાંતિ, અને સુખ પૂછે છે ? કોણ તે મૃગને આહાર-જળ આણી આપે છે ? જેમ તે મૃગ ઉપદ્રવમુક્ત થયા પછી વનગાળને જ્યાં સરોવર હોય છે ત્યાં જય છે, તૃશ્ણાદિકનું-પાણીનું સેવન કરે છે અને પાછું જેમ તે મૃગ વિચરે છે, તેમ હું વિચરીશ. એ મૃગરૂપચર્ચા આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતો યતિ મૃગની પેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્ચા સેવીને, સાવધ ટાળીને, યતિ વિચરે. જેમ મૃગ તૃશ્ણ-જળાદિકની ગોચરી કરે, તેમ યતિ ગોચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહિ, નિંદા કરે નહિ, એવો સંયમ હું આચરીશ.”

### સંયમસ્વરૂપ :

“એવં પુત્રા જહાસુખં - હે પુત્ર, તને સુખ ઊપજે એમ કર.” એમ માતા-પિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી ભમત્વ ભાવ છેદીને જેમ મહાનાગ કંચુકી છોડી ચાલ્યો જય છે, તેમ તે મૃગપુત્ર સંસાર ત્યાગી સંયમધર્મમાં સાવધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગાંસંબંધીઓના ત્યાગી થયા. વસ્ત્રને ઘૂણી જેમ રજ ખંખેરી નાંખીએ, તેમ તે સધળા પ્રપંચ-ત્યાગીને દીક્ષા લેવા માટે નીકળી પડ્યા. પવિત્ર પંચમહાત્મત યુક્ત થયા. પંચ સમિતિથી સુશોભિત થયા.

ત્રિગુમાનુગુમ થયા. બાધ્યાભ્યંતરે બાર પ્રકારના તપથી સંયુક્ત થયા. મમત્વરહિત થયા. નિરહંકારી થયા. સ્ત્રીયાહિકના સંગરહિત થયા. સર્વાત્મભૂતમાં એનો સમાન ભાવ થયો. આધારપાન પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઉપભોગ કે હૃદાય, જીવિતથી હો કે મરણ, હોઈ સુતી કરો કે કોઈ નિદા કરો, કોઈ માન ધો કે કોઈ અપમાન ધો, તે સઘળા પર તે સમભાવી થયા. ઋષિ, રસ અને શાતા એ ત્રિગ્યારવના અહંપદથી તે વિરક્ત થયા. મનંદ, વચનંદ અને તનંદ નિવર્તાયા. ચાર કૃપાયથી વિમુક્ત થયા. માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય એ ત્રણ શલ્યથી વિરાગી થયા. સમ મહાત્મયથી એ અલ્ય થયા. ધાર્ય અને શોકથી નિવર્ત્યા. નિદાનરહિત થયા. રાગ-દ્રેષ્ટુપી બંધનથી છૂટી ગયા. વાંચ્છારહિત થયા. સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા.

### મૃગાપુત્રની વીતરાખતા :

કરવાલથી કોઈ કાપે અને કોઈ ચંદન વિલેપન કરે, તે પર સમભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે હેઠાં. શુદ્ધ અંત:કરણ સહિત ધર્મધ્યાનાહિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિનેંદ્ર શાસનતત્ત્વ પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યકૃત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાત્મતની પાંચ ભાવના એમ પાંચ મહાત્મતની પચીસ ભાવનાએ કરી અને નિર્મણતાએ કરી એ અનુપમ વિભૂષિત થયા. સમ્યક્ પ્રકારે ઘડાં વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક માસનું અનશન કરીને તે મહાક્ષાણી યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોકષગતિએ પરવર્યા.

તત્ત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી બાર ભાવનામાંની સંસારભાવના દ્રઢ કરવા આ મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણિતું. મહર્ષિ મૃગાપુત્રનું સર્વોત્તમ ચરિત્ર સંસાર પરિબ્રમણ નિવૃત્તિનો અને તે સાથે અનેક પ્રકારની નિવૃત્તિનો બોધ આપે છે.\*

॥ ઇતિ શ્રી શાંતસુધારસગોયકાવ્યે સંસારભાવનાવિભાવનો નામ તૃતીય: પ્રકાશ: ॥

ઇતિ શ્રી શાંત સુધારસ નામના દાળબદ્ધ કાવ્યમાં

સંસારભાવના નામનો જીજે પ્રકાશ સમાપ્ત.

\* શ્રી અનાથી મુનિ, મૃગાપુત્ર એ આદિનો આ ભાવનાઓમાં છે સદ્ગુણોક કથાપસંગ દાખલ કર્યો છે, તે મોટે ભાગે શ્રીમદ્ રાજચંદ્ર કૃત શ્રી મોકષમાળા તથા ભાવનાબોધમાંથી લીધેલ છે.

ॐ

## એકત્વભાવના

આત્મા એકલો :

॥ સ્વાગતા વૃત્તં ॥

એક એવ ભગવાનયમાત્રા,  
જ્ઞાનદર્શન તરંગસરંગઃ ॥  
સર્વમન્યતુપકલ્પિતમેતતુ,  
વ્યાકુલીકરણમેવ મમત્વં ॥ ૧ ॥

અર્થ : એક જ ભગવાન તે આ આત્મા છે. શાન, દર્શન,  
ચારિગ્રહ્ય તેના ગુણ છે. તેમાં તે આનંદ-કલ્પોલ કરી રહ્યો છે. બાકી  
આ બીજું બધું કલ્યના ભાત્ર છે; વાસ્તવિક નથી. તે પર મમતા રાખવી  
એ વ્યાકુળતાનું જ કારણ છે. ૧

આત્મા અસંગ :

॥ વૈતાતીયવૃત્તં ॥

અવુધૈ: પરભાવલાલસા-  
લસદજ્ઞાનદશાવશાત્મયઃ ॥  
પરવસ્તુષુ હા સ્વકીયતા,  
વિષયાવેશશાદ્વિકલ્યતે ॥ ૨ ॥

અર્થ : પરવસ્તુમાં અત્યંત તીવ્ર ઈચ્છા-મોહ રાખવાં એ અજ્ઞાન  
દશાનું કારણ છે. વિષયના આવેશમાં તણાવાથી પરવસ્તુને વિષે  
મારાપણાની બુદ્ધિ થાય છે. અર્થાતું વાસ્તવિક રીતે પૌરુષગલાદિક પારકી

વસ્તુઓમાં જીવ મમત્વ કરે છે. આમ પરવસ્તુમાં મમત્વ રાખનારા કેવળ અબુધ છે; બોધરહિત, — અજ્ઞાની છે. અજ્ઞાની જીવો જ પરભાવમાં આસક્ત થઈ સ્વ સ્વભાવ પર આવરણ આપે છે. તેઓ જ વિષયવિવશ થઈ પરવસ્તુને “આ મારી, આ મારી” એમ કલ્પે છે. વસ્તુત: આત્મા એકલો છે; જ્ઞાન-દર્શન-ચારિત્ર જ તેનાં પોતાનાં ઋલ્લિ-પરિવાર છે. એને ગૃહ, કુટુંબ, પરિગ્રહાદિક પરવસ્તુ સાથે કશો સંબંધ નથી. એ એનાં નથી જ; છતાં એને પોતાનાં જાણી મમત્વ દાખવે છે અને વ્યાકુણ-દુઃખી થાય છે, એ ખરેખર જેદવાર્તા છે. ૨

કૃતિનાં દયિતેતિ ચિત્તનં  
પરવારેષુ યથા વિપત્તયે ॥  
વિવિધાર્તિભયાવહં તથા  
પરભાવેષુ મમત્વભાવનં ॥ ૩ ॥

**અર્થ :** પારડી સ્ત્રીઓ પ્રતિ આ મારી સ્ત્રી એમ વિત્તન પુષ્યવાન જીવોને કેમ વિપત્તિનું કારણ થાય છે; તેમ સ્વભાવને છાંડી પરભાવમાં મમત્વ દાખવવું એ જાતજાતનાં દુઃખ અને ભય ઉપજાવે છે. ૩

અધુના પરભાવસર્વતૃત્તિ  
હર ચેતઃ પરિતોડવર્ગુદ્ધિતં ॥  
ક્ષણમાત્મવિચારચંદન-  
દુમવાતોર્મિરસા: સ્પૃશંતુ માં ॥ ૪ ॥

**અર્થ :** આમ પરવસ્તુના મમત્વને દુઃખ-ભયનાં કારણ જાણી, ચેતન, ચોતરફ બિધાવેલી પરભાવરૂપી ચાદર સંકેલી મૂક; ચોતરફ ગુંધેલી પરભાવ જાણ સમેટી લે; પરભાવ મમત્વનો નાશ કર; અને આત્મવિચારરૂપ બાવનાચંદન પાસેથી આવતી પવનની લહેરો મને સ્પર્શ કરી આનંદ આપો; કેમ ચંદન વૃક્ષનો વાયુ આસપાસ સુગંધ કેલાવી આનંદ આપે છે તેમ આત્મવિચારરૂપ ચંદનવાયુ મને મીठી સુગંધ આપો; અર્થાત્ ચેતન, તું તારા વિચારમાં લીન થા; પરવિચાર મૂકી દે. ૪

એગોહં :

॥ અનુષ્ટુષ્ટૃત્ત ॥

એકતાં સમતોપેતામેના માત્રમનું વિભાવય ।

લભસ્વ પરમાનંદસંપર્દ નમિરાજવતુ ॥ ૫ ॥

અર્થ : આત્મા, તું એકલો છે; તું એકલો આવ્યો; એકલો જઈશ; પાપ પુણ્ય એકલો ભોગવીશ; બીજું કોઈ તારી સાથે નહિ આવે; એકલો જન્મયો; એકલો મરીશ.

‘આયા એકિલા, જવું એકિલા’

આમ બીજા સાથે સ્પર્શના પણ તારે નથી; કાંઈ લેવા-ટેવા નથી. તારું તે તારી પાસે છે. જ્ઞાન, દર્શનાદિ તારાં છે તે તારી પાસે છે; બાકી બીજું કાંઈ તારું નથી.

“એગોહં નથ્ય મે કોડી, નાહમગ્રસ્સ કસ્સિડી, ।

એગો મે સાસઓ અચ્યા, નાણદંસણ સંજુઓ ॥”

હું એકલો હું; મારું કોઈ નથી; હું બીજા કોઈનો નથી; જ્ઞાન-દર્શન-ચારિત્રણ હું શાશ્વત આત્મા હું. આમ હે ! ચેતન, સમતા આદરી, તું આ એકત્વ ભાવના ભાવ, અને આ એકત્વ ભાવના ભાવતાં જેમ નમિરાજર્ષિ પરમાનંદરૂપ સંપત્તિ પાચ્યા, તેમ તું પણ એકત્વ ભાવી પરમાનંદ સંપદા પાય. ૫

નમિરાજર્ષિ\*

“શરીરમાં વ્યાપિ પ્રત્યક્ષ થાય,

તે કોઈ અચ્યે લઈ ના શકાય;

એ ભોગવે એક સ્વ આત્મ પોતે,

એકત્વ એથી નય સુજ્ઞ ગોતે.”

— શ્રીમદ્ રાજચંદ્ર

\* શ્રીમદ્ રાજચંદ્ર કૃત ભાવનાબોધ એકત્વભાવના.

મહાપુરુષના આ ન્યાયને અચળ કરનાર શ્રી નમિરાજર્ખિ અને શર્કેદ્રનો વૈરાગ્યોપદેશક સંવાદ બહુ બોધદાયક છે. નમિરાજર્ખિ વિદેહ દેશમાં આવેલા મિથિલા નગરીના રાજેશ્વર હતા. શ્રી-પુત્રાદિકથી વિશેષ દુઃખનો સમૂહ પામ્યા નહોતા, છતાં અભેક્તવના સ્વરૂપને પરિપૂર્ણ પિછાઓવામાં રાજેશ્વરે કિચિત્ત વિભ્રમ કર્યો નથી.

ચારિત્ર લીધા પછી નમિરાજર્ખિ જ્યાં નિવૃત્તિમાં બિરાજ્યા છે, ત્યાં શર્કેદ્ર પ્રથમ વિપ્રરૂપે આવી પરીક્ષા નિર્દાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે :-

### નમિરાજ અને ઈંડ્રનો સંવાદ :

**શર્કેદ્ર વિપ્ર :** હે રાજ ! મિથિલા નગરીમાં આજે પ્રબળ કોલાહલ વાપી રહ્યો છે. હદ્યને અને મનને ઉદ્દેગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘણા દુઃખનો હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પત્ત થાય, તે દુઃખ સંસાર પરિબ્રમણનું કારણ ગણીને તું ત્યાં જા. ભોળો ન થા.

### જગત પોતાના સ્વાર્થને રડે છે :

**નમિરાજ :** હે વિપ્ર ! તું જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બળીઓ હતો; તેની મધ્યમાં એક વૃક્ષ હતું; શીતળ છાયા વડે તે વૃક્ષ રમણીય હતું; પત્ર, પુષ્પ, ફળથી એ શોભતું હતું; નાના પ્રકારનાં પક્ષીઓ એનો આશ્રમ લેતો હતો; વાયુના હલાકવાથી તે વૃક્ષમાં રહેનારાં પક્ષીઓ દુઃખાર્ત અને અશરણ થયાથી આકંદ કરે છે. વૃક્ષના પોતાના માટે કાંઈ તે વિલાપ કરતાં નથી; પોતાનું સુખ ગયું એ માટે એઓ શોકાર્ત છે.

**વિપ્ર :** પણ આ જો ! અભિન ને વાયુના મિશ્રથી તારું નગર, તારાં અંતઃપુર અને મંદિરો બળે છે; માટે ત્યાં જા અને તે અભિનને શાંત કર.

### મારું મારી પાસે છે, બહાર નથી :

**નમિરાજ :** હે વિપ્ર, મિથિલા નગરીનાં તે અંતઃપુરો અને મંદિરોના દાઝવાથી મારું કંઈ પડા દાઝતું નથી. જેમ મને સુખ ઉપજે છે તેમ હું વર્તું છું. એ મંદિરાદિકમાં મારું અલ્ય પણ નથી. મેં પુત્ર, શ્રી આદિના

વ્યવહારને છાંડચો છે. મને ઓમાંતું કાઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી.

**વિષ્ણુ :** પણ હે રાજ ! તારી નગરીને મજબૂત કિલ્વો, પોળ, કોઠા, કમાડ, ભોગળ, આસપાસ જબરી ખાઈ કરાવીને પછી જજે.

### શ્રદ્ધાનગરી :

**નમિરાજ :** હે વિષ્ણુ ! હું શુદ્ધ શ્રદ્ધારૂપ નગરી વસાવીને, સંવર રૂપી ભોગળ કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ; શુભ મનોયોગરૂપી કોઠા બાંધીશ; વચનયોગરૂપ ખાઈ કરીશ, કાયાયોગરૂપ શતઘ્ની કરીશ; પરાક્રમરૂપ ધનુષ્ય કરીશ; ઈર્યાસમિત્રારૂપ પણાછ કરીશ; ધીરજરૂપી કમાન સહાવાની મૂઠ કરીશ; સત્યરૂપ ચાય વડે ધનુષ્ય બાંધીશ; તપરૂપ બાજુ કરીશ; કર્મરૂપી વૈરીના સૈન્યને બેદીશ; લૌકિક સંગ્રહામની મને રુથિ નથી; હું માત્ર તેવા ભાવ-સંગ્રહામને ઈચ્છાં હું.

**વિષ્ણુ :** હે રાજનુ ! શિખરબંધ ઊંચા આવાસ કરાવીને, મણિકંચનમય જવાસ મુકાવીને, તળાવમાં કીડા કરવાના મનોહર મહાલય કરાવીને પછી જજે.

### મહેલરૂપી ધર્મશાળા અને વટેમાર્ગનો વિસામો :

**નમિરાજ :** તે જે જે પ્રકારના આવાસ ગણાવ્યા તે તે પ્રકારના આવાસ મને અસ્થિર અને અશાશ્વત જણાય છે. માર્ગના ઘર (Innccaravansary) રૂપ જણાય છે, તે માટે જ્યાં સ્વધાર છે ત્યાં શાશ્વતતા છે, અને જ્યાં શાશ્વતતા, સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું.

**વિષ્ણુ :** હે કણિયશિરોમણિ ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવો ટાળીને, નગરીનું એ દ્વારે કલ્યાણ કરી પછી તું જજે.

### અપરાધી દંડાય નહિ, નિરપરાધી દંડાય !!!

**નમિરાજ :** હે વિષ્ણુ ! અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા દડ દે છે. ચોરીના નહિ કરનાર જે શરીરાદિક પુદ્ધળ તે લોકને વિષે બંધાય

છે, અને ચોરીના કરનારા જે ઈદ્રિયવિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી; તો પછી એમ કરવાનું શું અવશ્ય ?

**વિપ્ર :** હે ક્ષત્રિય ! જે રાજાઓ તારી આણ માનતા નથી અને જે નરાધીઓ સ્વતંત્રતાધી વર્તે છે, તેને તું વશ કરીને પછી જાજે.

**ખરા વીર :**

**નમિરાજ :** દશ લાખ સુભટને સંગ્રહમાં જીતવા એ દુર્લભ ગણાય છે; તો પણ એવા વિજય કરનારા અનેક પુરુષો મળી આવે; પણ એક સ્વાત્માને જીતનાર મળવો અત્યંત દુર્લભ છે: દશ લાખ સુભટ પર વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરુષ પરમોકૃષ્ણ છે. આત્મા સંગાથે યુદ્ધ કરવું ઉચિત છે. બહિરૂ યુદ્ધનું શું પ્રયોજન છે ? શાન્દુપ આત્મા વડે કોધાદિક આત્માને જીતનાર સુત્પિપાત્ર છે. પાંચ ઈદ્રિયોને, કોધને, માનને, માયાને તેમજ લોભને જીતવાં દોષ્ઠલાં છે. જેણે મનોયોગાદિક જત્યું તેણે સર્વ જત્યું.

**વિપ્ર :** સમર્થ યક્ષો કરી શ્રમશ, તપસ્વી, બ્રાહ્મણાદિકને ભોજન આપી, સુવર્ણાદિ દાન દઈ, મનોક્ષ ભોગ ભોગવીને, રે ક્ષત્રિય ! પછી તું જાજે.

**સંયમ માહાત્મ્ય :**

**નમિરાજ :** મહિને મહિને જે દશ લાખ ગાયનાં દાન હે, તો પણ તે દશ લાખ ગાયોનાં દાન કરતાં સંયમ ગ્રહણ કરી સંયમ આરાધી છે, તે તે કરતાં વિશેષ મંગળ પામે છે.

**વિપ્ર :** નિર્વહિ કરવા માટે ભિક્ષાધી સુશીલ પ્રગજ્યામાં અસ્વય પરિશ્રમ વેઠવો પડે છે, તેથી તે પ્રગજ્યા ત્યાગીને અન્ય પ્રગજ્યામાં રુચિ થાય છે. માટે એ ઉપાધિભય ન આવે, તે અર્થે તું ગૃહસ્થાશ્રમમાં જ રહી પૌષ્ટાદિ પ્રતમાં તત્પર રહેજે. હે ! મનુષ્યના અધિપતિ ! હું ઢીક કહું છું.

**નમિરાજ :** હે વિપ્ર ! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે, પરંતુ સમ્યક્ ચારિત્ર તથા શુત્ધમની તુલ્ય ન થાય. એકાં કણા તે સોળ કણા જેવી કેમ ગણાય ?

**વિપ્ર :** અહો ક્ષત્રિય ! સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસ્ત્રાલંકાર અને અશાદિકની વૃદ્ધિ કરીને પછી જજે.

### સદા નવયૌવન લોભ :

**નમિરાજ :** મેરુપર્વત જેવા કદાચિત્ત સોના રૂપાનાં અસંખ્યાતા પર્વત હોય, તો પણ લોભી જીવોની તૃષ્ણા છીપતી નથી. લેશમાત્ર તે સંતોષ પામતો નથી, તૃષ્ણા આકાશના જેવી અનંત છે. ધન, સુવર્ણ, ચતુષ્યાદ ઈત્યાદિ સકળ લોક ભરાય એટલું લોભી માણસની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ઠતા છે, માટે સંતોષ નિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષો આચારે છે.

**વિપ્ર :** હે ક્ષત્રિય ! મને અદ્ભુત આશ્ર્ય ઉપજે છે કે તું છતા ભોગને છાડે છે. પછી અછતા કામભોગને વિષે સંકલ્પ-વિકલ્પ કરી છાર્થાઈશ; માટે આ ચંદળી મુનિત્વ સંબંધીની ઉપાધિ મૂક.

### વિષયવિપાક :

**નમિરાજ :** કામભોગ શલ્ય શરખા છે, વિષ સરખા છે, સર્વ સરખા છે. તેની વાંચુનાથી જીવ નરકાદિક અધોગતિઓ જાય છે, તેમજ કોઈ કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે. માયાને લઈ સદ્ગતિનો વિનાશ હોય છે, લોભથકી આ લોક પરલોકમાં ભય આવે છે; માટે, હે વિપ્ર ! તું મને એનો બોધ ન કર. મારું હેઠય કોઈ કાળો ચળનાર નથી; એ મિથ્યામોહિનીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને જેર કોણ પીએ ? દીવો લઈને કૂવામાં કોણ ઉત્તરે ? જાણી જોઈને વિભ્રમમાં કોણ પડે ? હું મારા અમૃત જેવા વૈરાગ્યનો મધુર રસ અપ્રિય કરી એ જેરને પ્રિય કરવા મિથ્યિલામાં આવનાર નથી.

**નમિરાજની કસ્ટોટી અને શર્કેદ્રની પ્રસ્ત્રતા -**

**તેણે કરેલી નમિરાજની સુતિ :**

મહાર્ષિ નમિરાજની સુદેઢતા જોઈ શર્કેદ્ર આનંદ પામ્યો. પછી વિપ્રવેષ છાડી ઈદ્રપણું વૈક્ષિય કર્યું. વંદન કરી મધુર વચ્ચને પછી તે રાજર્ષિની સુતિ કરવા લાગ્યો : “હે મહાપ્રશસ્ત્વી ! મહા આશ્ર્ય છે કે

તે કોધને છત્યો; આશર્વ તેં અહંકારનો પરાજ્ય કર્યો; આશર્વ તેં માયાને વળી; આશર્વ તેં લોભ વશ કર્યો; આશર્વ તારું સરળપણું, આશર્વ તારું નિર્મભત્વપણું; અહો, તારી આવી જબરી ક્ષમા; અહો તારું નિર્લોભપણું. હે પૂજ્ય ! તું આ ભવને વિષે ઉત્તમ છે અને પરબ્રહે ઉત્તમ હોઈશ. કર્મરહિત થઈ પ્રધાન સિદ્ધિગતિમાં પરવરીશ.” એ રીતે સુતિ કરતો કરતો, પ્રદિકાશા કરતો, શ્રદ્ધા ભક્તિએ તે ઋષિના પાદાંબુજને ચંદ્ન કરીને પછી તે સુંદર મુકુટવાળો શહેર આકાશ વાટે ગયો.

### પ્રમાણશિક્ષા :

વિપ્રરૂપે ઈંડ્રે નમિરાજનો વૈરાજ્ય તાવવામાં શું બાકી રાખી છે ? કાઈ નહીં. સંસારની જે જે લોલુપતા છવોને ચણાવનારી છે, તે તે લોલુપતા સંબંધી મહાગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળભાવથી સુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે; છતાં આપણે જોવાનું તો એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાજ્યના વેગમાં અમનું વહન અમણે ઉત્તરમાં દેખાડી આપ્યું છે. હે વિપ્ર, તું જે જે વસ્તુઓ મારા છે અને કહેવડાવવા માગે છે, તે વસ્તુઓ મારી નથી. હું એક જ હું; એકલો જનાર હું; અને માત્ર પ્રશંસનીય એકત્વને ચાહું હું. આવા રહસ્યમાં નમિરાજ પોતાના ઉત્તર ને વૈરાજ્યને દૃઢ કરતા ગયા છે.

### નમિઋષિ એકત્વ શાથી પામ્યા ?

એ નમિરાજને એકત્વ ભાન આં નીચેના પ્રસંગથી થયું. નમિરાજ રાજસુખ ભોગવત્તા હતા ત્યારે એક વેળા એના શરીરમાં દાહાજીવર ઊપજ્યો. એથી એને અત્યંત બળતરા થવા માંડી. ઘણા ઉપાયો કર્યા પણ એ રોગ શાંત થવાને બદલે ઊલટો વૃદ્ધિ પામ્યો. છેવટે એક કુશળ વૈધ મળ્યો. તેણે મલયાગિરિ ચંદ્નનું વિલેપન કરવા સૂચવ્યું. મનોરમા રાષ્ટ્રીઓ તે ચંદ્નને ઘસવામાં રોકાઈ. તે ચંદ્ન ઘસવાથી છાથમાં પહેરેલાં કંકણનો સમુદ્દર્ય પ્રત્યેક રાષ્ટ્રીઓ કને ખળભળાટ કરવા મંડી પડ્યો.

### કંકણનો કોલાહલ :

રાજ એક તો દાહની અસદ્ય વેદના ભોગવતો હતો ત્યાં આ કંકણનો કોલાહલ ઊપજ્યો. એથી રાજ ખળભળાટ ધૂમી શક્યો નહિ.

એટલે રાણીઓને ચંદન ઘસવા મના કરી. ખળભળાટ ન કરવા કહ્યું. ચંદન ઘસ્યા વિના તો ચાલે અમ નહોતું એટલે બધી રાણીઓએ મંગળ દાખલ એક એક કંકણ રાખી બાકી કંકણ ત્યાગ કર્યા. એથી ખળભળાટ શાંત થયો. નમિરાજે પૂછ્યું કે શું તમે ચંદન ઘસવું બંધ કર્યું? રાણીઓએ કહ્યું ના, કોલાહલ શાંત કરવા એકેક કંકણ રાખી બીજાં કાઢી નાખ્યાં છે. ચંદન તો ઘસીએ છીએ. કંકણનો સમુદ્દર હાથમાં નથી. એટલે કોલાહલ થતો નથી. આટલાં વચનો સાંભળ્યાં ત્યાં તો નમિરાજને રોમે રોમે એકત્વ સિદ્ધ થયું; વ્યાપી ગયું; તેનું મમત્વ ટઠી ગયું.

### જાજે જાજી ઉપાધિ :

ખરે, જાજાં મણ્યે જાજી ઉપાધિ જગ્યાય છે. જે હવે આ એક કંકણથી લેશ માત્ર ખળભળાટ થતો નથી. કંકણના સમૂહે કરી માધ્યું ફરી જય એવો કોલાહલ થતો હતો. ચેતન ! તું માન કે એકત્વમાં જ સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભોગવવાનું શું અવશ્ય છે? તેનો ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જે આ એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રહે છે? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભોગવતું હતું? તેવી જ રીતે તું પણ કંકણરૂપ છો. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સનેહી-કુટુંબીરૂપી કંકણ સમૂહમાં પડ્યો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવો પડશે. અને આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ, તો સિદ્ધગતિરૂપી મહાપવિત્ર શાંતિ પામીશ.

### વૈરાગ્ય અને જાતિસ્મૃતિ : રોગશાંતિ અને પ્રવજ્યા :

અમ વૈરાગ્યના પ્રવેશમાં ને પ્રવેશમાં તે નમિરાજ જાતિસ્મૃતિજ્ઞાન પામ્યા. પ્રવજ્યા ધારણ કરવાનો નિશ્ચય કરી શયન કરી ગયા. પ્રભાતે માંગલ્યરૂપ વાજીંત્રનો ધ્વનિ પ્રકટયો; દાદજીવરથી મુક્ત થયા.

એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન નમિરાજજિને અમિવંદન હો !

રાણી સર્વ મળી સુચંદન ઘસી ને ચર્ચવામાં હતી,  
બૂજ્યો ત્યાં કકળાટ કંકળાટણો, શ્રોતી નમિ ભૂપતિ;  
સંવાદે પણ ઈદ્રથી દૃઢ રહ્યો, એકત્વ સાથું કર્યું,  
એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અતે થયું.

**વિશેષાર્થ :** રાણીઓનો સમુદ્ધાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયો હતો. તત્સમયમાં કંકળાના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂજ્યો. ઈદ્રની સાથે સંવાદમાં પણ અચલ રહ્યો અને એકત્વને સિદ્ધ કર્યું. એવા એ મુજિત્સાધક મહાવૈરાગીનું ચરિત્ર ભાવનાબોધ ગ્રથે તૃતીય ચિત્રે પૂર્ણતા પામ્યું.

હવે આ ચોથી ભાવનાનું અષ્ટબળિયું કહે છે.

**સ્વ શું ? પર શું ?**

॥ પરજીયો રાગ ॥

વિનય ચિત્તય વસ્તુતત્ત્વ  
જગતિ નિજમિહ કસ્ય કિ ?  
ભવતિ મતિરિતિ યસ્ય હદ્યે ।  
દુરિતમુદ્યતિ તસ્ય કિ ? ॥ વિ૦ ૭ ॥

**અર્થ :** “હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?

એના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહદુ ?”

— શ્રીમદ્ રાજચંદ્ કૃત મોક્ષમાળા

ચેતન ! આ તું વિવેકપૂર્વક વિચાર. વિનય, તું વસ્તુતત્ત્વ વિચાર. આ જગતમાં પોતાનું શું અને પારહું શું એનો વિવેક કર.

“એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યો,

તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં.”

— શ્રીમદ્ રાજચંદ્ કૃત મોક્ષમાળા

વિનય ! જેને મારું શું અને પારશું શું એવો પ્રશ્ન તીકે છે અને જે એમાં વિવેક કરે છે, તેને કદી પાપ-દુઃખ આવે જરાં ? ના, કદાપિ નહિ. માટે વિનય ! તું વસ્તુતાવ વિચાર અને પરભાવ છાંડી હૈ. તારા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ એકલા આત્માને ચિંતવ. ૧

એકલો એક જી :

એક જત્પદત્તે તનુમાન ।  
એક એવ વિપદત્તે ॥  
એક એવ હિ કર્મ ચિનુતે ।  
સૈકકઃ ફળમશ્નુતે ॥ વિ૦ ૨ ॥

અર્થ : આત્મા એકલો જ દેહરૂપે તીપજે છે; એકલો જ દેહરૂપે વિપત્તિ પામે છે; મરે છે. એકલો જ કર્મ સંચે છે અને તે એકલો જ તેનાં ફળ ભોગવે છે. આમાં બીજું કોઈ ભાગીદાર નથી. એમ હે વિનય ! તું વસ્તુસ્થિતિ વિચાર. એકત્વ-વિચાર. ૨

જીવ જહાજ, મોહ કાણું, કષાય જળ, સંસાર સમુద્ર :

યસ્ય યાવાન્યરપરિગ્રહः ।  
વિવિધમભતાવીવદ્યः ॥  
જલધિવિનિહિતપોતયુક્તયા ।  
પતતિ તાવદસાવદ્યઃ ॥ વિ૦ ૩ ॥

અર્થ : જેમ ભરદવિયે વહાણ હોય અને તેમાં પથ્યર આદિ જુબરો ભાર ભર્યો હોય અને તેમાં કાણું પડે તો જળ અંદર ભરાઈ જઈ તે વહાણ જેમ બૂડી જઈ તળિયે બેસે છે, તેમ હે વિનય ! પર પરિગ્રહભારથી ભરેલો આ જીવ-જહાજ ભરસંસારસમુદ્રે પડ્યો છે, તેમાં મમત્વરૂપ કાણાથી કષાય જળ ભરાતાં તે તળિયે રૂબે છે. તેમાંથી એ જીવ જહાજને ભરાર નીકળવું અતિ દુષ્કર છે, માટે હે વિનય ! તું પરપરિગ્રહ અને તે પર મમત્વ બંને છાંડી હૈ, તો હળવો થઈને આ.

સંસારસમુદ્ર તરી જઈશ. વિનય ! તું વસ્તુતાત્પર વિચાર અને આ બીજી જંજાળ છોડી દઈ તારું અક્તવ વિચાર. ઉ

મોહ અને મહિરા :

સ્વસ્વભાવં મદ્યમુદિતો ।  
ભુવિ વિલુષ્ય વિચેષ્ટતે ॥  
દૃશ્યતાં પરભાવઘટનાત્ ।  
પતતિ વિલુઠતિ જુંભતે ॥ વિંદો ૪ ॥

અર્થ : જેમ કોઈ માણસ મધ્યપાનથી પોતાનો શુદ્ધબુદ્ધ ખોઈ અનેક પ્રકારની ગાંડા જેવી વિચિત્ર ચેષ્ટા કરે છે, અને જમીન પર પડે છે, લોટે છે, બગાસાં ખાય છે; તેમજ પરભાવ પર મૂર્ખાં કરવાથી, પરવસ્તુ પર મોહ-મમતા રાખવાથી જીવ પોતાનો સ્વસ્વભાવ વીસરી જઈ અનેક પ્રકારની વિભાવિક ચેષ્ટાઓ કરે છે, અધોગતિમાં પડે છે, જાતજાતની ગતિમાં ભમે છે અને વિંબના પામે છે. માટે જીવે પરવસ્તુ પર મોહ કર્તવ્ય નથી. પરભાવનું મમત્વ મધ્યપાન જેવું છે, માટે રે વિનય ! તું આ જગતમાં પોતાનું શું અને પારહું શું ? સ્વ શું અને પર શું ? તારું શું અને બીજાનું શું ? આત્માનું શું અને પુદ્ગલનું શું ? એ વિવેક કર; વસ્તુતાત્પર વિચાર. ૪

કુસંગીનો પ્રસંગ દે, કુસંગ રંગ અંગમાં :

પશ્ય કાંચનમિતરપુદુગત-  
મિલિતમંચતિ કાં દશાં ॥  
કેવલસ્ય તુ તસ્ય રૂપં ।  
વિદિતમેવ ભવાવુશાં ॥ વિંદો ૫ ॥

અર્થ : જો, સુવાજીમાં બીજી પુદ્ગલનું મિશ્રણ થવાથી એની શું દશા થાય છે ? સુવર્જનનું કેવલ સુવાર્ણ સ્વરૂપ કેવું હોય એ તો તારા જેવા જાણતા જ હોવા જોઈને. સોનાની રજ માટી સાથે ભળતાં માટીરૂપ થઈ જાય છે. સોનાની સાથે બીજી હલકી ધાતુનો બેળ

કરવામાં આવે તો તે હલકું થઈ જાય છે. ફરી એમાંથી એકાંત કેવળ સોનું ધ્યાન કરે થઈ શકે છે. માટી સાથે મળેલા સોનાનાં રજકણો માટી શોધી શોધીને તાવવાથી, ગાળવાથી, યંત્રપ્રયોગમાં આખવાથી જુદાં પડે છે. સુવર્ણ રજવાળી માટી ઉપર અનેક તાવવાના-ગાળવાના-શોધવાના પ્રયોગ કર્યા પણી તેમાંથી સોનાની રજ નીકળે છે. તે બધાને ફરી ફરી તપાવે ત્યારે ખરા-સોનાનો પિંડ બંધાય છે. તેમજ હલકી ધાતુ સાથે મિશ્ર થયેલ સોનું પણ તાવવાથી નીકળે છે. સોનાને જેમ બીજા પુદ્ગલ સાથે મળતાં આવી દશા ભોગવવી પડે છે, અને પાછું સોનાડુપે આવતાં તવાનું-ગળાનું પડે છે; તેમજ. ૫

### કન્ક અને ઉપલ - પ્રકૃતિ અને પુરુષ :

એવ માત્મનિ કર્મવશતો ।  
ભવતિ રૂપમનેકધા ॥  
કર્મમલરહિતે તુ ભગવતિ ।  
ભાસતે કાંદનવિધા ॥ વિ૦ ૬ ॥

**અર્થ :** આત્માનાં કર્મ સાથે ભળવાથી અનેક રૂપ થાય છે અને તે જ ભગવાનરૂપ આત્મા કર્મમેલરહિત થાય ત્યારે કુદન જેવો દીપી રહે છે. સોનું જેમ માટી કે બીજી હલકી ધાતુથી અલગ થતાં કુદનરૂપે ચળકાટ કરી રહે છે, તેમ આત્મા પણ કર્મ સંબંધથી અલગ થતાં, શુદ્ધ ચૈતન્યરૂપ થઈ જણહણી રહે છે. ચેતન ! એ આત્મપ્રકાશ કેવળ પરસંબંધથી અવરાઈ ગયો છે; તો તું તરણે શું અને બીજાનું શું એ વિચારી વસ્તુતાવ શોધ. ૬

### તત્ત્વમણિ :

જ્ઞાનદર્શનચરણપર્યવ-  
પરિવૃત્ત: પરમેશ્વર: ॥  
એક એવાનુભવસદને ।  
સ રમતામવિનશ્વર: ॥ વિ૦ ૭ ॥

અર્થ : અહો ! આ મારો આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર પર્યાપ્તિવાળો પરમેશ્વર છે. એ એક છે, એકલો છે, એનો બીજો સાથે સંબંધ નથી. એનાં તો જ્ઞાન, દર્શન, ચારિત્ર જ છે; અને જ્ઞાનાદિ ઐશ્વર્યસંપત્તિ તે પરમેશ્વર છે. વળી તે અવિનાશી છે. બીજી વસ્તુઓ તો વિનાશ પામે એવી છે; પુદ્ગળો અનિત્ય છે; એકદ્વિતી રહેતાં નથી; ત્યારે આ ચેતનદ્રવ્ય, આત્મા અવિનાશી છે. આવો મારો આત્મા અનુભવગૃહમાં આનંદ કરો. તે પોતે પોતાનો જ અનુભવ કરી તેથી આનંદ પામો. હે વિનય ! તું સ્વપરની વહેંચણી કર. તને નિશ્ચય થશે કે આ જ્ઞાનાદિ ગુણવાળો એક, અવિનાશી આત્મા જ તારો છે. તે જ તું છે, આ બીજી પૌદ્ગલિક વસ્તુ તારી નથી; તે તું નથી - દેહ તે તું નથી; સ્ત્રી તે તું નથી; પુત્ર તે તું નથી; ધન તે તું નથી; કુટુંબ તે તું નથી; એ આદિ પુદ્ગળ વસ્તુઓ તું નથી. તું તેથી પર છે; અલગ છે; એકલો છે; તારે તેથી સંબંધ, લેવાઈવા નથી. આવા પ્રકારનો તને તારો પોતાનો અને બીજાનો નિશ્ચય થશે. તેથી તું તારો પોતાનો, તારી પોતાની વસ્તુનો આશ્રય કરીશ અને તારી નહિ એવી તારાથી પરવસ્તુનું ભમત્વ છોડીશ; જે પરિણામે તને પરમ હિતદ્વારા થશે. ૭

### વિષયસુખ અને વિષયાતીત સુખ :

રુचિરસમતામૃતરસં ક્ષણ-  
 મુદિતમાસ્વાદ્ય મુદા ॥  
 વિનયવિષયાતીતસુખરસ-  
 રતિરુદંચતુ તે સદા ॥ વિ૦ ૮ ॥

અર્થ : ચેતન ! એ પ્રકારે વસ્તુતત્ત્વ વિચારવાથી, સ્વપરનો વિવેક કરવાથી તને સુંદર સમતા અમૃતરસ પ્રાપ્ત થશે; તો તેવો સમતા અમૃતરસ પ્રાપ્ત કરી એક ક્ષણ તું તેનો સ્વાદ તો લે, તને બહુ આનંદ થશે; જેણું વર્ણન ન થઈ શકે એવો સુખરસ તું પામીશ. વિનય ! હું ઈચ્છણું છું, કે તું તે અનુપમ સુખ પામ, એ સુખ વિષયસુખથી ક્યાંય ચેડે એમ છે. વિષયસુખ તો ક્ષણિક છે; પરિણામે દુઃખદાયી છે; આ

અવર્ણનીય સુખ શાશ્વત અવ્યાભાધ છે - તે તને પ્રામ થાઓ, એ મારી આશિષ છે. વિનય, તું વસ્તુતાત્વ વિચાર; સ્વપ્ર વિચાર, અને તને એ અનુપમ સુખ ચોક્કસ મળશે. પૂર્વે કહેલ શ્રી નાન્દીજિ એ જ વિચારથી અનુપમ મોકસુખ પામ્યા છે. ૮

॥ ઇતિ શ્રીશાંતસુધારસગેયકાવ્યે એકત્વ-ભાવના-વિભાવનો નામ ચતુર્થ પ્રકાશः ॥

ઇતિ શ્રી શાંત સુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં  
એકત્વભાવના નામનો ચોથો પ્રકાશ સમાપ્ત.



ॐ

## अव्यतिप्रभावना

कांटो केम साले ?

॥ उपजाति वृत्तं ॥

परः प्रविष्टः कुरुते विनाशं ।  
लोकोक्तिरेषा न मृषेति मन्ये ॥  
निर्विश्य कर्माणुभिरस्य किं किं ?  
ज्ञानात्मनो नो समपादि कष्टं ॥ १ ॥

अर्थ : "A foreign body, if allowed within can not but injure the native."

शरीरमां कांटो के काय के पथरी प्रवेश करे, तो ज्यां सुधी रहे त्यां सुधी हुँभ आपे; नवा नवा विकार पेदा करे. ए काढी नाष्टे निरांत थाय.

ऐकना धरमां बीजनो प्रवेश थयो, तो पडेलांनो नाश करे.

"रोटलो आपीअे पाश ओटलो न आपीअे."

अनंत शक्तिनो धड्ही रांड !!!

आ अधां व्यवहार सत्य छे; तेम आ ज्ञानादि गुणवाणो जे आत्मा तेमां तेथी पर, तेनाथी अन्य ऐवा जे कर्मपरभाषुओ, तेना प्रवेशथी ते ज्ञानात्माने शुं शुं हुँभ नथी वीत्यां ? अर्थात् आत्मामां ए कर्मउपी अन्य परवस्तुओनो पेसारो थवाथी ते हेरानहेरान थई गयो छे;

પોતાની બધી ઋષિ, છતી ઋષિ, કર્માંભે બથાવી પાડી છે; અને કર્મવશ થઈ અનંત શક્તિનો ધર્ષી છતાં રાંકની પેઠે, અવ્યાબાધ સુખવાળો છતાં દુઃખી થઈ, ભટકે છે. આમાં કારણ બીજું કર્દી નહિ, પણ પોતાથી પર, જુદી, અલગ વસુરૂપ કર્મે પોતાના ધરમાં પ્રવેશ કર્યો તે જ. તે પરવસુરૂપ કર્મનું આત્માના જ્ઞાનાદિ પર આવરણ આવી ગયું; અથી આત્મા દિશામૂઢ થયો. હવે તેમાંથી છૂટવાનો ઉપાય તો એ પરવસુને પાછી ધકેલી મૂકવી એ છે. ૧

### અનુપમ ભણિ :

॥ સ્વાગતા વૃત્તં ॥

ખિદસે નનુ કિમન્યકથાર્તઃ ।

સવૈવ મમતાપરતંત્રઃ ॥

ચિંતયસ્યનુપમાન્કથમાત્મ-

નાત્મનો ગુણમળીન્ન કરાપિ ॥ ૨ ॥

અર્થ : અહો ! ચેતન, તું મમતવને વશ થઈ તારાથી અન્ય એવા કુટુંબ, પુદ્ગલાદિ તેની જ ઝૂથલીથી પીડાતો કાં જેદ પામે છે ? તારા પોતાના જ્ઞાનાદિ શુષ્ણરૂપ અનુપમ ભણિને તું કેમ કોઈ વેળા પણ ચિંતવતો નથી ? તારા પોતાનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગ શુષ્ણો છે. તે અમૂલ્ય ભણિ સમાન છે.

### અરે ! રત્નો ચોરાય છે :

એ ભણિને ઉપમા આપી શકાય એવી બીજી વસ્તુ આ જગતમાં નથી, એ ભણિ અનુપમ છે; તો તું એની ચિંતા કેમ નથી કરતો ? તારી બેદરકારીથી એ અનુપમ ભણિને કષાયઆદિ કર્મરૂપી ચોરો ચોરી લે છે, માટે રે ! ચેતન ! તું તારા એ અનુપમ ભણિઓની, રત્નત્રયીની સંભાળ રાખ, એની ચિંતા કર, અનું ચિંતવન કર અને તારાથી પર એવા પુદ્ગલાદિની ચિંતા છોડી હો; કેમ કે એની ચિંતા કરવી નકામી છે; અને ઊલટો તું પરતંત્ર થઈ દુઃખી થાય છે. તને તારા દેહની ચિંતા છે. એટલી તારા આત્માની ચિંતા નથી એ આશ્વર્ય છે ! તું કેમ લૂલી જાય છે કે આ

देह तो पौद्यगविक वस्तु छे; तेथी ते स्वभावे ज सडी जह नाश पामे अम छे, तो ए तो नाशना धरमां ज पेठो छे. ते आजकाल वडेलो-मोडो पश अवश्य जर्जरित थई यथावसर के अक्समात् पडशे ज, तो ते अर्थे करेली चिंता तने शुँ इण आपशे ? कई नहि. उलटो तु तेनी चिंतामां हुःखी थई, ए काण जे तारी पोतानी भरी शाश्त्र ऋषि-ज्ञानादिना चिंतवनमां काढी शकत ते नकामो छारी गयो; दरभ्यान तारा गुण उपर जबरुं आवरण आवी पडयुं. येतन ! पर ऐवां शरीर, कुटुंब प्रमुख परनी चिंतानां इण पाम्यो, तो तु ए पारकी चिंता छोडी दह तारां अनुपम रत्नोने साचव, तेनी चिंता कर, तेनुं चिंतवन कर. २

ए तो पारकां छे, तारां नथी :

॥ शार्दूलविक्रीडितं वृत्तं ॥

यस्मै त्वं यतसे विभेषि च यतो यत्रानिशं मोदसे ।

यद्यच्छोचसि यद् यदिच्छसि हृदा यत्प्राप्य ग्रेषीयसे ॥

स्तिर्घो येषु निजस्वभावमपलं निर्लोक्य लालप्यसे ।

तत्सर्वं परकीयमेव भगवन्नात्मनं किंचित्तव ॥ ३ ॥

**अर्थ :** अहो येतन ! जेने लईने तुं प्रयत्न करी रक्षो छे, जेने लई तुं डेरे छे, जेने लई तुं सर्वकाल आनंद पामी रक्षो छे, जेने लई तुं शोय कर्या करे छे, जेने तुं अंतःकरणमां ईच्छे छे, जे भव्ये तुं आनंद पामे छे अने जेना उपर तुं स्नेह धरीने, तारा निर्मण स्वभावने दणी नांझी, तेनो नाश करी, लालनपालन करी रक्षो छे, ते बधां हे भगवद्गुप आत्मा ! पारकां छे; अमानुं कई तारुं नथी. तो ऐवी परवस्तुनी पोतानी वस्तुना भोगे शी चिंता ? ज्ञानादि जे पोतानी ऋषि तेना भोगे हे येतन ! परिषामे हुःख अने विटंबज्ञाना डेतुरूप पारकी चिंता तारे कर्तव्य नथी. हे येतन ! तुं विचारी जो.

तुं धन, कुटुंब, स्त्री, पुत्र, यश, अधिकार आदि माटे प्रयत्न करे छे, ते वस्तुओ तारी छे ? ना. तारी छोय तो तारी पासे रहेवी जेईमे; तेम तो नथी. ते तो नाश पामे छे; तुं ईच्छे के न ईच्छे पश तने छोडी जय छे.

## સ્વભાવનું ઓસડ છે ?

વળી એ બધાં અર્થે તું ભયમાં જ રહે છે કે રખેને એ ચાલી જશે. અથવા કોઈ હરી લેશે. તારા ડેહ માટે પણ તું ભયભીત થઈ ફરે છે કે રખે એ પડી જશે ! પણ હે બંધુ ! તું કેમ વિચારતો નથી કે સરીને નાશ પામવાના સ્વભાવવાળી એ તારાથી અન્ય એવી અનિત્ય વસ્તુઓ ગમે ત્યારે તેના સ્વભાવ પ્રમાણે ક્ષીક્ષા થશે, નાશ પામશે, તેના સ્વભાવને તું કેમ અટકાવી શકીશ ? બધાનું ઓસડ છે, પણ કોઈએ સ્વભાવનું ઓસડ દેખ્યું છે ? અર્થાત્ જ્યાં સ્વભાવ અટકાવી ન શકાય ત્યાં તું શા માટે નકામો ડર રાખી દુઃખી થાય છે ? ચેતન ! એ પારકી વસ્તુઓ છે; અને તારી નથી એથી તને ડર રહે છે.

## “પશ્ચાદ દુઃખ તે સુખ નહિ”

વળી એ જ વસ્તુઓ તને સાંપડી હોય છે ત્યારે તું આનંદ પણ પામે છે, પણ તે તારો આનંદ નકામો છે; મોહથી જ ઉપજ્યો છે; કેમ કે જે આનંદથી પછી દુઃખ પડે તે આનંદ ન કહેવાય. એ વસ્તુઓ જેથી તું આનંદ માને છે, તે હરાઈ ગયે, અથવા તેના સ્વભાવ મુજબ નાશ પામ્યે, તને બેવડું દુઃખ થશે.

વળી તું એ વસ્તુઓના વિયોગે શોક કરે છે; તેને અંતરમાં ઈચ્છે છે; તે માયે રાણ થાય છે; અને તે ઉપર ગાઢ સ્નેહ ધરી છાકી જાય છે; પણ સ્નેહ તે દુઃખનું મૂળ છે, એ વ્યવહાર સત્ય છે; અને નિશ્ચયે એ સ્નેહ, શોક, હર્ષ આદિથી તારા પોતાનાં જે નિર્ભલ જ્ઞાનાદિ ગુણો તે દ્વારા જાય છે. તેના પર આવરણ, ગાઢ આવરણ આવી જાય છે. તો હે ચેતન ! એ તારા પોતાના ગુણના ભોગે, તારા સુખના ભોગે તારે પારકી વસ્તુઓની, અર્થાત્ તારાથી પર એવી શરીર, પરિગ્રહ, કુટુંબ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ઈષ જન, ધર, હાટ, હવેલી આદિ બીજી વસ્તુઓની લેશ માત્ર ચિંતા કર્તવ્ય નથી. તેની પ્રાર્થિસે હર્ષ કે તેના વિરહે શોક, કે તેની કુશળતા પ્રતિ ભય, કે તેઓ પ્રતિ સ્નેહ-મોહ તારે કરવા યોગ્ય નથી.

પોતાનું પોતામાં, તારી પોતાની વસ્તુ તે તો મારું મારામાં, તારા પોતામાં જ રહેલી છે. તારું તારામાં.

તે તારાથી પર નથી.  
 તારાથી બહાર નથી.  
 તે બહારથી ખોળતાં નહીં મળે.  
 “તુમાં તું સમાયો છે.”

કસ્તૂરીમૃગ કસ્તૂરી અર્થે વનોવન વિચરે છે, પણ બિચારું નિરાશ પામે છે; કેમ કે કસ્તૂરી તો પોતાની જ નામિમાં છે, તે એને બહાર ભટક્યે કચ્ચાથી મળે ?

Why do you find without what is within yourself ?

આમ હે, ચેતન ! તારી વસ્તુઓ તો તારી પાસે છે; તું પારકી ચિંતા શા માટે કરે છે ?

“તેરા હે સો તેરી પાસે,  
 અવર કુછ નહિ તેરા,  
 આપ સ્વભાવમાં રૈ-અવધુ  
 સદા ભગનમેં રહેણા.”

— પ્રકીષ્ણ

“પર વસ્તુમાં નહિ મૂંજવો,  
 એની દ્યા મુજને રહી;  
 એ ત્યાગવા સિદ્ધાંત કે  
 પશ્ચાદ દુઃખ તે સુખ નહિ.”

— શ્રીમહ્ર રાજચંદ્ર કૃત મોક્ષમાળા-૩

આ મારું નહિ :

દુષ્ટાઃ કષ્ટકર્દર્થનાઃ કતિ ન તાઃ સોદાસ્ત્વયા સંસ્તૌ ।

તિર્યડ્નારકયોનિષુ પ્રતિહતચ્છિન્નો વિભિન્નો મુહુઃ ॥

સર્વ તત્પરકીયદુર્વિલસિતં વિસ્મૃત્ય તેષ્વેવ હા ।

રઘ્યનુદ્યાસિ મૂઢ તાનુપવરન્નાત્મન ન કિ ખજસે ? ॥ ૪ ॥

અર્થ : રૈ ચેતન ! તું આ સંસારમાં અનેક દુષ્ટ સંકટો પામ્યો નથી ?

અરે ! ઘણાં ઘણાં દુઃખો ફરી ફરી પામ્યો છે. વારંવાર નરક-તિર્યચ  
ગતિમાં તું છથાયો છે; છેદાણો છે, ભેદાણો છે; વિશેષપણો ભેદાણો છે.  
હે ચેતન ! તે બધી કદર્થના પારકી ચિંતાને લઈ તે ભોગવી છે. ઉપર  
જણાવેલ પર-પુદ્ગલાદિની ચિંતાથી વારંવાર એ દુઃખ, છેદન-ભેદન,  
તાડન-તરજનનાં દુઃખ તું પામ્યો છે. તારા સ્વરૂપની જ ચિંતા કરી હોત,  
તેનો જ વિચાર કર્યો હોત તો આ દુઃખ તું ન પામત. હે ચેતન ! તું આ  
બધું શું વીસરી ગયો કે હજુ પણ તેમાં - એ પરવસ્તુઓમાં રાગ ધરી,  
તેથી રાજુ થઈ, તેથી મોહ પામે છે, તેથી મૂર્ખીંત થાય છે ? આટલું  
ઇતાં, આવાં દુઃખોનાં પરિણામ ઇતાં, હજુ તું એ પરવસ્તુને તારી ગળી  
સેવે છે, તેની ચિંતા કરે છે, તે તને લાજ આવતી નથી ? તું વિચાર કે -

“ના મારાં તન રૂપ કાંતિ યુવતી  
ના પુત્ર કે આત ના,  
ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે  
ના ગોત્ર કે જ્ઞાત ના;  
ના મારાં ધન-ધામ યૌવન ધરા  
એ મોહ અજ્ઞાતવના,  
રે ! રે ! જીવ વિચાર એમ જ સદા  
અન્યત્વદા ભાવના.”

- શ્રીમદ્ રાજ્યંદ્ર કૃત ભાવનાઓથ  
અન્યત્વ ભાવના

ત્યારે મારું શું ? આ :

॥ અનુષ્ટુપ્ઘૃત ॥

જ્ઞાનદર્શનચારિત્રકેતનાં ચેતનાં વિના ।  
સર્વમન્યદ્વિનિશ્ચિત્ય યતસ્વ સ્વહિતામયે ॥૫॥

અર્થ : હે ચેતન ! તારાં લક્ષ્ય તો જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. જ્ઞાન,  
દર્શન, ચારિત્ર એ જ તારાં છે. તે સિવાય જે બીજી વસ્તુ તે તારી નથી;  
તે અન્ય છે; તે પર-પારકી છે, એમ વિશેષ પ્રકારે નિશ્ચય કરી તું તારા  
હિત અર્થે પ્રયત્ન કર.

## પારકું શું ?

ધન તારું નથી, એ પરવસ્તુ છે.  
 રૂપ તારું નથી, એ પરવસ્તુ છે..  
 કાંતિ તારી નથી, એ પરવસ્તુ છે.  
 સ્ત્રી તારી નથી, એ પરવસ્તુ છે.  
 પુત્ર તારો નથી, એ પરવસ્તુ છે.  
 ભાઈ તારો નથી, એ પરવસ્તુ છે.  
 ચાકર તારો નથી, એ પરવસ્તુ છે.  
 સેહી તારા નથી, એ પરવસ્તુ છે.  
 સ્વજન તારા નથી, એ પરવસ્તુ છે.  
 ગોત્ર તારું નથી, એ પરવસ્તુ છે.  
 શાત તારી નથી, એ પરવસ્તુ છે.  
 ધર તારું નથી, એ પરવસ્તુ છે.  
 ઘોવન તારું નથી, એ પરવસ્તુ છે.  
 જમીન તારી નથી, એ પરવસ્તુ છે.  
 મોહ તારો નથી, એ પરવસ્તુ છે.  
 અજ્ઞાન તારું નથી, એ પરવસ્તુ છે.

ઇત્યાદિ તારું કાંઈ નથી; એ બધાં તારાથી પર, તારાથી અન્ય,  
 તારાથી અલગ છે. એમાં તારે રાચવું યોગ્ય નથી. એમાં તારે મોહ  
 કર્તવ્ય નથી. એ પારકી વસ્તુનો મોહ દુઃખદાયી છે.

તારી પોતાની, તારી સાથે સદ્ગાળ રહેનારી વસ્તુઓ તો  
 જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ અમૂલ્ય-અનુપમ રત્નો છે. તે માટે હે યેતન ! તું  
 ચિંતા રાખ. એ જ્ઞાન, દર્શન, ચારિત્રનું સંક્ષેપે આ સ્વરૂપ છે, તે તું  
 વિચાર.

### : જ્ઞાન-સ્વરૂપ :

છે દેહાદિથી લિન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ,

મૂળ મારગ સાંભળો જીનનો રે. ૧

એમ આણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહું જ્ઞાન તેનું નામ ખાસ... .

મૂળ મારગ... ૨

### : દર્શન-સ્વરૂપ :

જે જ્ઞાને કરીને આણિયું રે, તેની વર્તો છે, શુદ્ધ પ્રતીતિ...

મૂળ મારગ... ૧

કહું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત...

મૂળ મારગ... ૨

### ચારિત્ર-સ્વરૂપ :

કેમ આવી પ્રતીતિ જીવની રે, આણ્યો સર્વથી ભિન્ન અસંગ...

મૂળ મારગ... ૧

એવો સ્થિર સ્વભાવ તે ઉપરે રે, નામ ચારિત્ર તે અજાલિગ...

મૂળ મારગ... ૨

- શ્રીમદ્ રાજચંદ્ર

ચેતન ! આ જ્ઞાનાદિનું સંકેપે સ્વરૂપ છે, તે તું વિચાર. તે વિશેષ વિશેષ વિચારી જોઈશ તો ઉત્તમ આત્માર્થ પામીશ. ચેતન ! તું સર્વથી ભિન્ન છે, અસંગ છે, બીજી વસ્તુઓ સાથે તારે કાંઈ લેવાદેવા નથી; તો તેની દુઃખદ ચિંતા છોડી દઈ, તારા પોતાની, તારા સ્વરૂપની ચિંતા કરી તારું હિત સાધ. ૫

હવે પાંચમી ભાવનાનું અષટાગ્યાયું કહે છે.

“પિયા નિજ મહેલ પધારો રે”

॥ શ્રી રાગ-તુજ ગુણ પાર નહિં સુણાઓ... એ દેશી ॥

વિનય નિપાલય નિજભવન ॥ ધ્રુવ ॥

તનુધનસુતસદનસ્વયજનાવિષુ

કિ નિજમિહ કૃગતેરવન ॥ વિ૦ ૧ ॥

અર્થ : હે વિનય, તું તારું પોતાનું જે ભવન છે, તેની નિકટ આવી

સંભાળ લે; અર્થાત તું તારા આત્માવાસ પાસે હવે આવ, અને એની સંભાળ લે. હવે તો બહુ થઈ.

આ સંસારમાં કુગતિમાં પડતાં તને કોણ બચાવશે ? તારું શરીર તારી રક્ષા કરશે, કે તારી લક્ષ્મી, કે તારાં પુત્ર કે ઘર કે સ્વજન, કોણ તારી રક્ષા કરશે ? કોણ તને દુર્ગતિમાં પડતો બચાવશે ? તું તેને તારાં તારાં કરી રહ્યો છે, તારા ગાણી તેના અર્થે હર્ષ-શોક-ભય ધરી રહ્યો છે, તેઓના અર્થે પાપ કરી રહ્યો છે, તેઓ એ પાપનાં ફળમાં ભાગ લેશે ? માઠી ગતિરૂપ એ પાપમાંથી તને બચાવશે ? ના. તો તું તેઓ પર કેમ મિથ્યા મોહ ધરી રહ્યો છે ? તું તારું પોતાનું આત્મદ્રવ્ય સંભાળ. હવે બહુ થઈ.

“પિયા પર ઘર ભત જાઓ રે, (૨)

કરી કરુણા મહારાજ, પિયા પર ઘર ભત જાઓ રે

અપને ઘર વાલમ કહો રે, કૌન વસ્તુકી ખોટ ?

શોગટ તદ<sup>૧</sup> કચમ લીજુએ, ખારે શિશ ભરમકી<sup>૨</sup> પોટ

પિયા નિજ મહેલ પધારો રે...”

— શ્રી ચિદાનંદ

હે ચેતન ! પ્રીતમ, હવે તો તું પર ધેર જ નહિ. હવે તો કરુણા કરી તારું જ ઘર સંભાળ.

દેહ પણ તારો નહિ ?

યેન સહાશ્રયસે�તિવિમોહા-

-દિદમહમિત્યવિભેદं ।

તદાપિ શરીરં નિયતમધીરં

ત્યજતિ ભવંતં ધૃતખેદં ॥ વિ૦ ૨ ॥

૧. તો

૨. ભરમ=(૧) વહેલ. (૨) અજ્ઞાન. (૩) ભવ-ભમણ. અથ ત્રણ અર્થ જુદી જુદી રીતે આમાંથી ઉત્તર એવું ચમત્કારવાનું આ કાલ્ય છે.

અર્થ : રે ચેતન ! બીજાની વાત તો અલગ રાખ; કેમ કે બીજાં ઘર, કુટુંબ, પરિગ્રહ આઈ તો તારાથી મ્રત્યક અલગ છે; પણ આ શરીર કે જેનો “આ હું” “આ હું” “આ શરીર તે હું” એવા પ્રકારે અત્યંત વિભાવિકપણાથી, મોહથી તું આશ્રય કરી રહ્યો છે, તે શરીર પણ નિશ્ચય કાણબંનુર છે; તે પણ તને રડતો મેળી, જેદ ઉપજવી ચાલ્યું જશે. અર્થાતું આ નશર દેહ જેમાં તું “હું પણું” (અભેદપણો, અર્થાતું દેહ એ જ આત્મા) માની બેઠો છે, અને તેના જ આશ્રયે રહ્યો છે, તે પણ નાશ પામરો, અને તને જેદ ઉપજવશે; તો તું એવી નાશવંત વસ્તુ જે તારી નથી તે પર વૃથા મૂર્ખઈ કેમ પામે છે ? તું એ દેહાત્મ-બુદ્ધિ છોડી કે અને તારી પોતાની ઋષિ સંભાળ.

છોડે અને છાંડને !

“રહી ઓછુંવાં વિષય સઉ જશે તજુ તને.” ચેતન, જે તને વહેલામોહુ છોડશે અને હુંખ ઉપજવશે, તને તું જ છોડી દેને. અર્થાતું એ પરવસ્તુનું અનિત્યપણું વિચાર; એ તારી નથી એમ વિચાર; એ વહેલામોડી જવાની એમ વિચાર; આમ વિચારી તે પરનો મોહ ત્યજુ દે ! એટલે એ રહે કે જાય તેથી તને કાંઈ આકુળવ્યાકુળતા નહિ થાય; આત્મા અસ્થિર પરિણામી નહિ થાય. આકુળવ્યાકુળતા કે અસ્થિર પરિણામ કર્મબંધના હેતુ છે. મોહ અને મમત્વને લઈ આકુળવ્યાકુળતા થાય છે. પરવસ્તુને વિષે તારાપણું તે માન્યું હોય તો તે વસ્તુના જવાથી તને જેદ થાય જ; હુંખ થાય જ; આકુળવ્યાકુળતા થાય જ; મોહ ઉપજે અને કર્મ લાગે; પણ પહેલેથી જ એ વસ્તુતાઃ તારી નથી એવો નિશ્ચય કરી રાખ્યો હોય તો પછી કાંઈ ભાવિ હુંખ, જેદ, કર્મ, આવરણનું કરણ રહેતું નથી; માટે ચેતન ! તું એ પર વસ્તુ તારી નથી એમ નિરધાર કરી તારા પોતાના ગુણની સંભાળ લે; તેમાં જ રમણ કર.

તારી સાથે શું આવે છે ?

જન્મનિ જન્મનિ વિવિધ પરિગ્રહ-  
-મુપાચિનુષે ચ કુદુંબ ।

તેષુ ભવંતં પરભવગમને,  
નાનુસરતિ કૃશમપિ સુંબं ॥ વિંદો ૩ ॥

**અર્થ :** હે ચેતન ! તું ભવભવને વિષે વિવિધ પ્રકારનાં કુટુંબ અને પરિશ્રદ્ધ સંપાદન કરે છે. તે કુટુંબ પરિશ્રદ્ધાદિમાંથી એક નાનો ત્રાંબિઓ પણ પરભવ જતાં તારી સાથે આવે છે ? ના, એક ફૂટી બદામ પણ નથી આવતી. અરે ! તારો દેહ પણ તારી સાથે નથી આવતો, એ પણ તું એમાંથી છૂટ્યો એટલે અતે નિશ્ચેત થઈ પડે છે; એને બાળી નાંખે છે. તું તો પરભવ એકલો તારાં પાપ-પુષ્ય કર્મ સાથે જાય છે. જેને વિષે તું જને જને મૂર્ખજી રાખે છે, તે કુટુંબ, પરિશ્રદ્ધ, દેહાદિમાંથી કશું તારી સાથે નથી આવતું એ શું બતાવે છે ? એ એમ બતાવે છે કે એ કુટુંબ, પરિશ્રદ્ધ તારાં નથી; પારકાં છે; તાંરાથી પર છે. તારા તો જ્ઞાનાદિ ગુણ છે, માટે પરવસ્તુનો મૌહ ત્યજ દઈ હે વિનય ! તું તારું પોતાનું ભવન સંભાળ. ઉ

### વિશુદ્ધિનું શોધન :

ત્વજ મમતાં પરિતાપનિદાનં ।  
પરપરિચય પરિણામં ॥  
ભજ નિસંગતયા વિશદીકૃત-  
મનુભવસુખરસમભિરામં ॥ વિંદો ૪ ॥

**અર્થ :** મમતા, મમત્વ, પરવસ્તુને વિષે મારાપણું, આ દુઃખનું કરાકા છે. માટે હે ! વિનય, તું એ મમત્વનો ત્યાગ કર. એ મમત્વ પરવસ્તુના પરિચયનું પરિજ્ઞામ છે. તું પરવસ્તુનો પરિચય છાંડી, સ્વવસ્તુનો પરિચય કર. તું નિઃસંગ થા; પરવસ્તુનો સંગ ત્યજ હે; તેમાં લેપા નહિ; તે પર આસક્તિ કર નહિ; તે-મય થા નહિ; ચેતન ! એથી તારો આત્માનુભવ પ્રગટ થશે; વિશુદ્ધ થશે; તેમાં રસ જમશે અને તને બહુ આનંદ આપશે; માટે પરવસ્તુનો પરિચય છાંડ; સ્વસ્ત્રરૂપનો પરિચય કર. ઉ

ભવરૂપી ધર્મશાળા અને પ્રવાસીનો મેળો :

પથિ પથિ વિવિધપથૈ : પથિકૈ : સહ ।  
 કુરુતે કઃ પ્રતિબંધ ॥  
 નિજનિજકર્મવશૈ : સ્વજનૈ : સહ ।  
 કિ કુરુષે મમતાબંધ ॥ વિઠ ૫ ॥

અર્થ : હે ચેતન ! જુદે જુદે સ્થાનકે માર્ગમાર્ગમાં જુદા જુદા વટેમાર્ગનું ભણવું થાય છે; તે કોઈ કોઈને પ્રતિબંધ કરે છે ? ના, કોઈ કોઈ પર મમત્વ નથી કરતું, સર્વ કોઈ પોતપોતાને માર્ગ ચાલ્યા જાય છે. તેમ જ આ બધા જેને તું સ્વજન, પોતાનાં જન ગણે છે તે બધા પોતપોતાનાં કર્મ આવી મળ્યાં છે; તે પણ વટેમાર્ગ તુલ્ય છે. તો તે સાથે તું કેમ મમત્વ બાંધે છે ? કર્મ પ્રેરાયલા આવ્યા છે, કર્મ પ્રેરાયા પોતપોતાના નિયત સ્થાને કૂચ કરી જશે. આ કુંદબરૂપી ધર્મશાળામાં જેમ તું ઉત્તર્યા છે તેમ તારાં માનેલા આ સ્વજન પણ ઉત્તર્યા છે. સવાર પડ્યે વહેલા-મોડા સૌ પોતપોતાની મેળે કોઈની વાટ જોયા વિના કૂચ કરી જશે. એમાં તારે મમત્વ કર્તવ્ય નથી. મમત્વથી કર્મ બંધાય છે.

“યંથી જાડ હેઠે બેઠો  
 બે ઘડી ઠરીને બેઠો,  
 મૂઢ જાણે જાડ મારું રે...  
 તે નથી તારું રે...”

- પ્રકૃષ્ણ

ચેતન ! તારે આવી મૂઢતા કરવી યોગ્ય નથી. તું પરવસુનો નિષ્ઠય કર, તે પરથી મમત્વ છાડ અને તારા પોતાના ભવનને, તારા પોતાનાં ઘરને સંભાળ. ૫

પ્રેમી સાથે પ્રેમ :

પ્રણયવિહીને દધદભિષંગ ।  
 સહતે બહુસંતાપ ॥

त्वयि निःप्रणये पुद्गलनिचये ।

वहसि मुद्या ममतातापं ॥ विं० ६ ॥

अर्थ :- “राजिण्यं राजी सहु रे”

निराजी शुं, श्यो राज ?”

“मन विना भण्वु, भीत साथे भटकावु.”

आ तो सत्य वात छे के स्नेहशून्य पदार्थ (पछी ते भनुष्य होय के तिर्यक्य होय, के ज्ञव होय के अज्ञव होय) प्रति स्नेह धरनारने अहु संताप सहन करवा पडे छे, तो पछी आ पुद्गलनो समूह जे तारा प्रति स्नेहरहित छे, जेने तारा साथे लेश मात्र पाण प्रेमभाव नथी, तेना पर ममत्व राखी तु झोक्ट हुँभ सहन करे छे. जे आपणा उपर प्रेमभाव, ममत्व राखतु होय, तेना पर प्रेम के ममत्व राखवो ते वात ठीक ० छे, न्यायनी छे, पाण जेने आपणी कशी तमा के परवा न होय तेना पर आपणे शा भाटे नकामा भूर्चिर्षत थवुं ? ऐ परपुद्गलादिने आपणा उपर प्रेम नथी ऐ तो प्रत्यक्ष छे.

आ ते कांઈ प्रेमनां लक्षण ?

आपणे एना भाटे मरी पडीऐ तो पाण ते आपणु सांभरता नथी; आपणे ढाई ढेता नथी; आपणे न गमे तोपाण ते आपणे पडता मुझी चाल्या भय छे. प्रेमनां आ लक्षण न होय. भाटे रे ! विनय ! तुं ओवी निष्ठेमी परपुद्गलादि वस्तु पर प्रेम धर नहि; ममत्व राख नहि; तेने पारकी गणी छाडी दे. तारा पोताना, तारी साथे सदा रहेता ऐवा शानादिनी संभाषण ले. ५

संयोग त्वां वियोग :

त्वज संयोगं नियतवियोगं ।

कुरु निर्मलमवधानं ॥

नहि विदधानः कथमपि तृप्यसि ।

मृगतृष्णा घनरसपानं ॥ विं० ७ ॥

અર્થ : ચેતન ! ત્યાં વિયોગ એ નિયત વાત છે, માટે જેનો ચોક્કસ વિયોગ થવાનો છે, જે વહેલા-મોંડું અવશ્ય વિખૂંટ પડવાનું છે, એવા પરપૌદ્ધગિક પદાર્થોનો સંયોગ ત્યજ દે, તેઓથી તું બંધા નહિ, એનું ભમત્વ છાડ, અને એમ કરી તારી ચિત્તવૃત્તિ શુદ્ધ કર.

### મૃગતૃષ્ણાથી તૃપા છીપે ?

મોહ ભમત્વને લઈ તારી ચિત્તવૃત્તિ ભલિન થઈ ગઈ છે, અસ્થિર થઈ ગઈ છે. તે હે ચેતન ! ભમત્વ છાંડવાથી સ્થિર-શુદ્ધ થશે. વળી એ પરપુદ્ધગલના ભમત્વથી રાચવું એ મૃગતૃષ્ણા, ઝાંઝવાના પાણીથી તરસ છિપાવવા જેવું છે. ચેતન ! ઝાંઝવાનાં જળ જેમ મિથ્યા છે અને એથી તૃપાવંતની તરસ છીપતી નથી, ઊલટી વધે છે; કેમ કે જળાભાસ દેખી એથી તરસ છીપશે એ આશાએ દીરે છે, પણ સત્ય જળ મળતું નથી એટલે વધારે તરસ્યો થઈ પ્રાણ ખુલે છે. પરપુદ્ધગલથી રાચી એથી સુખ મળશે, એમ ધારી તે ભાણી ખેંચાય છે; પણ સત્ય સુખ મળતું નથી, સત્ય સુખ તો વેગણું જતું જાય છે, માટે ચેતન ! પરવસ્તુ રૂપ ઝાંઝવાનાં પાણીથી તૃષ્ણા છિપાવવાની આશાને જતી કરી અને એ પરનું ભમત્વ છાંડી જેથી વાસ્તવિક રીતે તૃપા છીપે, જેથી વાસ્તવિક સુખ જલદી મળે, એવા તારા આત્મા રૂપ સરોવર પાસે જઈ જાનાદિ રૂપ સત્ય જળ પી, તારી તૃપા શાંત કર. વિનય ! બહુ થઈ. હવે તો તારું પોતાનું ઘર ખોલી સંભાળ : પરપંચાત મૂકી હે. ૭

### જગબંધુ શ્રી જિનેશ્વર :

ભજ જિનપતિ મસહાયસહાયં ।  
શિવગતિસુગપોમાયં ॥  
પિવ ગદશમન પરિયહતવમન ।  
શાંતસુધારસમનપાયં ॥ વિંઠ ૮ ॥

અર્થ : અને હે વિનય ! તું અસહાયના સહાય અને અશરણના શરણ એવા શ્રી જિનેશ્વર ભગવાનને ભજ. શિવગતિ પામવાનો આ સુગમ ઉપાય છે. વળી આ શાંતસુધારસનું પાન કર. એ સંસારનું

રોગને શમાવનારું ઓષધ છે. વળી એ ઓષધ નિર્દોષ છે. એ લેવાથી ફરી વમન-રોગ ઊપજતો નથી, માટે ભગવાનને ભજ; સમતા ધર; પરવસ્તુ પ્રતિની મૂર્ખાઈ ટાળ અને તારા શુણ સંભાળ. હે વિનય ! નિરુપદ્વરૂપ સ્થાન પામવાનો આ સરળ ઉપાય છે.

આ અન્યત્વ ભાવના ભાવતાં ચક્વતી ભરત મહારાજાનાં કર્મ શીખા થઈ તેઓ અનુપમ હિંય કમલાને વર્ષા, તેનું આ ઢૂક ચારિત્ર હે ચેતન ! તારે વિચારવા જેવું છે.

**ચક્વતીની ઋષિ - આરીસાભુવનમાં ભરત રાજા :**

ભરતેશ્વર<sup>+</sup>

“દેખી અંગુલી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા;  
છાડી રજ સમાજને ભરતજી, કેવલ્યજ્ઞાની થયા...”

જેને ત્યાં સાંપ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો, જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચણકાટમાન મુફ્ફ વિરાજિત હતો, જેના સાહિત્યનો, જેના દળનો, જેના નગર-પુર-પાઠ્યનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સંબંધે કોઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતો, એવા શ્રીમાન ભરત ચક્વતી, શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર, પોતાના આરીસાભુવનમાં વસ્ત્રાલંકારથી સજજ થઈ મનહર સિંહસન ઉપર બિરાજ્યા હતા. આવાસનાં ચોતરફનાં દ્વાર ખુલ્લાં હતાં; જાતજાતના સુગંધી ધૂપનો ધૂમ સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતો, નાના પ્રકારના સુગંધી પદાર્થો મધમંધી રહ્યા હતા; નાના પ્રકારનાં વાર્ષિકો યાત્રિક કળા વડે સુસ્વરો ખેંચી રહ્યાં હતાં. શીતળ, મંદ અને સુગંધી પવનની લહેરો આવતી હતી.

**શરીર શોભાનું નિરીક્ષણ અને એક વીટીનું સરી જવું :**

પોતાનાં આભૂષણાદિક પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન

+ શ્રીમદ્ રાજચંદ્ર કૃત ભાવનાઓથ - અન્યત્વ ભાવના

રાજરાજેશ્વર ભરત એ ભુવનમાં અપૂર્વતાને પામ્યા. અના હાથમાંની એક આંગળીએથી વીઠી નીકળી પડી.

### આંગળી અડવી !

ભરતજીનું ધ્યાન એ ભાણી બેચાયું અને આંગળી કેવળ અડવી જાણઈ. નવ આંગળીઓ વીઠીઓ વડે જે મનોહરતા ધરાવતી હતી, તે મનોહરતા વિના આંગળી ઉપરથી ભરતેશ્વરને મૂળોત્તર વિચારની પ્રેરણા થઈ. શા. કારણાથી આ આંગળી આવી લાગવી જોઈએ ? એ વિચાર કરતાં વીઠીનું નીકળી પડ્યું, એ કારણ, એમ તેમને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીઠી તેમણે બેચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીઠી નીકળી તેવી તે આંગળી અશોભ્ય દેખાઈ. વળી એ વાત સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીઠી સેરવી લીધી. એથી વિશેષ પ્રમાણ થયું. વળી યોથી આંગળીમાંથી વીઠી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધો.

એમ અનુક્રમે દશે આંગળીઓ અડવી કરી મૂકી. અડવી થઈ જવાથી સઘળીનો દેખાવ અશોભ્ય દેખાયો. અશોભ્ય દેખાવથી રાજરાજેશ્વર અન્યત્વ ભાવનામાં ગદ્યગદિત થઈ એમ બોલ્યા :

### આ તે શરીરની શોભા કે પારકી શોભા ?

“અહોછો ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પત્ત થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની. એ મુદ્રિકા વડે મારી અંગુલિ સુંદર દેખાઈ, એ આંગળીમાંથી વીઠી નીકળી પડતાં એથી વિપરીત દેખાપ દીધો, વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશોભ્ય જણાવાનું કારણ માત્ર વીઠી નહિ એ જ ઠર્યું કે ? જો વીઠી હોત તો તો એવી અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી, એ આંગળી વડે આ હાથ શોભે છે, અને એ હાથ વડે આ શરીર શોભે છે; તો હવે હું શોભા કેની ગણું ? અતિ વિસ્મયતા ! મારી આ મનાતી મનોહર કાંતિને વિશેષ દીપાવનાર મણિમંદિક્યાદિના અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યો; એ કાંત મારી ત્વચાની શોભા ઠર્યો; એ ત્વચા શરીરની ગુમતા ઢાકી સુંદરતા દેખાડે છે.

## શેની શોભા ગણું ?

અહો ! આ મહા વિપરીતતા છે ! જે શરીરને હું મારું માનું છું તે શરીર તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શોભે છે; ત્યારે શું મારા શરીરની તો શોભા કાંઈ નહિ જ કે ? રધિર, હાડમાંસનો જ કેવળ એ માળો કે ? અને એ માળો તે હું કેવળ મારો માનું છું ! કેવી ભૂલ ! કેવી અમણા !! અને કેવી વિચિત્રતા છે !!! કેવળ હું પરપુદ્ગલની શોભાથી શોભું છું. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું ? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું, તો પણ કેવળ હુઃખ્રમદ અને વૃથા છે. આ મારા આત્માનો શરીરથી એક કાળે વિયોગ છે. આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે, ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી નથી અને નહિ થાય ત્યારે હું અને મારી માનું છું, કે માનું એ કેવળ મૂર્ખતા છે.

## કાયા મારી નહિ તો હું શા માટે એનો થાઉં ?

જેનો એક કાળે વિયોગ થવાનો છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે, તેમાં મમત્વ શું રાખવું ? એ કાયા જ્યારે મારી થતી નથી, તો મારે એના થવું ઉચિત છે ? નહિ, નહિ, એ જ્યારે મારી નહિ ત્યારે હું એનો નહિ, એમ વિચારું, દૃઢ કરું અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે.

## એ કાંઈ મારું નહિ :

આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થથી ભરી છે; તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી, તે વસ્તુ મારી ન થઈ, તો પછી કઈ વસ્તુ મારી હોય ? અહો ! હું બહુ ભૂતી ગયો. મિથ્યા મોહમાં લથડી પડ્યો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુગ્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ્ય એ મારા નથી. એમાંનું લેશ માત્ર મારું નથી. એમાં મારો ડિચિર્ટ ભાગ નથી. જે કાયાથી એ સઘળી વસ્તુઓનો હું ઉપભોગ લઈ છું, તે ભોગ્ય વસ્તુ જ્યારે

મારી ન થઈ ત્યારે જે હું મારી માની બેઠો છું, એવી બીજી વસ્તુઓ, સ્નેહી, કુટુંબીઓ ઈત્યાદિ મારાં શું થનાર હતાં? નહિ, કંઈ જ નહિ. એ ભમત્વભાવ મારે જોઈતો નથી. એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્ણીને મારે મારા માનવાં જ નથી. હું એનો નહિ, એ મારા નહિ.

### પોતાનો દ્રેષ કરી પારકું ભમત્વ કોણ કરે?

પુષ્પાદિક સાધીને મેં જે જે વસ્તુઓ પ્રામ કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે? મારાં ઉગ્ર પુષ્પત્વનું એ ફળ આ જ કે? છેવટે એ સધળાંનો વિયોગ જ કે? પુષ્પત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિ માટે જે જે પાપ કર્યા, તે તે મારા આત્માએ જ ભોગવવાં કે? તે પણ એકલાએ જ કે? એમાં કોઈ સહિયારી નહિ કે? નહિ, નહિ. આમ એ દેહ જે મારાથી અન્ય છે, પર છે, કેવળ અલગ છે, તેનું ભમત્વ કરી, આત્માનો દેખી થઈ, તેને નરક, રૌદ્ર નરકમાં નાંખું, એના જેવું કયું અજ્ઞાન? એવી કઈ ભમકા છે? એવો કયો અવિવેક છે?

શલાકાપુરુષોમાંનો હું એક ગજાયો, ત્યાં આવાં કૃત્ય ટાળી શર્કું નહિ અને પ્રામ કરેલી પ્રભુતાને ખોઈ બેસું, એ કેવળ અયુક્ત છે. એ પુત્રોનો, એ પ્રમદાઓનો, એ રાજવૈભવનો અને એ વાહનાદિક સુખનો મારે કશો અનુરૂપ નથી; ભમત્વ નથી.”

### વૈરાગ્યનો પ્રકાશ અને તિભિરનું ટળવું:

વૈરાગ્યનું આવું ચિત્ર ચકીરાજ ભરતના અંતઃકરણમાં પડ્યું કે તિભિરપટલ ટળી ગયું. શુક્લ ધ્યાન પ્રામ થયું. અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં. મહાદિવ અને સમાનકિરણથી પણ અનુપમ કાંતિમાન કેવલ્યજ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા તેણે પંચમુષ્ટિ કેશલુંચન કર્યું. શાસનદેવીએ એને સંતસાજ આપ્યો; અને તે મહાવિરાગી, સર્વજ્ઞ, સર્વદર્શી થઈ, ચાર ગતિ, ચોવિશ દંડક અને આધિ-વ્યાધિ-ઉંપાધિથી વિરક્ત થયા. ચપળ સંસારના સકલ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી. પ્રિયપ્રિય ગયું; અને તે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયા.

### પ્રમાણ શિક્ષા :

એમ એ છ ખંડનો પ્રભુ, દેવના દેવ જેવો, અઢળક સાગ્રાજ્ય લક્ષ્મીનો ભોક્તા, મહાયુનો ધંશી, અનેક રત્ન ધરાવનાર, રાજરાજેશ્વર ભરત આદર્શ ભુવનમાં અન્યત્વ ભાવના ઉપજવાથી શુદ્ધ વિરાગી થયો.

ખરેખર ભરતેશ્વરનું મંત્ર કરવા યોગ્ય ચરિત્ર સંસારની શોકાર્તા અને ઔદાસીન્યતાનો પૂરેપૂરો ભાવ, ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે.

**ભરતને શી ખામી હતી ?**

એને ત્યાં કાંઈ ખામી હતી ? નહોતી એને ત્યાં નવયૌવના સ્થીરોની ખામી કે નહોતી રાજોદ્ધિની ખામી; નહોતી વિજ્યસિદ્ધિની ખામી કે નહોતી નવનિધિની ખામી; નહોતી પુત્ર સમૃદ્ધયની ખામી કે નહોતી કુદુંબ પરિવારની ખામી; નહોતી રૂપ કાંતિની ખામી કે નહોતી યશકીરીની ખામી ! આમ એ સંપૂર્ણ ઋદ્ધિ-સિદ્ધિ એને ત્યાં હતી, છતાં ભરતેશ્વરે વિવેકધી અન્યત્વનું સ્વરૂપ જોયું, આજ્ઞાનું અને સર્વ-કંચુકવત્ત સંસારપરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહાવૈરાગ્યની અચળતા, નિર્મમત્વતા અને આત્મશક્તિનું પ્રહૃદિલિત થતું આ મહાયોગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે.

**એ જ અરીસા ભુવનનો મહિમા :**

એક પિતા (શ્રી ઋષભદેવ ભગવાન)ના સો પુત્રમાં નવાણું આગળ આત્મ-સિદ્ધિને સાધતા હતા. સોમા આ ભરતેશ્વરે સાધી. પિતાએ પણ એ જ સિદ્ધ સાધી. ભરતેશ્વરી રાજ્યાસનભોગિયો ઉપરાઉપર આઠ વાર, એ જ આદર્શભુવનમાં તે જ સિદ્ધિને પામ્યા કહેવાય છે. એ સક્ષમ સિદ્ધિસાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવર્દન હો તે પરમાત્માઓને !!

॥ ઇતિ શ્રી શાંતસુધારસગેયકાવ્યે અન્યત્વ-

ભાવનાવિભાવનો નામ યચચ: પ્રકાશ: ॥

ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ  
કાવ્યમાં અન્યત્વભાવના નામનો પ્રકાશ સમાપ્ત.

ॐ

## અશુચિ ભાવના।

મહિરા ગાળવાનું વાસણ અને આ દેહ — સરખામણી :

॥ શાર્વલક્રિકીડિતં વૃત્તં ॥

સછિદ્રો મદિરાધટ: પરિગલસ્તેશસંગાશુચિ: ।

શુચા મૃદ્યમૃદા બહિ: સ બહુશો ધૌતોડપિ ગંગોદકૈ: ॥

નાથતે શુચિતાં યथા તનુભૂતાં કાયો નિકાયો મહા-

બીભત્સાસ્થિપુરીષમૂત્રરજસાં નાયં તથા શુદ્ધયતિ ॥ ૭ ॥

અર્થ : આ દેહ મહિરાના હુંબ જેવો છે. મહિરાના હુંબમાં મહિરા ગાળવા છિદ્રો પાઢેલાં હોય છે તેમ આ દેહમાં પણ અનેક છિદ્રો છે. મહિરાના ભાજનમાંથી છિદ્રો વાટે મહિરા બહાર ગળાતાં તેના જરા પણ સંગઠી તે ભાજન અપવિત્ર થાય છે; તેમજ આ દેહમાંથી જુદા જુદા છિદ્રવાટે મળ, મૂત્ર, પરસેપો, રુધિર, વીર્ય, પરુ આપદિ અપવિત્ર વસ્તુઓ જરી રહી છે તે આ દેહને અપવિત્ર કરી રહી છે. છિદ્રો વાટે ગળાતી મહિરાથી અપવિત્ર થતું મહિરાનું વાસણ જેમ પવિત્ર માટીથી બહાર ઘસ્યા છતાં, અને પવિત્ર ગંગા નદીના જળથી ધોયા છતાં પવિત્ર થઈ શકતું નથી તેમ આ દેહધારીઓનો આ દેહ પણ જે સૂગ આવે એવાં હાડ, ચર્મ, માંસ, રક્ત, મૂત્ર, મળ, શુક્રનું સ્થાન છે, અને જેનાં છિદ્રો દરા અનેક અશુચિમય પરિસ્વેદ, મૂત્રાદિ પદાર્થો વહી રહ્યા છે, તે પવિત્ર માટીથી ઘસો કે શુદ્ધ ગંગોદકથી ધોવો, પણ પવિત્ર થઈ શકતો નથી. તાત્પર્ય કે એક જ વાર અશુચિ જરી હોય અને ફરી પાઈ જરૂરાની ન હોય, તો તો માટી-જળ આદિથી ઘસતાં-ધોતાં મહિરાના વાસણ કે આ દેહને પવિત્ર કરી શકાય; પણ જ્યાં નિરંતર અશુચિ વહ્યા કરતી હોય, તે

ભાજનને ફરી ફરી મારીથી વસીએ, શુદ્ધ જળથી ધોઈએ તો પણ તે પવિત્ર થતું નથી; ઉલટાં એ મારી અને જળ અપવિત્ર થાય છે. ગંગાનું પાણી ગમે તેવું મીહું અને શુદ્ધ છતાં ખારા સમુદ્રમાં પડતાં ખાડું અને મલિન થાય છે, અથવા ગટરમાં પડતાં ગમે તેવું શુદ્ધ જળ અશુદ્ધ થાય છે, તેમ આ અપવિત્ર દેહ, જેમાંથી રાત્રિદિવસ અશુય્યિ વહ્યા કરે છે, જે અશુય્યિનું સ્થાનક છે, તે ધોયા-મસયા છતાં કેવા પ્રકારે શુદ્ધ થઈ શકે ? ૧

ઉકરડો અને આ દેહ :

॥ મર્દાક્રાંતા વૃત્તં ॥

સ્નાયં સ્નાયં યુનરયિ પુનઃ સ્નાનિ શુદ્ધાભિરભદઃ ।

વારં વારં બત મલતનું ચંદનનૈર્ચયંતે ॥

મૂઢાત્માનો વયમપમત્તાઃ પ્રીતિમિત્યાશ્રયંતે ।

નો શુદ્ધયંતે કથમવકરઃ શક્યતે શોધ્યુમેવ ॥ ૨ ॥

**અર્થ :** અહો ! મૂઢ જીવો એક વાર નાચ્યા, બીજી વાર નાચ્યા, ત્રીજી વાર નાચ્યા, એમ ફરી ફરી શુદ્ધ જળ વડે નાચ્યા છે; અને મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન સુખડથી ચર્ચે છે; અને હવે એમે પવિત્ર છીએ એમ ગાણી અના પર પ્રીતિમોહ ધરે છે; પણ વાસ્તવિક રીતે એમ નથી. એ શરીર કદી શુદ્ધ નથી થતું. ઉકરડો કદી શુદ્ધ થાય ખરો ? ન જ થાય; કેમ કે ત્યાં નિરંતર ખાતર, કચરો રહ્યાં કરે છે. એક વખતનો કચરો જ્યાં ન ઊપડ્યો ત્યાં બીજો આવી પડે છે. તેમ આ શરીર પણ કચરાના ઉકરડા જેવું છે. ત્યાં નિરંતર મળ રહે છે. એક વખતનો મળ જ્યાં દૂર કે ઓછો થતો નથી ત્યાં બીજો આવી ઊપજે છે. એક વખતનો પરસેવો, મેલ આદિ જ્યાં જળાદિથી ધોતાં દૂર થયો હોતો નથી, એટલામાં નવો પરસેવો, મેલ આદિ બહાર આવી પડે છે. આમ નિરંતર જેમાંથી મળ વહે છે, એવું અશુય્યિનું સ્થાનક દેહ છતાં, તેને સ્નાન વડે પવિત્ર થયેલું ગણનારા, તેના ઉપર ચંદનાદિ વિલેપનારા અને એને પવિત્ર ગણી તે પર પ્રીતિ-મૂર્ખા રાખનારા જીવો ખરેખર મૂઢ છે. ૨

લસણ અને આ ટેક :

॥ શાર્દૂલવિક્રીડિતં વૃત્તં ॥

કરૂરાદિભર્વિતોऽપિ લશુનો નો ગાહતે સૌરભં ।  
 ના જન્મોપકૃતોऽપિ હંત પિશુનઃ સૌજન્યમાલંબતે ॥  
 દેહીયેષ તથા જહાતિ ન નૃણાં સ્વાભાવિકી વિશ્રતાં ।  
 નાભ્યક્તોऽપિ વિભૂષિતોઽપિ વહુધા પુષ્ટોઽપિ વિશવસ્યતે ॥૩॥

અર્થ : કરૂર, ચંદન, બરાસ, ગોરોચન, અતાર આદિ સુગંધી વસ્તુઓનો લસણ ઉપર ભલે લેપ કરો, પણ લસણ પોતાનો દુર્ગંધ સ્વભાવ છાંટો સુગંધ ગ્રહણ કરે નહિ.

ભલે આખા જન્મ પર્યત તેના ઉપર ઉપકાર કરવામાં આવે પણ ચાડિયો દુર્જન સુજનતા પામે નહિ.

તેમ આ શરીરને વિવિધ પ્રકારનાં તેલ મર્દન કરો, અભ્યંગ કરો, શાંખગારો, ખવડાવી-પીવડાવી પુષ્ટ કરો, પણ તે તેની સ્વાભાવિક અશુદ્ધિ છોડે નહિ.

આ શરીર ઉપર સુગંધી છાંટો, ચંદન લેપ કરો, તેને શાંખગારો, ખવડાવો અને એમ માનો કે હવે એ સારું થયું, રૂંડ થયું, પવિત્ર થયું; પણ એમ માનવા જેવું નથી. એ ભરોસો પણ રાખવો યોગ્ય નથી. અર્થાત જે સ્વાભાવિક રીતે અપવિત્ર છે, તે કૃત્રિમ પવિત્રતાના સાધનોથી અપવિત્રતા છોડે જ નહિ.

“તન તું ગણો છે, તારું તે નથી તારું રે,  
 સંભાળીને રાખ્યું સાજું, તોલવાળું કીધું તાજું;  
 ખવડાવી ખારું ખારું રે,...તે નથી તારું રે.  
 જ્યારે એ રોગી જણાશે, મૂકવાનું મન થાશે,  
 અતિશે થશે અકારું રે... તે નથી તારું રે.” ૩.

- પ્રક્રીણા

દેહની સાહજિક અશુચિ, અન્ન-વિષા, પાન-પૂરીષ :

॥ ઉર્ધેદ્વજ્ઞા વૃત્તં ॥

યदીય સંસર્ગમવાય સદ્ગો,  
ભવેચુચીનામશુચિત્વમુદ્દે : ॥  
અમેધ્યયોનેવપુષોસ્ય શૌચ-  
સંકલ્પમોહોયમહો મહીયાનુ ॥ ૪ ॥

અર્થ : ઊંચા પ્રકારના પવિત્ર પદાર્થો પણ આ અપવિત્ર શરીરની સંસર્ગ પામતાં એકદમ અપવિત્ર થઈ જાય છે, તો તેવા અશુચિપણાના કારણરૂપ આ શરીરને પવિત્ર કરવાનો સંકલ્પ-વિચાર કરવો એ કોઈ મોટો આશ્રયકારક મોહ જ છે. ભલે ઊંચી જાતના બાવનાંદનાં વિલેપન આ શરીરને કરો પણ તે જ થોડા વખતમાં સુગંધરહિત દુર્ગંધિપણને ભજે છે. તેમ જ રૂડાં રૂડાં ભાતભાતનાં સ્વાદિષ્ટ સુગંધી અશન-પાન વડે આ દેહને પોષો, પણ તે ખાન-પાન પણ થોડા કાળમાં નરક-મૂત્રરૂપે પરિણામે છે. આવો જેનો અશુચિમય સ્વભાવ છે, એ દેહને પવિત્ર કરવાનો વિચાર,-એ તો ખરેખર મહાન મોહ છે. ૪

ખરો શુચિ પદાર્થ :

॥ સ્વાગતા વૃત્તં ॥

ઇત્યેવત્ય શુચિવાદમતથ્ય ।  
પથ્યમેવ જગદેકપવિત્ર ॥  
શોધનં સકલદોષમલાનાં ।  
ધર્મમેવ હદ્યે નિદધીથા : ॥ ૫ ॥

અર્થ : એ રીતે આ અપવિત્ર શરીરને પવિત્ર કરવાની વાદ ખોટો જાણીને જગતમાં એક પવિત્ર પથ સર્વ પાપદોષરૂપ મેલ-અશુચિને ટાળનાર-શોધનાર ધર્મને તમે હદ્યમાં ધારણ કરો. તાત્પર્ય કે અશુચિભરી કાયા તો શુચિરૂપ થઈ શકે એમ નથી માટે એ વાદ ત્યજી કેવો યોગ્ય છે, અને ખરેખરી પવિત્ર વસ્તુ ધર્મ, જે પથ છે, પાળવા-આદરવા યોગ્ય છે

અને કે બધાં પાપમેળને ધોઈ નાંખવા સમર્થ છે, તેનું જ શરણ ધારણ કર્તવ્ય છે. ૫

“ખાણ મૂત્ર ને મળની,  
રોગ જરા ને નિવાસનું ધામ;  
કાયા અદી ગણીને,  
માન ત્યજને કર સાર્થક આમ.”

- શ્રીમદ્ રાજચંદ્ર કૃત ભાવનાભોધ - અશુદ્ધિ ભાવના

હવે આ ભાવનાનું અલઘાળિયું કહે છે :

પવિત્ર તો આત્મા છે :

॥ આસાવરી રાગ ॥

॥ કળારે તનુ ચુની ચુની જવે... એ દેશી ॥

ભાવય રે વધુરિદમતિમલિન ।

વિનય વિવોધય માનસનલિન ॥

પાવનમનુચિત્ય વિભમેક ।

પરમમહોદયમુદિતવિવેક ॥ ભા૦ ૧ ॥

અર્થ : હે વિનય ! તું આ શરીરને અતિ મહિન ભાણ. અને તારા મનરૂપી કમળને સમજાવ કે પવિત્ર તો જેને મહાન જ્ઞાનાદિ ઔદ્ઘર્ય પ્રાપ્ત થયું છે, જેનામાં વિવેકનો ઉદ્ય થયો છે, - તે એક પરમાત્મા જ છે. તાત્પર્ય કે આ શરીર પવિત્ર નથી; માટે એનો વિચાર ત્યજ દે અને ખરેખર પરમ પવિત્ર તો જ્ઞાનાત્મા ભગવાન છે, તેનું તું ચિત્વન કર. ૧

શુક શોષિતનાં વિવર્ત એ આ દેહ :

દમ્પતીરિતોરધિરવિવર્ત,

કિં શુભમિહ મલકશમલગર્ત ।

ભૃશમપિ પિહિતઃ સ્નયતિ વિરૂપं,

કો બહુમનુતોવસ્કરકૂર્ય ॥ ભા૦ ૨ ॥

અર્થ : અહો ! આ શરીર તો સ્ત્રી-પુરુષનાં રક્ત-શુક્રના વિવર્તનું છે; અર્થાત્ સ્ત્રીનું રૂધિર અને પુરુષનું વીર્ય, એ બેના સંયોગથી ઉત્પન્ન થયેલો આ વિકાર છે. અહો ! એ મેલરૂપ ચૌખલ-કીચડ કાદવની ખાઈ છે અમાં શું સારું-શોભનિક છે ? કહી જ નહિ. એ શરીરને હાડ-ચામથી ગમે તેટલું ઢાંક્યું છે, તોપણ તેમાંથી અત્યંત દુર્ગંઘનીક, સૂગ આવે એવા પદાર્�ો નિરંતર જરી રહ્યા છે. તો એવા કયારાના ફૂવાનું તે કોણ બહુમાન કરે ? અર્થાત્ એવા અશુદ્ધિ ભરેલા શરીરનું લેશ માત્ર પણ માન કર્તવ્ય નથી. આમ હે વિનય ! તું શરીરનું અપવિત્રપણું વિચાર ! તારા મનકમણને વિકસાવ. ૨

કોયલો ધોવો :

ભજતિ સચંદ્ર શુચિતાંબૂલં ।  
કર્તૃ મુખમારુતમનુકૂલં ॥  
તિષ્ઠતિ સુરભિ કિયંતં કાલં ।  
મુખમસુગંધિ જુગુપ્સિતલાલં ॥ ભાગ ૩ ॥

અર્થ : જીવો મુખવાયુને અનુકૂળ કરવા, સુગંધી કરવા કર્પૂર પ્રમુખ નાંખીને તાંબૂલ-પાન ખાય છે; પણ આ મુખ જે અસુગંધી છે, દુર્ગંઘવણું છે, અને જેમાં સૂગ આવે એવી લાગ રહેલી છે, તેમાં તે એ સુગંધી કેટલો વખત ટકશે ? અર્થાત્ બહુ નહિ ટકે. રાત્રે ગમે તેવા સુગંધી પાન ચાવી સૂઈ રહ્યો; સવારે ઊંઠતાં મોહું ગંધાતું રહ્યો; જીભ પર ઊંઠનો મળનો પોપડો બાજ્યો હશે. આમ હે વિનય ! આ શરીરની અપવિત્રતા પ્રત્યક્ષ છે; તે તું વિચાર, વિચાર. તારા મનકમણને જાગ્રત કર. ૩  
કોઈનો કાદવ, અશુદ્ધિ કેમ ટણે ?

અસુરભિગંધવહોતરચારી ।  
આવરિતું શક્યો ન વિકારી ॥  
વપુરૂપજિગ્રસિ વાસ્વારં ।  
હસતિ બુધસ્તવ શૌચાચારં ॥ ભાગ ૪ ॥

અર્થ : હે વિનય ! દુર્ગંધિ વહેનારો અંતરમાં રહેલો વિકાર

ટાળવા-ઢાકવા તો તું સમર્થ નથી, છતાં આ તારા શરીર પર ફૂલિમ સુંગંધ છાંટી તેને તું વારંવાર સુંધે છે, તારો શૌચાચાર જેઈ ડાખ્યા માણસો હસે છે. તાત્પર્ય કે જે તારાથી બને તો ખરેખરું કર્તવ્ય તો એ છે કે દુર્ઘિના કારણરૂપ શરીરની અંદર રહેલો જે વિકાર તે દૂર કરવો; કારણ કે એ વિકારરૂપ મૂળ કારણથી બહાર અશુદ્ધિ નીકળી આવે છે. એ વિકારરૂપ કારણ દૂર થાય તો પછી અશુદ્ધિનો લેશ પણ ન રહે; પણ આ આંતર્દુર વર્તનારો વિકાર તો તું જાણે તેમ તારાથી દૂર થઈ શકે એમ નથી. એટલે બહારની પવિત્રતા રાખવા-જાળવવાના તારા મધ્યાસ મિથ્યા છે. તેમાં પણ જ્યારે એને ખરેખર પવિત્ર ગણી મોહવશ થઈ તું સુંધે છે, ત્યારે તો ડાખ્યા પુરુષો એ તારી કૃતિ પર ધૂમ હસે છે. આવો અશુદ્ધિ પ્રકાર દેહનો છે, તે તારા હદ્યમાં હે વિનય ! તું ધાર. ૪

**બારે વાટ ને નવે ધાટ વહેતી નીક – પવિત્રતા ક્યાં રહી ?**

દ્વાદશ નવ રંધ્રાળિ નિકામે ।  
ગલદશુચીનિ ન યાંતિ વિરામે ॥  
યત્ર વધુષિ તલ્કલયસિ પૂતાં ।  
મન્યે તથ નૂતનમાકૂતાં ॥ ભાં ૫ ॥

**અર્થ :** પુરુષના શરીરમાં નવ અને લીના શરીરમાં બાર મોટાં છિંડો વાટે અહોરાત્ર અશુદ્ધિ જરી રહી છે. તે શરીરને તું પવિત્ર માને છે, એ તો હે વિનય ! મને તારો કોઈ નવીન આચાર લાગે છે. અર્થાતું આવો આચાર તો મેં જોયો-સાંભળ્યો નથી. જે પ્રત્યક્ષ અપવિત્રતાનું સ્થાન છે, જેમાંથી નિરંતર અશુદ્ધિ વધ્યા કરે છે, તેને તું પવિત્ર માને છે ? પણ એ પવિત્ર નથી, એમ હે વિનય ! તું નિરધાર. ૫

**વિષ્ટા અને મૂત્ર, અશજ્ઝણા વિકાર !**

અશિતમુપસ્કરસંસ્કૃતમત્ત્વં ।  
જગતિ જુગુપ્તાં જનયતિ હત્ત્રં ॥  
પુંસવનં ધૈનવમણિ લીઢં ।  
ભવતિ વિગર્હિતમતિજનમીઢં ॥ ભાં ૬ ॥

અર્થ : અહો ! આ જગતમાં ભસાલા, વધાર પ્રમુખ સામગ્રીથી સંસ્કાર કરેલું, રાઈ, મરચાં, એલચી આઈ ભરી સ્વાદિષ્ટ કરેલું અને ખાંધા પછી વિષાડુપે પરિણમી જુગુખા-સુગ ઉપજાવે છે; તેમજ વીર્યવૃદ્ધિ કરે એવું ગાયનું દૂધ પણ પીધા પછી અત્યેત ગંધીણીય મૂત્રરૂપે પરિણમે છે. તાત્પર્ય કે આ દેહની અંદર કોઈ એવી વિકાર રહેલો છે કે સ્વાદિષ્ટ અને અને પવિત્ર ગાયાતી ગાયનું દૂધ પણ અનુકૂમે વિષા અને મૂત્રરૂપે પરિણમે છે. આવું અશુચિનું સ્થાનક દેહ છે, તે હે વિનય ! તું વિચાર, વિચાર. ૬

### ઉકરડામાંનું રત્ન :

કેવલમલમયપુદ્રગલનિચયે ।  
અશુચીકૃતશુચિભોજનસિચયે ॥  
વપુષિ વિચિત્ર પરથિહ સારં ।  
શિવસાધનસામર્થ્યમુદારં ॥ ભાગ ૭ ॥

અર્થ : There is something bright even in the darkest cloud. શ્યામાં શ્યામ વાદળામાં પણ કંઈક ડેજળો ચળકાટ છે, - એવી એક લોકવાણી સત્ય છે, ગમે તેવી ખરાબ અસારરૂપ વસ્તુમાંથી તત્ત્વગવેષકો સાર શોધી કાઢે છે. તેમ હે વિનય ! આ શરીર જે કે કેવળ સરી-પડી જવાના, નાશ પામવાના સ્વભાવવાળા પુદ્રગલનો સમૂહ છે, અને એની અંદર પદેલ પવિત્ર આદાર-પાન પણ વિષા-પૂરીખરૂપે પરિણમે છે, આમ જે કે કેવળ મહિન અને અસારભૂત આ દેહ છે, તોપણ તેમાં આ એક પરમ સારભૂત વસ્તુ છે, તે તું વિચાર. ગમે તેવો અશુચિમય આ દેહ છે, છતો એમાં શિવસુખ, મોકષસુખ આપવાનું સામર્થ્ય છે; એવો એ દેહ ઉદાર-ઉચ્ચ છે.

### મનુષ્યદેહનું માહાત્મ્ય :

જે દેહ અશુચિમય હોતાં કેવળ અસારભૂત છે, તે મનુષ્યદેહને સારભૂત કરવો હોય, તેનું સાર્થક કરવું હોય, તો તે દેહમાં મોકષસુખ આપવાનું જે સામર્થ્ય છે, તેનો તું લાભ લઈ લે. કોઈ પણ ગતિમાંથી

મોક્ષ પામી શકાય એમ હોય તો તે આ મનુષ્યગતિ જ છે; બીજે દેહ મોક્ષ પામી શકતો નથી. દેવતાઓ પણ એ દેહને હંચું છે. દેવતાઓ સંયમ આરાધી શકતા નથી, જ્યારે આ દેહથી સંયમ પાળી શકાય છે; વિરતિના ભાવ, ઉદ્ઘમ આ દેહ થઈ શકે છે. સંયમ-વિરતિ વિના, ચારિત્ર વિના મોક્ષ સુલભ નથી. આમ આ દેહ મોક્ષ પમાડવાનું સામર્થ્ય ધરાવે છે; પણ તે તો જે આ દેહનો ઉપયોગ સંયમ-પ્રતિ-ચારિત્ર અર્થે કરવામાં આવે તો જ.

“દેહસ્ય સારं બ્રતધારણं ચ.”

**મનુષ્યદેહ ઉત્તમ નૌકા, ચતુર નાવિક જોઈએ :**

દેહનો નિર્વાહ કરવો, તેને ખવડાવવું, પીવડાવવું, પહેરાવવું, ઓદ્દાદવું એ કેવળ પ્રત-સંયમના નિર્વાહ અર્થે જ હોય તો દેહનું સાર્થક છે. કેવળ મોહને લઈ, વિષયાધીન વૃત્તિને લઈ દેહનો ઉપયોગ ખાવામાં, પીવામાં, વિષયભોગમાં કરવામાં આવે, તો તે દેહ હારી જવા જેવું છે, માઈ ગતિનું કારણ છે. તો એવી મૂર્ખી ટાળવા આ અશુચિ ભાવના ભાવવી ઘટે છે. દેહનું અપવિત્રતામય વાસ્તવિક સ્વરૂપ સદ્ગુદ્ધિપૂર્વક વિચારીએ તો આ મૂર્ખી અવશ્ય ટણશે, અને પ્રત-સંયમ આદિ આત્મહિતપ્રવૃત્તિ ભણી આ અમૂલ્ય દેહનો ઉપયોગ થશે. સંસારસમુદ્રભાંધી જીવને તારી નિર્વાણકાંઠે લઈ જનાર નાવ આ મનુષ્યદેહ છે, પણ તેમાં કષાય, મોદ, મૂર્ખી, પ્રમાદ, આર્ત-રીદ્રધ્યાન આદિ બાકાં ન પડે તો; અને પ્રત-સંયમ, ઉપયોગ-જાગૃતિ, સાધ્યદાસ્તિ, પુરુષાર્થ, સત્ય, વિનય આદિ ઉત્તમ સદ, કુવાસ્તંભ અને અનુકૂળ પવન હોય તો જ એ વહીણ સહીસલામત મુક્તિ બંદરે પહોંચાડે છે. આમ આ મનુષ્યદેહનો સાર શિવસુખ આપવાનું તેનું સામર્થ્ય છે, માટે એ સામર્થ્યનો તું લાભ લઈ લે; અને બીજી રીતે જે દેહને અશુચિમય, અસાર ગણા, એમાં મૂર્ખી પામ નહિ. ૭

‘આઈનાં ફૂલ બાઈને, શોભા મારા ભાઈને’,

એ તો ચેતનનો જ ગુણા :

યેન વિરાજિતમિદમતિપુણ્યં ।

તચ્ચિતય ચેતનનૈપુણ્યં ॥

### વિશ્વદાગમમધિગમ્ય નિપાનં ।

વિરજ્ય શાંતસુધારસપાનં ॥ ભાગ ૮ ॥

**અર્થ :** જો કે ઉપર કહું કે આ મનુષ્ય દેહ મોક્ષપ્રાપ્તિનું સાધન છે, અને એથી અતિ પુષ્પવાન પવિત્ર બણાય છે; અને એ કારણથી એ દેહ શોભનિક છે; પણ આ દેહને જે શોભા મળી છે, તે કંઈ તેના પોતાના ગુણ કે નિપુણતાને લઈ નહિ. એ તો આ ચેતનની જ કુશળતા-નિપુણતા-ચતુરાઈ છે કે દેહ આ માન ખાટી જાય છે. બાકી દેહની પોતાની શોભા અને તેની પોતાની નિપુણતા તો અશુચિપણામાં જ છે ! આવો દેહનો અશુચિ પ્રકાર હે વિનય ! તું વિચાર, અને પવિત્ર સિદ્ધાંત, સત્યાસ્ત્રાદૃપ જીવસ્થાન પામી તું શાંતસુધારસનું પાન કર. તાત્પર્ય કે સદ્ગુરુને શોધ; તે પણ જા; વિનયપૂર્વક તેઓ સમીપે શાસ્ત્રશ્રવણ કર; સમતાનો બોધ લે; અને એ સમતારૂપી અમૃતપાન કરી અમર થા. હે ચેતન ! જો કરી આ અશુચિમય દેહ કોના કોના જેવો છે ? કહી જઉ છું, તે તું વિચાર -

### દેહને ઉપમા

- (૧) દેહ યોમેર છિદ્રવાળા ભડિરાના વાસણા જેવો છે.
- (૨) દેહ કચરાના ઉકરડા જેવો છે.
- (૩) નઘરની ખાળ (Gutter) જેવો છે.
- (૪) દેહ લસણ જેવો છે.
- (૫) દેહ દુર્જન જેવો છે.
- (૬) દેહ કચરાની ખાશ છે.

આવું દેહનું અશુચિમય સ્વરૂપ વિચારી તેમાં સુઝ જીવે મૂર્ખ્ય કરવી ન ધટે.

બીજી દસ્તિએ એ જ દેહ કરી એ વડે પ્રતિસંયમ આદરવામાં આવે, તો મોક્ષ આપવા જેટલું સામર્થ્ય ધરાવે છે. ૮

આ અશુચિમય દેહનું લેશ માત્ર મોહ, માનુ, અભિમાન કરવા જેવું નથી. એ સંબંધી શ્રી સનાતકુમારની આં વાત બહુ મનન કરવા જેવી છે.

### સનત્કુમાર\*

#### સનત્કુમારનું સુરૂપ અને સ્વર્ગમાં પ્રશંસા :

ચક્રવર્તીના વૈભવમાં શી ખામી હોય ? ભરત રાજાની વાતમાં એ વૈભવની બહોળાશ બતાવી છે. સનત્કુમાર પણ ચક્રવર્તી હતા. તેના વર્ષા અને રૂપ અત્યુત્તમ હતાં. એક વેળા સુધર્મ સભામાં એ રૂપની સુતિ થઈ. કોઈ બે દેવોને એ વાત રૂચી નહિ. આથી તેઓ તે શંકા ટાજવાને વિપ્રરૂપે સનત્કુમારના અંતઃપુરમાં ગયા. સનત્કુમારનો દેહ તે વેળા જેળથી ભર્યો હતો. તેને અંગે મહીનાદિ પદાર્થનું માત્ર વિલેપન હતું. તેણે એક નાનું પંચિયું પદેર્યું હતું અને તે સ્નાનમજજન કરવા બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણ કાયા અને ચંદ્ર જીવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા અને માથું ધુષાવ્યું.

#### દેવતાઓની પ્રસંગતા :

આ જોઈને ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું શા માટે ધુષાવ્યું ? દેવતાઓએ કહ્યું, અમે તમારું વર્ષા અને રૂપ જેવા બહુ અભિલાષી હતા; સ્થળે સ્થળે તમારાં વર્ષા-રૂપની સુતિ સાંભળી હતી; આજે અમે એ પ્રત્યક્ષ જેયું, જેથી અમને પૂર્ણ આનંદ ઉપજયો. માથું ધુષાવ્યું અનું કારણ એ કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિરોધ છે, પરં ઓછું નથી.

#### સનત્કુમારનો રૂપમદ્દ :

સનત્કુમાર સ્વરૂપવર્ષાની સુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા કે તમે આ વેળા મારું રૂપ જેયું તે બહે, પરંતુ હું રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ષા જેવાં થોળ્ય છે. અત્યારે તો હું જેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારાં રૂપવર્ષા જુઓ તો અદ્ભુત ચમત્કારને પામો અને ચર્ચિત થઈ જાઓ. દેવોએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવશું. એમ કહી તેઓ ત્યાંથી ચાલ્યા ગઈયા.

સનત્કુમારે ત્યાર પછી ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કર્યા. અનેક

\* શ્રીમદ્ રાજચંદ્ર કૃત ભાવનાલોધ - અશુદ્ધ ભાવના.

ઉપયારથી જેમ પોતાની કાયા વિશેષ આક્ષર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસુભામાં આવી સિદ્ધાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્ધાનો અને અન્ય સભાસદો યોગ્ય આસને બેસી જયા હતા.

### રાજસભા અને દેવોનું આગમન :

રાજેશ્વર ચામર, છત્રથી વિઝાતા અને ખમા ખમાથી વધાવાતાં વિશેષ શોભી રહ્યા છે, ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્ભુત રૂપ-વર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું; ચક્કવતીએ પૂછ્યું, અહો ! બ્રાહ્મણો, ગઈ વેળાં કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે ?

### દેવતાઓનો ખેદ અને સનત્કુમારની શંકા :

અવધિજ્ઞાનાનુસારે દેવવિઘ્રોએ કહ્યું, “હે મહારાજ ! તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ-આકાશનો ફેર પડી ગયો છે.” ચક્કવતીએ તે સ્પષ્ટ સમજાવવાને કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું, અધિરાજ ! તમારી કાયા પ્રથમ અમૃતતુલ્ય હતી. આ વેળા તેરતુલ્ય છે. જ્યારે અમૃતતુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા; અને આ વેળા તેરતુલ્ય છે, ત્યારે ખેદ પામ્યા.”

### શંકા સમાધાન, અને પૂર્વકર્મનો ઉદ્ય :

અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે તાંબૂલ થૂંકો; તે પર માખી બેસશે, તે તત્કાળ પરલોક પહોંચી જશે.

### કાયાનું વિષરૂપ થવું – સનત્કુમારનો વૈરાગ્ય :

સનત્કુમારે એ પરીક્ષા કરી તો સત્ય ઠરી. પૂર્વિત કર્મના પાપનો જે ભાગ તેમાં આ કાયાના મદ સંબંધીનું મેળવણ થવાથી એ ચક્કવતીની કાયા તેરમય થઈ ગઈ હતી. વિનાશી અને અશુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનત્કુમારને અંતકરણમાં વૈરાગ્ય આવ્યો. આ સંસાર કેવળ ત્યજાવા યોગ્ય છે. આવી ને આવી અશુચિ રહી, પુત્ર, મિત્રાદિકના શરીરમાં રહી છે. એ સધારું મોહમાન કરવા યોગ્ય નથી, એમ વિચારી તે છ ખંડની પ્રભુતા ત્યાગી ચાલી નીકળ્યા.

## રોગનો ઉદ્ય - કર્મરોગ :

સાધુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે તેઓને મહારોગ ઉત્પત્ત થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને હોઈ દેવ ત્યા વૈદ્યરૂપે આવ્યો. સાધુને કહું-હું બહુ કુશળ રાજવૈદ્ય છું. તમારી કાયા રોગનો ભોગ થયેલી છે. જે હિંદુ હોય તો તત્કાળ તે રોગને હું ટાળી દઉં. સાધુ બોલ્યા હે વૈદ ! કર્મરૂપી રોગ મહા ઉન્મત છે; તે રોગ ટાળવાની તમારી જે સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો, એ સમર્થતા ન હોય તો આ રોગ ભલે રહ્યો. દેવતા બોલ્યા-એ રોગ ટાળવાની સમર્થતા નથી.

## સનતુકુમારની લખિય :

સાધુએ પોતાની લખિયનાં પારિપૂર્ણ પ્રબળ વડે થૂકવાળી આંગળી કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગનો નાશ થયો; અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાશયું; ધન્યવાદ ગાઈ, વંદન કરી તે પોતાને સ્થાનકે ગયો.

## પ્રમાણાશિક્ષા :

રક્તપિત જેવા, સદૈવ લોહીરૂપથી ગદ્ગદૃતા, મહા રોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે, જે પ્રત્યેક રીમે પોણા બબ્બે રોગવાળી હોઈ રોગનો ભંડાર છે, અને વગેરેની ન્યૂનાધિકતાથી જે પ્રત્યેક કાયામાં દેખાવ દે છે, મળમૂત્ર-નરક-હાડ માંસ-પદુ અને શ્લેષ્મથી જેનું બધારણા ટકચું છે, ત્વચાથી માત્ર જેની મનોહરતા છે તે કાયાનો મોહ ખરે વિબ્રમ જ છે. સનતુકુમારે જેનું લેશમાત્ર માન કર્યું, તે પણ જેનાથી સંખાયું નહીં, તે કાયામાં અરે ! પામર, તું શું મોહે છે ? એ મોહ મંગળદાયક નથી.

॥ ઇતિ શ્રી શાંતસુધારસ મેયકાવ્યે અશુચિભાવનાવિભાવનો નામ ષષ્ઠઃ પ્રકાશઃ ॥

ઇતિ શ્રી શાંતસુધારસ નામના દ્વારાબદ્ધ કાવ્યમા-

અશુચિ ભાવના નામનો છઢો પ્રકાશ સમાપ્ત !



ॐ

## આશ્રવ ભાવના

આશ્રવ જરણા, જીવ સરોવર; કર્મ કાદવ :

॥ ભુજ્ઞગપ્રયાતં વૃત્તં ॥  
 યથા સર્વતો નિઝૈરાપત્રદ્ભિઃ ।  
 પ્રપૂર્યેત સદ્યઃ પયોભિસ્તટાકઃ ॥  
 તથૈવાશ્રવૈ: કર્મભિઃ સંભૂતોઙ્ગી ।  
 ભવેદ્ વ્યાકુલશ્રંચલઃ પંકિલશ ॥ ૧ ॥

અર્થ : જેમ ચોમેર પાણીના જરણાં પડતાં હોવાથી તળાવ એકદમ્બ  
 ભરાઈને છલી જાય છે, અને તેમાં પછી કાદવ વધે છે, તેમ ચોતરફથી  
 કર્મ આશ્રવ આવતાં પ્રાણી તેથી ભરાઈ જાય છે; તેને કાંઈ સૂજતું નથી,  
 તે વ્યાકુળ થાય છે; ગભરાય છે; તેની ચિત્તવૃત્તિ અસ્થિર થાય છે અને  
 મેલી થાય છે. ૧

અખંડ વરસાદ – છુટાય કેમ ?

॥ શાર્દૂલવિક્રીડિત વૃત્તં ॥

યાવત્લિંચિદિગાનુભૂય તરસા કર્મેહ નિર્જીવિતે ।  
 તાવચાશ્રવશત્રવોऽનુસમયં સિંચંતિ ભૂયોऽપિ તત् ॥  
 હા કષ્ટં કથમાશ્રવપ્રતિભટા: શક્યા નિરોધ્યું મયા ।  
 સંસારાદતિભીષણાન્યમ હહા મુક્તિઃ કથં ભાવિની ॥૨॥

અર્થ : અહો ! હજુ કંઈક કર્મ જ્યાં ભોગવાઈ નિર્જરી જાય છે,  
 ત્યાં તો આશ્રવરૂપ શત્રુ સમયે સમયે નવાં કર્મો સિંચાં કરે છે. અહો !  
 આમ જોતા આ આશ્રવરૂપી શત્રુઓને હું કેવી રીતે જીતી શકીશ ? અને  
 આ ભયંકર સંસારમાંથી મારો મોક્ષ કેવી રીતે થશે ? ૨

શાથી જીવ ભમે છે ?

॥ પ્રહષણી વૃત્તં ॥

મિથ્યાત્વાવિરતિકષાયયોગસંજ્ઞા- ।

ક્ષત્વારઃ સુકૃતિભિરાશ્રવાઃ પ્રદિષાઃ ॥

કર્માણિ પ્રતિસમયં સ્ફુરૈરમીભિ-

ર્બધંતા અ૰મયશતો અ૰મંતિ જીવાઃ ॥ ૩ ॥

અર્થ : (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) યોગ એ નામના ચાર આશ્રવ પુણ્યશાળી પુરુષોએ કથા છે. ભમે કરી, અર્થાતું વસ્તુનું યથાર્થ જ્ઞાન નહિ હોવાથી આ આશ્રવે કરી પ્રતિક્ષણે જીવો નવાં નવાં કર્મ બાંધે છે, અને ચાર ગતિરૂપ સંસારમાં ભમે છે. ઉ

કર્મના આવવાના પ્રકાર :

॥ સ્થોદ્ધતા વૃત્તં ॥

ઇંદ્રિયાબ્રતકષાયયોગજાઃ ।

પંચ પંચતુરાચ્ચિતાસ્ત્રયઃ ॥

પંચવિશતિરસત્ક્રિયા ઇતિ ।

નેત્રવેદપરિસંખ્યયાઽધ્યમી ॥ ૪ ॥

અર્થ : આ આશ્રવના બેંતાલીસ પ્રકાર છે.

(૧) પાંચ ઇંદ્રિયો	૫-૫
(૨) પ્રાણાત્પાતાદિક પાંચ અગ્રત	૫-૧૦
(૩) કોધાદિ ચાર કષાય	૪-૧૪
(૪) ભનાદિક ઋજુ યોગ	૩-૧૭
(૫) કાયિકાદિક પંચવિશ અસત્ક્રિયા	૨૫-૪૨

પ્રથમ પાંચ મિથ્યાત્વાદિ જ્ઞાય્યાં, તે તો આશ્રવનાં કારણો; ઝૂઠાત્મ મિથ્યાત્વને લઈ કર્મ આવે; અગ્રતને લઈ આવે; કષાયને લઈ આવે; પ્રમાદને લઈ આવે અને યોગને લઈ આવે.

અને આ બેંતાલીસ ભેદ કર્યા તે કેવા પ્રકારે કર્મ આવે તે બતાવવા, અર્થાત् પાંચ ઈદ્રિયોના વિષયરૂપે કર્મ આવે; પાંચ અવત રૂપે આવે; ચાર કખાય રૂપે આવે; ત્રણ યોગરૂપે આવે; પંચવિંશ પ્રકારની અસત્કિયા રૂપે પણ આવે.

ઈદ્રિયોના વિષય ભોગવતાં કર્મ લાગે; પ્રાણધાત, અસત્ય, સ્તોપ, મૈથુન, પરિગ્રહમૂર્ખરી આચરતાં કર્મ લાગે.

કીથાદિ કરતાં કર્મ લાગે. વિના ઉપયોગે, વિના પ્રયોજને, ઉઠતાં બેસતાં, લેતાં, મૂકતાં, ફેંકતાં આહિ અનેક કિયાએ કરી કર્મ લાગે.

### કર્મ આવવાનાં કારણ :

કોઈ કર્મ મિથ્યાત્વને લઈ આવ્યું હોય; કોઈમાં અવિરતિ કારણ હોય; કોઈમાં પ્રમાદ કારણ હોય; કોઈમાં યોગ કારણ હોય; કોઈમાં બે કારણ હોય; કોઈમાં ત્રણ હોય; કોઈમાં વધારે, ઓછાં કે બધાં કારણો હોય; કોઈમાં એક પ્રધાન કારણ હોય તો બીજાં ગૌણ હોય. આમ મિથ્યાત્વાદિ પાંચ કારણને લઈ બેંતાલીસ પ્રકારે આશ્રવ આવે છે.

એ આશ્રવનાં મુખ્ય કારણનાં પણ અનેક પ્રતિભેદ છે.

મિથ્યાત્વના પાંચ ભેદ છે.

૫-૫

અત્રતના બાર ભેદ છે.

૧૨-૧૭

કખાયના પરીસ ભેદ છે.

૨૫-૪૨

યોગના પંદર ભેદ છે.

૧૫-૫૭

### જેવું કારણ તેવો બંધ :

એમ આશ્રવનાં મુખ્ય ચાર કારણના ઉત્તરભેદ સત્તાવન છે. આ ભેદ બ્રંથાંતરથી (નવતત્ત્વ,-તત્ત્વાર્થ પ્રમુખ બ્રંથથી) જાળવા યોગ્ય છે. એમાંથી એક કે વધારે કારણે લઈ કર્મ બંધાયે છે. તેમાં જેવું કારણ તેવો બંધ પડે છે. આકરા કખાયથી આકરો બંધ પડે છે પાતળો કખાય હોય તો શિથિલ બંધ પડે છે. તેમ બીજાં કારણોનું સમજવું, લાંબા કાળના કે ઢૂકા કાળના, આકરો કે શિથિલ, નાનાં કે મોટાં, એમ કર્મના બંધ પડે છે. તે

જે કારણોથી તે બંધાય છે, તે કારણો ઉપર આધાર રાખે છે. એ આશ્રવનાં કારણો ટાળવાથી, દૂર કરવાથી, રોધવાથી પરમ કલ્યાણ છે. એ આશ્રવના રોધને સંવર કહે છે.

**દેહ પર્યત કિયા તો છે :**

**પણ જીવે શાથી ડરવું જોઈએ છે ?**

દેહધારી જીવ દેહમાં રહ્યો છે ત્યાં સુધી તેને ઈદ્રિયો તો છે જ; યોગ છે, આંખ જેશે; કાન સાંભળશે; નાક સુંધરુશે; જીબ ચાખશે; શરીર સ્પર્શશે; બીજી કિયાઓ પણ ચાલશે. આથી ડરવાનું નથી; પણ ડરવાનું છે તે તો મિથ્યાત્વાટિ કોઈ આશ્રવના કારણને લઈ એ કિયા થાય તો; માટે સુજ્ઞ જીવોએ, આત્માથીઓએ જ્ઞાનો જ્ઞાનો વિચારવું કે કર્મ લાગે છે તે મિથ્યાત્વ, અપ્રત, કષાય અને યોગથી લાગે છે, બીજી રીતે નથી લાગતાં; માટે અમુક કિયા ચાલવામાં, ખાવામાં, પીવામાં, બોલવામાં, હરવામાં, ફરવામાં, ચાખવામાં, લેવામાં, દેવામાં વગેરે કિયામાં કયું કારણ વર્તે છે, એનો સૂસ્થ ઉપયોગ રાખવો. વિચારવું કે મિથ્યાત્વ છે કે અવિરતિ છે, કષાય છે કું યોગ કે પ્રમાદ, - શું પ્રધાનપણે વર્તે છે, - એ વિચારી તેને અટકોવવાં. આથી આશ્રવનાં કારણો ઓછાં થશે; ટણશે; દૂર થશે; સંવરનો અભ્યાસ પડશે અને પરિણામે પરમ કલ્યાણ થશે. ૪

**આશ્રવ ટણ્યે છૂટકો :**

॥ ઇંદ્રવજા વૃત્તં ॥

ઇત્યાશ્રવાણામદિગમ્ય તત્ત્વं ।

નિશ્ચિત્ય સત્યં શુતિસત્ત્વિદ્ધાનાતુ ॥

એમાં નિરોધ વિગલદિરોધે ।

સર્વાત્મના દ્રાગ્ય યતિતત્વમાત્મનુ ॥ ૫ ॥

**અર્થ :** હે આત્મા ! તું અને બધા જીવો આ પ્રકારે આશ્રવ તત્ત્વ સમજું શાસ્ત્રાશ્રવણ કરી સત્યનો નિશ્ચિત્ય કરો; અને એ આશ્રવ શત્રુનો નિરોધ કરવા તરત પ્રયત્ન કરો; એમાં વિરોધ જેવું કશું નથી; એમાં કાઈ કહેવા જેવું નથી, એ આશ્રવનો રોધ કર્યે જ છૂટકો છે; કલ્યાણ છે; માટે

સદ્ગુરુ સમીપે એ આશ્રવતરત્વ જાણી સત્યનો નિરધાર કરી એ આશ્રવ છાંડવા ઉદ્ઘમ કરો. ૫

હવે આ સાતમી ભાવનાનું અષ્ટકાળિયું કહે છે.

ઉચ્છ્રંખલને શ્રુંખલામાં બાંધ્યો સારો :

॥ ધનાશ્રી રાગ - ભોગીડા રે હંસા રે  
વિષય ન રાચીયે... એ દેશી ॥

પરિહરણીયા રે સુકૃતિભિરાશ્રયા ।

હવિ સમતામવધાય ॥

પ્રભવંત્યેતે રે મૃશમુચ્છંખલા ।

વિભુગુણવિભવવધાય ॥ પ૦ ૧ ॥

અર્થ : અહો ! કુશળ આત્માઓએ ફદ્યને વિષે સમતા ધારડા કરી આ આશ્રવનો પરિહાર કર્તવ્ય છે; કેમ કે આ ઉચ્છ્રંખલ આશ્રવ (ઉચ્છ્રંખલ છૂટો, બેડી વિનાનો, આશ્રવને તો રોધ્યો સારો, બેડીમાં બાંધ્યો સારો, છૂટો ખરાબ) આત્માના જ્ઞાનાદિ ગુણરૂપ જે વૈભવ-ઐશ્વર્ય તેનો નાશ કરવામાં ફિલે પામે છે. હે ! સજજનો ! તમે આશ્રવને છાંડો; કેમ કે એ આત્માના જ્ઞાનાદિ ગુણને ગાઢ આવરણનું કારણ થાય છે. ૧

કુમતપાશ મિથ્યાત્વ :

કુગુરુનિયુક્તા રે કુમતિપરિલુતાઃ ।

શિવપુરષથમપણાય ॥

પ્રયતંતેડમી રે ક્રિયા દુષ્યા ।

પ્રત્યુત શિવવિરહાય ॥ પ૦ ૨ ॥

અર્થ : અહો ! કુગુરુથી પ્રેરાપેલા અને કુમતિના પાશમાં ફસેલા આ છુવો શિવપુરનો માર્ગ ત્યજી દઈ જિલટા દુષ્ટ કિયા વડે અવળા ચાલ્યા છે ! અહો ! આ તો તેઓનો શિવસુખ પામવાને બદલે તે હારી જવાનો પ્રયાસ છે, ભાટે જે આશ્રવરૂપ દુષ્ટ કિયાથી શિવસુખ નાશ પામે, છેંદ્ર જ્યય, એનો તમે હે સજજનો ! પરિહાર કરો. ૨

દિશાભમથી દુઃખ તેમ ઈદિયો ખુલ્લી રાખવાથી પડો દુઃખ :

અવિરતવિત્તા રે વિષયવર્ણીકૃતા ।

વિષહંતે વિતતાનિ ॥

ઇહ પરલોકે રે કર્મવિપાકજા-

ન્યવિરલદુઃખશતાનિ ॥ પ૦ ૩ ॥

**અર્થ :** ઉપર જણાવ્યું કે કુગુરુ અને કુમતિના પાશમાં પડી મિથ્યા માર્ગ જીવો ગ્રહણ કરે છે; ઉત્તરમાં જરૂર હોય અને લે દક્ષિણાની વાટ; અને સમજે કે અમે ઉત્તરમાં જઈએ છીએ. જે કિયા-વર્તનથી મોક્ષ દૂર જાય, કર્મ વધારે વધારે આકરાં બંધાતાં જાય, તે ડિયા-વર્તનથી શિવસુખમોક્ષ મળશે એમ ગણી આચર્યા રહે, તો તેઓને મોક્ષ મળે જરો? ના, કહી નહીં. આમ ઘણા જીવો જ્યારે મિથ્યાત્વ આશ્રવથી કર્મ બાંધે જાય છે, ત્યારે વળી બીજી ઘણા જીવો છે, કે જેના ચિત્તમાં લેશ માત્ર પ્રતનાં, વિરતિનાં, વૈરાગ્યનાં પરિણામ નથી, જે બિચારા વિષયવશ પડ્યા છે; અને એ વિષયાશ્રવથી ઉપાર્જલાં કર્મનાં સેંકડો ગમે વિપાક-ફલ આ ભવમાં તથા પરબ્રહ્મમાં નિરંતર સહન કરી રહ્યા છે.

શારીરિક કીળતા આદિ રોગ એ આ ભવનાં વિષયસેવનથી થબેલાં પ્રત્યક્ષ ફળ છે; પરભવે પણ નરક, તિર્યચ ગતિરૂપ અનેં ફળ છે. વિષયસેવનથી રોગ થાય; રોગથી તન-મનની-સ્રૂતિ ન રહે; આત્મવીર્યોત્ત્વાસમાં ખાની આવે; આહંકદોહંક ચિત્તવં થાય; મન અસ્થિર રહે; આર્તીરૌદ્ર ધ્યાન ધરે; કુતર્ક કરે; આથી માઠાં કર્મ બંધાય; જે પરિણામે દુઃખરૂપ માઠી ગતિને આપે. આમ પરંપરાએ વિષયસેવન કરશભૂત થાય છે. એટલે ઘણા જીવો કુગુરુ અને કુમતિના પાશમાં પડ્યા હોવાથી તત્ત્વ પામતા નથી. સત્યને અસત્યરૂપે ગણો છે; અસત્યને સત્યરૂપે ગણો છે; કવચિત્ ખોટું જાણતાં છતાં જાણી જોઈને છાડતા નથી; સાચું જાણતાં છતાં જાણી જોઈને આદરતા નથી, આવા મિથ્યાત્વી, અવળે રસ્તે ચાલનારા, વસુસ્વરૂપના જ્ઞાનથી વિમુખ, એ દુઃખ પામે છે. તેમ જ વિષયાધીન વૃત્તિવાળા જીવો પણ અગાઉ કહું તેમ આ, ભવ, પરભવ બંનેમાં વિષયજન્ય કર્મના કડવા વિપાક અનુભવે છે; મારે હે ! સજીજાનો ! તમે આ આશ્રવ છાડો. ૩

## હાથી ને વિષય :

કરિજાપમધુપા રે શલભમૃગાદયો ।  
 વિષયવિનોદરસેન ॥  
 હંત લભંતે રે વિવિધા વેદના ।  
 બત પરિણતિવિરસેન ॥ પ૦ ૪ ॥

**અર્થ :** અહો ! જેનું પરિણામ ખરેખર માહું છે, જેના વિપાક કડવા છે, એવા વિષયાનંદના રસે કરી હાથી, માછલાં, ભરમરા, પતંગિયાં, હરણ આદિ જીવો જાતજાતની વેદના ભૂગર્બ છે. વિષયજન્ય વેદનાનાં આ પ્રત્યક્ષ પરિણામ છે. હાથી સ્પર્શોદ્રિયના વિષયમાં લુભ્ય છે; તો તે જ વિષયલોભ તેને અંધ કરી ફસાવે છે. માછલાં જીહુવેદ્રિયના વિષયને વશ છે; ભરમરા સુગંધને વશ છે; પતંગિયાં રૂપ-તેજને વશ છે; હરણિયાં ગાળને, સુસ્વરને વશ છે. આમ એકેક ઈદ્રિયના વિષયને વશ થઈ, એમાં એવા લીન થઈ જાય છે કે પોતાને ભૂલી જઈ પ્રાણ ખોયા જેવી સ્વિતિમાં ફસાઈ જાય છે.

હાથીને સ્પર્શોદ્રિયનો લોભ જ ફસાવે છે. વિષયને વશ પ્રાણીનાં બંને અસુઝો, ચર્મ તથા ભાવયક્ષુ અંધ થઈ જાય છે. તે દેખી શકતો નથી, વિચારી શકતો નથી, આ પ્રત્યક્ષ વાત છે. કામવિવશ હાથી, હાથણી દેખી એવો વિહૃવળ થઈ જાય છે કે કશું દેખી શકતો નથી. આ વિષયાંધપજાથી એ મહાન જબરું પ્રાણી પણ વશ થાય છે. જંગલમાં હાથીઓનાં ટોળામાંથી હાથીને પકડવાની આ યુક્તિ પ્રચલિત છે.

## હાથી કેમ પકડાય છે ?

જંગલમાં એક જબરો, બે-ત્રણ હાથી માય એવડો ખાડો ખોદવામાં આવે છે. તે ઉપર ખપાટો ઓરસચોરસ ભરી લઈ તેને ઢાંકી કે છે. ઉપર એક જીવતી હાથણીના આકારની કાગળની કે બીજી ઝૂટ્રિમ હાથણી ઊભી રાખવામાં આવે છે. બિચારો કામવિવશ હાથી તો હાથણીની શોધમાં જ ભટકતો હોય છે, અને જ્યાં હાથણી દેખી બાં આંધળોભીત થાય છે; અને તેના ઉપર પોતાનું ચાલે તો હુમલો કરેવા જાય છે. આ ઝૂટ્રિમ

હાથળી પાસે પણ એ પ્રકારે હાથી આવી થડે છે. એને પકડનારા આસપાસ સંતાઈ રહે છે. આસપાસ કોઈ નથી, એ જાણી હાથીને વધારે જેર આવે છે અને દૂત્રિમ હાથળી પર હુમલો કરવા જાય છે, ત્યાં પોતાના ભારથી વાંસની જળી તૂટી પડે છે. અને પોતે ખાડામાં સરી પડે છે, અહીંથાં તેનો મદ ઉત્તરી જતાં સુધી તેને ભૂખ્યો-તરસ્યો રાખી મૂકવામાં આવે છે, આથી તે ગળી જઈ શાંત થઈ પકડાય છે અને પાળી શકાય છે. આમ હાથી જેવું રાક્ષસી પ્રાણી એક સ્પર્શેદ્વિદ્યના વિષયને લઈ વિટંબણા પામે છે, તો પછી બધી ઈદ્રિયોને વશ જીવને કેટલી વિટંબણા થાય ? એ હે જીવ ! તું વિચાર.

**માછલીને રસ, ભ્રમરને સુગંધ, પતંગને**

**રૂપ, મૃગને રાગ – પ્રાણ જવાની વાત :**

માછલી બિચારી જીભના વિષયને વશ હોવાથી ખાવાની લાલથે પકડાય છે. ભ્રમરો સુગંધનો ભોગી થતાં તે વિષયથી છેવટ સુધી રૂમિ નથી પામતો, એથી સાંજે કમળ, જેમાં તે રહ્યો હોય છે તે બિડાઈ જતાં અંદર પ્રાણ ખૂબે છે. પતંગિયાં રૂપથી આકર્ષાઈ બળતા ઢીવામાં ઝંપલાઈ દુઃખ પામે છે, પ્રાણ ખૂબે છે. છરણિયાં મધુર જાયનથી લુલ્ય થઈ શિકારીના પાશમાં ફસાઈ પ્રાણ ખૂબે છે. વિષયજન્યના આ ગ્રત્યક્ષ વિપાક છે. એકેક વિષયના લોભથી આવું માર્ગ પરિણામ આવે છે, તો પછી બધી ઈદ્રિયોને વશ રહેતાં કેટલું દુઃખ આવે ? હે ચેતન ! તું એ વિચારી એ વિષયથી વેગળો રહે ! વેગળો રહે !! એ વિષયનાં પરિણામ માઠાં છે; માટે હે પુષ્પવંત જીવો ! તમે આશ્રમ છાંડી દો. ૪

આમ જ્યારે ઘણા મિથ્યાત્વ અને વિષયથી દુઃખ પામે છે ત્યારે ઘણા કખાયથી પામે છે એ બતાવે છે.

**કખાયથી દુઃખ :**

ઉદિતકષાયા રે વિષયવશીકૃતા ।

યાંતિ મહાનરકેષુ ॥

પરિબત્તિ રે નિયતમનંતશો ।

જન્મજરામરणેષુ ॥ ૪૦ ૫ ॥

અર્થ : અહો ! જેને કષાયનો ઉદ્ય થયો છે, જે વિષયને વશ થયા છે, તે બિચારા મહાધોર નરક ગતિ પામે છે અને નિશ્ચયે અનંતી વાર જ્ઞમ-જ્ઞાન-મરણનાં દુઃખ અનુભવે છે. વિષય, કષાય, પ્રમાણ, મિથ્યાત્વ, આશ્રવનાં આવાં કડવાં ફળ છે, તો છે પુષ્પશાલી જીવો ! તમે આશ્રવનો પરિહાર કરો ! પરિહાર કરો !! ૫

તેવા જ પ્રકારે મન-વચન-કાયાના માઠા યોગે જીવો દુઃખ પામે છે તે બતાવે છે.

ચંચળતાનાં દુઃખ :

મનસા વાચા રે વપુષા ચંચલા ।  
દુર્જયદુરિતભરેણ ॥  
ઉપલિપ્યંતે રે તત આશ્રવજયે ।  
યતતાં કૃતમપરેણ ॥ પ૦ ૬ ॥

અર્થ : અહો ! જે પ્રાણી મન, વચન, કાયાએ અસ્થિર થાય છે, અથર્ત્વ જેના મનોયોગ, કાયયોગ, વાચાયોગ કાલુમાં રહેતા નથી, તે પ્રાણીઓ દુર્જય, આકદું પાપ બાધે છે, માટે હે ચતુરજનો ! તમે આશ્રવને જીતવાનો પ્રયાસ કરો. નવાં કર્મ બાંધો નહિ. મન, વચન, કાયાના યોગ સ્થિર કરો. આશ્રવનાં પરિષ્ઠામ માઠાં છે, માટે બેને છાંડો. ૬

આ તો અશુદ્ધ યોગના ફળની વાત કહી, પણ શુભ યોગથી પણ જીવોને ભમવું પડે છે; ભલે શાતા ભોગવે છે, પણ તે કર્મનું કારણ હોવાથી, ભવમાં ભમાડે છે, એ બતાવે છે.

સોનાની અને લોઢાની બેડી :

શુદ્ધા યોગ રે યદયિ યતાત્મનાં ।  
સ્વર્વંતે શુભકર્માણિ ॥  
કાંચનનિગડાંસ્તાન્યાપિ જાનીયાત્ ।  
હતમિવૃત્તિશર્માણિ ॥ પ૦ ૭ ॥

અર્થ : સંયતિ પુરુષોના ભલે શુભ યોગ હોય, તો પણ તે યોગ હોવાથી શુભ કર્મને આણે છે; કર્મરહિત નથી કરતાં આ શુભ કર્મ પણ મોક્ષસુખનો નાશ કરવાને સુવર્ણ બેડી સમાન સમજવાં. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી જીવ બેડીમાં બંધાયલો છે; અને ત્યાં સુધી તેનો મોક્ષ થાય નાદિ. ભલે અશુભ કર્મવાળાની લોઢાની બેડી ગણો, શુભ કર્મવાળાની સોનાની, પણ બંને બંધાયલા તો છે. આમ શુભયોગ પણ આશ્રવ છે. તેને હે સજ્જનો ! તમે પરિહરો. ૭

આશ્રવ છાંડે તે અમર થાય :

મોદસ્વૈવ રે સાશ્રવપાપ્ના-  
રોધે ધિયમાધાય ॥  
શાંતસુધારસપાનમનારતં  
વિનય ! વિધાય વિધાય ॥ ષ૦ ૮ ॥

અર્થ : માટે રે વિનય ! સુવિનીત ચેતન ! તું આવા પ્રકારે આશ્રવજ્ઞ્ય પાપને રોધવાની બુદ્ધિ કર; અને આ શાંતસુધારસનું વાર્ણવાર પાન કરી આનંદ પામ. આશ્રવનાં કરવા પરિણામ આમ જાણી હે સજ્જનો ! હે ચેતન ! તમે આ મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય, યોગરૂપ કર્મને આવવાનાં નિબિડ કારણરૂપ આશ્રવને છાંડે. ૮

આમ આશ્રવ વિચારી તે અટકાવતાં જીવને મોક્ષ પામવામાં કાઈ વાર નથી. તે અમર થાય છે. તેને ભય રહેતો નથી.

“અભ હમ અમર ભયે ન મરેંગે,  
યું કારણ મિથ્યાત હિયો તજ  
કાણો કો દેહ ધરેંગે ? અભ હમો.”

— શ્રી આનંદધનજી

બંધનું કારણ આશ્રવ — મુક્તિનું કારણ સંવર.

“કારણ યોગે હો બંધે બંધને રે,  
કારણે મુક્તિ મુકાય,

આશ્રવ-સંવર નામ અનુકૂળ રે,  
હેયોપાદેય સુણાય."

— શ્રી આનંદઘનજી. પદ્મપ્રભુનું સત્વન.

### આશ્રવદ્વારે કુંડરિક :

#### પુંડરિક-કુંડરિક\*

મહાવિદેહમાં પુંડરિકિણી નગરીમાં પુંડરિક અને કુંડરિક બે ભાઈઓ રાજ્ય કરતા હતા. એક સમયે મહાતત્ત્વજ્ઞાની મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવી ચડ્યા. તેઓનાં વૈરાગ્યવચનમૂર્તથી કુંડરિક દીક્ષા લેવાનો અનુરૂપી થયો. ઘરે આવી પોતાનું રાજ્ય પુંડરિકને સૌંપી પોતે ચારિત્ર ગ્રહણ કર્યું.

### ભગ્નપરિણામી કુંડરિક :

સરસ-નિરસ આહાર કરતાં થોડા કાળે એને રોગ ઉપાખ્યો; તેથી તે ચારિત્ર પરિણામે ભગ્ન થયો. પુંડરિકિણી નગરીના અશોક ઉધાનમાં આવી તેણે ઓધો-મુહુપત્રિ વૃક્ષે વળગાડી મૂક્યાં. નિર્યતર તે પરિચિતવન કરવા મંજ્યો, કે પુંડરિક મને રાજ્ય આપશે કે નહિ? વનપાળે કુંડરિકને ઓળખ્યો. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે તમારો ભાઈ આકુળવ્યાકુળ થતો અશોક બાગમાં રહ્યો છે. પુંડરિકે આવી કુંડરિકના મનોભાવ જોયા, અને તેને ચારિત્રથી ડેલતો-ભાષ થતો જોઈ કેટલોક ઉપદેશ આપી, પછી રાજ્ય તેને સૌંપી ધેર આવ્યા.

### મહારૌક ધ્યાન :

સહસ વરસ ગ્રવર્જ્યા પાળી પછી તે પરિત થયો, તેથી કુંડરિકની આણા સામંત કે મંત્રી કોઈ માનતા નહિ અને ઉલટા તેને વિકારતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરી તેને બહુ પીડા થઈ, વમન થયું. અભાવને લઈ કોઈ તેની પાસે આવ્યું નહિ; તેથી તેના મનમાં પ્રગંડ કોધ વ્યાપ્યો. તેણે નિશ્ચય કર્યો કે આ દાદ્યી જે

\* શ્રીમદ્ રાજ્યંત્ર કૃત ભાવનાબોધ-આશ્રવ ભાવના

મને શાંતિ થાય તો પછી પ્રભાતે હું એ બધાને જોઈ લઈશ. એવા મહા માઠાં દુર્ઘાનથી મરીને સાતમી નરકે અપયંઠાણ પાથડે તેત્રીસ સાગરોપમના આયુષ્યે અનંત દુઃખમાં જઈ ઉપજ્યો. કેવું વિપરીત આશ્રવદ્વાર !!! આશ્રવથી કુંડરિકની શી અવસ્થા થઈ ?

આમ જણી મુમુક્ષુઓએ આશ્રવ છાંડવો પોત્ય છે.

હવે પુંડરિકનું શું થયું જુઓ !

### સંવરદ્વારે પુંડરિક :

કુંડરિકના ઓથો-મુખવસ્ત્રિકા આદિ સંયમોપકરણ જે તેણે અશોક બાગમાં જડે લટકાવ્યાં હતાં, તે ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે મારે મહર્ષિ ગુરુ કને જવું; અને ત્યાર પછી જ અમજણ ગ્રહણ કરવાં. અશવાણે ચરણે પરવરતાં પગમાં કકર, કંટક ખૂંચવાથી લોહીની ધારાઓ ચાલી. તો પણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક અવીને સમર્થ સર્વાર્થસિદ્ધિ વિમાને તેત્રીસ સાગરોપમના અત્યુગ્ર આયુષ્યે દેવરૂપે ઉપજ્યો.

આશ્રવથી કુંડરિકની શી દુઃખદશા ! સંવરથી પુંડરિકની શી સુખદશા !!!

॥ ઇતિ શ્રી શાંતસુધારસગેયકાવ્યે આશ્રવભાવનાવિભાવનો

નામ સત્પત્રમઃ પ્રકાશઃ ॥

ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં

સાતમી આશ્રવ ભાવના સમામ.



ॐ

## संपर्क भावना।

॥ स्वागता वृत्तं ॥

येन येन य इहाश्रवरोधः ।  
 संभवेन्नयतमौपयिकेन ॥  
 आदियस्य विनयोध्यतचेता-  
 स्तत्तदांतरदशा परिभाव्य ॥ १ ॥

**अर्थ :** हे विनय ! आ जगतभां जे जे उपाये करी निश्चये आश्रवरोध थाय, ते ते उपायो अंतर दृष्टिए विचारी ते प्रति चित्त लगाडवाभां आटर कर. १

संयमेन विषयाविरतत्वे ।  
 दर्शनेन वित्ताभिनिवेशं ॥  
 ध्यानमार्तमध रौद्रमजसं ।  
 चेतसः स्थिरतया च निरुद्ध्याः ॥ २ ॥

**अर्थ :** हे विनय ! विषय अने अन्नतनो संयम वडे निरोध कर. असत्यना अभिनिवेश-आश्रहरूप जे भिष्यात्व तेनो सम्यग्दर्शन वडे, सम्यक्त्व वडे निरोध कर अने चित्तनी स्थिरता वडे आर्त अने रौद्र ए बे भाठां ध्याननो छमेश निरोध कर. विषय, अन्नत, भिष्यात्व, दुर्ध्यान ए बधां आश्रवनां कारणो छे; तो ते कारणो तेना प्रतिपक्षी कारणो संयम, दर्शन, स्थिरताथी हूर करी शकाय छे. २

॥ शालिनी वृत्तं ॥

क्रोधं क्षांत्या मादविनाप्रिमानं ।  
 हन्त्या माया मार्जविनोऽखलेन ॥

લોભ વારાંશિરૌદ્ર નિસુંધ્યા: ।  
સંતોષેણ પ્રાંશુના સેતુનેવ ॥ ૩ ॥

**અર્થ :** જેમ રૈદ્ર-ભયંકર લાગતી પાણીની રાશને ઉંચી પાળ બાંધી ખાળી શકાય છે, તેમ હે વિનય ! તું કોધનો ક્ષમા વડે, માનનો નમ્રતા વડે, માયા કપટનો ઉજ્જવળ સરળ ચિત્ત વડે અને લોભનો સંતોષ વડે નિરોધ કર. ૩

॥ સ્વાગતા વૃત્ત ॥

ગુણિભસ્તિસૃભિરેવમજવ્યાનુ ।  
ત્રોનુ વિજિત્વ તરસાઽધમયોગાનુ ॥  
સાધુસંવરણે ગ્રયતેથા ।  
લઘ્યસે હિતમનીહિતમિદ્ધં ॥ ૪ ॥

**અર્થ :** હે વિનય ! જીતવા મુશ્કેલ એવા ત્રણ મન-વચન-કાયાના અધમ યોગને મનોગુમિ, વચનગુમિ અને કાયગુમિ એ ત્રણ ગુમિ વડે જીતી, તું હુડી સંવર માર્ગમાં પ્રયત્ન કર; એથી પરિણામે તું શાશ્વત હિતાર્થ પામીશ; અથર્ત્વ કોઈ કાળે નાશ ન પામે એવો મોક્ષ પામીશ. ૪

॥ મંદાક્રાંતા વૃત્ત ॥

એવ રુદ્રેષ્યમલહદ્યૈરાશ્વેષ્યાસ્તવાક્ય-  
શ્રદ્ધાચંચત્તિતપટપટુ: સુપ્રતિષ્ઠાનશાલી ॥  
શુદ્ધૈયોગેર્જવનપવનૈ: પ્રેરિતો જીવપોત: ।  
સ્વોતસ્તીતર્વ ભવજલનિધેયાતિ નિર્વાળપુર્યા ॥ ૫ ॥

**અર્થ :** મિથ્યાત્વ, અપ્રત, પ્રમાદ, કખાય અને યોગ એ પાંચ આશ્રવનાં કારણો છે, કર્મ જળ આવવાનાં એ પાંચ મોટા નાળાં છે.

મિથ્યાત્વ નાળું સમ્યગ્રદ્ધનરૂપ દરવાજ (સંવર) વડે બંધ કરી શકાય છે.

અપ્રત, વિષય, પ્રમાદરૂપ નાળું ચારિત્રશી બંધ કરી શકાય છે.

કોધ, કખાય ક્ષમા સંવરથી અટકાવી શકાય છે.

માન આશ્રવ મૃદુતા સંવરથી અટકાવી શકાય છે.

માયા આશ્રવ સરલચિત્તરૂપ સંવરથી રોધી શકાય છે.

લોભ આશ્રવ સંતોષ સંવરથી રોધી શકાય છે.

મનોયોગ મનગુમિથી અટકાવી શકાય છે.

વચનયોગ વચનગુમિથી અટકાવી શકાય છે.

કાયયોગ કાયગુમિથી અટકાવી શકાય છે.

### જીવવહાણ મોક્ષબંદરે કેમ પહોંચે ?

આમ જે જે કર્મ આવવાનાં મોટાં દ્વાર છે, તે દ્વારને બંધ કરવાના તેવા જ દરવાજી છે. તે દરવાજારૂપ સંવરને હે વિનય ! તું આદર. હે નિર્મલ હૃદયવાળા પુરુષો ! એ સંવરનું તમે સેવન કરો. એ સંવરનો આદર અને આશ્રવનો રોધ થતો જીવરૂપ વહાણ સંસારસમુદ્રના પ્રવાહને તરી જઈ નિર્વાણપુરી પહોંચી જાય છે. એ જીવરૂપી વહાણમાં પરમ આમપુરુષ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનાં પવિત્ર વચન પર શ્રદ્ધારૂપ સઢ ફરફારી રહ્યા છે; અને મન, વચન, કાયાના શુદ્ધ યોગરૂપ વેગવાળા પવને કરી તે જીવરૂપ નૌકા સરસડાટ નિર્વાણપુરી ભણી મયાણ કરી રહી છે. સમુદ્રમાં વહાણ હોય તેને જે કંઈ જવું હોય તે કંઈ પહોંચવામાં અનુકૂળ પવન જોઈએ; કૂવાસ્થંભ અને સઢ સારા જોઈએ. જીવરૂપી વહાણને સંસારસમુદ્રમાંથી મોક્ષપુરી બદરે પહોંચવું છે. તે જીવરૂપ જહાજને શ્રી તીર્થકરનાં વચન પર આસ્થારૂપ સઢ છે; તે સઢને શુદ્ધ યોગરૂપી પવન જીંયે ફરફારાવી રહે છે; એથી જીવવહાણ તીવ્ર વેગે મુક્તિપુરી બંદર ભણી દોહ્યું જાય છે અને નિર્વિઘ્નપણે ત્યાં તલાજ પહોંચે છે. જીવજહાજને મુક્તિએ પહોંચ્યાઉનારા આ અનુકૂળ સઢ અને વાયરારૂપ શ્રદ્ધા અને શુદ્ધયોગ આશ્રવનો રોધ થાય તો જ મળે છે; માટે હે સંસારસમુદ્ર તરવાની ઠચ્છાવાળા મુમુક્ષુઓ ! તમે આશ્રવને રોધો; સંવરને આદરો; સંયમ આરાધો; સમ્યગ્દર્શન સેવો; મન સ્થિર રાખો; ક્ષમા, નભ્રતા, સરણતા અને સંતોષ ધરો; મન, વચન, ક્રીયાની ત્રણ ગુમિ, ત્રણ શુદ્ધ યોગ આદરો. ૬

હુએ સંવરભાવનાનું અધ્યાત્મિયું કહે છે :-

॥ नट राम-महावीर मेरो लालन ए देशी... ॥

शृणु शिवसुखसाधनसदुपायं ।  
सदुपायं रे सदुपायं ॥ शृणु० ।।  
ज्ञानादिक पावनरत्नत्रय  
फरमाराधनमनपायं रे ॥ शृणु० ॥ १ ॥

अर्थ : हे विनय !! तु मोक्षसाधननो दृढे उपाय सांभળ. ऐक तो :-

(१) निर्दोष पवित्र ज्ञान-दर्शन-चारित्र रत्नत्रयीनुं आराधन कर्वुं  
ते. १

बीजुं -

विषयविकार मपाकुरु दूरं ।  
क्रोधं मानं सहमायं ॥  
लोभं रिपुं च विजित्य सहेलं ।  
भज संयमगुणमकषायं ॥ शृणु० ॥ २ ॥

अर्थ : (२) विषयविकार दूर कर.

(३) क्रोध-मान-भाया-लोभद्रुप शत्रुने सहेलाईथी छती लई  
कुधायथी रहित संयम आराध. २

### शिवसुख साधन :

वणी :-

उपशमरसमनुशीलय मनसा ।  
रोषदहनजलदग्रायं ॥  
कलाय विरागं धृतपरभागं ।  
हृदि विनयं नायं नायं ॥ शृणु० ॥ ३ ॥

अर्थ : हे विनय ! क्रोधद्रुपी अग्निने ठारवा भेघ समान जे उपशम  
रस ते तु तारा हृष्टयमां धारण कर; ते उपशम रसनो तु अन्यास पाड;  
हृष्टयमां विनय अग्निने परपुद्रगलाई भाव छांडी वैराग्यनो परियथ कर.

હे विनय ! पुद्गलादि જે પર વસ્તુ તે વૈરાગ્ય વિના ટળશે નહિ; માટે વૈરાગ્ય આણ. આ શિવસુખ પ્રાપ્ત કરવાનો હડો ઉપાય છે, તે તું હે વિનય ! શ્રવણ કર. ૩

વણી -

આર્ત રૌદ્રં ધ્યાનं માર્જય ।  
દહ વિકલ્પરચના નાય ॥  
યદિ યમરૂઢા માનસવીથી ।  
તત્ત્વવિદઃ પંથા નાય ॥ શ્રૂણ૦ ॥૪॥

અર્થ : હે વિનય ! આર્તરૌદ્રધ્યાન વાળી નાખ; આર્તરૌદ્ર ધ્યાનરૂપી ક્ષયરો વાળી નાખ; અને સંકલ્પ-વિકલ્પ-કુતર્કરૂપી જાળને બાળી ભર્સ કરી નાખ; કેમ કે મનરૂપી ધોરી રસ્તો-મનરૂપી યોગ-મોકણો, ખુલ્લો રાખવો, એ તત્ત્વવેત્તાઓનો ધર્મ નથી. તત્ત્વવેત્તાઓનો તો મનોયોગનો નિરોધ કર્તવ્ય છે, કેમ કે એ મનરૂપ માર્ગ ખુલ્લો હોય તો હુદ્ધાન અને કુતર્ક વિકલ્પરૂપ શાનાદિ એમાં પ્રવેશ કરે ને ? માટે મનોયોગને રૂધવો એ હિતકર છે.

“યોગશ્ચિત્તવૃત્તિનિરોધः” - યોગદર્શન

મન મારો :

વણી -

“હે જીવ ! નહિ મેલ રે મન તું મોકણું,  
મન મોકલ્લે રે હાથ, -  
સંકોચ્યાથી રે સંવર નીપજે,  
થાય કોટિ કલ્યાણ.” જીવ૦

- સ્વાધ્યાય

માટે રે વિનય ! તું આ હુદ્ધાન દૂર કરવારૂપ અને મુનોયોગને કાબૂમાં રાખવારૂપ શિવસુખના ઉપાયને શ્રવણ કર. ૪

વણી -

મન કેમ શુદ્ધ થાય :

સંયમયોગેરવહિતમાનસ -  
શુદ્ધયા ચરિતાર્થ્ય કાયં ॥  
નાનામતરસચિગહને ભુવને ।  
નિશ્ચિનું શુદ્ધપથં નાયં । શૃં ૫ ॥

અર્થ : હે વિનય ! સંયમના યોગથી અર્થાત् ઈદ્રિયોને દાબમાં રાખીને, અથવા ચારિત્ર પ્રછણ કરીને મનની શુદ્ધિ કર અને એમ કરી કાંઈ પણ કૃતાર્થતા પામ; કેમ કે મનની શુદ્ધિ વિના સહયતા નથી. વળી આ જગત જેમાં જીતજીતના ભત-ધર્મની રૂચિ વ્યાપેલી છે, જેમાં અનેક પ્રકારના ભત-પંથ વર્તી રહ્યા છે, તેમાં શોધી શોધીને શુદ્ધ પંથનો નિશ્ચય કર. હે વિનય ! આ મોકસુખનો સદુપાય છે, તે તું સાંભળ. ૫

ગ્રહબ્રતમંગીકુરુ વિમલં ।  
વિભ્રાણ ગુણસમવાયં ॥  
ઉદિતગુરુવદનાદુપદેશં ।  
સંગૃહાણ શુચિમિવ રાયં ॥ શૃં ૬ ॥

અર્થ : વળી હે વિનય ! ગુણના સમુદ્ધાયને ધરનારા અર્થાત્ ઘણા ચુલ્લવાણા નિર્મિષ બ્રહ્મયર્થપતને તું અંગીકાર કર; અને જે પ્રકારે શુદ્ધ દ્રવ્યનો સંપ્રછ કરીએ છીએ, તે જ પ્રકારે સદ્ગુરુના મુખકમળમાંથી નીકળેલા ઉપદેશ વચ્ચામૃતને સમ્યક્ પ્રકારે ગ્રહણ કર. હે વિનય ! આ બધા શિવસુખપ્રાપ્તિના પરમ-ઉત્તમ ઉપાય છે, તે તું શ્રવણ કર. ૬

સંયમવાઙ્ગ્યકુસુમરસૈ રતિ ।  
સુરભય નિજમધ્યવસાયં ॥  
ચેતનમુપલક્ષય કૃતલક્ષણ-  
જ્ઞાનવરણગુણપર્યાયં ॥ શૃં ૭ ॥

અર્થ : શુદ્ધ સંયમનો પવિત્ર ઉપદેશ કરનારા વીતરાગ પુસુધોનાં મુખકમળમાંથી જરેલાં જે વચ્ચનપુષ્ટો તેનો રસ જીલી, હે વિનય ! તારા

અધ્યવસાય સુવાસિત કર. અને એ જ વચનપુષ્પો જીલી જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્ય-ઉપયોગ એ ગુણપર્યાયરૂપ લક્ષણવાળા તારાં ચેતનનું તું ઓળખાજી કર. તાત્પર્ય કે વીતરાગ ઉપદેશા સમીપે તું જી; તેઓશ્રીનાં વચનામૃતો સાંભળ; તેઓનો સંયમ આદરવાનો ઉપદેશ સાંભળ; આથી તારા અધ્યવસાય નિર્ભળ થશે, તારાં મનપરિષામ વિશુદ્ધ થશે, અને તેઓશ્રીનાં વચનો દ્વારા તારો ચેતન ઉપયોગ લક્ષણવાળો છે, જ્ઞાનાદિ ગુણપર્યાયવાળો છે, એ ઓળખાજી કર. હે વિનય ! શિવસુખ પામવાનો આ માર્ગ છે, તે તું સાંભળ. ૭

### શિવસૌખ્ય સાધન :

વદનમલાંકુરુ પાવનરસનં ।  
જિનચરિતં ગાયં ગાયં ॥  
સાવિનયશાંતસુધારસમેનં ।  
ચિરં નંદ પાયં પાયં ॥ શ્રો ૮ ॥

અર્થ : હે વિનય ! તું જિન ચરિત જાઈને તારા મુખને અલંકૃત કર; તારી જલને પવિત્ર કર; વિનયપૂર્વક આ શાંતસુધારસનું પાન કર; અને ચિરકાલ આનંદ આનંદ પામ. હે વિનય ! આ શિવસુખ પ્રાપ્તિનાં ઉત્તમ સાધન છે, તે તું શ્રવણ કર.

- (૧) જ્ઞાનાદિ રત્નત્રયી આરાધ.
- (૨) વિષયવિકાર છાંડી હે.
- (૩) કષાયનો ત્યાગ કર.
- (૪) ઉપશમ આદર.
- (૫) વૈરાગ્ય ધારણ કર; પુદ્રગલમૂર્ખી છાંડ.
- (૬) આર્ત-રૌદ્ર ધ્યાન ત્યાજ હે.
- (૭) વિકલ્પ કુતર્કો છાંડી હે.
- (૮) મનોયોગ રોધ.
- (૯) સંયમ ધારણ કર.
- (૧૦) તત્ત્વનો નિર્ણય કર.

- (૧૧) બ્રહ્મચર્ય પાળ.
- (૧૨) સદગુરુનો યોગ મેળવ.
- (૧૩) તેઓશ્રી પાસેથી શાસ્ત્રજ્ઞવણ કર.
- (૧૪) પરિષામ વિશુદ્ધિ કર.
- (૧૫) આત્માનું ઓળખાણ કર.
- (૧૬) જિનેશ્વર ભગવાનનાં ગુણગાન કર.

હુ વિનય ! આ બધાં શિવસુખ, નિરુપદ્રવ સ્થાન પામવાનાં ઉત્તમ સાધન છે; તે તું સાંબળ અને એનો ઉપયોગ કર. ८

આ સંવર ભાવના આશ્રવ ભાવનાથી વધારે સ્હૃંગ થાય એમ છે. આશ્રવનો નિરોધ એ સંવર. આશ્રવનાં ચાર મુખ્ય કારણો અને તેના સત્તાવન પ્રતિભેદને રોધવા તે સંવર.

મિથ્યાત્વ	પાંચ	૫
અપ્રત	બાર	૧૭
કથાય ૧૬		
કથાય	૫	૪૨
નોકથાય ૮		
યોગ મન-વચન-કાયા	પંદર	૫૭

આ સત્તાવનને સુષ્ઠુમ ઉપયોગે આવતા અટકાવવા તે સંવર. આશ્રવ ભાવનામાં આ સ્હૃંગ કરેલ છે. છતાં વિગતે વિસ્તારથી સમજ્ઞવા શ્રી તત્ત્વાર્થ પ્રમુખનો આશ્રય લાભરૂપ છે. સંવર આશ્રયી શ્રી વજસ્વામીનું ચરિત્ર બોધક છે. પુરાણિકનું ટૂંક કૃત્તાત તો કુર્દિકના અનુસંધાનમાં આશ્રવભાવનાના છેઠે આપેલ છે.

### રુક્મિણીનો મોહ :

શ્રી વજસ્વામી\*

શ્રી વજસ્વામી કંચન-કામિનીના કેવળ દ્રવ્ય-ભાવ પરિત્યાગી હતા.

\* શ્રીમદ્ રાજચંદ્ર કૃત ભાવનાબોધ - સંવર ભાવના

એક શ્રીમતની રુક્મિણી નામની સુંદર પુત્રી, વજસ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરી મોહિત થઈ. વેર આવી માતા-પિતાને કહ્યું કે જો હું આ દેઢે પતિ કરું તો માત્ર વજસ્વામીને જ કરું; અન્ય સાથે લગ્નગાઠ જોડવા માટે પ્રતિષ્ઠા છે.

રુક્મિણીને તેનાં માતાપિતાએ ઘણું કહ્યું કે બેલી, વિચાર તો કર કે મુનિરાજ તે કદી પરણો? એ મુનિએ તો આશ્રવદ્વારની સત્ય પ્રતિષ્ઠા કરી છે. તો પણ રુક્મિણીએ કહ્યું ન માન્યું. નિરૂપાયે તેના પિતા ધનાવાહ શેઠ કેટલુંક દ્રવ્ય અને સુરૂપા રુક્મિણીને સાથે લઈ વજસ્વામી સમીપે આવ્યા અને શેઠ મુનિને કહ્યું: આ લક્ષ્મીનો તમે યથારુચિ ઉપયોગ કરો, વૈભવ વિલાસમાં વાપરો અને આ મારી મહાસુકોમળા રુક્મિણી નામની પુત્રીથી પાણિઅહૃત્ત્વ કરો. એમ કહી તે પોતાને વેર આવ્યો.

ધૌયનસાગરમાં તરતી અને રૂપના અંબારદ્વાપ રુક્મિણીએ વજસ્વામીને અનેક પ્રકારે ભોગ સંબંધી ઉપદેશ કર્યો; ભોગનાં સુખ અને પ્રકાર વર્ણવી દેખાઇયાં. મનમોહક હાવભાવ તથા અનેક પ્રકારનાં અન્ય ચયાંવાવના ઉપાય કર્યા; પરંતુ તે વૃથા ગયા. મહાસુંદરી રુક્મિણી પોતાના મોહ-કટાક્ષમાં નિર્ઝળ ગઈ.

### વજસ્વામીની દેઢતા :

ઉગ્રચરિત્ર વિજયમાન વજસ્વામી મેરુની પેઠે અચળ અને અડોલ રહ્યા. રુક્મિણીનાં મન, વચન, અને તનના સર્વ ઉપદેશ અને હાવ-ભાવથી તે લેશમાત્ર પીગળ્યા નાલ્યા. આવી મહાવિશાળ દેઢતાથી રુક્મિણીએ બોધ પામી નિશ્ચય કર્યો કે આ સર્વ જિતેદ્વિય મહાત્મા કોઈ કાળે ચલિત થનાર નથી. લોહ-પથ્થર પિગળાવવા સુલભ છે, પણ આ મહાપવિત્ર સાધુ શ્રી વજસ્વામીને પિગળાવવા સંબંધીની આશા નિરથીક તો છે, પણ તીવ્યતી અધોગતિના કારણદ્વાપ છે.

એમ સુવિશારી તે રુક્મિણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્રેત્વ વાપરી, ચારિત્ર ગ્રહણ કર્યું. મન, વચન, કાયાને અનેક પ્રકારે દમન કરી

આત્માર્થ સાધ્યો. આને જ્ઞાનીઓ સંવર કહે છે. સંવર એ આત્મહિત પામવા પરમ સાધન છે.

॥ ઇતિ શ્રી શાંતસુધારસગેયકાવ્યે સંવરભાવનાવિભાવનો  
નામ અષ્ટમ: પ્રકાશ: ॥

ઇતિ શ્રી શાંત સુધારસ નામના દ્વારાબદ્ધ કાવ્યમાં  
સંવર ભાવના નામનો આઠમો પ્રકાશ સમાપ્ત.



ॐ

## નિર્જરા ભાવના

એક છતાં અનેક કેમ ?

॥ ઇંદ્રવજ્રા વૃત્તં ॥

યર્જિનિરા દ્વારશથા નિરુક્તતા ।  
 તદ્ દ્વારશાનાં તપસાં વિભેદાત् ॥  
 હેતુપ્રભેદાદિહ કાર્યભેદઃ ।  
 સ્વાતંત્ર્યતસ્ત્વેકવિધૈવ સા સ્યાત् ॥૧॥

અર્થ : નિર્જરા પોતે તો એક જ પ્રકારની છે; છતાં તેના બાર ભેદ કર્યા, તે તેનાં કારણ તપના બાર ભેદ છે તેને લઈને; કારણ કે કારણભેદ કાર્યભેદ થાય એ રીતિ છે. એટલે કારણની અપેક્ષા વિના સ્વતંત્રપણો જો લઈએ તો નિર્જરા એક જ પ્રકારની છે; બાકી તેના કારણ તપને લઈ તે બાર પ્રકારની છે. ૧

કારણભેદ કાર્યભેદ :

॥ અનુષ્ટુપ્ વૃત્તં ॥

કાષ્ઠોપલાદિસ્ત્પાણાં નિદાનાનાં વિભેદતઃ ।  
 વહિર્યથૈકરૂપોऽપિ પૃથગ્રુ વિષયતે ॥ ૨ ॥

અર્થ : જેમ અખિની જાતે તો એક જ રૂપનો છે, પણ તે જેમાંથી ઉત્પત્ત થયેલ હોય તે કારણને લઈ જુદા જુદા પ્રકારનો કહેવાય છે. જેમ કે આ કાણનો અખિની, આ પાણાણનો અખિની હત્યાદિ. ૨

નિર્જરાપિ દ્વારશથા તપોભેદૈસ્તથોદિતા ।  
 કર્મનિર્જરણત્વા તુ સેકર્સપૈવ ચર્સુતઃ ॥૩॥

અર્થ : તેમ તપના ભેદને લઈ નિર્જરા પણ બાર પ્રકારની કહી છે; બાકી વાસ્તવિક રીતે કર્મ નિર્જરાને તો એકરૂપ જ છે. ૩

**તપ-વજ અને કર્મ પર્વત :**

॥ ઉષેદ્રવજા વૃત્તં ॥

નિકાચિતાનામણિ કર્મણાં યદ્વ ।

ગરીયસાં ભૂધરદુર્ધરાણાં ॥

વિભેદને વજમિવાતિતીવ્રં ।

નમોડસ્તુ તસ્મૈ તપસેડિભુતાય ॥૪॥

અર્થ : અહો ! તે અતિ તીવ્ર અદ્ભુત તપને મારો નમસ્કાર હો ! જેમ વજ દુર્ધર પર્વતોને ભેદી નાંખે છે તેમ પર્વત જેવાં દુર્ધર મોટા નિકાચિત-આકરાં કર્માને પણ એ ભેદી નાંખે છે; ક્ષીણ કરી નાંખે છે. જે ભોગવ્યા વિના છુટકો નથી, એવાં આકરાં કર્માને પણ તપ નિર્જરી નાંખે છે. ૪

॥ ઉપજાતિ વૃત્તં ॥

કિમુદ્યતે સત્તપસઃ પ્રભાવઃ ? ।

કઠોરકર્માર્જિતકિલ્બિષોડપિ ॥

દૃઢપ્રહારીવ નિહત્ય પાર્ય ।

યતોડપવર્ગ લભતોડચિરેણ ॥૫॥

અર્થ : અહો એ અદ્ભુત તપનો પ્રભાવ તે શું કહીએ ? અર્થાતું એ પ્રભાવ વર્ણવ્યો જાય એમ નથી. કેમ કે કઠોર કર્મને લઈ ધોર પાપના કરનારા પણ દૃઢપ્રહારીની પેઠે એ તપના પ્રભાવે પાપનો નાશ કરી અલ્ય વખતમાં મોક્ષ પામે છે. ૫

**દૃઢપ્રહારી કેમ કહેવાયો ?**

દૃઢપ્રહારી\*

કોઈ પ્રાણીનો પોતાના પુત્રને સમવ્યસનભક્ત જાણી પોતાના ધરમાંથી

\* શ્રીમદ્ રાજચંદ્ર કૃત ભાવનાબોધ - નિર્જરાભાવના

કાઢી મૂક્યો, તે ત્યાંથી નીકળી પડ્યો અને લઈને એક તસ્કરમંણીથી સ્નેહસંબંધ જોડ્યો. તે મંડળના અગ્રેસરે તેને સ્વકામનો પરાકમી જાણી પુત્ર કરીને સ્થાપ્યો, એ વિપ્રપુત્ર દુષ્ટ દમન કરવામાં દૃઢપ્રથારી જણાયો, એ ઉપરથી અનું ઉપનામ દૃઢપ્રથારી કરીને સ્થાપ્યું.

### ભાસ્યાને ઘેર ક્ષીરનું ભોજન, અને દૃઢપ્રથારીની ચાર હત્યા :

તે દૃઢપ્રથારી તસ્કરમાં અગ્રેસર થયો, નગર-આમ ભાંગવામાં બળવાન થયો; છાતી ભારે થઈ; તેણે ઘણા પ્રાણીઓના પ્રાણ લીધા. એક વેળા પોતાના બધા સાથીઓને લઈને તેણે એક મોહું નગર લુંટ્યું. ત્યાં દૃઢપ્રથારી એક ભાસ્યાને ઘેર બેઠો હતો. તે વિપ્રને ત્યાં ઘણા પ્રેમ ભાવથી ક્ષીરભોજન કર્યું હતું. તે ક્ષીરભોજનના ભોજનને વિપ્રના આશાભર્યા બાળકડાં વિટાઈ વખ્યાં હતાં. દૃઢપ્રથારી એ ભોજનને અડકવા માંડ્યો એટલે ભાસ્યાનો કહ્યું : અરે મૂર્ખના સરદાર ! એ અભડાવ કાં ? અમારે પછી કામ નહિ આવે, એટલું એ તું સમજતો નથી ? દૃઢપ્રથારીને આ વચ્ચનથી પ્રચંડ કોધ વ્યાપ્યો, અને તેણે તે દીન સ્ત્રીને કાળધર્મ પમાડી, - મારી નાંખી. નહાતો નહાતો ભાસ્યા સ્ત્રીને સહાય આપવા દોડ્યો, તેને પણ તેણે પરબ્રહ્મ પ્રાપ્ત કર્યો.

### દૃઢપ્રથારીનો નિર્વદ :

એટલામાં ધરમાંથી ગાય દોડતી આવી અને તેણે શીંગડાં વતી દૃઢપ્રથારીને મારવા માંડ્યો, તે મહાદુષે તે ગાયના પણ તાડના વડે પ્રાણ લીધા. એ ગાયના પેટમાંથી એક વાછરહું નીકળી પડ્યું, એને તરફડતું દેખી દૃઢપ્રથારીને કંપારી છૂટી.

### વેરાણ્ય-દીક્ષા :

દૃઢપ્રથારીના મનમાં બહુ બહુ પશ્ચાત્તાપ થયો. અહો ! મને વિકાર છે ! મેં મહાધોર હિંસાઓ કરી. અરે ! મારો એ મહાપાપોથી ક્યારે છૂટકારો થશે ? ખરે ! આત્મસાર્થક સાધ્યામાં જ શ્રેય છે. એવી ઉત્તમ ભાવનાએ તેણે પંચમુદ્રિ કેશલુંચન કર્યું. નગરની ભાંગોળે આવી ઉત્ત્ર કાયોત્સર્જ રહ્યો.

## અપૂર્વ ઉપશમ ભાવ :

આજા નગરને પૂર્વે સંતાપરૂપ થયા હતા, એથી લોકોએ તેમને બહુ પ્રકારે સંતાપવા માંડ્યા. જતાં આવતાનાં ઘૂળાઢેણાં, પથર, હીટાળા અને તરવારની મુષ્ઠિકા વડે તેને અતિ સંતાપ પ્રાપ્ત થયો. ત્યાં આગળ લોકસમુદ્દાયે દોઢ માસ સુધી તેને પરાભવ્યા. પછી થાક્યા અને તેને મૂકી દીધા. દૃઢમણારી ત્યાંથી કાયોત્સર્ગ પાળી બીજી ભાગોળે એવા જ ઉગ્ર કાયોત્સર્ગથી રહ્યા. તે દિશાના લોકોએ પણ એમ જ પરાભવ્યા. દોઢ મહિનો છંછેડી મૂકી દીધા. ત્યાંથી કાઉસર્ગ પાળી દૃઢમણારી ત્રીજી પોળે રહ્યા. તેઓએ પણ મહાપરાભવ આપ્યો. ત્યાંથી દોઢ મહિને મૂકી દીધાથી ચોથી પોળે દોઢ માસ સુધી રહ્યા. ત્યાં અનેક પ્રકારના પરિષહને સહન કરીને તે ક્ષમાધર રહ્યા.

## કર્મની નિર્જરા કેવલ્યપ્રાપ્તિ :

ઇછે માસે અનંત કર્મ સમુદ્દરને ખાળી વિશોધી-વિશોધીને તે કર્મરહિત થયા. સર્વ પ્રકારના ભમત્વનો તેમણે ત્યાગ કર્યો. અનુપમ કેવલ્યજ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખમાં વિરાજિત થયા. તપનો, ક્ષમાનો, કાયોત્સર્ગનો પ્રભાવ !!

## તપરૂપી તાપ – આત્માની વિશુદ્ધિ :

યથા સુવર્ણસ્ય શુચિસ્વરૂપં ।  
 દીપઃ કૃશાનુઃ પ્રકાટીકરોતિ ।  
 તથાત્મનઃ કર્મરજો નિહત્ય ।  
 જ્યોતિસ્તપત્તદ્વિશદીકરોતિ ॥ ૬ ॥

અર્થ : જેમ બહુ આકરો અગ્નિ સોનાનું પવિત્ર સ્વરૂપ પ્રગટ કરે છે, તેમ કર્મરૂપી રજનો, મેલનો નાશ કરી આત્માની જ્યોતિ-આત્માનો પ્રકાશ તપ પ્રગટ કરે છે. સોનાને જેમ જેમ તાપમાં તપાવીએ, તેમ તેમ તે શુદ્ધ પવિત્ર કુંન થાય છે, તેવી જ રીતે આકરાં તપશ્વરણથી આત્મા વિશુદ્ધ-પવિત્ર-કર્મરહિત થાય છે; પ્રકાશ પામે છે. આવું અદ્ભુત તપનું પ્રબળ છે ૬

## તપનું માહાત્મ્ય :

॥ સ્થગ્રધરા વૃત્તં ॥

બાદ્યોનાભ્રંતરેણ પ્રથિતબહુભિદા જીયતે યેન શત્રુ-  
શ્રેણી બાદ્યાંતરંગા ભરતનૃપતિવત્ ભાવલબ્ધદૃઢિસ્ના ॥  
યમસત્ત્વાદુભ્રવિયુઃ ગ્રકટિતવિભવા લથ્યઃ સિદ્ધયશ્ચ ।  
વંદે સ્વર્ગાર્પિકર્ષણપદ્દુ સતતં તત્ત્વો વિશ્વવંદ્ય ॥ ૭ ॥

**અર્થ :** બાદ્ય અને અભ્રંતર એવા એ તપના બહુ ભેદ છે. એ તપ પર ટેઢ ભાવ રાખનારા ભરતરાજની પેઠે પોતાના બાદ્ય અને અંતરંગ વૈરીઓના સમૂહ પર વિજય મેળવે છે. વળી એ તપના પ્રભાવે વૈભવઔશ્ચર્ય પ્રગટ કરનારી લભ્યાઓ, સિદ્ધિઓ પ્રગટ થાય છે. તથા એ તપ સ્વર્ગ અને મોક્ષસુખ આપવામાં કુશળ છે. આમ એ તપ આખા જગતને વંદવા પૂજ્યવા યોગ્ય છે. તે તપને હું વંદું છું.

હવે આ નવમી ભાવનાનું અષ્ટાણિયું કહે છે :

॥ સારંગ રાગ-જિણાંદરાય શરણ તાહરે આચો રે... એ દેશી ॥

વિભાવય વિનય તપોમહિમાનં ॥ ધ્રુવપદં ॥  
બહુભવસંચિતદુષ્કૃતમ્પુના ॥  
લભતે લઘુ લઘિમાનં ॥ વિ૦ ૧ ॥

**અર્થ :** હે વિનય ! તું તપનો મહિમા વિચાર, ઘણા ભવનું એકહું થયેલું પાપ એ તપથી તરત જ ઓછું થઈ જઈ નાશ પામે છે. એવા એ તપનો મહિમા હે સુવિનીત જીવ ! તું તારા ધ્રદ્યમાં ચિંતવ. ૧

## તપરૂપી વાયરો - કર્મરૂપી રજ ઊડી જાય :

યાતિ ઘનાષિ ઘનાઘનપટલી, ।

ખરપવનેન વિરામં ॥

ભજતિ તથા તપસા દુરિતાલી, ।

ક્ષણભંગુરુપરિણામ ॥ વિ૦ ૨ ॥

અર્થ : જેમ ભારે વાયરાથી ભેગાં થબેલાં મોટાં વાદળાં પણ  
વીજરાઈ જય છે તેમ આ તપના પ્રભાવે એકઠાં થબેલાં મોટાં પાપો પણ  
કાણવારમાં નાશ પામે છે. ૨

### તપનો ભહિમા :

વાંચિતમાકર્ષતિ દૂરાદપિ ।  
રિપુમપિ બ્રજતિ વયર્ય ॥  
તપ ઇદમાશ્રય નિર્મલભાવા- ।  
દાગમપરમહરસ્ય ॥ વિંદો ૩ ॥

અર્થ : એ તપ દૂરથી પણ ઈચ્છિત વસ્તુને પાસે આણી આપે છે;  
એ તપના પ્રભાવે શત્રુ પણ મિત્ર થાય છે; શત્રુ પણ મિત્રનું કાર્ય સારે  
છે; શત્રુએ આપણને પ્રતિકૂળ અથવા અણાડિતકારી ધારી કરેલું કામ પણ  
એ તપને લઈ અનુકૂળ અથવા ડિતકર થઈ પડે છે; એ તપ આગમનું  
પરમ રહસ્ય છે; આગમનો મોટો એ સાર છે. પરાપૂર્વથી ઉત્તરોત્તર  
ઉત્તરી આવેલું કર્મનાશના હેતુરૂપ એ મોટું રહસ્ય છે. તે તપનો  
નિર્મલભાવે તું આશ્રય કર. હે વિનય ! આવા ભહિમાવાળા તપને તારા  
હદ્યમાં ચિંતવ; અને તે તપ આચર. ૩

અનશનમૂનોદરતાં વૃત્તિ-  
હાસં રસપરિહારં ।  
ભજ સાંલીન્ય કાયક્લેશં,  
તપ ઇતિ બાહ્યમુદારં ॥ વિંદો ૪ ॥

અર્થ : એ તપના આ છ બાબ્ય બેદ છે.

૧. અનશન : ભોજનનો ત્યાગ. ઉપવાસ, છષ્ટ, એકાશન, આંબિલ  
ઇત્યાદિ.

૨. ઊણોદરી : ઓદ્ધું જમવું તે. ખાવામાં જોઈએ તે કરતાં ઓછા  
કવલ લેવા તે.

૩. વૃત્તિધ્રાસ : વૃત્તિસંક્ષેપ, ખાનપાન, સ્વાદિષ્ટ ભોજન પ્રતિ વૃત્તિ  
જતી અટકાવવી, ઓછી કરવી.

૪. રસ પરિહાર : રસગારવ ત્યજવો. સ્વાહિયા ન થવું. આ સરસ છે અને આ નીરસ છે, એમ કર્યા વિના કૃધાતૃમિ અર્થે જમી લેવું.

૫. સંલીનતા : અંગોપાંગ સંકોચ્યો સૂવું, બેસવું, એક જ આસને બેસી રહેવું, આસન જય કરવો.

૬. કાયાકલેશ : કાયાની કસોટી કરવી, એને કલેશ આપવો.

આમ ઉદાર તપના છ બાધ્ય ભેદ છે. ૪

હવે આંતર ભેદ કહે છે.

પ્રાયશ્ચિત્ત વૈયાવૃત્તં  
સ્વાધ્યાયં વિનયં ચ ॥  
કાયોત્ત્સર્ગ શુદ્ધ ધ્યાન-  
માભ્યંતરમિદમંચ ॥ વિઠ ૫ ॥

અર્થ : (૧) પ્રાયશ્ચિત્ત : કરેલાં પાપોનો પશ્ચાત્તાપ અને તે ફરી ન થાય એવું ચિત્તવન. થાંદે અપરાધનો દડ.

(૨) વૈયાવૃત્તં : રોગી, જ્લાન, બાલ, ગુરુ, આર્ત આદિની સેવા ચાકરી. તેઓનાં દુઃખ દૂર થાય, તેઓનાં દુઃખ રોગ વિસારે પડે અથવા તેમાં તેમને દ્વિલાસો-શાંતિ મળે, તેમને શાત્રા ઊપજે એ વગેરે રીતે તેઓના તરફ વર્તન-એ વૈયાવૃત્તં.

(૩) સ્વાધ્યાય : સજાય. પોતાનું જાણપણું વધે, આત્માની ઓળખાણ થાય, આત્મજ્ઞાન થાય, - એ પ્રકારે સત્થાસ્ત્રનું વાંચન-મનન-પઠન. સત્પુરુષોનાં ચરિત્રોનું ચિત્તવન, તેઓના ગુણગ્રામ કરવા, સત્થાસ્ત્રનું વાંચવું, આત્મકલ્યાણના પ્રશ્નોનું વિનયપૂર્વક સદ્ગુરુને પૂછવું; ન સમજાતું હોય તે વિનયપૂર્વક પૂછવું; વાચેલું-ગોખેલું-સમજાયલું ફરી ફરી વિચારી જવું; સંસારના અનિત્યાદિ ભાવ ફરી ફરી ચિત્તવા, વૈરાગ્યની ભાવનાઓ ભાવવી, ધર્મકથા કરવી ને સાંભળવી, એ વગેરે સ્વાધ્યાયના પ્રકાર છે.

(૪) વિનય : ગુણીનો, જ્ઞાનીનો, શુરુનો, વડીલનો, યોગ્ય પુરુષનો વિનય કરવો. તે પાસે નમ્ર થવું; આજાંકિત થવું; માન ત્યજ દેવું,

તેઓના શુષણું બહુમાન કરી પોતાના ગુડ્ઝ તેઓની અપેક્ષાએ કંઈ નથી,  
એમ ચિંતવનું, એમ વર્તવું - તે વિનય.

(૫) કાયોત્સર્ગ : કાયા ઉપરનો મોહ ઉતારી ઘડીભર આત્માને  
વિષે સ્થિર થવું; આત્માનો વિચાર કરવો; અથવા આત્માર્થ જેનો સર્યો  
છે એવા મહાપુરુષોનું સ્મરણ કરવું; તેઓનાં સ્તવન મનમાં ગાવાં,  
નવકર-લોભસ્સનું ચિંતવન પદ્ધન કરવું અથવા પોતે કરેલાં દોપો  
ફદ્યમાં વિચારી જઈ તેની પશ્ચાત્પરૂપક ક્ષમા ચાહવી ઈત્યાદિ  
કાયોત્સર્ગ.

(૬) ધ્યાન : આત્માનું અથવા સદગુરુનું, તીર્થકર દેવનું, ધર્મનું - ચિત્ત  
વિષે બેકાશ્તાસી વ્યાવવું તે ધ્યાન.

આ તપના છ અભ્યંતર ભેટ જાણવા. હે વિનય ! આ તપનો  
મહિમા તું વિચાર. ૫

**મનુષ્યદેહ-માનસ આત્મા-હંસ તપ-આનંદ :**

શમયતિ તાપં ગમયતિ પાપં ।  
રમયતિ માનસહંસ ॥  
હરતિ વિમોહં દૂરારોહં ।  
તપ ઇતિ વિગતાશંસ ॥ વિંદો ૬ ॥

અર્થ : એ તપ તાપને શમાવે છે, સંસારજન્ય તાપની શાંતિ કરે છે,  
પાપનો નાશ કરે છે; મનરૂપી હંસને આનંદ આપે છે, અથવા મનુષ્ય  
દેહરૂપી માનસ સરોવરમાં રહેલા આત્મારૂપી હંસને આનંદ આપે છે,  
અને બીજી રીતે દૂર કરવો અશક્ય એવા વિભાવિક મોહનો તપ નાશ  
કરે છે. આવું તપ અદ્ભુત છે. હે વિનય ! તું એ તપનું, એના  
મહિમાનું ચિંતવન કર. ૬

**તપ ચિંતામણિ :**

સંયમકમલાકાર્મણમુજ્વલ-  
શિવસુખસત્યકારં ॥

ચિત્તિતચિત્તામણિપારાધ્ય  
તપ ઇહ વારંવારં ॥ વિંદો ૭ ॥

અર્થ : વળી એ તપ સંયમરૂપ લક્ષ્મીને વશ કરવાની વિદ્યા છે; ઉજ્જ્વલ એવાં મોક્ષસુખને આપવા સમર્થ છે; એ તપથી મોક્ષસુખ ચોક્કસ મળે છે; એ તપ ઈચ્છિત-ચિત્તિત વસ્તુ આપવામાં ચિત્તામણિ સમાન છે; અર્થાત્ ચિત્તામણિ જેમ ધારેલું ફળ આપે છે તેમ એ તપ આદરવાથી ધારેલ સિદ્ધ થાય છે; આવા પ્રભાવવાળા તપને આ જગતમાં હે વિનય ! તું વારંવાર અંગીકાર કર. એ તપનો મહિમા હે વિનય ! તું ચિત્તવ. ૭

**કર્મ રોગ, તપ ઔષધ, શાની વૈદ્ય, આજ્ઞા અનુપાન :**

કર્મગાદૌષધમિદમસ્ય ચ,  
જિનપતિમતમનુપાન ॥  
વિનય સમાચાર સોષ્યનિધાન,  
શાંતસુધારસપાન ॥ વિંદો ૮ ॥

અર્થ : હે વિનય ! એ તપ કર્મરૂપી રોગનું અમોદ ઔષધ છે; કર્મરૂપી રોગ ટાળવામાં આ તપ-ઔષધ નિષ્ઠળ જતું નથી; શ્રી જિનવર દેવે પ્રગટ કરેલ ભત એ તપ ઔષધનું અનુપાન છે. અર્થાત્ જેમ કુશળ વૈદ્ય બતાવેલા અનુપાન પ્રમાણે ઔષધ લેતાં રોગ દૂર થાય તેમ શ્રી જિનેશ્વર ભગવાને પ્રરૂપેલ રહ્યે, તે ભતે આ તપશર્યા આચરતાં કર્મરૂપી રોગ ટળે જ, અજ્ઞાન રૂપે, સ્વચ્છંદે, પોતાની ભતિએ તપ કરતાં કર્મરોગ ન જાય. સારા કુશળ વૈદ્યની સલાહ વિના જેમ સ્વમતિએ ઔષધ લેતાં રોગ દૂર ન થાય, પણ ઊલટો નવો વિકાર પેદા થાય, તેમ કુશળ વૈદ્યરૂપ શ્રી જિનેશ્વર ભગવાનના ભતની નિશા વિના સ્વમતે તપ કરવાથી, અજ્ઞાન તપ કરવાથી કર્મ ક્ષીણ ન થાય, પણ ઊલટાં નવાં પેદા થાય; માટે તપરૂપી ઔષધ ગ્રહણ કરવું, પણ તે શ્રી જિનેશ્વરના ભતરૂપ અનુપાન સાથે. એમ લેવાય તો જ કર્મરોગ નાશ પામે.

**અજ્ઞાન તપ શાતા આપે, ભવ ન છેટે :**

અજ્ઞાન તપશર્યાદી કર્મ ક્ષીણ થતાં નથી, પરંતુ નવાં પેદા થાય છે.

ભલે શુભ ગતિ કે વૈભવ એનાં ફળરૂપે પ્રામ થાય; પણ એ પરિણામે નિર્જરાના હેતુ નથી, માટે જ્ઞાનીની આજ્ઞાએ, તપશ્ચર્યાએ આચરતી ઘટે છે. તપ ન આચરવું એમ કહેવાનું નથી, તપશ્ચર્યાની માં બહુ બહુ જરૂર છે, એના વિના તો કોઈ કાળે કર્મ ક્ષીણ થવાનાં નથી. જેટલા મહાપુરુષો સિદ્ધિ પાખ્યા, તે બધા તપના બળે કર્મ નિર્જરીને જ માટે તપશ્ચર્યા તો અવશ્ય કરવાની છે; પણ તે સદગુરુની આજ્ઞાએ; શ્રી જિનેશ્વર ભગવાનના મત પ્રમાણે સુખ, ઋષિ આદિ પામવા-મેળવવાની વાંચણ-આજ્ઞાએ નહિં; પણ કેવળ તપશ્ચર્યા ખાતર જ તપ કર્તવ્ય છે.

### નિર્જમ તપ :

કશી ફળની આજા-ઈચ્છા વિના તપ કર્તવ્ય છે. શ્રી જિનેશ્વર ભગવાનની એ જ આજ્ઞા છે, એમનો એ જ મત છે કે આજા-ઈચ્છા વિના તપ કરવું આથી કર્મભળ ટળી આત્મજ્ઞાન થાય છે. શ્રી સદગુરુની આજ્ઞારૂપ અનુપાન સાથે જ તપ ઔષધ લેતાં કર્મરોગ ટળે છે, એમ કહેવાનો આ હેતુ છે.

“આણાએ ધર્મો આણાએ તતો.”

— આર્ધવચન

આજ્ઞાએ ધર્મ, આજ્ઞાએ તપ. તો જે પ્રકારે, જે હેતુએ શ્રી જિનવર દેવે તપશ્ચર્યા કરવાની આજ્ઞા કરી છે તે પ્રકારે તે હેતુએ એ આરાધતાં કલ્યાણ થાય છે. કર્મરોગ ટળે છે. હે વિનય ! તું સુખનો ભંડાર એવું આ તપ આચર. તું શાંતસુધારસના પાનરૂપ આ તપ આદર. હે વિનય ! તું તપનો મહિમા વિચાર. ૮

॥ ઇતિ શ્રી શાંતસુધારસગેયકાવ્યે નિર્જરાભાવના વિભાવનો નામ  
નવમઃ પ્રકાશઃ ॥

ઇતિ શ્રી શાંત સુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં  
નિર્જરા ભાવના નામનો નવમો પ્રકાશ સમાપ્ત.



ॐ

## धर्मभावना

धर्मना चार प्रकार :

॥ उपजाति वृत्तं ॥

दानं च शीलं च तपश्च भावो ।  
धर्मशतुर्धा जिनबांधवेन ॥  
निरुपितो यो जगतां हिताय ।  
स मानसे मे समतामजस्त्रं ॥

अर्थ : जिनबांधव श्री तीर्थकर देवे धान-शील-तप अने भाव ए  
चार प्रकारनो धर्म जगतना हित अर्थ उपदेश्यो छे. ते धर्म मारा  
हृष्यमां निरंतर रहो अने भने आनंद आपो. श्री जिनेन्द्र देवे ए धर्म  
प्रश्रुत्यो, तेथी भने बहु आनंद थाय छे. जे धर्मथी जगतनु हित थाय  
एम छे, जे धर्म जगतना बंधु श्री तीर्थकर देवे उपदेश्यो अने जे धर्म  
तेना उपदेशा सर्वक्षण वीतराग परमात्मा होवाथी निःसंशय कल्याणकरी  
छे, ते धर्म निरंतर मारा हृष्यमां वास करो. १

ए धर्मना भुज्य बीज प्रकार कहे छे.

॥ इंद्रवज्ञा वृत्तं ॥

सत्यक्षमामार्दवशौचसंग-  
त्यागार्जव ब्रह्म विमुक्तिं युक्तिः ॥  
यः संयमः किंच ततोपगृह ।  
शारित्रधर्मो दशधायमुक्तः ॥ २ ॥

अर्थ : श्री जिनवर देवे उपदेशेवा धर्मना ए प्रकार छे. (१)  
शारित्र धर्म अने (२) श्रुत धर्म. लेमां शारित्र धर्म ए आ दश प्रकारनो

છે. (૧) સત્ય. (૨) ક્ષમા. (૩) માર્દવ (મૃહૃતા) વિનય, નિર્મનીપણું.  
 (૪) શૌચ. (૫) સંગત્યાગ, (૬) આર્જવ (સરળતા, ઋજુતા,  
 નિર્જપટપણું.) (૭) બ્રહ્મચર્ય (૮) વિમુક્તિ અર્થાતું વિશેષ પ્રકારે  
 પરિગ્રહથી છૂટવું તે, નિર્લોભતા. (૯) સંયમ અને (૧૦) અંકિચનત્વ  
 (પરિગ્રહરહિત અવસ્થા.) ચારિન ધર્મના આ દશ પ્રકાર છે.

(૧) સત્ય - મન, વચન, કાયાએ કરી,

૧. સત્ય ચિંતન	{	પોતાને અને
૨. સત્ય વચન		પરને હિત
૩. સત્ય વર્તન		ધ્યાય તેમ.

સત્ય વદવું એ સામાને કઠોર ન લાગે એવી  
 પ્રિય મૃદુ ભાષામાં.

વસ્તુની જે પ્રકારે સ્થિતિ હોય તે જ પ્રકારે,  
 તેમાં લેશ માત્ર ફેરફાર કર્યા વિના,

જે વર્તન તે સત્ય વર્તન,  
 જે વચન તે સત્ય વચન,  
 જે ચિંતન તે સત્ય ચિંતન.

(૨) ક્ષમા - કોઈ કખાયનો ત્યાગ, ઉપશમ ભાવ, અપરાધી પ્રતિ  
 પણ કોઈ ન આણાવો.

(૩) માર્દવ - વિનય, નિર્મનીપણું, મૃહૃતા.

(૪) શૌચ - તન, મનની, દ્રવ્ય-ભાવની શુદ્ધિ - પવિત્રતા.

૧ પવિત્ર વિચાર.

૨ પવિત્ર ઉચ્ચાર.

૩ પવિત્ર આચાર.

(૫) સંગત્યાગ - કોઈ વસ્તુ પ્રતિ લેશ માત્ર આસક્તિ ન રોંખવી.  
 આસંગો વર્જ દેવા તે. નિર્બિપ રહેવું તે. કુસંગ વર્જવો. સત્સંગ કરવો.

(૬) આર્જવ - ઋજુતા, સરળતા, નિષ્કપટ ભાવ, માણા-કષાયનો ત્યાગ. કોઈને છેતરવું નહિ, અસત્ય આચરવું નહિ, આમળો રાખવો નહિ. વક્તા છાંડવી.

(૭) ભ્રદ્ધર્થ - શીલનું પાલન, કામનો જ્ય, દ્રવ્યભાવે મૈથુનનો ત્યાગ.

(૮) વિમુક્તિ - પરિગ્રહ મૂળજથી વિશેષપણે છૂટવું તે. નિર્લોભપણું.

(૯) સંયમ - ઈદ્રિયો ઉપર, મન ઉપર સભ્યકુ પ્રકારે કાળૂ રાખવો.

(૧૦) અક્રિયનતા - નિષ્પરિગ્રહપણું. પરિગ્રહની મૂળજનો ત્યાગ. પરિગ્રહનો ત્યાગ.

આ દશ પ્રકાર ચારિત્ર ધર્મના છે. તે ચારિત્ર ધર્મ આરાધવાથી અનંત કર્મવર્ગણા કીણ કરી જીવ સ્વસ્વરૂપને પામે છે. ૨

### ધર્મનું માહાત્મ્ય :

એ ધર્મનો મહિમા બતાવે છે.

યस્ય પ્રભાવાદિહ પુષ્પદંતૌ ।  
વિશ્વોપકારાય સદૌદ્વૈતે ॥  
ગ્રીષ્મોવ્યભીજા મુદિતસ્તડિલ્વાન् ।  
કાલે સમાશવાસયતિ ક્ષિતિં ચ ॥ ૩ ॥

અર્થ : એ ધર્મના પ્રભાવે કરી આ જગતમાં સૂર્ય-ચંદ્ર પણ જગતના ઉપકાર અર્થે હમેશા ઊરે છે. ઉનાળાની ઋતુમાં અત્યંત તમ થયેલી જમીનને વષાંત્રિઃતુમાં મેઘ વષાંતિ કરી ઠંડી કરે છે. ૩

વળી -

### અધર્મના અનર્થ :

ઉલ્લોલકલોલકલાવિલાસે-  
નાસ્તાવયયંબુનિધિઃ ક્ષિતિં યત્ ॥  
નાસ્તાંતિ યદ્ વ્યાઘ્રમરુદ્વાદ્ ।  
ધર્મસ્ય સર્વાચ્યનુભાવ એષઃ ॥ ૪ ॥

અર્થ : સમુદ્ર મોટાં મોજાંએ કરી પૃથ્વીને બૂડાવતો નથી; અને વ્યાપ્ત કે પવન કે દાવાનળ કોઈને મારતા નથી એવો ધર્મનો પ્રભાવ છે. અર્થાત્ ધર્મના પ્રભાવે સમુદ્ર પોતાની ભર્યાદિ છોડતો નથી; ધર્મના જ પ્રભાવે જીવો હિસ્ક જીવોથી - વંટોળિયા આદિ પવનના તોકાનથી, દાવાનળ આદિથી બચી જાય છે. અધર્મનો પ્રચાર થાય છે ત્યારે જીવો તાપથી, રૂખથી, કુધાથી આદુણવ્યાકુળ થાય છે. અનાવૃષ્ટિ થાય છે; કંઈ તો અતિવૃષ્ટિ થાય છે; દુર્ભિક્ષ થાય છે; મારી મર્ક્ઝી આદિ પ્રાણધાતક રોગોના ઉપદ્રવ થાય છે; ઉલ્કાપાત થાય છે; ભૂકુંપ થાય છે; દાવાનળ પ્રજળો છે અને અનેક જીવોનો સંહાર થઈ જાય છે. ભયંકર વાવોજાં, વંટોળિયા, પવનનાં તોકાન થાય છે; સમુદ્ર પણ પૃથ્વી ઉપર આગળ ધર્મી આવે છે, અને એક જ મોજાંએ આસપાસના પ્રદેશને જળસમાચિ આપે છે; જંગલથય થાય છે, હત્યાદિ અધર્મના ફેલાવાનાં ફળ છે.

### પંચમ કાળ સાક્ષી :

આ પંચમકાળ એના પ્રત્યક્ષ પુરાવારૂપ છે. જેમ જેમ અધર્મ આચાર, વિચાર, ઉચ્ચારનો પ્રસાર થતો જાય છે તેમ તેમ લોકો દુઃખ, દારિદ્ર્ય, રોગથી વિશેષ વિશેષ પીડાતા પ્રતિદિવસ આપણે જોઈએ છીએ. આવા ભયંકર પ્રસંગોમાં પણ, અર્થાત્ દેશ પર દુઃખ, દારિદ્ર્ય, દાવાનળ, મર્ક્ઝી, આદિનાં સંકટો-ઉપદ્રવો આવ્યે સતે ધર્મી જીવો સુખી છે. ધર્મી જીવોને ધર્મ ગમે તેવા સંકટમાં સહાયક છે, આ નિર્વિવાદ વાત છે. આવો ધર્મનો મોટો મહિમા છે. તે ધર્મ હે ભવ્યો ! તમે આચરો, સુખી થાઓ અને બીજાને સુખી કરો. ૪

ધર્મનો વિશેષ મહિમા બતાવે છે.

“ધર્મે જ્ય પાપે ક્ષય.”

॥ શાર્દૂલવિક્રીડિત વૃત્ત ॥

યस્મિનેવ પિતા હિતાય યતતે ભ્રાતા ચ માતા સુત: ।

સૈન્ય દૈન્યમુપैતિ ચાપચપલ યત્રાફલ દોર્વલ ॥

तस्मिन्कष्टदशाविपाकसमये धर्मस्तु संवर्गितः ।  
सज्जः सज्जन एष सर्वजगतस्त्राणाय बद्धोधमः ॥ ५ ॥

**अर्थ :** पिता, माता, भाई, पुत्र आदि आपणा हितने अर्थे उद्यम करे छे, ते धर्मने ज लहिने. धनुष्ठना योगे चपल थयेलुं अवूं जे जबुं लक्ष्यर ते पश्च आवीने दीनता धरे छे, ते धर्मनुं ज इण. वणी भुजाभण ज्यारे नाश पामे छे, अेवी कष्ट अवस्थाना परिणाम काणे पश्च आ धर्म ज मित्र समान थाय छे. आम आ धर्मदृप सज्जन आपा जगतना रक्षण अर्थे सज्ज थई उद्यम करी रह्यो छे. आ देखीती वात छे के अधर्मनो उद्य थये माता, पिता, पुत्र, भाई आदि वैरीनुं काम सारे छे, अने अङ्गाहित चितवे छे, अङ्गाहित करे छे. आ वर्तमान काणमां आवा दाखला शोधवा जवुं पडे अेम नथी; माटे धर्मनुं आराधन परम हितकरे छे. ५

**धर्मना आधारे जगत शोभे छे :**

त्रैलोक्यं सच्चाचरं विजयते यस्य प्रसादादिदं ।  
योत्रामुत्र हितावहस्तनुभृतां सर्वार्थसिद्धिप्रदः ॥  
येनानर्थकदर्थना निजमहस्सामर्थ्यतो व्यर्थिता ।  
तस्मै कारुणिकाय धर्मविभवे भवित्प्रणामोऽस्तु मे ॥ ६ ॥

**अर्थ :** ऐ धर्मना ज प्रसाद वडे करी आ स्थावर जंगभमय त्राण लोक, आ सच्चाचर विश्व शोभी रह्युं छे. ऐ धर्म ज आ लोक तथा परलोकने विषे प्राणीओनुं हित करे छे. अने ऐ ज सर्व अर्थनी सिद्धि आपे छे; छलोनां सर्व कार्यो सिद्ध करे छे.

**धर्म विभु :**

ऐ धर्म ज पोताना तेजबणे करी पापदृप विटंबणानो नाश करी नाख्यो छे. आवो जे द्यावंत धर्मदृप विभु-प्रभू तेने भारा भजित्वावे नमस्कार हो ! ६

ધર્મકલ્પ વૃક્ષનાં આ ફળ :

ધર્મ એ આ જગતમાં કલ્પવૃક્ષ છે -

॥ મંદાક્રાંતા વૃત્તં ॥

પ્રાજ્યં રાજ્યં સુભગદયિતા નંદના નંદનાનાં ।

રમ્ય સ્થય સરસકવિતા ચાતુરી સુખરત્નં ॥

નીરોગિલ્વ ગુણપરિચય: સજ્જનત્વં સુદુદ્રિ ।

કિન્તુ બ્રૂમ: ફલપરિણાતિ ધર્મકલ્પદુમસ્ય ॥ ૭ ॥

અર્થ : આ બધાં ધર્મરૂપી કલ્પવૃક્ષનાં ફળ છે. મોહુ રાજ્ય, સારાં ભાગ્યવાળી, સારાં વર્તનવાળી, અચલપ્રેમી સ્ત્રી, પુત્રોના પુત્રો, સુંદર કાંતિ, સરસ કવિત્વ, ચતુરાઈ, બીજાને સાંભળતાં મીઠાશ ઉપજાવે અને છાપ પાડે એવો સારો સ્વર, આરોગ્યતા, ગુણોનો પરિચય, સજ્જનત્વા, સારી બુદ્ધિ, ઈત્યાદિ કેટલુંક કહીયે ? આ બધાં ધર્મરૂપ કલ્પવૃક્ષનાં ફળ છે. ધર્મ વિના આવા જગતને વિષે સુખરૂપ ગણાતાં સાધનો ન મળે, માટે હે ભાવો ! એ ધર્મને સેવો. એ ધર્મ કલ્પવૃક્ષ ઈચ્છિત ફળ આપશે. ૭

ધર્મનું ધૈર્ય :

હવે આ દશમી ભાવનાનું અષ્ટાગિયું કહે છે :

॥ વસેત રાગ - ભવિ તમે વંદો રે  
ધીરવિજ્ય સૂર્યિસાયા... એ દેશી ॥

પાલય પાલય રે પાલય માં જિનધર્મ ॥

મંગલકમલાકેલિનિકેતન ।

કરુણાકેતન ધીર ॥

શિવસુખસાધન ભવભ્યવાધન ।

જગદાધાર ગંભીર ॥ પાઠ ૧ ॥

અર્થ : રે ! જિનધર્મ ! તું મારું રક્ષણ કર, રક્ષણ કર. તું માંગલિક-રૂપ લક્ષ્મીનું કીડાગૃહ છે, અર્થાત् તું જ્યાં હોય ત્યાં મંગલ લક્ષ્મી વત્તવે છે; તું કરુણાનું સ્થાનક છે, અર્થાત् તું જ્યાં હોય ત્યાં દ્યા, કરુણા,

અહિસા વર્તે છે; તું ધીર છે; તું મોકસુખનું સાધન છે; તું જ્વાલયનો નાશ કરનાર છે; તું જગતનો આધાર છે; અને પરમ ગંભીર છે, એવા હે જૈનધર્મ ! તું મારું રક્ષણ કર ! રક્ષણ કર !

ધર્મ ધીર છે, અર્થાત् ધીરજવંત છે, એમ બતાવ્યું તેનો હેતુ એ કે જગતમાં બીજી ડેટલીક એવી તાસુભીઓ રહેલી છે, કે એકવાર એનો અનાદર કરતાં ફરી એને મનાવવી બહુ મુશ્કેલ થઈ પડે છે, જ્યારે હે ધર્મ ! તું તો એવો ધીરજવાળો છે, કે કોઈ જીવ તારા પ્રતિપક્ષી અધર્મનો અનેકવાર આશ્રય કરી તારો અનાદર કરે, તો પણ ફરી એ જીવ તારે શરણે આવે ત્યારે તું શરણ આપી એનું કલ્યાણ કરે છે.

### ધર્મનું ગાંભીર્ય :

વળી હે ધર્મ ! તું અતિ ગંભીર છે. અર્થાત् જગતુમાં બીજી એવી વસ્તુઓ છે, કે જે પોતે કરેલો ઉપકાર ગાઈ બતાવે છે, પણ તું તો મોહું દિલ રાખી તારો આશ્રય કરનારનું મુંગે મોઢે શ્રેય કર્યે જાય છે.

એવા હે ગંભીર, શિવસુખના સાધનરૂપ પવિત્ર જૈનધર્મ ! તું મારું રક્ષણ કર. હું તારે શરણે આવ્યો છું. ૧

સિંહતિ પયસા જલધરપટલી ।

ભૂતલમમૃતમયેન ॥

સૂર્યચંદ્રમસાબુદ્યેતે ।

તવ મહિમાતિશયેન ॥ પાઠ ૨ ॥

**અર્થ :** જલધર અમૃતમય જળે કરી ભૂતળને સીયે છે અને સૂર્ય તથા ચંદ્ર ઉદ્ય પામે છે, તે બહું હે ધર્મ ! તારા મહિમાતિશયને લઈ. તું મારું રક્ષણ કર, રક્ષણ કર. ૨

નિરાલંબમિયમસદાધારા ।

તિષ્ઠતિ વસુધા યેન ॥

તં વિશ્વસ્થિતિમૂલસ્તંભ ।

ત્વાં સેવે વિનયેન ॥ પાઠ ૩ ॥

**અર્થ :** જેને કાંઈ આધાર નથી અને જે આલંબન વિનાની છે, એવી પૃથ્વી હે ધર્મ ! તારો વડે જ રહેલી છે, તો વિશ્વને, જગતને આધારરૂપ, ટેકાવી રાખનાર મૂલસ્તંભરૂપ એવા હે ધર્મ ! તને હું વિનય ભક્તિભાવે સેવું છું. વિશ્વના આધારરૂપ એવા હે ! પવિત્ર નિરાગીપ્રદૂપિત ધર્મ ! તારું મને શરણ હો ! તું મારું રક્ષણ કર. વિશ્વનો આધારભૂત એક ધર્મ જ છે. તે ધર્મ આત્મહિતેભીએ આદરવો યોગ્ય છે. ૩

**દાનશીલશુભભાવતપોમુખ-**  
**ચરિતાર્થીકૃતલોક ॥**  
**શરણસ્મરણકૃતામિહ ભવિના ।**  
**દૂરીકૃતભયશોક ॥ પાઠ ૪ ॥**

**અર્થ :** દાન, શીલ, તપ અને ભાવ જેમાં મુખ્ય છે, એવા હે ધર્મ ! તું લોકને ચરિતાર્થી કરે છે; અર્થાત્ લોકોને ચારિત્રનો ખપ કરાવે છે. વળી તારું જે સ્મરણ કરે છે અને તારો જે આશ્રય લે છે એવા ભવ્ય જીવોના ભય શોક દૂર થાય છે. આમ તું ચારિત્ર આપનારો અને ભય શોક નિવારનારો છે. હે જિનધર્મ ! તું મારું રક્ષણ કર. હું તારે શરણો આવ્યો છું. ૪

**ક્ષમાસત્યસંતોષદયાદિક-**  
**સુભગસકલપરિવાર ॥**  
**દેવાસુરનરપૂજિતશાસન ।**  
**કૃતબહુભવપરિહાર ॥ પાઠ ૫ ॥**

**અર્થ :** હે ! ધર્મ ! ક્ષમા, સત્ય, સંતોષ (પ્રામ વસ્તુમાં આનંદ) અને દયા આદિ તારો સમસ્ત પરિવાર સુંદર છે. હે ધર્મ ! દેવ, અસુર, નર તારી આજ્ઞા પૂજી રહ્યા છે અને એમ તારી આજ્ઞા આરાધી તેઓએ ઘણા ભવનો પરિહાર કર્યો છે. અર્થાત્ હે ધર્મ ! તારો આરાધનથી સુર, અસુર અને મનુષ્યોના ઘણા ભવ નાશ પામ્યા છે. એવો તારો મહિમા છે. એવા હે શ્રી જિનધર્મ ! મારું રક્ષણ કર ! રક્ષણ કર !! હું તારો આશ્રયે આવ્યો છું. ૫

## અબંધુનો બંધુ ધર્મ :

बंधुरबंधुजनस्य दिवानिश-  
 मसहायरय सहायः ॥  
 ग्राम्यति भीमे भवगहनेंगी ।  
 त्वां बांधवमपहाय ॥ पा० ૬ ॥

**અર્થ :** હે ધર્મ ! તું જેને બાંધવ નથી તેનો બંધુ છે; અને જેને કોઈ સહાય નથી તેને અહોરાત્ર સહાયરૂપ છે. અહો ! આવો તું અબંધુનો બંધુ અને અસહાયનો સહાય છતાં, તારો જેવો બાંધવ છાંડી જીવો ભયંકર ભવમાં ભટકે છે !

હે ભવ્ય જીવો ! જેને કોઈ બંધુ નથી, જેને કોઈ મદ્દગાર નથી, તેનો બંધુ તથા મદ્દગાર ધર્મ છે. આમ છતાં તેવા બંધુને છાંડી, તેનો લાભ નહિ લેતાં તમે ભયંકર ભવાટીમાં રહ્યાં કાં દુઃખ પામો છો ? એ ધર્મ આરાધો, ધર્મ આરાધો. હે ! પરમ બાંધવ જૈનધર્મ ! હું તારું શરણ ગ્રહું દ્યું. મારું રક્ષણ કર ! રક્ષણ કર ! ૬

## ધર્મના પ્રભાવ :

द्रंगति गहनं जलति कृशानुः ।  
 स्थलति जलधिरचिरेण ॥  
 तव कृपयाऽखिलकामितसिद्धि ।  
 -बहुना किंतु परेण ॥ पा० ૭ ॥

**અર્થ :** હે પરમ બાંધવ ધર્મ ! તારી કૃપાથી અરણ્ય મોટાં નજર થાય છે; જંગલમાં મંગળ થાય છે; પાવકનું પાણી થાય છે, અર્થાત્ અગ્નિ શીતળ થાય છે; જલ ત્યાં સ્થળ થાય છે; સમુદ્ર માર્ગ આપે છે; પ્રાણી માત્રની ઈષ્ટસિદ્ધિ થાય છે. આવો તારો મહિમા છે. હે પવિત્ર જૈનધર્મ ! તને વિશેષ શું કહું ? મારા પર કૃપા કર ! મારી રક્ષણ કર ! ૭

“મોટા જંગલમાંઠી મંગળ થશે, આધાર અધીનનો;”

આનંદોત્સવ આપશે અવનિમાં, સર્વધર્મ શ્રી જૈનનો.”

— પ્રકૃત

ધર્મ આ લોકે પરલોકે સુખી :

ઇહ યચ્છસિ સુખમુદિતદયાંગં ।  
પ્રેત્યોગાદિપદાનિ ॥  
ક્રમતો જ્ઞાનાદીનિ ચ વિતરસિ ।  
નિઃશ્રેયસસુખદાનિ ॥ પાઠ ૮ ॥

અર્થ : જેને દ્યાધર્મ સ્ફુર્યો છે, તેને હે ધર્મ ! તું આ ભવમાં જ સુખ આપે છે, અને પરલ્ભવે ઈદ્રાદિક પદવી આપે છે અને ક્રમે કરી મોક્ષસુખ આપનાર જ્ઞાનાદિ ગુજા આપે છે. આવો તારો પ્રભાવ છે. હે ધર્મ ! મારી રક્ષા કર ! રક્ષા કર ! ૮

શિવ ઉર્ભ્રનું ધર્મ સોપાન :

રાર્વતંત્રનવનીતસનાતન ।  
સિદ્ધિસદનસોપાન ॥  
જય જય વિનયવતાં પ્રતિલંબિત-  
શાંતસુધારસપાન ॥ પાઠ ૯ ॥

અર્થ : હે ધર્મ ! તું સનાતન-શાશ્વત છે. બધાં શાસ્ત્રોનાં ભાખણારૂપ-સારરૂપ છે. તું મોક્ષ આવાસ પર જ્યા નિસરહી સમાન છે. તું વિનયવંત શિષ્યોને શાંત સુધારસનું પાન કરાવે છે. એવા હે ધર્મ ! તું જયવંત વર્ત ! જયવંત વર્ત ! મને તારું શરણ હો ! તારી કૃપા હો ! તું મારું રક્ષણ કર ! ૯

॥ ઇતિ શ્રી શાંતસુધારસગોયકાવ્યે ધર્મ ભાવનાવિભાવનો નામ દશમઃ પ્રકાશः ॥

ઇતિ શ્રી શાંત સુધારસ નામના ઢાણભદ્ર કાવ્યમાં -

ધર્મભાવના નામનો દશમો પ્રકાશ સમાપ્ત.



ॐ

## लोकस्वरूप भावना।

राजलोकरूप पुरुषनुं वर्णन - ऐ ५०, कटि, कंदोरो :

॥ शालिनी वृत्त ॥

सप्ताधोधो विस्तृता याः पृथिव्य-  
श्छत्राकाराः संति रत्नप्रभाद्याः ॥  
ताथि पूर्णो योऽस्त्यधोलोक एतौ ।  
पादौ यस्य व्यायतौ सप्तरज्ञौ ॥ १ ॥  
तिर्यग्लोको विस्तृतो रजुमेकां ।  
पूर्णो द्वीपैरर्णवांत रसंख्यैः ॥  
यस्य ज्योतिशक्रकांचीकलापं ।  
मध्ये काश्ये श्रीविचित्रं कटित्रं ॥ २ ॥  
लोकोऽथधर्घो ब्रह्मलोके द्युलोके ।  
यस्य व्यासौ कूर्परौ पंच रज्ञौ ॥  
लोकस्यांतो विस्तृतो रजुमेकां ।  
सिद्धज्योतिशित्रको यस्य मौलिः ॥ ३ ॥  
यो वैशाखस्थानकस्थायिपादः ।  
श्रोणीदेशे न्यस्तहस्तद्वयश्च ॥  
कालेऽनादौ शश्वदूर्ध्वं दमत्वाद् ।  
विश्राणोऽपि श्रांतमुद्ग्रामखित्रः ॥ ४ ॥  
सोयं ज्ञेयः पूरुषो लोकनामा ।  
षट्क्रव्यात्माऽकृत्रिमोऽनायनंतः ॥  
धर्माधर्माकाशकालात्मसंज्ञै-  
द्रव्यैः पूर्ण सर्वतः पुद्गलैक्ष ॥ ५ ॥

**અર્થ :** તે આ લોક નામનો પુરુષ જાગ્રત્તા. એકબીજાની નીચે નીચે વિસ્તારી છાકારે રહેલ રનપ્રભાદિ સાત નરકપૃથ્વી છે, તેથી પૂર્વ એવા અધોલોકરૂપ સાત રજુ પ્રમાણ એ લોકપુરુષના બે પગ છે (૧) એ લોકપુરુષની મધ્યમાં અર્થાત્ ડેડ તિર્યક્લોક આવેલો છે જે વિસ્તારમાં એક રજુપ્રમાણ છે, અને જેમાં અસંઘાતા દીપસમુદ્રે આવેલા છે. જ્યોતિષયકરૂપ કંચીકલાપ એ પુરુષની ડેના કંદોરાનું કામ સારે છે. અર્થાત્ સૂર્ય-ચંદ્રાદિ જે જ્યોતિષયક આ તિર્યક્લોકની આસપાસ ફરતું આવેલું છે, તે આ લોકપુરુષનો કંદોરો છે.

### કોણી :

(૨) હવે ઉધ્વ લોક તે લોકપુરુષની કટિભાગની ઉપર જીચે પ્રભ દેવલોક છે, જે પાંચ રજુ પ્રમાણ વિસ્તારમાં હોઈ બે કોણીઓનું કામ સારે છે. સિદ્ધશિલા જે એ લોકપુરુષના અંતે ઉધ્વભાગમાં આવેલ છે, અને જે પણ વિસ્તારમાં એક રજુ છે, તે એ લોકપુરુષનું ભરતક છે.

### શિર :

(૩) એ લોકપુરુષ છાશ કરવા ઉભેલા પુરુષની જેમ પગ પઢોળા કરી ઉભેલ છે; અને એણે પોતાના બે હાથ ડેડ ઉપર રાખેલા છે. તે લોકપુરુષ અનાદિકાળનો નિરંતર ઉધ્વ જીવાવાળો છે; ઉધ્વ જીવાવાળો છે, ઉચ્ચ એની ગતિ છે; ઉચ્ચ એનો આશય છે; જિતેદ્રિય છે; અને શ્રાંતમુદ્રા ધારણ કરતો છતાં ખિસ નથી.

### અનાદિ શાશ્વત :

(૪) એ લોકપુરુષ છ દ્વયે ભરેલો છે. એ પુરુષ અકૃતિમ છે, અને કોઈએ કરેલો નથી. એ અનાદિ અનંત છે. એનાં જન્મ-મृત્યુ થયાં નથી અને ચોતરફ ધર્મ, અધર્મ, કાળ, આકાશ, જીવ અને પુરુષગલ એ નામના છ દ્વયથી ભરેલો છે. આવો તે લોકપુરુષ છે. (૫)

### લોકરૂપ રંગમંડપ — Theatre :

રંગસ્થાનं પુરુગલાનાં નદાનાં ।  
નાનાસ્થૈપૈનૃત્યતામાત્મનાં ચ ॥

કાલોદ્યોગસ્વસ્વભાવાદિભાવૈः ।  
કર્મતોદૈર્ણતિતાનાં નિયત્યા ॥૬॥

અર્થ : વળી એ લોક રંગમંડપરૂપ છે, જેમાં પુદ્રગલ અને આત્મા નટ છે, અને કાલ, ઉધમ, સ્વભાવ, કર્મ અને નિયતિ એ પાંચ સમવાય કારણોરૂપ વાંચિત્રોએ નચાચ્યા નાચતા જુદા જુદા વેષે એ પુરુષરૂપ રંગમંડપમાં નાચી રહ્યા છે. ૫

### ગણિતાનુયોગ :

એવं લોકો ભાવ્યમાનો વિવિકત્યા ।  
વિજ્ઞાનાં સ્યાન્માનસરસ્થૈયહેતુઃ ॥  
સ્થૈર્ય પ્રાપ્તે માનસે ચાત્મનીના ।  
સુપ્રાયેવા�ધ્યાત્મસૌખ્યપ્રસૂતિઃ ॥ ૭ ॥

અર્થ : એ રીતે લોકનું સ્વરૂપ જુદી જુદી રીતે સ્પષ્ટ ભાવતાં વિજ્ઞાની પુરુષો મનની સ્થિરતા પ્રાપ્ત કરે છે; અને મનની સ્થિરતા પ્રાપ્ત થયે આત્માને હિતકારી એવી અધ્યાત્મ સુખપ્રાપ્તિનાં કારણો સુલભ થાય છે.

“ગણિતાનુયોગ ગણવા થકી મુક્ત થાય જડ ચિત્ત”

— સ્વાધ્યાય

જિનેદ્રાગમમાં જ્ઞાનગ્રંથોની ચાર અનુયોગમાં વહેંચણી થાએલી છે, તેમાં એક ગણિતાનુયોગ છે. આ લોકસ્વરૂપનું જ્ઞાન, એનો વિચાર ગણિતાનુયોગમાં સમાવેશ પામે છે. મનરૂપી કરવતને ગણિતાનુયોગ કાનસ સમાન છે. એ લોકનો જુદી જુદી રીતે સ્પષ્ટપણે વિચાર કરવાથી ચિત્ત સ્થિર થાય છે, બધે ભમતું અટકે છે; જડતા છાડે છે અને એમ થાય છે કે અહો ! આ લોકરૂપ રંગમંડપમાં અનેક વખત નાચ્યો. એવું કોઈ પણ સ્થળ નથી, એવો આ લોકનો કોઈ પણ વિભાગ બાકી રહ્યો નથી કે જ્યાં આ જીવે સ્પર્શ ન કર્યો હોય, આમ એને સુલુદ્ધ ઊપરે છે અને પરિણામે આત્મહિત થાય છે; માટે જીવે આ લોકસ્વરૂપ જુદી જુદી રીતે પણ સ્પષ્ટપણે વિચારવું ધટે છે. ૭

## ચિત્ર :

હવે આ લોકસ્વરૂપ ભાવનાનું અણાળિયું કહે છે :

॥ કાઢી રાગ-આજ સખી મનમોહનો - એ દેશી ॥

વિનય વિભાવય શાશ્વતં,  
હદિ લોકાકાશં ॥  
સકલચરાચરધારણે,  
પરિણમદવકાશં ॥ વિં ૧ ॥

અર્થ : હે વિનય ! તારા હૃદયમાં આ શાશ્વત લોકાકાશનું ચિત્તવન કર; આ શાશ્વત લોકાકાશનું ચિત્ર તારા હૃદયમાં આલેખ. એથી તને સર્વ જંગમ-સ્થાવર, ચર-અચર, છુવ-અછુવ, તેની કૃતિ-ચેષ્ટાઓ આદિનું ભાન થશે, તે બધું તારાં હૃદય આગળ ખડું થશે; કેમ કે લોકાકાશમાં એ બધું આવેલું છે. હે વિનય ! તો સકળ ચરાચર વસ્તુઓ જેમાં રહેલી છે, એવા લોકાકાશનું ચિત્ર જે તારા હૃદયપટ પર પડે તો તું અતિ સ્થિર થઈ આત્મહિત પ્રાપ્ત કરીશ; માટે એ લોકસ્વરૂપ ચિત્તવ. ૧

## લોકાકાશનું માન :

લસદલોકપરિવેષિતં,  
ગણનાતિગમાનં ॥  
પંચભિરપિ ધર્માદિભિ:  
સુધારિતસીમાનં ॥ વિં ૨ ॥

અર્થ : એ લોકાકાશ કેવો છે ? શોભાયમાન છે. એની ચોમેર અલોકાકાશ વીટયાઈ રહ્યો છે, જે જે પરિમાણ મૂડીને રહ્યો છે; અર્થાત્ અસંઘાતો છે. અને પાંચ દ્વય ધર્મ-અધર્મ-કાળ-છુવ-પુદ્ગલ-એ પાંચ વડે તેની સીમા સુધારિત થયેલી છે. અર્થાત્ જેટલા કૈત્રમાં એ પાંચ દ્વયો વર્તે છે તેટલું કેત્ર એ લોકાકાશ છે. આવો ચૌદ રાજલોક નામક પુરુષ છે, તેનું હે ! વિનય ! તું તારા હૃદયપટ ઉપર ચિત્ર આલેખ. ૨'

## લોકાકાશ અને કેવાલી સમુદ્ધાત :

સમવધાતસમયે જિનૈઃ,  
પરિપૂરિતદહં ॥  
અસુમદણુકવિવિધક્રિયા,  
ગુણગૌરવગેહં ॥ વિ૦ ૩ ॥

**અર્થ :** વળી આ લોકાકાશ કેવો છે ? શ્રી જિનેશ્વરભગવાન સમુદ્ધાત સમયે પોતાના આત્માના પ્રદેશ વડે એ લોકપુરુષના સમસ્ત પ્રદેશને પૂરી નાખે છે, અને આ લોકાકાશમાં જીવ અને પુદ્ગલપરમાણુ વિવિધ પ્રકારની કિયા કરી રહ્યા છે. અર્થાત् જીવ અને અણુની જાતજાતની કિયા અને ગુણના ગૌરવનું આ લોકાકાશ સ્થાનક છે. એનો એક પ્રદેશ એવો ખાતી નથી, કે જ્યાં જીવ-અજીવની કિયા ન વર્તતી હોય. એવા લોકપુરુષને હે વિનય ! તું તારા ચિત્તમાં ચિંતાવ. ૩

## લોકાકાશ અને પુદ્ગલવિવર્તો :

એકસ્થપમણ્ય પુદ્ગલલૈઃ,  
કૃતવિવિધવિવર્ત ॥  
કાંચનશલશિખરોત્તરં,  
કવચદવનતરગર્ત ॥ વિ૦ ૪ ॥

**અર્થ :** વળી એ લોકાકાશ કેવું છે ? ત્યાં પુદ્ગલોને લઈને એકરૂપ છતાં જાતજાતનાં વિવર્તો રૂપે રૂપાંતર પામી રહ્યું છે. તે લોકાકાશ કોઈ સ્થળે મેરુ જેવા ઊંચા સુવર્ણના શિખરોરૂપ થઈ રહેલ છે; તો બીજે સ્થળે એવી જ ઊર્ધ્વી નીચી મોટી ખાઈઓ રૂપે થઈ રહેલ છે. આવા લોકપુરુષને હે વિનય ! તારા હદ્યમાં ધાર અને સ્થિર થઈ તારું સ્વરૂપ વિચાર. ૪

## વિવર્તના દાખલા :

કવચન તવિષમणિમંદિર-  
સદિતોદિતસૂર્ય ॥  
ઘોરતિમિરનરકાવિભિ:  
ક્વચનાતિવિરૂપ ॥ વિ૦ ૫ ॥

અર્થ : (લોકપુરુષમાં પુદ્ગલનાં વિવરીના વધારે દાખલા આપે છે.) કોઈ કોઈ સ્થળે દેવતાઓના રમ્ય આવાસ આવી રહેલા છે. તે સૂર્યકાંત મણિની શોભાથી બહુ સુંદર લાગે છે ત્યારે બીજી બાજુએ ઘોર ભયંકર અંધકારમય નરકાદિ આવેલાં છે, જે બહુ માદા લાગે છે. આમ આ લોકાકાશમાં ક્યાંય મેરુ જેવા ઊંચા સોનાના પરવતો આવેલા છે, તો ક્યાંય ઊડી ખીંચો આવેલી છે; ક્યાંય દેવતાઓના રમ્ય સ્વર્ગભવન આવેલાં છે, તો ક્યાંય ભયંકર અંધકારમય નરકનિગોદનાં સ્થાનો આવેલાં છે, જે એકરૂપ છતાં પુદ્ગલનાં કરેલાં વિવિધ વિવર્તો છે. લોકાકાશ પોતે તો એકરૂપ છે, એક જ છે; પણ તેમાંથી અનેક ચિત્રવિચિત્ર નાનાં-મોટાં નવાં રૂપ પેદા થાય છે.

### પુદ્ગલના વિવર્તો અને આધુનિક શોધકોની શોધો :

પાણીના વિશાળ સરોવરમાં ડાંકરો નાંખતાં એક કુડાળું (Ripples) થયું, લાગલું બીજું એથી મોટું, તલ્ખણ ત્રીજું એથી મોટું, અમ ઉત્તરોત્તર મોટાં જુદાં જુદાં કુંઝાં થઈ ઠેક આખા સરોવરમાં વ્યાપી જાય છે તેમ એક રૂપમાંથી અનેક વિવર્ત (vibrations) પુદ્ગલો રચે છે. એક શબ્દ આખા લોકાકાશને સ્પર્શી આવે છે.

આ આધારે, પુદ્ગલની વિવર્ત શક્તિના આધારે, આ જમાનાના Telegraph, Telephone, Phonograph, Wireless Telephone આદિ શોધાયાં છે. હે ચેતન ! આમ આખો લોકાકાશ પુદ્ગલવિવર્તથી વ્યામ છે, તેને તું હદ્યમાં ધાર. ૫

વળી એ લોકાકાશનું બીજું રીતે ચિત્ર આપે છે.

### લોકરૂપ નાટ્યગૃહ :

કવચિદુત્સવસમયમુઞ્ચલ,  
જયમંગલનાર્દ ॥  
  
કવચિદમદહાહારવं,  
પૂર્થુશોકવિષાર્દ ॥ ચિ. ૦ ૬ ॥

અર્થ : વળી લોકપુરુષ રૂપી નાટકની રંગભૂમિ કેવી છે ? કોઈ કોઈ

સ્થળોએ ઉજ્જ્વલા ઉત્સવ સમય વર્તી રહ્યો છે અને જ્યના મંગળ અવાજો, ગીતો ગવાઈ રહ્યા છે; તો વળી બીજે સ્થળે અત્યંત હાહાકાર થઈ રહ્યો છે; મહાજબરા શોકનું અને જેદનું કારણ વર્તી રહ્યું છે, અર્થાત્ ક્ષયાય વિવાહ જેવા મંગળ પ્રસંગો ઉજ્જ્વલાય છે; તો ક્ષયાય ઈષ પ્રિય યુવાન સ્વજનના મરણ જેવો દારુણ પ્રસંગ બધાને શોકમળ કરે છે. કોઈ હારે છે, કોઈ જીતે છે, કોઈ રડે છે, કોઈ હસે છે, કોઈ લક્ષ્મી કમાય છે; કોઈ ખોઈ હે છે, આમ અનેક પ્રકારનાં ચિત્રવિચિત્ર નાટકો આ પુરુષ-લોક નાટ્યગૃહમાં ભજવાય છે, તેનું ચિત્ર હે વિનય ! તું તારા હૃદયપટ ઉપર ચીતર, અને આ લોકની એવી પ્રથા હેખી શાંત ચિત્ર થઈ સમતા આદર, આથી તારું પરમ કલ્યાણ થશે. ૬

### વિધવિધ વેષનું કારણ મમત્વ :

बहुपरिवितमनन्तशो,  
निखिलैरपि सत्त्वैः ।  
जन्ममरणपरिवर्तिभिः,  
कृतमुक्तममत्वैः ॥ वि० ૭ ॥

**અર્થ :** (જે પુદ્ગલ દ્વયે કરેલાં વિવર્તોથી છવાઈ રહેલો આ લોકાકાશ છે, તે પુદ્ગલ કેવા છે, તે બતાવે છે) અનંતી અનંતી વાર એ પુદ્ગલ દ્વયનો સર્વ પ્રાણીઓએ પરિચય કર્યો છે, કેમ કે સર્વ પ્રાણીઓ અનંતી વાર જન્મ-મરણ કરી ચૂક્યાં છે; તેથી પૂર્વ પૂર્વ મમત્વની પરંપરાએ પુદ્ગલો છોડે છે, ગ્રહે છે. આમ ઘટમાળ આ લોકાકાશમાં ચાલી જ રહી છે. જે પુદ્ગલ એક વાર છાંઝું, તે જ ફરી બીજા રૂપે મમત્વ યોગે અછણ કરે છે. જીવો જન્મ-મરણ કરી રહ્યા છે, તેથી આગલા ભવમાં જીવના પરિચયથી નવા જન્મમાં જાણો એ બધું કદી ના મળ્યું હોય એમ એ પુદ્ગલભોગ તરફ જાવાં નાંખે છે, પુદ્ગલની જ્યાં આવી જાળ ફેલાયલી છે એવા લોકાકાશ નાટકશાળાને હે વિનય ! તું તારા ચિત્તથસુ વડે જોઈ જઈ સ્થિર થા. ૭

ઇહ પર્યાટનપરાહૂણાઃ,  
પ્રણમત ભગવંતં ॥

શાંતસુધારસપાનતો,  
ધૃતવિનયમવંતં ॥ વિ૦ ૮ ॥

અર્થ : માટે હે ચેતન ! હે ભવ્ય જીવો ! જેમાં આવું નાટક  
ભજવાઈ રહ્યું છે, એવા-આ લોકાકાશના પર્યાટનથી તમે જે પરાજ્યુખ થયા  
હો, અર્થાત् તમે ભવભટકણથી થાડી ગયા હો અને એથી છૂટવા માગતા  
હો તો આ શાંતસુધારસનું પાન કરો, અને શરદ્ધાગત વિનયવંતનું રક્ષણ  
કરનાર ભગવાનને પ્રકૃષ્ટ ભાવે નમો. ૮

॥ ઇતિ શ્રી શાંતસુધારસગેયકાવ્યે લોકસ્વરૂપભાવના વિભાવનો નામ  
એકાદશઃ પ્રકાશઃ ॥

ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાણબદ્ધ કાવ્યમાં  
અગિયારમો લોકસ્વરૂપ ભાવના નામનો પ્રકાશ સમાપ્ત.



ॐ

## બોધિદુર્લભ ભાવના

બોધિપ્રભાવ :

॥ મંદાક્રાંતા વૃત્તં ॥

યસ્માદિસ્માપયિતસુમનસ્વર્ગસંપદ્દિલાસ-

પ્રામોહ્લાસાઃ પુનરાપિ જનિઃ સત્કુલે ભૂરિભોગે ॥

બ્રહ્માદૈતપ્રાગુણપદવીપ્રાપકં નિઃસપલં ।

તદૃષ્ટાપં ભૂશમુરુધિયઃ સેવ્યતાં બોધિરલં ॥ ૧ ॥

અર્થ : હે વિશાળ બુદ્ધિવાળા સજ્જનો ! અતિ દુષ્ટાપ, મહામુશકેલીએ પમાય એવું જે બોધિરલ સમ્યકૃત તેનું તમે સેવન કરો. એ બોધિના પ્રભાવે કરી દેવતાઓ પણ વિસ્મય પામે એવો સ્વર્ગસંપત્તિનો વિવાસ પામી જીવ આનંદોલ્લાસ પ્રાપ્ત કરે છે. વળી એ બોધિના પ્રભાવે પુષ્ટ વૈભવબોગવાળા ઉત્તમ કુળમાં જીવ ફરી ફરી જન્મ પામે છે; અને કરી અદ્વિતી બ્રહ્મપદવી (મોક્ષ) સુધી જીવને પહોંચાડવામાં કોઈ જેને બાધક નથી એવું મહદૂભૂત એ બોધિરલ છે, તેને તમે હે બુદ્ધિશાળીઓ ! સેવો. ૧

દુર્લભ શું છે ?

॥ ભુજંગપ્રયાત વૃત્તં ॥

અનાદૌ નિગોદાંધકૂપે સ્થિતાના-

મજસ્ત્ર જનુર્મૃત્યુદુઃખાર્દિતાનાં ॥

પરીણામશુદ્ધિઃ કૃતસ્તાદૃશી સ્યા-

દ્યયા હંત તસ્માદિનિર્યાતિ જીવાઃ ॥ ૨ ॥

અર્થ : અનાદિકાળના નિગોદરૂપ અંધારા કૂવામાં રહેલા અને કરી કરી જન્મ-મરણનાં દુઃખથી પીડાતા જીવોને એવી પરિણામશુદ્ધિ ક્યાંથી થાય કે જેથી તે નિગોદરૂપ અંધકારમય કૂપમાંથી બહાર આવે ? અર્થાતું પ્રથમ તો એવી પરિણામ વિશુદ્ધિ જ દુર્લભ છે; એટલે એ અનાદિ નિગોદમાંથી નીકળવું મહાદુર્લભ છે. હવે કદાચ તે નિગોદમાંથી જીવ બહાર આવે તો ૨

એથી દુર્લભ શું છે ?

તતો નિર્ગતાનામણિ સ્થાવરસ્તં ।  
ત્રસતં પુનર્દુર્લભ દેહભાજાં ॥  
ત્રસત્વેપિ પંચાક્ષપર્યામસંજ્ઞિ-  
સ્થિરાયુષ્યવત્ત દુર્લભ માનુષત્વં ॥ ૩ ॥

અર્થ : એ નિગોદમાંથી બહાર નીકળેલાને સ્થાવરપણામાં રહેવું થાય; કેમ કે દેહધારીઓને ત્રસપણું પામવું દુર્લભ છે. હવે કદાચ ત્રસપણું પ્રાપ્ત થાય તેમાં પણ પંચેદ્રિયપણું પામવું દુર્લભ છે; પંચેદ્રિયપણું પ્રાપ્ત થાય તો સંપૂર્ણ છ પર્યાપ્તિ પામવી દુર્લભ છે. તે પણ કદાચ મળે તો સંજ્ઞિ પંચેદ્રિયપણું, તે સાથે વળી લાંબું આયુષ્ય અને મનુષ્યપણું એ પરમ દુર્લભ છે. ૩

એથી વિશેષ દુર્લભ શું છે ?

તદેતન્મનુષ્યત્વમાણાપિ મૂઢો ।  
મહામોહિમિથ્યાત્વમાયોપગૂઢઃ ॥  
ભ્રમન્દૂરમગનો ભવાગાધગતો ।  
સુનઃ કવ પ્રપદેત તદ્વોધિરતન ॥ ૪ ॥

અર્થ : એ મનુષ્યપણું પણ કદાચ મળ્યું, તો સટે મૂઢ જીવ મહામોહ, મિથ્યાત્વ અને માયા કપટે કરી યુક્ત છે; અને એથી સંસારરૂપ અગાધ ખાડામાં ભમતો ભમતો બૂડી રહ્યો છે. તેને આ બોધિરતન કેમ કરી પ્રાપ્ત થશે ? અર્થાતું હે ચેતન ! આ બોધિરતન કરી મળવું બહુ દુર્લભ છે.

“આવો રૂડો મનભા દેહ ફરી ફરી ક્યાં મળશે રે ?

આવું રૂદું બોધિરત્ન ફરી ફરી ક્યાં મળશે રે ?”

અર્થાત् એ મળવું દુર્લભ છે. અનાદિ નિગોદમાંથી નીકળવું દુર્લભ છે; ત્યાંથી નીકળતાં ત્રસપણું બેથી વધારે દુર્લભ છે; તેમાં પણ પંચેદ્રિય, પર્યાપ્તિ પૂરી, સંજીવણું, દીર્ઘ આયુષ્ય, મનુષ્યપણું અને આ સમૃદ્ધ બોધ એ પામવાં ઉત્તરોત્તર અત્યંત દુર્લભ છે; માટે ચેતન ! હાલ તને એ બધું મળ્યું છે, તો સાવધ રહી એ પરમ દુર્લભ બોધિનો લાલ લઈ લે. ૪

॥ શિખરિણી વૃત્તં ॥

વિભિન્નાઃ પંથાનઃ પ્રતિપદમનલ્યાશ્ મતિનઃ ।

કુયુક્તિવ્યાસં ગૈર્નિજનિજમતોલાસરસિકાઃ ॥

ન દેવા સાન્નિધ્યં વિદધતિ ન વા કોપ્યતિશય-

સ્તદેવં કાલેડસ્મિન્દ્ય ઇહ દૃઢધર્મા સ સુકૃતી ॥૫॥

અર્થ :

“વસ્તુ વિચારે રે હિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિરધાર,  
તરતમ બોધે હો તરતમ વાસના રે, વાસિત બોધ આધાર.”

- શ્રી આનંદધનજી

“મત મત ભેદ હો જો જઈ પૂછીયે રે સહુ થાપે અહમેવ.”

- શ્રી આનંદધનજી

જુદા જુદા પંથો પડી ગયા છે, ભિન્ન ભિન્ન મતવાણા છે. તેઓ પોતે જે મત માનતા હોય (ભલે તે અસત્ય હો) તેના ઉલ્લાસમાં રસિક છે; અને કુયુક્તિનો ઉપયોગ કરી તે ફેલાવવામાં રસ લે છે. દેવતાઓ પણ સાન્નિધ્ય કરતા નથી, સમીપ પધારતા નથી કે તેઓને પૂછી સત્યપંથનું નિરાકરણ કરીએ. તેમ કોઈ ભર્મ જાણનાર રસિક અતિશયવંત મહાપુરુષ પણ નથી દેખાતો કે જેને જઈ નિર્ઝય પૂછીએ, માટે આ કણમાં તો જે ધર્મ ઉપર દૃઢતા રાખે છે તે પુષ્યશાળી જાણવો. ૫

સાધે તે વાધે :

॥ શાર્દૂલવિક્રીડિતં વૃત્તં ॥

યાવહેહમિદં ગર્વે ને સૃદિતં નો યા જરાજર્જરે ।

યાવત્વકદંબકં સ્વવિષયજ્ઞાનાવગાહક્ષમં ॥

યાવચાયુરભંગુરં નિજહિતે તાવદ્ બુધૈર્યત્વતાં ।

કાસારે સ્ફુટિતે જલે પ્રચલિતે પાતિઃ કથં બધ્યતે ? ॥ ૬ ॥

અર્થ : હે ચેતન ! જ્યાં સુધી આ દેહ રોગથી શિથિલ થયો નથી, જ્યાં સુધી ઘડપણથી ક્ષીણ થવા નથી માંડ્યો, જ્યાં સુધી પંચેદ્રિયોનો સમૂહ પોતોતાના વિષયો લેવા સમર્થ છે અને જ્યાં સુધી આયુષ્ય ક્ષીણ થયું નથી, ત્યાં સુધીમાં તારે તારા હિત અર્થે પ્રયત્ન કરવો ઘટે છે; કેમ કે રોગ કે ઘડપણ આવ્યે ઈદ્રિયોની શક્તિ ક્ષીણ થયે, અથવા આયુ પૂર્ણ થયે તું શું કરી શકીશ ? માટે આ અવસર છે, ત્યાં ચેત. તળાવ ફાટી જઈ પાણી બહાર ચાલ્યું જશે, પણી પાળ કેવી રીતે બંધાગે ? માટે - “પાણી પહેલાં પાળ અજ્ઞાની બાંધ રે.”

સ્વાધ્યાય

“અવસર આવ્યે અવશ્ય કર, અવસર આવ્યે મત ભૂલ્ય;

અવસર ચૂક્યા જે નરા, તે નર કોડી મૂલ્ય.”

- પ્રકૃષ્ટ

ધર્મ કરતાં ઢીલ શી ?

॥ અનુષ્ટુપ્ વૃત્તં ॥

વિવિધોપદ્રવ્ય દેહમાયુષ્ચ ક્ષણભંગુરં ।

કિમાલંબ ધૃતિ મૂઢે: સ્વશ્રૈયસિ વિલંબ્યતે ॥ ૭ ॥

અર્થ : જાતજાતના ઉપદ્રવયુક્ત આ દેહ છે, આયુ ક્ષણભંગુર છે; છતાં મૂઢ જીવો ઢીલા થઈ કેમ પોતાના શ્રેયમાં વિલંબ કરે છે ? “શ્રેયાંસિ બહુવિભાનિ પ્રાયશો મહતામણિ” અને “ધર્મસ્ય લારિતા ગતિ:”

મહાપુરુષોને પણ પ્રાયઃ શ્રેયમાં વિભન આવે છે અને ધર્મ કરતાં હીલ ન  
કરવી-એ લક્ષ હે ચેતન ! તારે રાખવો યોગ્ય છે. ૭

### બુજ, બુજ :

હવે આ બોધિદુર્લભ ભાવનાનું અષ્ટાણીયું કહે છે.

॥ ધનાશ્રી રાગ : હીંયે રે હીંયે રે પીઆ હિડોલડે-એ દેશી. ॥

બુધ્યતાં બુધ્યતાં બોધિરતદુર્લભ,  
જલધિજલપતિતસુરરલયુક્ત્યા ॥  
સમ્યગારાધ્યતાં સ્વહિતપિહ સાધ્યતાં,  
વાધ્યતામધરગતિરાત્મશક્ત્યા ॥ બુ૦ ૧ ॥

અર્થ : રે ચેતન ! બુજ, બુજ. આ બોધિરતન અતિ દુર્લભ છે.  
સમુદ્રના જળમાં પડેલું ચિંતામણિરતન જેમ દુર્લભ છે તેમ આ બોધિરતન  
જો એક વાર હાર્યો તો ફરી મળવું બહુ દુર્લભ છે; માટે બુજ રે ! બુજ !  
એ બોધિનું સમ્યકું પ્રકારે આરાધન કર અને તારું હિત સાધ; અને  
સ્વશક્તિએ કરી તારી દુર્ગતિ થતી અટકાવ. ૧

### ચક્રવર્તીનું ભોજન :

ચક્રભૌજાદિદ્વિ નરભવો દુર્લભો ।

આધ્યતાં ઘોરસંસારકષે ॥

બહુનિગોદાદિકાયસ્થિતિવ્યાયતે ।

મોહમિથ્યાત્મમુખચોરલક્ષે ॥ બુ૦ ૨ ॥

અર્થ : આ સંસાર-અરાધ્ય જે બહુ નિગોદાદિ કાય-સ્થિતિએ કરી  
વિશાળ છે, અને જેમાં મોહ-મિથ્યાત્મ પ્રમુખ લાખો ચોર-લૂટાય વસે છે  
અને જે ઘોર-ભયંકર છે તેમાં ભમતા, પરિભ્રમણ કરતા જીવોને નરભવ  
પામવો એ ચક્રવર્તીના ભોજનની જેમ દુર્લભ છે. ચક્રજીનું ભોજન એક  
વખત મળ્યા પછી બીજી વખત જેમ મળવું દુર્લભ છે, કેમ કે બીજી  
વખત ત્યાં જમવા આવવાનું થાય તે પહેલાં તો ઘણો કાળ ગયો હોવાથી

આયુ પણ પૂરું થઈ ગયું હોય) તેમ નરભવ એક વાર મળ્યા પછી તેનું જે સાર્થક ન થયું તો ફરી મળવો અતિ દુર્લભ છે.

### જીવો કેમ દિશામૂઢ છે ?

આ સંસાર ધોર નિબિડ અંધકારવાળો છે, એટલે એમાં ભમતા જીવોને દિશા સૂઝતી નથી. વળી અનેક નિગોદ-નરક આદિ કાયરસ્થિતિ એમાં હોવાથી એ અરણ્ય એટલું બધું વિશાળ છે કે એનો પાર પામતાં થાકી જવાય. તેમાં કદાચ આગળ થાક ગ્રહણ કર્યા વિના વધે તો આડા મોહ, અજ્ઞાન, મિથ્યાત્વરૂપી વાટપાહુઓ બેઠા છે, તે લૂંટી લઈ આગળ વધવા દેતા નથી. આમ મનુષ્યભવ મળવો અતિ દુર્લભ છે માટે હે ચેતન ! જે તને એ હમણાં મળ્યો છે, તો સમ્યક્ક પ્રકારે બોધિનું આરાધન કરી તેનું તું સાર્થક કરી લે. ૨

### અનાર્ય દેશ, પાપનું નિમિત્ત :

લબ્ધ ઇહ નરભવોऽનાયદેશેષુ યઃ ।

સ ભવતિ પ્રત્યુતાનર્થકારી ॥

જીવહિંસાદિપાપાશ્રવબ્યસનિનાં ।

માધવત્યાદિમાર્ગાનુસારી ॥ બુદ્ધ ૩ ॥

**અર્થ :** નરભવ મળવો તો દુર્લભ છે, પણ તે કદાચ મળે તો આયદીશ, આર્યપણું પામતું દુર્લભ છે. અનાર્ય દેશમાં મનુષ્યદેહ મળવો એ વળી અનર્થનું કારણ થાય છે, કારણ કે ત્યાં જીવો જીવહિંસા આદિ પાપોથી વ્યાકુળ છે કે જેનું પરિણામ મધા, માધવતી આદિ નરકગતિ છે; માટે રે જીવ ! બુઝ ! બુઝ ! તને તો આ દુર્લભ માનવદેહ, આયદીશ અને બોધિરિત મળ્યું છે તેનો લાભ લઈ લે ! લાભ લઈ લે !! એક વાર હારીશ તો ફરી એ મળવું દુષ્કર છે. ૩

આયદિશસ્પૃશામપિ સુકુલજન્મનાં ।  
 દુર્લભા વિવિદિષા ધર્મતત્ત્વે ॥  
 સ્તપરિગ્રહભયાહારસંજ્ઞાર્તીમિ-  
 હત મન્ન જગદુઃસ્થિતત્ત્વે ॥ બુદ્ધ ૪ ॥

**અર્થ :** આર્થ દેશમાં અને વળી રૂડા કુળમાં જન્મ થયો હોય તેવાઓને પણ ધર્મતત્ત્વમાં ઈચ્છા થવી એ દુર્લભ છે. કારણ કે મૈથુન, પરિગ્રહ, ભય અને આલાર એ ચાર સંજ્ઞામાં આણું જગત ભૂડી રહ્યું છે. આર્થપણું અને સાથે ઉંઘું કુળ એ બંને દુર્લભ છતાં મળે તો પણ તત્ત્વજ્ઞાસા થવી દુર્લભ છે, કેમ કે જીવ માત્ર મૈથુનાટિ ચાર સંજ્ઞામાં મૂર્ખિક્ત થયા છે; તો મનુષ્ય દેહ, જેમાં બોગનાં વિવિધ સ્થાનક રહેલાં છે તેમાં જીવ મૂર્ખા પામ્યા વિના કેમ રહે ? એ મૂર્ખા આડે તત્ત્વજ્ઞાસા ક્યાંથી થાય ? તને તો હે ચેતન ! એ બધું-મનુષ્યપણું, આર્થતા, ઉત્તમ કુળ અને જ્ઞાસા એ બધું પ્રામ થયું છે, તો હવે તું એનો લાભ લઈ, એ મળ્યાનું સાર્થક કરી લે. ફરી ફરી એ મળવું દુર્લભ છે. હે ચેતન ! બોધ પામ, બોધ પામ. ૪

વિવિદિષાયામપિ શ્રવણમતિદુર્લભં ।  
 ધર્મશાસ્ત્રસ્ય ગુરુસંનિધાને ॥  
 વિતથવિકથાદિતત્ત્વસાવેશતો ।  
 વિવિધવિક્ષેપમલિનાવધાને ॥ બુદ્ધ ૫ ॥

**અર્થ :** કદાચ જાગ્રત્વાની ઈચ્છા પ્રામ થાય, તો ધર્મશાસ્ત્રશ્રવણ અતિ દુર્લભ છે; કેમ કે સદગુરુનો યોગ ન હોય. હવે કદાચ સદગુરુનો યોગ પણ હોય, તો નકારી વિકથારસના આવેશથી જાતજાતના વિક્ષેપ પેદા થઈ ચિત્તવૃત્તિ એવી મહિન થઈ હોય કે એમાં પવિત્ર સદગુરુનો બોધ ન સોછાય. આમ હે ચેતન ! તને એ દુર્લભ શ્રવણ પણ મળ્યું છે, આ સત્પુરુષનો યોગ પણ પ્રામ થયો છે; તો વિકથા આદિજતા કરી તું આ મળેલ અપૂર્વ જોગનો લાભ લઈ લે. ફરી આં જોગ, આ બોધ મળવી અતિ દુર્લભ છે; માટે બુજ, રે બુજ. ૫

## તેર કાઠિયા :

ધર્મમાકર્ણ સંબુધ્ય તત્ત્વોદ્ઘમ ।  
 કુર્વતો વૈરિવગોતરંગ: ॥  
 રાગદ્વેષશ્રમાલસ્યનિદ્રાદિકો ।  
 બાધતે નિહતસુકૃતપ્રસંગ: ॥ બુદ્ધ ૬ ॥

**અર્થ :** વળી જીવ ધર્મ સાંભળી સમ્યક પ્રકારે બોધ પામી ધર્મને વિષે ઉદ્ઘમ કરે છે, ત્યાં તેને રાજ-દ્વેષ-ખેદ-આલસ્ય-નિદ્રા આદિ અંતરંગ વૈરીઓ આડભીલી નાંખે છે, અને તેના સુકૃત પ્રસંગને, તેની ધર્મકરણીને બાધા ઉપજાવે છે. જીવ ધર્મ કૃત્ય ભણી પ્રેરાય ત્યાં મોહાદિ તેર કાઠિયા તેને નડે છે. આમ ઉત્તરોત્તર ધર્મની હુર્લભતા છે. એવો ધર્મ, એવું બોધિરત્ન ફરી મળવું દુષ્કર છે. હે જીવ, બુજ, બુજ અને એનો લાભ લે. ૬

## જિજ્ઞાસા વિના શ્રવણ કેમ થાય ?

ચતુરશીતાવહો યોનિલક્ષેષ્યિં ।  
 કવ ત્વયાકર્ણિતા ધર્મવાર્તા ॥  
 પ્રાયશો જગતિ જનતા મિથો વિવદતે ।  
 ઋદ્ધિરસશાતગુરુગૌરવાર્તા ॥ બુદ્ધ ૭ ॥

**અર્થ :** અહો ચેતન ! આ ચોરાશી લાભ જીવયોનિમાં તે ક્યાંયે ધર્મવાર્તા શ્રવણ કરી ? ક્યાંયે કરી નહિ હોય, કેમ કે ઋદ્ધિ, રસ અને શાતા એ ત્રણ મહા મોટા ગારવોથી પીડાયલા જનો પ્રાય: જગતમાં એક-બીજા સાથે કલેશવાદ કરી રહ્યા છે. તેઓને ધર્મવાર્તા સાંભળવામાં ક્યાંથી આવે ? બધા જીવો પોતપોતાની ઋદ્ધિ, પોતપોતાના રસ અને પોતપોતાની શાતામાં ખૂંચી રહ્યા છે, તેમાંથી નીકળી શકે તો ધર્મ સાંભળેને ? આમ, હે ચેતન ! ચોરાશી લક્ષ જીવયોનિમાં ફરતાં જીવને ધર્મશ્રવણ બહુ હુર્લભ છે. તે તને પ્રામ થયું છે, તેનો લાભ લઈ લે. જીવ ! બુજ, બુજ. ૭

**Summary :**

एवमतिदुर्लभात्याप्य दुर्लभतम् ।  
 बोधिरलं सकलगुणनिधानं ॥  
 कुरु गुरुप्राज्यविनयप्रसादोदितं ।  
 शांतरस सरस पीयूषपानं ॥ बु० ८ ॥

**અર્થ :** એ પ્રકારે દુર્લભમાં દુર્લભ અને બધા શુષ્ણોનો ભંડાર એવું બોધિરતન પ્રાપ્ત કરી હે ચેતન ! તું ગુરુના મોટા વિનયના પ્રસાદથી ઉત્પત્ત થાયેલો છે આ રચિક શાંતસુધારસ તેનું પાન કર. હે ચેતન ! બધા ગુણના ચાશિદૃપ એવું આ બધા કરતાં અતિ દુર્લભ બોધિરતન તને મળ્યું છે. પૂર્વે કહ્યું છે કે નિગોદધાંથી નીકળવું, ત્રસપણું પામવું, તેમાં પણ પર્યેદ્રિયપણું પામવું, સંપૂર્ણ છયે પર્યાપ્તિ પામવી, સંક્ષિ પર્યેદ્રિયપણું પામવું, તેમાં પણ મનુષ્યપણું પામવું, લાંબું આયુષ્ય પામવું, આર્થિપણું પામવું, ઉત્તમ કુળ પામવું, ધર્મજિજ્ઞાસા પામવી, સદગુરુનો યોગ અને તત્ત્વશ્રવણ પામવું, બોધિરતન પામવું એ ઉત્તરોત્તર અતિ અતિ કઠિન છે. તે બોધિરતન તું પાય્યો છે, તો ચેતન ! સદગુરુનો પરમ વિનય કર, તેની પ્રસત્તા મેળવ અને આ શાંતસુધારસનું પાન કરી અમર થા ! અમર થા !! રે ચેતન ! બુજી, બુજી. ફરી ફરી કહેલી દુર્લભ વસ્તુઓમાં દુર્લભમાં દુર્લભ આ બોધિરતન મળવું મુશ્કેલ છે. મળ્યું છે તો લાભ લે, સાર્થક કરી લે.

**શાંતસુધારસ વિનયનું ફળ :**

“ગુરુપ્રાજ્યવિનયપ્રસાદોદિતં શાંતસુધારસં ॥”

એ શબ્દો કહી શ્રી કર્તાપુરખે સૂચવી દીધિં કે આ શાંતસુધારસ શ્રી સદગુરુના પરમ વિનયની પ્રસાદી છે. અર્થાત્ શ્રી સદગુરુની વિનયભક્તિ ન કરી હોત તો આ ગ્રંથ ન થાત. આમ સદગુરુભક્તિનો મહિમા બતાવી એનો બોધ કર્યો. ८

ઇતિ શ્રી શાંતસુધારસગેયકાચ્યે બોધિદુર્લભ  
 ભાવના વિભાવનો નામ દ્વારદશ: પ્રકાશ: ॥

ઇતિ શ્રી શાંતસુધારસ નામના દ્વારદશ કાચ્યમાં  
 બારમી બોધિદુર્લભ ભાવના સમામ.



ॐ

## મैत्रीભાવના।

ध્યાન રસાયન :

॥ અનુષ્ઠળ વૃત્તં ॥

સર્વર્થધ્યાનસંધ્યાનહેતવઃ શ્રીજિનેશ્વરૈः ।

મैત્રીપ્રભૂતયઃ પ્રોક્તા શ્વતસ્ત્રો ભાવનાઃ પરાઃ ॥ ૧ ॥

અર્થ : શ્રી જિનેશ્વર ભગવાને સર્વર્થ ધ્યાનધ્યાના હેતુએ મैત્રી આદિ બીજી ચાર ભાવના પ્રકાશી છે. ૧

તથાહુ : ।

મैત્રીપ્રમોદકારુણ્યમાધ્યસ્થાનિ નિયોજયેત् ।

ધર્મધ્યાનમુપસ્કર્તુ, તદ્દ્વિ તસ્ય રસાયનं ॥ ૨ ॥

અર્થ : તે આ પ્રમાણે,—

(૧) મैત્રી (૨) પ્રમોદ (૩) કારુણ્ય (૪) માધ્યસ્થ - આ ચાર બીજી ભાવનાઓ ધર્મધ્યાનને ઉપકારક હોવાથી ભાવવી ઘટે; કેમ કે એ ધર્મધ્યાનને રસાયનરૂપ છે, અર્થાત્ રસાયનની પેઢે એ ધર્મધ્યાનને પુષ્ટિરૂપ છે, હિતકર્તા છે. ૨

હવે એ ભાવનાનું સ્વરૂપ સમજાવે છે.

॥ ઉપજાતિ વૃત્તં ॥

મैત્રી પરેણા હિતચિતનં યત્ ।

ભવેતુ પ્રમોદો ગુણપક્ષપાતઃ ॥

કાર્ય મુત્તાગિરૂજાં જિહીરે-  
તુપેક્ષાં દુષ્ટધિયામુપેક્ષા ॥ ૩ ॥

અર્થ : (૧) પારું ભલું ચિત્તવં એ મैત્રીભાવના, (૨) ગુણનો  
પક્ષપાત એ પ્રમોદ ભાવના, (૩) આર્ત, દુઃખી, દીન, રોગી જીવોનાં  
દુઃખ દૂર કરવાની ઈચ્છા એ કાર્ય ભાવના અને (૪) દુષ્ટ બુદ્ધિવાળા  
જીવોની ઉપેક્ષા કરવી એ ચોથી ઉપેક્ષા અથવા માધ્યરથ ભાવના. ત

### Universal Brotherhood :

સર્વત્ર મैત્રીમુપકલ્પયાત્મન् ।  
ચિત્ત્યો જગત્યત્ર ન કોપિ શત્રુः ॥  
કિયદિનસ્થાયિનિ જીવિતેડસ્મિન्  
કિ ખિદ્યતે વૈરાધિયા પરસ્મિન् ॥ ૪ ॥

અર્થ : હે આત્મા ! તું સર્વત્ર મैત્રીભાવ વિચાર. આ જગતમાં મારો  
કોઈ પણ વૈરી નથી એવું ચિત્તવં ઘટે છે, કેમ કે આ જીવિત તો થોડા  
દિવસ રહેવાનું છે, તેમાં પરસ્પર વૈરાધિયી શું ખેદ પામે છે ? ૪

વધી-

### ભૂત બંધુ :

સર્વેયમી બંધુત્યાડનુભૂતાઃ ।  
સહસ્રશોડસ્મિન્ ભવતા ભવાદ્યૌ ॥  
જીવાસ્તતો બંધવ એવ સર્વે ।  
ન કોડપિ તે શત્રુરિતિ ગ્રતીહિ ॥ ૫ ॥

અર્થ : આ સંસારસમુદ્રમાં બધા જીવો હજરો વેળા બંધુપણાને  
પામ્યા છે, તો એ બધા તારા ભાઈઓ જ છે; કોઈ પણ શત્રુ નથી એવી  
જાતરી આણ. ૫

### ભૂત કીર્તનિઃખા :

સર્વે પિતૃભ્રાતૃપિતૃબ્યમાતૃ-  
પુત્રાંગજાસ્ત્રીભગિનીસ્તુધાત્ર ॥

जीवा: प्रपञ्चा वहुशस्तदेतत् ।  
कुटुंबमेवेति परो न कथित् ॥ ६ ॥

**अर्थ :** सर्वे ज्ञावो पिता, भाई, पित्राई, मातुल, पुत्र, पुत्री, स्त्री, बहेन, पुत्र-स्त्री आदि इपे अनेक वयस्त संभव-संबंध करी यूक्या छे, तो ऐ ताडुं कुटुंब ज छे; एमांथी कोई पारकु नथी, एम धारी अधा साथे मैत्रीभाव राख. ५

**भावि धंधु :**

॥ इंद्रबज्ञा वृत्तं ॥

एकंद्रियाद्या अपि हंत जीवा ।  
पर्वेद्रियत्वाद्यधिगत्य सम्यग् ॥  
बोधिं समाराध्य कदा लभते ।  
भूयो भवभ्रांतिश्रियां विरामं ॥ ७ ॥

**अर्थ :** वणी येतन ! एकंद्रिय ज्ञावो पशा पर्वेद्रियपशुं पामी सम्बन्धशन आराधी कोई वेणा भवभटकशउप भयनो अंत करशे, भोक्ष पामशे, अेवुं विचारी तेओनी साथे मैत्री आदर. ७

**प्राणीभात्र सुखी थाओ :**

या रागरोषादिरुजो जनानां ।  
शास्यंतु वाङ्कायमनोद्रुहस्ताः ॥  
सर्वेषुदासीनसंसंसंतु ।  
सर्वत्र सर्वे सुखिनो भवंतु ॥ ८ ॥

**अर्थ :** वणी येतन ! एती मैत्रीभावना भाव के मन, वयन, कायानो द्रोह करनारा एवा जे राग द्वेषउप जनोना रोग छे ते शांत थाओ ! अधा प्राणी उदासीन भावमां परिश्राम पापो, अने सर्व स्थाने सर्व ज्ञावो सुखी थाओ ! ८

## કર્મવિચિત્રતા અને વિવિધ ગતિ :

હવે મૈત્રીભાવનાનું અષ્ટદાળિયું કહે છે.

॥ દેશાખ રાગ-રે જીવ ! કેન્દ્રમ ક્રીજિયે...એ દેશી ॥

વિનય વિચિત્રય મિત્રતાં,  
ત્રિજગતિ જનતાસુ ।  
કર્મવિચિત્રતયા ગતિ,  
વિવિધાં ગમિતાસુ ॥ વિ૦ ॥ ૧ ॥

અર્થ : હે વિનય ! હે સુવિનીત ચેતન ! આ ત્રણ જગતના જીવો પ્રતિ મિત્રતા ચિંતવ, મિત્રતા ચિંતવ. એ બધા જીવો કર્મની વિચિત્રતાને લઈ વિવિધ ગતિ પામેલા છે. ૧

## બધા તારા મિત્ર :

સર્વે તે પ્રિયબાંધવા,  
ન હિ રિષુરિહ કોપિ ।  
મા કુરુ કલિકલુષું મનો,  
નિજસુકૃતવિલોપિ ॥ વિ૦ ॥ ૨ ॥

અર્થ : એ બધા તારા પ્રિય બાંધવ છે, કોઈ પણ તારો શત્રુ નથી; માટે તારા સુકૃતનો નાશ કરેનાર ઓવા કોષે કરી, વૈરે કરી તારા મનને કલેશ ન પમાડ; કલુષિત ન કર. ૨

## નકામો કોધ શો ?

યદિ કોણ કુરુતે પરો,  
નિજકર્મવશેન ।  
અપિ ભવતા કિ ભૂયતે,  
હાદિ રોષવશેન ॥ વિ૦ ॥ ૩ ॥

અર્થ : એ કોઈ પોતાના કર્મવશે કરી કોપ કરે, તો પણ તું હદ્યને વિષે શા માટે રોષ કરે છે ? અર્થાતું એ તો બિયારો કર્મવશ પડેલ છે, એથી કોધ કરે છે, તું નકામો એ સામો શા માટે રોષ કરે છે ? એથી કર્મ બંધાય છે. ૩

### विवेकसर अने चेतन हँस :

अनुचित मिह कलहं सतां,  
त्यज समरसभीन ।  
भज विवेककलहंसतां,  
गुणपरिवयपीन ॥ वि० ॥ ४ ॥

**अर्थ :** समतारूप ज्ञाना सरोवरमां वसता हे मत्स्य ! आ जगतमां सत्पुरुषोने अयोग्य ऐवो क्लब तु त्यज्ञ हे, त्यज्ञ हे; अने गुणोना परिवयने पुष्ट करनार ऐवुं जे विवेकरूप सरोवर, तेना हे राजहंस ! तु विवेकरूप क्लबहंसताने भज, अर्थात् विवेक आचर, सर्व श्वो प्रति भैत्री आदर. ४

### सर्व ज्ञवनुं ईर्ष्यो सुभ :

शनुजनाः सुखिनः समे,  
मत्सरमपहाय ।  
संतु गंतुभनसोप्यमी,  
शिवसौख्यगृहाय ॥ वि० ॥ ५ ॥

**अर्थ :** बधा शनुजनो मत्सर छोडी ईर्ष्यो सुभी थाओ; तेम ज तेओ शिवसुखनुं धर-भोक्त ते प्रति ज्ञाना भनवाणा थाओ; अर्थात् तेओनुं भोक्त ग्राम थवारूप परम कल्याण थाओ ! आवी भैत्रीभावना हे विनय ! तु भाव. ५

### चाखे ते भागे - सास्वादन :

सकृदपि यदि समतालवं,  
हृदयेन लिहंति ।  
विदितरसास्तत इह रतिम्,  
स्वत् एव वहंति ॥ वि० ॥ ६ ॥

**अर्थ :** अेकवार पक्ष जे तेओ हृदयने विषे समताना बिंदुनो आस्वाद करे, तो तेओने समरस शुं छे ऐनी भबर पडशे, अने पोतानी भेण आ समताने विषे रति भेडशे; अर्थात् समता ज तेओने प्रियकर

થશે.. એમ વિચારી હે વિનય ! તું તેઓ ઉપર રોષ ન આડ. તેઓ કુર્ખવશ છે એમ ગણ અને કર્મ વિવર આપશે ત્યારે ઠેકાણે આવશે, સમતા ગ્રહશે, આમ જાણી તેઓ પ્રતિ મૈત્રી આચર. ૫

### માર્ગ પાંચો :

કિમૃત કુમતમદમૂર્છિતા,  
દુરિતેષુ પત્તંતિ ।  
જિનવચનાનિ કર્ય હહા,  
ન રસાદુપર્યંતિ ॥ વિ૦ ॥ ૭ ॥

અર્થ : અહો ! કુમતરૂપી મદથી મૂર્છિત થએલા આ જીવો કેમ પાપને વિશે પડતા હશે ? અરે ! વીતરાગ પરમાત્માનાં પવિત્ર વચ્ચનોમાં તેઓ શા માટે રસ પામતા નથી ? એમ હે વિનય ! તેઓ પ્રતિ તું મૈત્રીભાવે જો. ૭

### Universal well-being :

પરમાત્મનિ વિમલાત્મનः,  
પરિળઘ્ય વસંતુ ।  
વિનય સમામૃતપાનતો,  
જનતા વિલસંતુ ॥ વિ૦ ॥ ૮ ॥

અર્થ : નિર્મણ અંત:કરણવાળા જીવો પરમાત્માને વિશે પરિણામ ખમો; અર્થાત્ પરમાત્માના સ્વરૂપમાં લીન થાઓ; અને હે વિનય ! હે સુવિનીત થેતન ! જનમંડળ સમતારૂપી અમૃત પાને કરી વિલાસ પાંચો-આનંદ પાંચો. અથવા વિનય અને સમતારૂપી અમૃતપાન વડે જનમંડળ આનંદ અનુભવો. આવો વિચાર કરી હે વિનય ! તું જગજંતુ પ્રતિ મૈત્રીભાવ ધારણ કર ! મૈત્રીભાવ ધારણ કર !! ૮

॥ ઇતિ શ્રી શાંતસુધારસગોયકાબ્યે મૈત્રીભાવના

વિભાવનો નામ ત્રયોદશઃ ગ્રકાશઃ ॥

ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાણબદ્ધ કાબ્યનો  
મૈત્રીભાવના નામનો તેરમો પ્રકાશ સમાપ્ત.



ॐ

## પ્રમોદ ભાવના॥

વીતરાગ સ્તવ અને ગુજરાતી પ્રમોદ :

॥ સ્થથરા વૃત્ત ॥

ધન્યાસ્તે વીતરાગઃ ક્ષપકપથગતિક્ષીણકર્માપરાગ-  
સ્તૈલોક્યે ગંધનાગઃ સહજસમુદ્દિતજ્ઞાનજગ્નાવિરાગઃ ।  
અધ્યારુદ્ધાત્મશુદ્ધયા સકલશસિકલાનિર્મલધ્યાનધારા-  
મારાનુકર્તેઃ પ્રગઞાઃ કૃતસુકૃતશતોપાર્જિતાહર્ત્યલક્ષ્મી ॥ ૧ ॥

અર્થ : (ગુજરાતી પદ્ધતિ એ પ્રમોદ ભાવના, તો તેવા ગુજરાતી દેખી કેવો પ્રકૃષ્ટ આનંદ થાય ? એ બતાવતા પરમગુણી એવા વીતરાગ દેવની સુતિ કરે છે) અહો ! ધન્ય છે તે વીતરાગ પરમાત્માઓ ! કે જેણે ક્ષપકશ્રેષ્ઠી પર ચઢી કર્મભળને ધોઈ નાંખી ક્ષીણ કર્યા છે; જેઓ ત્રણ લોકને વિષે ગંધહસ્તી સમાન છે; જેઓને સહજ ઉદ્ય પામેલા ડેવલજ્ઞાને કરી વૈરાગ્ય જાગ્યો છે; જેઓ આત્મશુદ્ધિ વડે સંપૂર્ણ ચંદ્રકલા જેવી શેત-નિર્મળ ધ્યાનધારાએ ચચ્ચા છે અને જેઓ સેંકડો ગમે પુષ્યકર્મે કરી અહીંત ભગવાનને યોગ્ય લક્ષ્મી પ્રામ કરી મુક્તિ નજીક પહોંચ્યા છે. અહો ! આવા વીતરાગ પરમાત્માઓ ધન્ય છે ! ધન્ય છે !! (આમ ગુજરાતી જેઈ હર્થાયિમાન થઈ જવ પ્રમોદ ધારણ કરતો અનંત નિર્જય કરે છે.) ૧

તેણાં કર્મક્ષયોત્યૈરતનુગુણગળૈનિર્મલાત્મસ્વભાવૈ-  
ગર્ય ગાય પુનીમઃ સ્તવનપરિણતૈરષ્ટવર્ણાસ્પદાનિ ॥  
ધન્યાં મન્યે રસજ્ઞાં જગતિ ભગવતઃ સ્તોત્રવાણીરસજ્ઞા-  
મજ્ઞાં મન્યે તદન્યાં વિતથજનકથકાર્યમોખર્યમગ્રાં ॥૨॥

**અર્થ :** અહો ! તે તીર્થકર ભગવાનને કર્મક્ષય થવાથી ઘણા ગુણોનો સમૂહ ઉત્પત્ત થયો છે; નિર્મળ આત્મસ્વભાવ પ્રગટ્યો છે અને તેથી તેની સુતિ થઈ છે; અહો ! એવા પરમાત્માના આ ગુણોની સુતિ ગાઈ ગાઈને અમે આઈ વર્ણના પદને પવિત્ર કરીએ છીએ. અહો ! હું જગતમાં તે જીબને ધન્ય ગણું હું કે જી જીબ ભગવાનનાં સ્તોત્ર ગાવામાં રસ્ત છે, ભગવાનની સુતિ કરવામાં રસ લે છે; બીજુ જીબ જે નકારી જનકથામાં, વિકથામાં, યદ્વાતદ્વા બોલવામાં મશગૂલ છે, તેને અજ્ઞ-અધન્ય માનું હું. ૨

### વીતરાગની સુતિ કરનારાની સુતિ – ગુણપ્રમોદ :

અતે એમ બતાવ્યું કે તીર્થકર પરમાત્મા તો ધન્ય છે, પણ તેઓશ્રીની સુતિ ગાનારા પણ ધન્ય છે.

નિર્ગ્યાસ્તેઽપિ ધન્યા ગિરિગહનગુહાગ્નારાંતનિવિદ્ધા ।

ધર્મધ્યાનવધાનાઃ સમરસસુહિતાઃ પક્ષમાસોપવાસાઃ ।

ચેઽન્યે�પિ જ્ઞાનવંતઃ શ્રુતવિતતધિયો દત્તધર્મોપદેશાઃ ।

શાંતા દાંતા જિતકા જગતિ જિનપતે: શાસન ભાવયંતિ ॥ ૩ ॥

**અર્થ :** પર્વતોની ગાઢન ગુફા-કોતરોમાં રહી ધર્મધ્યાનમાં એકાગ્ર, સમતાવંત, પક્ષદિન કે માસના ઉપવાસ કરાવાવાણા નિર્ભ્રથ, રાગ-દ્વેષની ગ્રંથિ જેની છેદાઈ છે, એવા મહાપુરુષો પણ ધન્ય છે. તેમ જે બીજા જ્ઞાનવંત મહાપુરુષો જેની બુદ્ધિ શ્રુતજ્ઞાને કરી વિસ્તાર પામી છે, જેઓ ધર્મનો ઉપદેશ કરી રહ્યા છે, જે શાંત છે, જે દાંત છે, જિતોદ્રિય છે અને જે જગતને વિષે શ્રી જિનવરેન્દ્રનાં પવિત્ર શાસનને પ્રકાશિત કરે છે, તેઓ પણ ધન્ય છે. ૩

### ધર્મપુરુષો ધન્ય, ગુણપ્રમોદ :

દાન શીલ. તણો યે વિદધતિ ગૃહિણો ભાવનાં ભાવયંતિ ।

ધર્મે ધન્યાશ્રતુર્ધા શ્રુતસમુપચિતશ્રદ્ધયારાધયંતિ ॥

સાધ્યઃ શ્રાદ્ધયક્ષ ધન્યાઃ શ્રુતવિશદધિયા શીલમુદ્ભભાવયોત્-

સ્તાનું સર્વાન્નું મુક્તા ગર્વાઃ પ્રતિદિનમસકૂદ્ર ભાગ્યભાજાઃ સુવંતિ ॥ ૪ ॥

**અર્થ :** વળી તે ગૃહવાસીજનો જે દાન, શીલ, તપ આહરે છે, ભાવના ભાવે છે અને એ પ્રકારે ચાર પ્રકારનો ધર્મ શુદ્ધશાનથી વૃદ્ધિ પામતી શક્યાએ આરાધ્ય છે, તે ધન્ય છે; તેમજ વળી તે સાધ્યાઓ અને શાવિકાઓ, જેની બુદ્ધિ પવિત્ર શુદ્ધશાન વડે વિશુદ્ધ થઈ છે, અને જે શીલનું પાલન કરે છે તે પણ ધન્ય છે.

### ગુજરાનુરાગી ધન્ય ગુણપ્રમોદ :

અહો ! આ બધાને પ્રતિદિવસ નિરંતર જે જીવો ગર્વ છાડી દઈ સત્તે છે, તેઓ ભાગ્યશાળી છે. અર્થાત્ ગુજરીના ગુણો દેખી અનુમોદનાર, પ્રમોદભાવ પામનાર, હર્ષ પામનાર મહાભાગ્યવંત છે. ૪

આ તો પરમ ભાગ્યશાળી અદ્વા સમ્યગુદૃષ્ટિ જીવોની સ્તુતિ થઈ, પણ પ્રમોદ ભાવનાવાસિત જીવો અન્યના ગુણો દેખી પણ પરમ આનંદ પામે છે, એ દેખાડતાં કહે છે.

“પરગુણપરમાણૂન् પરતીકૃત્ય નિત્યં ।

નિજહદિ વિકસંતઃ સંતિ સંતઃ કિયંતઃ ॥”

— શ્રી ભર્તૃહરિ

### માર્ગનુસારી ધન્ય — ભાવિબોધ જીવ — ગુણપ્રમોદ :

॥ ઉપજાતિ વૃત્તં ॥

મિથ્યાદૃશામયુપકારસારં ।

સંતોષસત્યાદિગુણપ્રસારં ॥

કદાન્યતા વૈનયિકાપ્રકારં ।

માર્ગનુસારીત્યનુમોદયામઃ ॥ ૫ ॥

**અર્થ :** મિથ્યાદૃષ્ટિઓ પણ જેઓમાં સંતોષ, સત્ય, શૌચ આદિ ગુણો પ્રકાર રહ્યા છે, જેમાં દાન ગુણ, વિનય ગુણ રહેલા છે, તેઓનો પણ અમે ઉપકાર માનીએ છીએ, અને તેઓ પણ માર્ગનુસારી છે એમ જીથી અનુમોદના કરીએ છીએ. અર્થાત્ ભલે સમ્યગુદૃષ્ટિ ન હોય પણ સત્ય, સંતોષ, શૌચ, દાન, વિનય આદિ ગુણોવાળા જીવો દેખી અમને બહુ

પ્રમોદ ઉપજે છે. એઓ પણ માર્ગને અનુસરવાવાળા જાણી કોઈ વેળા એ જ ગુણોથી સમ્યગ્ બોધ પામી કલ્યાણ પામશે, એ જાણી અમને આનંદ થાય છે. ૫

### જીભ, કાન, આંખ ધન્ય – ગુણપ્રમોદ :

॥ સ્વર્ગરાવૃત્ત ॥

જિહ્વે પ્રાણી ભવ ત્વં સુકૃતિસુચરિતોદ્વારણે સુપ્રસન્ના ।  
ભૂયાસ્તામન્યકીર્તિશ્રુતિરસિકતયા મેઝય કર્ણો સુકર્ણો ॥  
વીક્ષાન્યપ્રૌઢલક્ષ્મી દ્વાતમુપચિનુતાં લોચને રોચનત્વં ।  
સંસારેઽસ્મિન્નસારે ફલમિતિ ભવતાં જન્મનો મુખ્યમેવ ॥ ૬ ॥

અર્થ : હે જીભ ! તું પુરુષશાળી જીવોનાં સુચરિતો ઉથ્યારી પવિત્ર થા, સુપ્રસન્ન થા; બીજાની કીર્તિ સાંભળવાનો રસ પામી મારાં બંને કાનો આજે સુકર્ણ અર્થાત્ સફળ થાઓ. અહો ! બીજાની ઉત્તમ લક્ષ્મી, બીજાનું ઐશ્વર્ય દેખી મારાં લોચનો ઠરો, દ્રવો, એમાંથી હર્ષાશ્રૂ આવો. હે જીવ ! હે કાન ! હે ચક્કુ ! આ અસાર સંસારમાં આવી ભાવના એ જ તમારા જન્મનું પરમ સાર્થક છે. ૬

### ગુણગ્રામથી ગુણ વધે :

॥ ઉપજાતિ વૃત્ત ॥

પ્રમોદમાસાદ્ય ગુણૈ: ફરેણા ।  
યેણા મતિ: મજ્જતિ સામ્યસિંધૌ ॥  
દેદીપ્રતે તેષુ મન:પ્રસાદો ।  
ગુણાસ્તથૈતે વિશદીભર્વંતિ ॥ ૭ ॥

અર્થ : બીજાના ગુણોથી પ્રમોદ પામી જેની મતિ સમતાસમુદ્રમાં જીલે છે, તેનું મન પ્રહૃદિલિત થઈ દીપી રહે છે, એટલું જ નહિ પણ તેની ગુણો પણ વિશુદ્ધ થઈ જણહળી હાલે છે. પારકાનાં ગુણોથી પ્રમોદ પામવાનું, પારકા ગુણો જોઈ રાજુ થવાનું આવું ઉત્તમ ફળી છે. ૭

### ગુણાનુરાગ :

હવે પ્રમોદ ભાવનાનું અષ્ટદાળિયું કહે છે :

॥ ટોડી રાગ-ક્રષ્ણભકી મેરે મન ભગતિ વશીરી-એ દેશી ॥

વિનય વિભાવય ગુણપરિલોષં ॥ ધ્રુવપદં ॥

નિજસુકૃતામ્બરેષુ પરેષુ ।

પરિહર દૂરં મત્તરદોષં ॥ વિ૦ ૧ ॥

અર્થ : હે વિનય ! તું ગુણી પુરુષોના ગુણથી સંતોષ આનંદ પામવાનું વિચાર. પોતાનાં સુકૃત્યોથી જે વર પામ્યા છે અથવા જે પોતાનાં સુકૃત્યોથી ભાગ્યશરાળી થયા છે, અથવા જે પોતાના સુકૃત્યોથી ઉત્તમ આમ પુરુષોની સર્કમાં બિરાજે છે, એવા અન્ય મહિદ્ભાગીઓ પ્રતિનો મત્તસર, ઈચ્છા દોષ દૂર કરે. તેઓના ગુણોનો રાગી થા; તેઓના ગુણથી આનંદ પામ ! આનંદ પામ !! ૧

### ગુણાનુમોદન - પુષ્યનું કારણ :

દિષ્ટયાયં વિતરતિ બહુદાન,

વરમયમિહ લભતે બહુમાનં ॥

કિમિતિ ન વિમૃશસિ પરપરમાગં,

યદિભજસિ તત્સુકતવિભાગં ॥ વિ૦ ૨ ॥

અર્થ : અહો શાબાશ છે આને, કે એ બહુ દાન આપે છે, અથવા બહુ રૂંડું થાય છે કે આને આ જગતમાં બહુમાન મળે છે. (અહો ! એનાં સુકૃત્યો જોતાં એ માન એને છાજે જ છે.) હે વિનય ! તું આ પ્રકારે કેમ હજુ સુધી વિચારણા કરતો નથી ? સ્થળે સ્થળે પારકા ગુણો ગાવા એ જ હે વિનય ! તેના ગુણોમાં, સુકૃતોમાં ભાગ લેવા જેવું છે. તાત્પર્ય કે ગુણીને, પુષ્યકર્તાને ગુણ-પુષ્યનું તો ફળ છે, પણ ગુણ-પુષ્યની જે અનુમોદના કરે છે, તે પણ તેનો ભાગી થાય છે. ૨

### ગુણી પુરુષોનાં નામનો જ્ઞાપ પણ કલ્યાણકારી :

યેષાં મન ઇહ વિગતવિકારાં,

યે વિદધતિ ભુવિ જગદુપકારાં ॥

તેણા વયસુચિતાવારિતાનાં,  
નામ જપાનો વારંવારં ॥ વિંઠ ૩ ॥

**અર્થ :** આ જગતમાં જે પવિત્ર પુરુષોનાં મન વિકારરહિત થયાં છે, જે મહાત્માભ્યર્વંત પુરુષો જગત પર ઉપકાર કરે છે, તે ઉચ્ચિત-આચરણવાળા મહાપુરુષોનાં નામ અમે વારંવાર ક્ષણો ક્ષણો જીવીએ છીએ અર્થાત્ એવા મહા સત્યપુરુષોનાં ગુણો દેખી તેઓનાં એવા નામથી પણ અમે આનંદ પામીએ છીએ. ગુણી પુરુષોનાં નામનો જપ પણ પરમ કલ્યાણદાતા છે, માટે હે વિનય ! તું પરના શુદ્ધ દેખી રહ્યું થા, રાજુ થા. ૩

**ગુણદર્શનથી આનંદ, ભગવાનની ક્ષમા !**

અહઃ તિતિક્ષા ગુણમસમાનં,  
પશ્યત્ ભગવતિ મુક્તિનિવાનં ॥  
યેન રૂણ સહ લસદભિમાનં,  
જાટિતિ વિઘટતે કર્મવિતાનં ॥ વિંઠ ૪ ॥

**અર્થ :** અહો ! જેના સમાન બીજે કોઈ ગુણ નથી, અને જે મુક્તિના કારણદુઃખ છે, એવો તિતિક્ષા-ક્ષમા ગુણ શ્રીભગવાનને વિધે જુઓ ! કે જે ક્ષમાગુણને લઈ કોષસહિત અતિમાને કરી નાચતો એવો કર્મનો સમૂહ એકદમ નાશ પામે છે ! અહો ! ધન્ય છે ! એ ભગવાનના ક્ષમા ગુણને ! એમ હે વિનય ! તું તારા ફદ્યમાં પરગુણથી સંતોષ પામ, સંતોષ પામ. ૪

**શીલનો મહિમા – સત્યીલવાન ધન્ય :**

અદ્યુः કેવન શીલમુદારં,  
ગૃહિણોऽપિ પરિહતપરદારં ॥  
યશ ઇહ સંપ્રત્યપિ શુચિ તેણાં,  
વિલસતિ ફલિતફલં સહકારં ॥ વિંઠ ૫ ॥

**અર્થ :** જે જે ગૃહસ્થીઓ પરસ્ત્રીનો પરિત્યાગ કરીને ઉત્તમ-ઉદાર શીલની આદરે છે, તેઓનો પવિત્ર ઉજ્જીવણ યશ અને ઉમણાં પણ

ફળિત થઈ અંભાના વૃક્ષ પેઠે શોભી રહે છે; અર્થાત્ તેઓને પરભવે તો કાળાંતરે લાભ થાય છે, પણ હમણાં તત્કાળ તેઓનો યશ વૃદ્ધિ પામી અનેક ફળ આપે છે, આવો શીલનો મહિમા છે. તેવા શીલપ્રતધારી જીવો ધન્ય છે, એમ હે વિનય ! તું પારક ગુણની અનુમોદના કર. ૫

**સતી સ્ત્રી ધન્ય – સતીનું દર્શન, પુષ્યનું ફળ અને પુષ્યજ્ઞનક :**

આ વનિતા અધિય યશસા સાકં,  
કુલમુગલ વિદ્ધાતિ સુપત્તાકં, ॥  
તાસાં સુચરિતસાચિતરાકં,  
દર્શનમપિ કૃતસુકૃતવિપાકં ॥ વિ૦ ૬ ॥

અર્થ : તેમજ જે સ્ત્રી પણ પોતાના શીલ ગુણો કરી પોતાના માવિત્ર તથા પતિના એમ બંને કુળને યશની ઘજ બંધાવે છે, અર્થાત્ શીલ પાળી બંને કુળને જે અજવાણે છે તે સ્ત્રીઓનું પુષ્યપરિપાકથી પ્રામ થયેલું જે દર્શન તે પણ પુષ્યરૂપી ઘન પ્રામ કરાવનારું છે. અર્થાત્ આવો શીલવંતી સ્ત્રીઓનું દર્શન હુર્લબ્દ છે; અને એ દર્શન પ્રામ થાય તો તે પણ પુષ્યનો ઉદ્ય હોય તો જ થાય છે; અને દર્શન થાય તો તે દર્શન પણ ભાવિ પુષ્યનું કારણ છે. અહો ! આવો શીલવંતી વનિતાઓ ધન્ય છે. એમ હે વિનય ! તું પારક ગુણોથી રોમાંચિત થા, રોમાંચિત થા. ૬

**તત્ત્વ વિવેચક ધન્ય :**

તાત્ત્વિકસાત્ત્વિકસુજનવતંસા:,  
કેચન યુક્તિવિવેચનહંસા: ।  
અનમકૃષત કિલ ભુવનાભોગં,  
સ્મરણમમીષાં કૃતશુભયોગાં ॥ વિ૦ ૭ ॥

અર્થ : તત્ત્વ અને સત્ત્વ ગુણને ધારણ કરનારા એવા સંજ્ઞાનોમાં શ્રેષ્ઠ, અને જેમ હંસ યુક્તિથી દૂધ પાણીનો વિવેક કરી દૂધ બ્રહ્મણ કરે છે તેમ જે યુક્તિ વડે સારોસારનો વિવેક કરે છે, - એવા પુરુષો ત્રણું જગતના ખરેખર ભૂષણરૂપ છે, તેઓના સ્મરણથી પણ શુદ્ધ યોગ પ્રામ થાય છે. અર્થાત્ જે પવિત્ર પુરુષો સત્ત્વ ગુણધારી તત્ત્વને બ્રહ્મણ કરે છે.

અને સારાસારનો લેણ જાણી સાર ગ્રહે છે તેઓ ધન્ય છે, હે વિનય !  
એવા તત્ત્વશોધકીની તું અનુમોદના કર. ૭

### ગુણાનુરાગરૂપ જન્મ પણ ધન્ય :

ઇતિ પરગુણપરિભાવનસારં,  
સફળય સતતં નિજમબતારં ॥  
કુરુ સુવિહિતગુણનિધિગુણગાનं,  
વિરચય શાંતસુધારસપાનં ॥ વિ૦ ૮ ॥

અર્થ : અહો ! જન્મ લેવાનું સાર્થક પારક ગુણાનું  
ચિંતવન-અનુમોદન છે, તો હે વિનય ! એમ કરી તું તારો અવતાર  
એકદમ સર્ફણ કરી લે; અને સારા આચરણવાળાં ગુણના ભંડાર એવા  
મધાપુરુષોનું ગાન કર, અને આ શાંતસુધારસનું પાન કરી અમૃત થા.  
એમ હે વિનય ! તું પારક ગુણ ચિંતવ, અનુમોદ. ૮

॥ ઇતિ શ્રી શાંતસુધારસગોયકાવ્યે પ્રમોદ-ભાવના વિભાવનો નામ જ્ઞતુર્વશः પ્રકાશઃ ॥

ઇતિ શ્રી શાંતસુધારસ નામના ટાળખદ્ધ કાવ્યમાં  
પ્રમોદ ભાવના નામનો ચૌદ્ભો પ્રકાશ સમામ.



ॐ

## કારુણ્ય ભાવના

જગતના જીવોનાં દુઃખ અને તેથી ઉપજતી કરુણાઃ

॥ માલિની વૃત્તં ॥

પ્રથમમશનપાનપ્રામિવાંચ્છાવિહસ્તા ।

સ્તદનુ વસનવેશમાલંકૃતિવ્યગ્રવિત્તાઃ ॥

પરિણયનમપત્યાવામિમિષેદ્રિયાર્થાન् ।

સતતમભિલંઘંતઃ સ્વસ્થતાં ક્વાસુતીરન् ॥ ૧ ॥

**અર્થ :** અહો ! આ જગતવાસી જીવોની સ્થિતિ જેઈ કરુણા આવે છે. અહો ! નવી નવી ઉત્પત્તિ થતી એવી અનંત અભિલાષા આડે તેઓ સ્વસ્થતા તે કેમ પામે ? પ્રથમ તો ખાનપાનની પ્રામિની ઈચ્છાએ તેઓ આકુળ-વ્યાકુળ રહે છે, એથી તેઓ પોતાના આત્માનું કાંઈ કરી શકતા નથી; ખાનપાનની પ્રામિ થઈ, ત્યાં વળી લુગડાં-લતાં, ઘર-બાર, અને ઘરેઝાં,- ગાંઠા મેળવવા ચિત્ત વ્યત્ર થાય છે; આ આડે પણ આત્માર્થ ક્યાંથી સૂઝે ? જ્યાં એ લુગડાં-લતાં આદિની ભાગ્યયોગે પ્રામિ થાય છે ત્યાં પરણવાની, અને પછી પુત્ર-પ્રામિની અને કુમે કુમે ઈદ્રિયોના ઈન્દ્રિય ભોગ મેળવવાની અભિલાષા ઉપજે છે. અહો ! આમ નવી ઉગતી અભિલાષા આડે જગતવાસી જીવો સ્વસ્થતા, આત્મશાંતિ તે ક્યાંથી પામે ? એ વિચારતાં કરુણા આવે છે. ૧

જીવ, ભૂલો ભમ નહિ !

॥ શિખરિણી વૃત્તં ॥

ઉપાયાનાં લક્ષે: કથમણિ સમાસાદ્ય વિભવં ।

ભવાભ્યાસાત્તત્ર ધ્રુવમિતિ નિવધનાતિ હૃદયં ॥

અથાકસ્માદસ્મિન્ચિકિરતિ રજઃ કૂરહ્દયો ।

રિપુર્વા રોગો વા ભયમુત જરા મૃત્યુરથવા ॥ ૨ ॥

અર્થ : અહો ચેતન ! લાખો ઉપાયો વડે કરી મહામુશકેલીએ તું વૈભવ પાય્યો; તે વૈભવ જાણે હંમેશા માટે કાયમ રહેવાનો છે એમ જાણી ભવોભવના અભ્યાસને લઈ તારું ચિત્ત તું તેમાં ચોટાડે છે; અર્થાત્ એ લક્ષ્મી સ્થિર છે એમ ગણી તું તેમાં લય પામે છે; પણ અરે ! તને ખબર નથી. એના ઉપર કોઈ કૂર વ્યદ્યવાળો શત્રુ અથવા રોગ અથવા ભય અથવા વૃદ્ધાવસ્થા અથવા મૃત્યુ અકસ્માત ધૂળનાંખે છે. અર્થાત્ તું એમાં મોહ શું પામે છે ? કોઈ શત્રુ પેદા થશે અને એ લક્ષ્મીને ઓચિતી હરી જશે; અથવા તને જ કોઈ રોગ થશે, અને તું એનો ઉપભોગ નહિ લઈ શકે; અથવા રાજ્યાદિકના ભયથી એ જ લક્ષ્મી તને હુઃખનું કારણ થશે; અથવા જરાવસ્થાને લઈ તું એ ભોગવી નહિ શકે અથવા બીજા યુવાનો પડાવી લેશે અથવા અકસ્માત છેવટ મૃત્યુ આવ્યે એ લક્ષ્મી તારે છાડવી પડશે; તો હે ચેતન ! તું એને કાયમ રહેવાની ગણી તેમાં લય પામે છે, એ જોઈ તારી કરુણા આવે છે. ૨

“હે ! જીવ ક્રય ઈર્થિત હવે, હે ઈર્થણા હુઃખ મૂલ;  
જબ ઈર્થણા કા નાશ તબ, મટે અનાદિ ભૂલ.”

— શ્રીમહ રાજચંદ્ર

અહો ! અરસપરસ કલેશ :

॥ સ્વર્ઘરા વૃત્તં ॥

સ્વર્ઘંતે કેઽપિ કેવિદ્ર દધતિ હદિ મિથો પત્સરં કોધદર્ધા ।

યુધ્યંતે કેષ્ઠરુદ્ધા ધનયુવતિપશુક્ષેત્રપદ્રાદિહેતો : ॥

કેવિલોભાલ્લભંતે વિપદમનુપરં દૂરદેશાનંતઃ : ।

કિં કુર્મઃ કિં વદાપો ભૃત્યમરતિશતૈવર્યાકુલ વિશ્વમેતત ? ॥ ૩ ॥

અર્થ : અહો ! અમને કરુણા આવે છે; અમે શું કરીએ ? અમે શું બોલીએ ? આ જગત સેંકડો ગમે હુઃખોથી અત્યંત વ્યાકુળ છે. કોઈ કોઈ

જીવો અરસપરસ સ્પર્ધા કરી રહ્યા છે; કોઈ કોષથી બળીને હદ્દયને વિશે અરસપરસ મત્સર-ઈખ્યા ધારણ કરી રહ્યા છે; કોઈ સ્વચ્છદેખન-સ્ત્રી-પશુ-ક્ષેત્ર-ગામ આહિનાં કારણે લડી રહ્યા છે, અને તેટલાંક લોભને લઈ દૂર દેશાંતરમાં ભટકતા સત્તા પદે પદે વિપત્તિઓ પામે છે. અહો ! આવી રીતે આપું જગત અનેક દુઃખોએ કરી અત્યંત વ્યાકુળ છે ત્યાં અમે શું કરીએ ? અમે શું બોલીએ ? અમને દયા આવે છે; કરુણા આવે છે; અનુકૂળા સ્હુરે છે. ૩

**બેસવાની ડાળ ભાંગે છે !**

॥ ઉપજાતિ વૃત્તં ॥

સ્વર્વં ખનંતઃ સ્વકરેણ ગર્તાન् ।  
મધ્યે સ્વંય તત્ત્વ યથા પતંતિ ॥  
તથા તતો નિષ્ક્રમણં તુ દ્વો-  
ઇદ્યોધઃ પ્રપાતાદ્વિરમંતિ નૈવ ॥ ૪ ॥

**અર્થ :** અહો ! પ્રાણીઓ પોતે પોતાના હાથે ખાડા ખોદી તેમાં એવી રીતે પડે છે કે તેમાંથી બહાર નીકળું તો દૂર રહ્યું, પણ નીચે ને નીચે સરતા જ અય છે; બિચારાના અધોપાતનો અંત જ નથી આવતો, - એવી ખરાબ રીતે, તૃષ્ણા અંગે, કથાય અંગે, અજ્ઞાનને લઈ તેઓ ખાડો ખોદે છે અને તેમાં પોતે પડે છે. અહો ! આ જાણી દેખી કરુણા આવે છે. ૪

**નાસ્તિકમતિ કરુણા :**

પોતે ખોટેલા ખાડાનું દૃષ્ટાંત આપે છે.

ગ્રકલ્પયજ્ઞાસ્તિકતાદિવાદ- ।  
મિદં પ્રમાદં પરિશીલયંતઃ ॥  
મમના નિગોદાદિષુ દોષદંધા ।  
દુરંતદુઃખાનિ હહા સહંતે ॥ ૫ ॥

**અર્થ :** અહો ! જીવ જેવું કર્દી છે નાહિ, અથવા જીવ જન્મે છે અને

મરે છે, એમ જીવના અસ્તિત્વમાં નહિ ભાજનારા, પાપ-પુણ્ય છે નહિ એમ નાસ્તિકાદિ વાદની પ્રકલ્પના કરી, પ્રમાદ સેવી, દોષે કરી દળ થઈ, નરક-નિગોદાદિ અધોગતિમાં બૂડી જીવો,- જેનો અંત મહામુશ્કેલીએ આવે એવાં દુઃખો સહન કરી રહ્યા છે,- એ દેખી ખરેખર કરુણા આવે છે. જીવ પોતે જ પોતાની મેળે ખાડો ખોદે છે અથડી સ્વર્ચદે કલ્પના કરે છે કે જીવ કે પુણ્ય-પાપ જેવું કંઈ નથી. ખાંચો, પીંચો, વિષયાદિ સેવો-એમ નાસ્તિક, જાળ પાથરે છે, અને પાપ-પુણ્યની શ્રદ્ધા નહિ હોવાથી વિષયકખાયમાં યથેચું વર્તી પરિણામે નરકનિગોદમાં પડે છે. ત્યાં પણ દુર્બંધ ભોગવતા છતાં વધારે ને વધારે ઊડાં દુઃખનાં સ્થાનમાં ઊતરતા જાય છે, કેમ કે જીવને પોતાના હોવાપણાનું, પાપ-પુણ્યનું ભાન થાય છે, તેની શ્રદ્ધા થાય છે ત્યારે એ પ્રમાણથી વિરામ માબે છે, અને પ્રમાદ છાડે તો કબે કબે સારી ગતિ પામી શાશ્વત સુખ પામે છે; પણ જિયારા નાસ્તિકોને એ ગમ ન હોવાથી પોતે પાથરેલી જાળમાં પોતે જ એવા લેવાતા જાય છે કે તેમાંથી છૂટવું મહામુશ્કેલ થાય છે, આ દેખી દ્યા આવે છે. ૫

### સર્વ જીવનું ઈચ્છો સુખ :

શ્રુણંતિ યે નૈવ હિતોપદેશં ।  
ન ધર્મલેશં મનસા સ્યુંભંતિ ॥  
રૂજઃ કથંકારમથાપનેયા- ।  
સ્તોષામુપાયસ્ત્વયમેક એવ ॥ ૬ ॥

**અર્થ :** અહો ! જે પ્રાણીઓ ડિતોપદેશ સાંભળતા નથી, જેને ધર્મના લેશનો પણ મનથી સ્પર્શ થતો નથી, તેનાં રોગો, દુઃખો કેવા પ્રકારે દૂર થઈ શકે ? તે દુઃખ દૂર કરવાનો ઉપાય તો આ એક જ છે. ૬

એ ઉપાય બતાવે છે :

॥ અનુસુપ્ત વૃત્ત ॥  
પરદુઃખપ્રતીકારમેવ ધ્યાયંતિ યે હદિ ।  
તભંતે નિર્વિકારં તે સુખમાયાતિસુંદરં ॥ ૭ ॥

**અર્થ :** જે પ્રાઇસીઓ પારકાનાં દુઃખનાં ઉપાય હૃદયને વિશે ભાવે છે તે પ્રાઇસી પરિણામે સુંદર એવાં નિર્વિકાર સુખને પામે છે, અર્થત્ જીવ બીજું તો કદાચ ન કરી શકે તો કાંઈ નહિ, પણ પારકાં દુઃખ કેમ ટળે ? એટલો માત્ર વિચાર સદા હૃદયને વિશે કરે તો તે પરિણામે સુખી ધાય છે; માટે નાસ્તિક આદિને કરુણા ભાવથી કહે છે કે બલે તમે બોઝે હિતોપદેશ ન સાંભળો, બલે તમે બીજું ધર્મકૃત્ય ન કરો, પણ તમે આટલું તો કરો, કે પારકાનાં દુઃખ કેમ ટળે એનો અહોનિશ વિચાર તમારે કરવો. અહો ! તમારી અમને કરુણા આવે છે. તમે પારકાનાં દુઃખો દૂર કરવાના ઉપાયો ચિંતવશો તો તમારાં દુઃખ દૂર થશે. ૭

### નિષ્કારણ કરુણાવાળા ભગવાનને ભજો :

હવે કરુણય ભાવનાનું અષ્ટધાળિયું કહે છે :

॥ રામકુલી રાગ-હમારો અંબાર દેહુ સુરતી... એ દેશી ॥

સુજના ભજત મુદા ભગવંતં ॥ ધ્રુવપદ ॥

શરણાગતજનમિહ નિષ્કારણ-

કરુણાવંતમંતં રે ॥ સુ૦ ॥ ૧ ॥

**અર્થ :** હે સુજન જનો ! તમે ભગવંતને પરમ ગ્રેમે હર્ષે ભજો; તમે ભગવંતને પરમ ભાવે ભજો. અહો ! એ ભગવાન આ જગતમાં પોતાને શરણો આવેલા જનોની નિષ્કારણ કરુણાએ રક્ષા કરે છે. માટે હે સજજનો ! એવા નિષ્કારણ કરુણાણું પ્રભુને પરમ પ્રમોદ ભાવે ભજો ! ભજો. ॥ ૧ ॥

### મન સ્થિર કરો :

ક્ષણમુપધાય મન: સ્થિરતાયાં,

પિબત જિનાગમસારં ।

કાપથપટનાવિકૃતવિચારં ।

ત્વજત કૃતાંતમસારં રે ॥ સુ૦ ૨ ॥

**અર્થ :** મનને એક ક્ષણ સ્થિરતામાં આણીને જિનાગમસારનું પાન કરો, અને જે કૃત્યોમાં કુત્સિત ઘટનાએ કરી આપણા વિચારમાં વિકાર

આવે છે તેને અસાર જડી, તેનો અંત આણી તેને ત્યજી દો. આમ હે સુજનો ! તમે મનને સ્થિર કરો, અસાર વિચાર છાંડી દો. એ બાબતની કરુણા ઊપજે છે. ૨

### કુગુરુ તજો, સુગુરુ ભજો :

પરિહરણીયો ગુરુસિવેકી,  
અમયતિ યો મતિમંદ ॥  
સુગુરુવચઃ સકૃદપિ પરિષીતં,  
પ્રથયતિ પરમાનંદ રે ॥ સુ ૦ ૩ ॥

**અર્થ :** મંદમતિવાળાને જે ભમાવે છે એવા અવિવેકી ગુરુનો ત્યાગ કરવો. સદ્ગુરુનું વચન એક વખત જ પીવામાં આવે, અથીત સદ્ગુરુના વચનામૃતનું એક જ વાર પાન કરવામાં આવે, તો તે પરમાનંદને વિસ્તારે છે; માટે હે સુજનો ! તમે પ્રમોદભાવે ભગવંતને ભજો. અવિવેકી ગુરુનો ત્યાગ કરો. તમારા પ્રતિ કરુણા આવે છે, એથી આ કહીએ છીએ. ૩

### દૈશ્યધને માર્ગ કાં પૂછો :

કુમતતમોભરમીલિતનયનं,  
કિમુ પૃછ્છન પન્થાન ? ।  
દાધિબુદ્ધયા નર જલયંથન્યા,  
કિમુ નિદધત મંથાન રે ? ॥ સુ ૦ ૪ ॥

**અર્થ :** અધો, સજજનો ! કુમતરૂપ ગાઢ અંધકારથી જેનાં લોયન મીચાઈ ગયાં છે, બિડાઈ ગયા છે, એવા અસદ્ગુરુને તે તમે શાને માટે માર્ગ પૂછો છો ? જે માર્ગ પોતે જ ન દેખતો હોય તે બીજાને કચાંથી બતાવશે ? હે સજજનો ! દહી મળશે એવી બુદ્ધિથી તમે પાણીથી ભરેલી દોષીમાં મંથ – રવેયો શાને ફેરવો છો ? પાણી વલોવવાથી કાંઈ દહી નહીં મળે, તેમ અસદ્ગુરુને પૂછવાથી માર્ગ નહીં મળે. ૪

### મન કાબૂમાં આણો :

અનિરુદ્ધ મન એવ જનાનાં,  
જનયતિ વિવિધાતંક ॥

સપદિ સુખાનિ તદેવ વિધતે,  
આત્મારામમશંકં રે ॥ સું ૫ ॥

**અર્થ :** માણસનું મન જે કાબૂમાં ન રહ્યું તો તો તે જ વિવિધ પ્રકારનાં હુંખ ઉપજાવે છે, અને તે જ ફરી જે કાબૂમાં આવ્યું તો નિઃસંશય આત્મારામને સુખ ઉપજાવે છે. માટે હે સજજનો ! ભગવંતને પરમ પ્રમોદભાવે ભજો, અને મનને કાબૂમાં લાવી આત્માને સુખ આપો. તમારી કરુણા આવે છે. ૫

સંવરને પરણો :

પરિહરતાશ્રવવિકથાગौરવं,  
મદનમનાદિવયસ્ય ॥  
ક્રિયતાં સાંવરસામપદીન,  
ધ્રુવમિદમેવ રહસ્યં રે ॥ સું ૬ ॥

**અર્થ :** હે સુજજનો ! તમે મહાન આશ્રવ અને વિકથા તથા અનાદિ કાળનો તમારો ભિત્ર જે મદન તેને છોડી દો અને સંવર સાથે હંમેશ માટે લગ્ન કરો. આ જ એક ગુમ તત્ત્વ છે. હે સજજનો ! તમારા ઉપર કરુણા સ્હૂરતાં આ કહીએ છીએ કે તમે મોટી વિકથાઓ છાંડી દો, કામવાસનાથી દૂર રહો, આશ્રવ રોધો, અને સંવર આદરો. ૬

રાગદ્વેષ રોગ — જિનેશ્વર વૈદ્ય :

સહૃત ઇહ કિં ભવકાંતારે,  
ગદનિકુર્બમપાર,  
અનુસરતા હિતજગદુપકાર,  
જિનપતિમગદંકારં રે ॥ સું ૭ ॥

**અર્થ :** અહો ! આ ભવાટવીમાં રાગદ્વેષરૂપી અપાર શેળના સમૂહને તમે કેમ સહન કરો છો ? અરે ! તમારે એ રોગથી 'ધૂટવું નથી ? ધૂટવું હોય તો જગતને ઉપકારી શ્રી જિનેશ્વર ભગવાનરૂપ વૈદ્ય સેવો, અર્થાત् તમારા રાગદ્વેષ, મત્સરાદિ રોગો ટાળવા શ્રી જિનવર દેવ

વૈદ સમાન છે, તેને તમે સેવો, હે સજજનો ! કુરુક્ષા આવવાથી આ કહીએ છીએ. ૭

**પ્રભુ ભજો, નીતિ સજો, પરઠો પરોપકાર :**

શ્રુણુતૈકं વિનયોદિતવ્ચચનं,  
નિયતાયતિહિતર્વચનं ॥  
રચયત સુકૃતસુખશતસંધાનं,  
શાંતસુધારસપાનં રે ॥ સું ૮ ॥

અર્થ : હે સજજનો ! વિનય વડે ઉચ્ચારેલું આ એક વચન શ્રવણ કરો; ચોક્કસ માનો કે પરિણામે એથી છિત થશે અર્થાત् એ વચન પરિણામે છિતકર થશે. અહો ! તમે શાંતસુધારસનું પાન કરો. એથી બેંકડો સુકૃત અને સુખ ગ્રામ થશે. હે સજજનો ! તમે ભગવંતને પરમ હર્ષોત્ત્વાસથી સેવો ! તમારા પ્રતિ કરુણા સુરતાં આ કહીએ છીએ તે લક્ષમાં લ્યો, એથી છિત થશે. ૮

॥ ઇતિ શ્રી શાંતસુધારસગેયકાવ્યે કારુણ્યભાવનાવિભાવનો નામ  
પંચદશઃ પ્રકાશઃ ॥

ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં  
કુરુક્ષ્યભાવના નામનો પંદરમો પ્રકાશ સમામ.



ॐ

## માદ્યરથ ભાવના

ઉદાસીનતા - આશ્રમ :

॥ શાલિની વૃત્તં ॥

શ્રાંતા યस્મિન् વિશ્રામ સંત્રયંતે ।  
 રુગ્ણાઃ પ્રીતિ યત્સમાસાદ્ય સદ્યઃ ॥  
 લભ્યં રાગદ્વેષવિદ્વેષિરોધા-  
 દૌદાસીન્ય સર્વદા તત્ત્વ પ્રિયં નઃ ॥ ૧ ॥

અર્થ : અહો ! તે ઉદાસીનતા અમને સદા પ્રિય છે. થાકેલા જીવોને, ભવજ્ઞમણાથી થાકેલા જીવોને એ વિશ્રામનું સ્થાન છે. રોગી જીવો એનો આશ્રય કરતાં રોગ ભૂલી જઈ હર્ષ પામે છે, કેમ કે એ ઉદાસીનતા રાગદ્વેષરૂપી શત્રુનો રોધ કરવાથી પ્રાપ્ત થાય છે. આવો તટસ્થ ભાવ, આવી માધ્યરથ વૃત્તિ તે અમને સદા પ્રિય છે. સંસાર-કંતારમાં ભટકતા જીવો થાકે ત્યારે વિચારે કે અહો ! રાગ-દ્વેષથી આમ ભટકવું પડ્યું માટે હવે તો સમતાભાવે રહેવું. એમ કરતાં સુખી થાય છે. રોગી જીવ પણ ધારે છે કે સમતાએ રોગ વેદવો સારો છે, કેમ કે કરેલાં કર્મ ગમે તે પ્રકારે આર્ત-રૌદ્રધ્યાન વડે કે સમતાએ ભોગવ્યે છૂટકો છે, માટે વિષમભાવે ભોગવી ફરી કર્મ ન બાંધતાં, એને સમતાએ વેદી લેવાં, એમ મધ્યરથભાવને આદરતા રોગી જીવો વિચારે છે. ૧

હશે ! કોના ઉપર રોષ ? કોના ઉપર તોષ ?

લોકે લોકા ભિન્નભિન્નસ્વરૂપાઃ ।  
 ભિન્નભિન્નાઃ કર્મભિર્મર્મભિદ્વિભિ: ॥  
 રમ્યારમ્યૈશ્રદ્ધિતૈ: કસ્ય કસ્ય ।  
 તદ્વિદ્વિભસ્તુષ્યતે રુષ્યતે વા ॥ ૨ ॥

અર્થ : અહો ! આ જગતમાં લોકો મિશ્ર મિશ્ર સ્વરૂપવાળા છે, જુદી જુદી પ્રકૃતિવાળા છે, જુદાં જુદાં વિચિત્ર કર્મોવાળા છે; તેઓની ચેષ્ટાઓ પણ મિશ્રમિશ્ર છે. કોઈની ચેષ્ટાઓ રમ્ય છે, તો કોઈની અરમ્ય, એદ ઉપજાવે એવી છે. આમ મર્મને ભેદી નાખે, અંતઃકરણ ચીરી નાખે એવી મિશ્ર મિશ્ર ચેષ્ટાઓ અને પ્રકૃતિઓ વર્તે છે; તેમાં જાણ-ડાહ્યા પુરુષોએ કોના ઉપર રોષ કરવો કે કોના ઉપર તોષ ધરવો ? અર્થાત્ વિદ્વાન પુરુષોએ આમાં મધ્યસ્થ રહેવું. ૨

ભગવાન પણ મધ્યસ્થ થતા હતા :

મિથ્યા શંસન् વીરતીર્થેશ્વરેણ ।  
સેદ્ધું શેકે ન સ્વશિષ્યો જમાલિઃ ॥  
અન્યઃ કો વા રોત્સ્થતે કેન પાપાત્ ？ ।  
તસ્માદૌદાસીન્યમેવાત્મનીનं ॥ ૩ ॥

અર્થ : તીર્થના નાથ શ્રી વીર ભગવાન પણ મિથ્યા પ્રરૂપણા કરતા એવા પોતાના શિષ્ય જમાલીને અટકાવી ન શક્યા તો પછી બીજે કોણ કોને પાપમાંથી અટકાવી શક્શે ? માટે ઉદાસીનતા એ જ આત્મહિતનું કરશું છે. ૩

સર્વ જીવ કાળસ્થિતિ પાકુંદે દેકાશે આવશે :

અહો�પિ ગ્રાજ્યશક્તિસ્યુશઃ કિ ।  
ધર્મોદ્યોગં કારયેયુઃ ગ્રસહ્ન ॥  
દદ્યુઃ શુદ્ધ કિંતુ ધર્મોપદેશં ।  
યત્કુર્વાણા દુસ્તરં નિસ્તરાંતિ ॥ ૪ ॥

અર્થ : જુઓ ! અહીંત ભગવાન જેઓ અનંતશક્તિના ધારક હતા તેઓ પણ શું બળાત્કારે ધર્મ પ્રવર્તાવતા ? ના. પરંતુ તેઓ તો એવી શુદ્ધ દેશના આપતા કે જે પ્રમાણે વર્તવાથી તરથો મુશ્કેલ એવો સંસારસમુદ્ર લોકો તરી જતા, તરી જય છે, તરી જશે. તાત્પર્ય કે કોઈ જીવ કર્મવશે માઠી બુદ્ધિવાળો થઈ જય, તો તેના પર બળાત્કાર ન કરતાં તેના પ્રતિ ઉપેક્ષા કરવી, તેના પ્રતિ મધ્યસ્થ વૃત્તિએ જોવું. એના નિબિદ મોહનો

કથ્ય થશે અથવા એ પ્રકૃતિ ઉપશમણે, ત્યારે વળી કોઈ સત્પુરુષનું નિમિત્ત મળશે તો ઠેકાણે પડશે. તીર્થકરહેવ પણ આવા પ્રસંગોએ તિતિક્ષા કરી મધ્યસ્થવૃત્તિ ધારી રહ્યા છે, તો અન્ય જીવોએ તો એ મધ્યસ્થતા જ વિચારવી ઘટે છે. જમાલી જેવો પોતાનો શિષ્ય અને શ્રી ભણાવીર દેવ જેવા પરમ સદ્ગુરુ, આમ છતાં માટી બુદ્ધિના ઉદ્દે જ્યારે જમાલીએ વિપરીત પ્રકૃતપણ કરવા માટી ત્યારે શ્રી વીર ભગવાને તેને બળાતકારે ન અટકાવ્યો; કેમ કે તેઓએ કોઈ એવી જ ગ્રાઢ પ્રકૃતિનો ઉદ્દ્ય જેથો કે મધ્યસ્થતા રાખવી યોગ્ય ગણી. આમ વિચારી સુધ્ય જીવોએ રોષ-તોષ ન અણતાં કર્મની પ્રકૃતિ વિચારી મધ્યસ્થ રહેવું. ૪

“જુગતું જીવ હૈ કર્મધીના  
અચારિજ કથુઅ ન લીના,  
આપ સ્વભાવમાં રે અવધુ  
સદા મગનમે રહેણાં.”

— પ્રકીણ

“સબે જીવા કમ્મવસા” — આર્થવયન

ઓદાસીન્ય અમૃત :

તસ્માદૌદાસીન્યણીયૂષસારં ।  
વારં વારં હંત સંતો લિહંતુ ॥  
આનંદાનામુત્તરંગતરંગૈ-  
જીવદ્વભિર્યદ ભુજ્યતે મુક્તિસૌખ્યં ॥ ૫ ॥

અર્થ : માટે હે સંતપુરુષો ! તમે આ ઉદાસીનતારૂપ અમૃતનો વારેવાર-ફરી ફરી આસ્વાદ કરો, આ મધ્યસ્થતારૂપ પીયુષનું પાણ પુનઃ પુનઃ કરો; અને એમ કરી આનંદ જેમાં વહે છે એવા મોજાંએ કરી જીવન્મુક્તિ સુખ પામો. ૫

ઉદાસીન્ય એક સુખ કી સહેલી હૈ :

હવે ઉપેક્ષા ભાવનાનું અષ્ટાણિયું કહે છે :

**પ્રભાતી રાગ - આદર જીવ ક્ષમા ગુણ આદર - એ દેશી**

અનુભવ વિનય સદા સુખમનુભવ,  
ઔદાસીન્યમુદારં રે  
કુશલસમાગમમાગમસારં,  
કામિતફલમંદારં રે ॥ અ૦ ૧ ॥

**અર્થ :** હે વિનય ! તું સદાકાળ સુખનો અનુભવ કર. હે વિનય ! તું ઉદાર એવી ઉદાસીનતા સેવ, ઉદાસીનતા સેવ. જે તારે સુખનો અનુભવ લેવો હોય તો ઉદાસીનતા સેવ. એ ઉદાસીનતા કેવી છે ? તો કે સત્પુરુષોના સમાગમનું ફળ એ ઉદાસીનતા છે. આગમનો, સત્શાસ્ત્રનો સાર એ ઉદાસીનતા છે. ઈચ્છિત ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન એ ઉદાસીનતા છે; એવી એ ઉદાસીનતા ઉર્ય-ઉદાર છે, માટે તેનું તું સેવન કર. સત્સમાગમનું ફળ મધ્યસ્થ ભાવનું આવવું; તેમજ સત્શાસ્ત્રનું ફળ પણ મધ્યસ્થ ભાવનું આવવું એ છે.

**સંત સમાગમનું ફળ - ઉદાસીનતા :**

હવે જ્યારે સત્સમાગમ અને સત્શાસ્ત્રનો મહિમા આટલો બધો ગવાય છે, તો તેનાં ફળ તો કેવાં અદ્ભુત હોવાં જોઈએ ? તો તેનું ફળ જે ઉદાસીનતા એ એવી અદ્ભુત છે કે મનોવાંચિત પૂરણ કરનાર કલ્પવૃક્ષ સમાન અને જ્ઞાનીઓ કહે છે, એ સત્ય જ છે; કેમ કે રાગદ્વેષના પરિહાર વિના ઔદાસીન્ય આવે નહિ, અને રાગ-દ્વેષનો કષય એ મોક્ષ. મનોવાંચિત વસ્તુ મોક્ષ જેવી કઈ બીજી મોટી ઘટે ? તો એ મનોવાંચિત પૂરવા ઔદાસીન્ય એ જ સેવવા યોગ્ય છે. ૧

**પરચિતા છાંડ :**

પરિહર પરચિતાપરિવારં,  
ચિત્તય નિજમયિકારં રે ॥  
ઘપતિ કોડપિ ચિનોતિ કરીરં,  
ચિનુતેઽન્યઃ સહકારં રે ॥ અનુ૦, ૨॥

**અર્થ :** હે ચેતન ! પર એવી જે પુદ્ગલાદિની અનેક ચિત્તાઓ તું

રાખે છે તે ત્યજ અને તું પોતે જે અવિકારી વસ્તુ છે તેનું ચિંતવન કર,  
અથવા તારું પોતાનું નિર્વિકારપણે ચિંતવન કર. તારાથી અન્ય, તારાથી  
પર એવાં શરીર, કુંભ, પરિગ્રહ આદિ બાબ્ય પૌરુષલિક પદાર્થોની ચિંતા  
છોડી દે. તારા પોતાના સ્વરૂપનો વિચાર કર કે :

“હું કોણ હું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?

કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું ?

એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જે કર્યા.

તો સર્વ આત્મિક જ્ઞાનનાં સ્પિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.”

— શ્રીમદ્ રાજચંદ્ર કૃત મોક્ષમાળા

માટે રે ચેતન ! તું તારું સ્વરૂપ વિચાર. વળી તું કુંભાદિ જે  
તારાથી પર, તેની ચિંતા નકામી કરે છે; કેમ કે—

“કીરી સંચે ખેતર ખાય, પાપીનું ધન એળે જાય.”

— પ્રકૃષ્ણ

વળી —

“કવણે વાડી વાવિયાં,  
કવણે ગુંથ્યાં ફૂલ,  
કવણે જિનવર ચડાવિયાં”

— પ્રકૃષ્ણ

**અર્થાત્** - તું એમ ચિંતવે છે જે આ બધાંનો આધાર મારા ઉપર છે  
તો તે તારી ચિંતા મિથ્યા છે. આંબો કોઈ રોપે છે, બીજો કલમ કરે છે  
અને ફળ કોઈ ત્રીજો જ ખાય છે. આમ ધારી તું મધ્યસ્થ વૃત્તિ રાખ,  
તારું સ્વરૂપ વિચાર.

કોધનું ફળ સ્વસુખનો લોપ :

યોઽપિ ન સહતે હિતમુપદેશં,  
તદુપરિ મા કુરુ કોપં રે ॥

નિષ્કળયા કિ પરજનતસ્યા ।  
કુરુષે નિજસુખલોપં રે ॥ અનુ૦ ૩ ॥

**અર્થ :** જો કોઈ હિતકારી ઉપદેશ સાંભળે નહિ તો તેના ઉપર કોઈ કરીશ નહિ; કેમ કે બીજા ઉપર નકામું શું તપવું? અથી લાભ કાઈ નથી થતો, કક્તા પોતાના સુખનો લોપ થાય છે; માટે રે વિનય! જો તારે સુખનો અનુભવ લેવો હોય તો મધ્યસ્થ વૃત્તિ ધારણ કર. ઉ

દુષ્ટબુદ્ધિ દૂધ મૂકી મૂત્ર પીએ છે – શું કરશું !

સૂત્રમપાસ્ય જડા ભાષંતે,  
કેવન મતમુત્સૂત્રં રે ॥  
કિ કુર્મસ્તે પરિદ્યતપયસો,  
યદિ પીયંતે મૂત્રં રે ॥ અનુ૦ ૪ ॥

**અર્થ :** અહો કેટલાક જ્ઞાનો સુશ્રણે કોરે મૂકી ઉત્સૂત્ર ભાષે છે. એવા દુષ્ટબુદ્ધિવાજાનું અમે શું કરીએ? અહો! એની ઉપેક્ષા કરવી યોગ્ય છે. દૂધ છાંડી કોઈ મૂત્ર પીએ તો આપણે શું કરશું? માટે એ વિનય! જો તારે સુખનો અનુભવ કરવો હોય તો ઉદાર એવી ઉદાસીનતા સેવ. ૪

ગતિ તેવી ભતિ :

પશ્યતિ કિ ન મનઃપરિણામે ?  
નિજ નિજ ગત્યનુસાર રે ॥  
દેન જનેન યથા ભવિતવ્યં,  
તદ્દ ભવતા દુર્વાર રે ॥ અનુ૦ ૫ ॥

**અર્થ :** અરે! તું જેતો નથી કે જીવોની જેવી ગતિ થવાની હોય તેવી ભતિ ઊપજે છે. “યા ગતિ: સા મતિ:” અથવા “વિનાશકાળે વિપરીત બુદ્ધિ.” સારી ગતિ ભળવાની હોય તો મનનાં સારાં પરિણામ રહે છે, માઠી મળવાની હોય તો માઠાં રહે છે. જે પ્રાણીની જેવી ભવિતવ્યતા છે તે પ્રાણીના તેવાં મનઃપરિણામ વર્તે છે, તો તે તારથી વારવા, દાળવા,

બદલાવવા દુષ્કર છે, અર્થાત્ એ દુઃખે પણ વારી શકાય એમ નથી; માટે રે વિનય ! જે તું સુખનો અનુભવ ઈચ્છતો હોય તો મધ્યસ્થભાવ આદર. ૫

### પ્રપંચમાં પૂળો મૂક :

રમય હવા હદ્યંગમસમતાં,  
સંવૃણ માયાજાલ રે ॥  
વૃથા વહસિ પુદ્ગલપરવશતા-  
માયુઃ પરિમિતકાલં રે ॥ અનુ૦ ૬ ॥

અર્થ : માટે રે ચેતન ! હદ્યને આનંદ આપનારી એવી જે સમતા તે હદ્યમાં ધારણ કરી આનંદ પામ, માયાજાલ સંકેલી મૂક. તું પુદ્ગલપરવશતા નકામું બેંચે છે; કેમ કે એ માયા અને એ જંજાળ અને એ પ્રપંચ એ બધું પડ્યું રહેશે, ધારણા ધરી રહેશે, કેમ કે તારું આયુષ્ય તે તો અમુક પરિમિત કાળનું છે. અર્થાત એની સ્થિતિની તો હુદ છે, એટલે એ વહેલામોહું પડશે, અને આ તારી પ્રપંચજાળ તો અસીમ છે તે ધરી રહેશે; માટે એને સંકેલી મૂક અને મધ્યસ્થતા આદર. હે સંતજનો ! મતમતાંતરની જાળમાં તમે ન ગુંથાઓ, એ જાળ ઉકેલવા ન મથો; એ જાળ ઉકેલાવી ધરી રહેશે અથવા વધારે જાણું ગુંચવાઈ જશો. જ્યાં તમારું આયુ ક્ષય થયે વર્તમાન દેહે તમે હતા ન હતા થઈ જશો, માટે દુષ્ટબુદ્ધિવંતો પ્રતિ અથવા મતમતાંતરોની જાળો પ્રતિ મધ્યસ્થ રહી તમે તમારું વિચારવામાં સાવધ રહો. ૬

### અનુપમ તીર્થ આ ચેતન :

અનુપમતીર્થમિદં સ્મર ચેતન-  
મંતસ્થિતમભિરામં રે ॥  
ચિરં જીવ વિશદપરિણામં,  
લભસે સુખમવિરામં રે ॥ અનુ૦ ૭ ॥

અર્થ : હે વિનય ! આ અંતરમાં રહેલું આનંદનું કારણ એવું આ ચેતન અનુપમ તીર્થ છે, એના જેવું બીજું કોઈ તીર્થ નથી, તેનું તું સમરણ કર. લાંબો જાળ વિશુદ્ધ પરિણામે રહે અને તું શક્યત સુખને પામીશ. ૭

શાંતસુધારસનું પાન અને બ્રહ્મપદપ્રામિઃ

પરબ્રહ્મપરિણામનિદાનं,  
સ્ફુર્તકેવલવિજ્ઞાનં રે ।  
વિરચય વિનયવિવેચિતજ્ઞાનં,  
શાંતસુધારસપાનં રે ॥ અનુ૦ ૮ ॥

અર્થ : હે વિનય ! તું શાંતસુધારસનું પાન કર. એ શાંતસુધારસનું પાન કરવાથી પરબ્રહ્મતા અથાર્ત પરમાત્મપણું ગ્રામ થાય છે, એથી કેવળજ્ઞાન પ્રગટે છે; માટે જેમાં સાર-અસારનો, કૃત્ય-અકૃત્યનો વિવેક કરેલ છે એવું શાંતસુધારસનું પાન કર. એ અમૃતપાન કરી અમર થા. ૮

॥ ઇતિ શ્રી શાંતસુધારષગેયકાવ્યે માધ્યસ્થભાવના  
વિભાવનો નામ ષોડશઃ પ્રકાશઃ ॥

ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાંબદ્ર કાવ્યમાં  
માધ્યસ્થભાવના નામનો સોષભો પ્રકાશ.



## ગ્રંથપ્રશસ્તિ

આ ગ્રંથનો મહિમા બતાવે છે :

ભાવનાઓનો પ્રભાવ :

॥ સંગ્રહા વૃત્તં ॥

એવं સદ્ભાવનામિ: સુરભિતહૃદયા: સંશયાતીતગીતો-  
ગીતસ્કીતાત્મતત્ત્વાસ્ત્વરિતમપસરસ્મોહનિદ્રામમત્વા: ॥  
ગત્વા સત્ત્વા મમત્વાતિશયમનુપમાં ચક્રિશક્રાધિકાનાં !  
સૌખ્યાનાં મશ્નુ લક્ષ્મી પરિચિતવિનયા: સ્કારકીર્તિ શ્રયંતે ॥ ૧ ॥

અર્થ : આ સદ્ભાવનાઓથી હૃદય સુવાસિત થાય છે; સંશય દૂર થાય છે; ઉચ્ચ તત્ત્વાવબોધ થાય છે; થતે-ઉજ્જીવળ આત્મતત્ત્વ પમાય છે; મોહ-નિદ્રા-મમત્વ એકદમ ખર્ચી જાય છે; વિનયનો પરિચય થાય છે; મમત્વાતિશય દૂર થાય છે; અને આમ થતાં જીવો ચક્રવર્તી અને શક્કેનાં સુખથી પડો અધિક એવી અનુપમ સુવિશાળ કીર્તિસ્તુપ લક્ષ્મી પામે છે. આવો અદ્ભુત એ સદ્ભાવનાઓ છે. ૧

દુર્ધ્યાનપ્રતીડા પ્રભવતિ ન મનાકૃ કાચિદદ્વંદ્વસૌખ્ય-  
સ્કાતિ: પ્રીણાતિ નિત્તં પ્રસરતિ પરિતઃ સૌખ્યસૌહિત્યસિધુ: ॥  
ક્ષીયંતે રાગરોષપ્રભૂતિરિપુભટા: સિદ્ધિસામ્રાજ્યલક્ષ્મી: ।  
સ્યાદશ્યા યન્મહિમા વિનયશુચિધિયો ભાવનાસ્તા: શ્રયધં ॥ ૨ ॥

અર્થ : હે સજ્જનો ! હે ભય જીવો ! તમે આ સદ્ભાવનાનો આશ્રય કરો, એ ભાવના ભાવો, એનો મહિમા એવો છે કે દુર્ધ્યાનસ્તુપ ભૂત-પ્રેતની પીડા લગાર માત્ર થતી નથી; આર્ત રૈદ્ર ધ્યાન દૂર થાય છે, અને કોઈ અપૂર્વ અદ્દંદ (અર્થાત् દુઃખનાં કારણોનો જેમાં દેશ નથી) સુખનાં કારણોની વૃદ્ધિ થાય છે; ચિત્ત પ્રસમ રહે છે; અને ચોતરફ સુખ

અને છિતનાં કરણોની નદી પ્રસરે છે. વળી રાગદ્વેષરૂપ શનુઓ કાય પામે છે; પરમ સિદ્ધિરૂપ મુક્તિલક્ષ્મી, આજાં વિશ્વના રાજ્યરૂપ લક્ષ્મી વશ થાય છે. આવો જેનો ભાણી છે તે પવિત્ર સદ્ગ્રાવનાઓનો વિનયથી જેની બુદ્ધિ પવિત્ર થઈ છે એવા હે ભવ્ય જીવો ! તમે આશ્રમ કરો. ૨

### પદ્માવતી :

હવે કર્તાપુરુષ શ્રી વિનયવિજ્યજી પોતાની પદ્માવતી આપે છે :

॥ પથ્યા વૃત્તં ॥

શ્રીહીરવિજયસૂરીશ્વર-  
શિષ્યૌ સોદરાવભૂતાં દ્વાં ॥  
શ્રી સોમવિજયવાચક  
વાચકવરકીતીર્તિવિજયાખ્યૌ ॥ ૩ ॥

અર્થ : શ્રી હીરવિજયસૂરીશ્વરના શિષ્ય બે ભાઈ હતા. એક વાચકોને વિષે ઉત્તમ એવા વાચક શ્રી સોમવિજ્યજી અને બીજા શ્રી કીર્તિવિજ્યજી. ૩

॥ ગીતિ વૃત્તં ॥

તત્ત્વ શ્રીકીર્તિવિજયવાચકશિષ્યોપાધ્યાવિનયવિજયેન ॥  
શાંતસુધારસનામા સંદૃષ્ટો ભાવનાપ્રબોધોऽય ॥ ૪ ॥

અર્થ : તેમાં ઉપાધ્યાય શ્રી કીર્તિવિજ્યજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજ્યજીએ આ શાંતસુધારસ નામનો પ્રભોધ રચ્યો. ૪

શિખિ<sup>३</sup>નદ<sup>४</sup>નસિધુ<sup>५</sup>શ<sup>६</sup>શિમિતવર્ષે હર્ષણ ગંધપુરનગરે ॥  
શ્રીવિજયપ્રભસૂરિપ્રસાદતો યત્ન એष સફલોऽભૂત ॥ ૫ ॥

અર્થ : સંવત ૧૭૨૭ના વરસે આ પ્રયત્ન શ્રીગંધપુર (ગાંધાર, ખંભાત પાસે કાવી ગાંધાર છે તે) નગરમાં સૂરિશ્રી વિજ્યપ્રભના પ્રસાદથી સફળ થયું. ૫



## ઉપસંહાર

॥ ઉપજાતિ વૃત્તં ॥

યथા વિદ્યુઃ ષોડશભિઃ કલાશભિઃ ।  
સંપૂર્ણતામેત્વ જગત્યુનીતે ॥  
ગ્રંથસત્થા ષોડશભિઃ પ્રકાશૈ-  
ર્યં સમગ્રૈઃ શિવમાતનોતું ॥ ૬ ॥

**અર્થ :** જેમ ચંદ્રમા સોળે કળાથી પૂર્ણતા પામી જગતને ઉજાવળ-પવિત્ર કરે છે તેમ આ ગ્રંથ પણ સોળે કળારૂપ સોળે પ્રકાશે કરી જગતનું કલ્યાણ કરો ! આ ગ્રંથ તો કલ્યાણરૂપ જ છે, પણ કહેવાનું કે જગતણ્ણવો આ ગ્રંથ વાંચી-વિચારી કલ્યાણ પામો. ૬

॥ ઇંદ્રવજ્ઞા વૃત્તં ॥

યાવઞ્ચગત્યેષ સહસ્રભાનુઃ ।  
પીળૂષભાનુશ્ સદોદયેતે  
તાવત્સતામેતદયિ પ્રમોર્દ ।  
જ્યોતિઃ સ્ફુરદ્વાદ્યમાતનોતુ ॥ ૭ ॥

**અર્થ :** આ ગ્રંથમાં પણ પ્રકાશમાન વાણીરૂપ જ્યોતિ રહેલી છે, તો તે પણ જ્યાં સુધી આ જગતમાં હજારો ડિરણોથી પ્રકાશતો જે સૂર્ય અને અમૃતજરતો જે ચંદ્ર એ બે રહે ત્યાં સુધી સત્પુરુષોને આનંદ આપો, અર્થાત્ સૂર્ય-ચંદ્રની જેમ આ ગ્રંથ સદાકાળ રહેવાનો છે. એના કાગળ, પૂઠાં, છાપ આદિ જે પૌરાણિક વસ્તુ તે ભલે તેના સ્વભાવ પ્રમાણે સરી જઈ નાશ પામે-રૂપાંતર પામે, પણ એમાં રહેલું જે શાન, એમાં રહેલો જે ગૂઢ મર્મ, એ તો ચંદ્ર-સૂર્ય પેઠે કાયમ રહેવાનાં. ભવ્ય જીવ, સત્પુરુષરૂપ કમલ અને કુમુદને એ આનંદનો હેતુ થાઓ ! ૭

॥ ઇતિ શ્રીમન્મહોપાધ્યાય શ્રીકીર્તિવિજયગણિ-  
શિષ્યોપાધ્યાય શ્રીવિનયવિજયગણિવિરचિત  
શ્રી શાંતસુધારસગ્રંથઃ સમાપ્તઃ ॥

સમાપ્ત